

॥ અધ્યાય તૃણ ॥

ગુરુ મહિમા વર્ણનમ्
(ઇશ્વર પ્રાપ્તિના માર્ગમાં ગુરુના મહત્વનું વર્ણન)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

પાછળના અધ્યાયમાં સાઈબાબાનાં ચરણો પાસે વિજયઆનંદ સંન્યાસી નિર્વાણ પાખ્યો અને બાળકરામ માનકર આત્માનંદમાં લીન થયા તેનું વર્ણન હતું. તેમજ તાત્યાસાહેબ નુલકર અને બાબાના શૈષ અસીમ ભક્ત મેધા, આ બંનેએ બાબાની આંખો સામે જ દેહ છોડ્યો તે પણ કહ્યું છે. એના કરતાં પણ અધિક, વાઘ જેવા ફૂર પ્રાણીના મૃત્યુના પ્રકારનો મોટો ચમત્કાર પણ શ્રોતાઓએ સાંભળ્યો. હવેના આ શરૂ થયેલા અધ્યાયમાં બાબાએ વર્ણન કરેલા અને શ્રોતાઓ માટે અત્યંત કલ્યાણકારક એવા મધુર વૃત્તાંતનું હું કથન કરી રહ્યો છું. (ઓ. ૧-૪)

એક વખત બાબા વનમાં હતા ત્યારે તેમને અચાનક કલ્યાણમાં પણ ન હોય, એવી રીતે ગુરુનું દર્શન થયું. ગુરુની કરણી એટલી અદ્ભુત હોય છે, તે ધ્યાન દઈને સાંભળો. આ કથાની મોટી અન્લયબીનું મુજ પામર શું વર્ણન કરી શકે ! આ કથા ભક્તિ અને શ્રદ્ધા વધારનારી અને ભક્તને જન્મ મરણથી મુક્તિ આપનારી છે. એવું સાઈબાબા સ્વમુખે બોલ્યા છે. આવું જ એક બાઈના મનમાં હતું કે બાબાનાં દર્શન કરવાં અને ત્યાં જ નકોરડા ઉપવાસ કરીને વ્રત લઈ ત્રણ દિવસ ત્યાં રહેવું. પણ બાબાએ તેને યોગ્ય લાગ જેઠીને તેનો નિશ્ચય કેવી રીતે બહાર્યો અને તેની તરફથી સરસ મજાની સ્વાદિષ્ટ પુરણપોળી કેવી કરાવી લીધી અને ફક્ત કરાવી લીધી જ નહિ પણ તેની પાસેથી પોતે આરોગી અને તેને પણ પેટ ભરીને ખવડાવી. બીજના કામ માટે દુહેને સાર્થક કરવો એ શ્રેયકર અને વધારે સારું હોય છે. એમાં જ આપણું અને પોતાનું કલ્યાણ જ હોય છે. ઉપવાસ કરતાં તેમાં અનેક ફાયદા અને ગુણ હોય છે, એ વાત તે બાઈને કયારેય ન ભૂલી શકાય તેવી રીતે એના મનમાં દસાવી દીધું. તેવી જ રીતે જેને પરમાર્થની દીચ્છા હોય છે તેને શાશ્વત વસ્તુ પ્રાપ્ત કરવા માટે કેવો દફ અને ઊંડો અભ્યાસ કરવો જોઈએ અને અધ્યરૂપાં સાહસ ખેડવું જોઈએ તે માટે અમૃત કરતાં પણ, મધુર કથાનો કમ શ્રોતાઓમાં ભક્તિ અને ગ્રેમ ઉત્પન્ન કરશો, અને એમનાં દુઃખનો અંત લાવશો. (ઓ. ૫-૧૨)

હવે પદીની કથા ખૂબ જ રસાળ છે. એ સાંભળવાની દીચ્છા ધરાવનારના મનના કોડ પૂરા થશે. અને વક્તા અને શ્રોતાઓને સ્વાનંદનો લાભ મળશે. તે સાથે કથા સાભળનારાનું જીવન સાર્થક થઈ જશે. આ ભક્તિપૂર્ણ અને અતૌકિક પ્રેમથી ભરેતી કથા સાઈ મારી પાસેથી લખાવી લેશે. મારા જેવા ગરીબ મૂર્ખને તે લખતાં ડગલે ને પગલે આનંદ થશે. ગંગાનદીનાં દર્શનથી જેમ પાપ અને ચંદ્રનાં દર્શનથી તાપ નહિ જેવા થઈ જતાં હોય છે. તેવી જ રીતે સાઈબાબાના મુખના શરીરો ભક્તોનાં પાપોનું નિવારણ કરે છે. હે શ્રોતાજીનો ! ગુરુનું દર્શન થયું તે અંગે સાઈનાથ મહારાજના મુખે કરવામાં આવેલ વર્ણન સાંભળવા મનને તૈયાર કરો. વેદ-વેદાંગોનું અધ્યયન કરો. શ્રુતિશાસ્ત્રનું એટલે કે વેદોના નિયમોનું વારંવાર પારાયણ કરો, તેમ છતાં ગુરુકૃપા વીના જીનની પ્રાપ્તિ થતી નથી અને પછી તે બધા પ્રયત્નો ફોગટના શ્રમ જેવા જ ક્ષીણ થઈ જતા હોય છે. (ઓ. ૧૩-૧૭)

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પહેલા અદશ્ય એવા એટલે કે આદિ અનંત અને અંત અને ત્યારબાદ સ્થિત અથવા તો વ્યક્ત એવા થયેતા એટલે અંત નહિ એવા અતિ વિસ્તાર પામેલ સંસારઝી વૃક્ષ જન્મભરણોનાં દુઃખોથી ભરેલ શોકમય પણ આંખોથી ઉત્પન્ન થયેતાં હોવાને લીધે નાશ પામનારાં છે. આ તૂઠી જનાર અને નાશ પામનાર છે. માટે તેને 'વૃક્ષ' કહ્યું છે. તે આ અવ્યક્ત સંસાર, પછી સ્થાવરનાં એવાં રૂપમાં આવ્યો, માટે તેને વૃક્ષની ઉપમા આપી છે. એવાં આ દેખાનારાં અને નાશ પામનારાં સંસાર વૃક્ષનાં મૂળ ઉપર આકાશમાં છે. ભગવાન વાસુદેવ નિત્ય, અનંત હોવાને લીધે સર્વનો આધાર છે. તેમજ તેઓ બધાથી ઉપર પોતાના વેકુંઠમાં સગુણ રૂપે જ વાસ કરી રહ્યા છે. તેઓ જ આ સંસારઝી વૃક્ષનું મૂળ કારણ છે. માટે આ વૃક્ષને ઉધ્વરમૂળ એટલે મૂળ આકાશ તરફનાં કહેવામાં આવ્યા છે. તેની ડાળીઓના વિસ્તારની થોડી પણ કલ્પના કરી શકતી નથી. દરેક ક્ષણમાં આ શાખાઓ દૂર દૂર બિન્ન બિન્ન દિશાઓમાં ફાંટા ફૂટી એનો પસાર વધતો જ જય છે. આ વૃક્ષનાં મૂળમાંથી એટલે કે પરમાત્માની ઉત્પન્ન થયેલો મનુષ્ય અને બીજી બધી શૂદ્ધયોનિમાંથી અનંત પ્રાણીઓને શાખાઓની ઉપમા આપી છે. કારણ કે તેમનો વિસ્તાર આ શાખાના પ્રમાણમાં જ છે, જ નીચે પૃથ્વી ઉપર પણ પસરતો જય છે. તે દૂરથી મનોહર અને રમણીય સુખદાયક લાગે છે, પણ પાસે જતાં તેના અંગ ઉપર બધા કાંટા જ કાંટા દેખાય છે. કેળનાં જાડનાં થડ જેવાં નિરસસ્તંભ જેવાં, મૃગજળ અથવા તો ગંધર્વનગર કે જે શહેર છે તે પ્રમાણ અતિ લાલસારઝી પાણીથી જકડીને રાખવામાં આવ્યું છે એવું આ શ્રેષ્ઠ વૃક્ષ બહારથી શોભનારું દેખાય છે. ખોડી ઈચ્છાઓથી પેદા થયેલ કર્મોથી ઉત્પન્ન થયેલ અવ્યક્તકર્મઝી બીજભાં જેનો જન્મ હોય છે. તે જ્ઞતે અસ્તિત્વ રહિત હોવાં છતાં દરેક ક્ષણે જુદા જુદા સ્વભાવવાળું દેખાય છે. મૂળમાંથી જ અનર્થ ઉત્પન્ન કરનાર એવા અજ્ઞાનને પેટે તેનો જન્મ થાય છે. તેની આસપાસ ઈચ્છા, તૃષ્ણા અને લાલસા વગેરેનો બંડાર છે. ધન, ધાન્ય, પુત્ર અને પત્નીના પરિવારનો તેનો પસારો અને દેહબુદ્ધિને લીધે જ તેને ત્યાં આશ્રય મળે છે તથા તેને આધાર આપવા માટે તે ત્યાં રહેલ છે. સ્વી અથવા પુરુષની જેમ લિંગમેદનાં અસંખ્ય પ્રાણી જેના ફાંટા છે અને કર્મ, વાસના વગેરે વહવાઈઓથી તે બંધાયેલું છે. એવું આ આખું વૃક્ષ ફેલાયેલું છે. સંસારમાં બધારે બંધાઈ જય છે. એટલું જ નહીં એનો પુનર્જન્મ પણ થાય છે, માટે જ એને વહવાઈઓની શ્રુતિ, સમૃતિ વગેરે પણ રૂપે જે ભરેલું છે અને શબ્દસ્પર્શ રૂપી નવાં ફૂટેલાં પાંદડાઓથી જે ગીય ભરેલ છે, યજા, દાન વગેરે કિયારુપી ફળોથી જેની ઉપર વસંત આવે છે, સુખદુઃખરૂપી રસથી જે સભર છે, જેની ઉપર ફળોનો અંત જ નથી. એ સંસારવૃક્ષ બધાનું જીવવા માટેનું સાધન બનેલું છે. શ્રુતિ સમૃતિ સંસારવૃક્ષનું રક્ષણ અને વૃદ્ધિ કરનારાં એટલે શોભા બધાનારા છે માટે તેમને પણ કે પાંદડાં કહેવામાં આવ્યાં છે – અને ઉપમા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સ્થૂળ દેહ અને ઇન્દ્રિયો કરતાં પણ તે સૂક્ષ્મ હોય છે. માટે તેમને કુમળો પાતો અથવા તો કુમળાં પાંદડા કહ્યાં છે. યજા, દાન વગેરે સત્કર્મો શોભા આપનારાં સારી કીર્તિરૂપે સુગંધથી મનને પ્રસંગ કરનારાં છે. માટે તેને પુર્ખોની ઉપમા આપેતી છે. સંસારમાં સુખદુઃખ, લાભહાનિ વગેરે જેઠીઓનાં ફળો અગણિત હોય છે, એ તો બધાં જ જાણે છે. ભૂ: ભૂવઃ વગેરે લોક આ સંસારવૃક્ષથી જુદા નથી. કયારે નાચ, ગાન અને વાદોનાં વાદન તો કયારેક હસણું, રમણું અથવા તો રુદ્ધન હોય એવા આ પુરાતનકાળનો અશ્વત્થ પીપળો સદાયે નીચું મોકું કરીને એટલે કે દુઃખી બિજી હોય છે, માયાથી ઉત્પન્ન થતાં બ્રહ્મ જે પ્રગટ થાય છે અને વૈરાગ્ય રૂપી શાસ્ત્રોથી જેનું અસ્તિત્વ નાશ પામે છે. જેનું શુદ્ધ મૂળ કારણ જે સારી મનોવૃત્તિ તેના નૈસર્જિક ધર્મ સ્વભાવ જ્યોતિરૂપ છે તેને જાણી લો. પીપળને અશ્વત્થ કહેવાનું કારણ એ છે કે તે ક્ષણભંગર છે. બીજા દિવસ સુધી ટકનાર નથી. ‘અ’ એટલે નહીં અને ‘વ’ ‘શ્વ’ એટલે બીજા દિવસ સુધી ન ટકનારું. ઈશ્વરની યોગમાયાથી ઉત્પન્ન થયેલો આ સંસાર ક્ષણભંગર છે, નાશવંત અને દુઃખસરૂપ છે. અને સનાતન કહેવાનું કારણ એ જ કે આ સંસારની પરંપરા અનાદિ કાળથી ચાલી આવેલી છે. સંસારને આપેલા અશ્વત્થ વૃક્ષની ઉપમા માટે ભગવદ્ગીતા અ. ૧૫ ||૧૧|| શ્લોકમાં કહ્યું છે ઉધ્વરમૂલમધ:

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

શાખાંમથું પ્રાહુરવયમ્ । છન્દાંસિ યસ્ય પણાંનિ યસ્તં વેદ સ વેદવિત् ॥૧॥ જે વૃક્ષનાં મૂળ ઉપર બ્રહ્મમાં અથવા પરમાત્મામાં અને જેની શાખાઓ નીચે હોવાને લીધે તેને અવિનાશી કહેવામાં આવ્યો છે. અને વેદો જેનાં પાંડાં છે, એવા સંસારદૂપી પીપળાને (વૃક્ષને) જે જાણે છે, તે વેદવેતા એટલે જાની કહેવાય છે ॥૧॥ તેવી જ રીતે કઠોપનિષદ્ધ અ. ૨ વલ્લી, ૩ લોક. ૧માં કહ્યું છે ઉર્ધ્વમૂલોડવાકશાખ અષોડધ્યાં: સનાતનઃ: (ઓ. ૧૮-૩૦)

આ પ્રહ્લબ બધાનો આધાર હોવા છતાં સાચુ સત્ય સ્વરૂપ એટલે પરમ સત્ય અને વાસ્તવિક છે. જ્યારે આ જગત એક સ્વખ્ય પ્રમાણે મિથ્યા, ખોદું, માયામય અને કાલ્પનિક છે. તેની શરૂઆત પણ નથી અને અંત પણ નથી, અને તેને કોઈ આધાર પણ નથી. તે પછી વચ્ચેના ગાળામાં તે કેવી રીતે રહી શકે? જેને માટે વૈરાગીઓ પરિશ્રમ કરતા હોય છે. સંતો જેમાં આસક્ત રહે છે, જેની મુખ્યક્ષેત્રોને અપેક્ષા હોય છે અને જે સાધકોની અંતિમ ઇચ્છા હોય છે તે જેને આ પ્રાપ્ત થાય એવું લાગતું હોય તેવાઓએ સંતોનું શરણ લેવું અને શંકા ફુશંકા છોડીને તેઓ જે કહે તે અવશ્ય સાંભળવું. મનની ગઠડી બાંધીને (મનના બધા વિચાર ભેગા કરીને) બુદ્ધિને ઘડેલી દઈને, માયા અને મમતાનો સર્વસ્વપણે ત્યાગ કરીને તથા ગુરુચરણાનો આશ્રય લઈને તેમાં જ વ્યવસ્થિત રીતે ધ્યાન કેન્દ્રિત કરવું અને ખોટી શંકાઓને ત્યલુ દેવી નહિ તો તે માર્ગમાં અવરોધો ઉભા કરશે. અભિમાનને પગ નીચે દુબાવીને રણદોળી નાખો, તો જ સંસારના પેલા કિનારે જઈ પહોંચશો. આ બાબતને આધારે એક મધુર આખ્યાન બાબાએ જાતે કહ્યું છે, તે સાંભળો. તેમાંનું ગુરુવચનરૂપી અમૃત પીને સૌને ખૂબ હરખ અને આનંદ થશે. (ઓ. ૩૧-૩૬)

એક વર્ખત અમે ચારે જગ્યા પોથીપુરાણા અને પુસ્તકો વાંચીને જ્ઞાન પ્રાપ્ત થતાં, બ્રહ્માની (જગતની ચર્ચા) કરવાલાણ્યા. એક ઉદ્ઘરેદાત્મનાત્માનં એ ભગવદ્ ગીતામાં અધ્યાય ૬ નો પભો શ્લોકનો અર્થ જાણીને બીજી ઉપર આશા રાખીને બેસી રહેવું તે સર્વ પ્રકારે જ અધ્યોગ્ય છે એવો વિચાર વિમર્શ કરવા લાગ્યા કે જે આ કર્મયોગ છે. ત્યારે બીજાંએ જવાબ આપ્યો કે, જેનું મન પોતાના તાખામાં સ્વાધીન છે તે જ ધન્ય છે. કલ્પના કરવી કે સંશય કરવાનું છોડીને મન એકાગ્ર કરીને પોતાના સિવાય આ જગતમાં બીજી કોઈનું પણ અસ્તિત્વ નથી, એવી ભાવનાથી રહેવું. ત્રીજાએ કહ્યું, જે વસ્તુ માટે વિકાર થતો હોય અથવા તો સ્થિતિ બદલાતી હોય તે અનિત્ય એટલે નાશવંત અને જે વસ્તુ બદલાતી નથી તે નિત્ય હોય છે. માટે સહાયે નિત્ય અને અનિત્યનો વિચાર વિવેકપૂર્વક કરવો જેઠાંએ. તે જ્ઞાન યોગ છે. યોથાને ફક્ત પુસ્તકિયું જ્ઞાન ગમતું ન હતું. એનું કહેવું હતું કે શાસ્ત્રોએ જેને યોગ્ય દરાવ્યું છે તેવું આચરણ કરીને ગુણુચરણમાં શરીર અને વાચા સાથે પંચગ્રાણ સમર્પણ કરવા. ગુરુ તે સાક્ષાત્ પરમાત્મા હોવાને લીધે બધી ચર અને અચર વસ્તુઓમાં અંદર અને બહારથી ભરેલા છે. આવો આપણો નિશ્ચય થાય તે માટે અપાર નિષ્ઠા હોવી જરૂરી છે. શાસ્ત્રોનું જ્ઞાન જાણનારા, કેવળ તર્ક કરનારા અને વાદવિવાદ માટે સહાય તૈયાર રહેનારા તથા નિર્થક શંકા કુશંકા કરનારાઓને સંપૂર્ણ અને યથાર્થ જ્ઞાન સ્વભન્માં પણ મળતું જ નથી. ત્યાં ફક્ત શુદ્ધ મનનો ભક્તિભાવવાળો અને અંત:કરણવાળો શ્રદ્ધાવાન ભાવિક માણસ જેઠાંએ. આ ભક્તિયોગ છે. ગુરુને પ્રત્યક્ષ દૃશ્યથર માનીને એની ભક્તિ દર્શાવેલી છે. (ઓ. ૩૭-૪૪)

આવા અમે ચારેય બુદ્ધિવાન પેલા વલની શોધ કરવા માટે નીકળ્યા. અમારામાંથી ત્રણની ઈચ્છા એવી હતી કે શોધ આપણી પોતાની બુદ્ધિથી સ્વતંત્રપણે અને નિશ્ચિત મનથી કોઈની મહદુદુ વગર કરવી. પછી વનમાં સ્વચ્છંદપણે વિચરતાં રસ્તામાં એક વણજારો મખ્યો અને તેણે અમને પૂછ્યું, ‘આકરો તાપ પડી રહ્યો છે ત્યારે તમે કયાં અને શા માટે જઈ રહ્યા છો ?’ અમે જવાબ આપ્યો કે, અમો વન અને વનની અંદરના ભાગોની શોધ કરી રહ્યા છીએ. તે સાંભળી પેલા વણજારાએ ફરી અમને પૂછ્યું, ‘આટલી બધી શોધ શેની કરી રહ્યા છો ?’ તે સાંભળીને અમે બોલ્યા, ‘ગુપ્ત વાતો વહેતી કરવી એ સારું નહિ.’ છતાં અમારી ચારેયની દોડાદોડી જેઠને પેલા વણજારો અકળાયો અને તે કહેવા લાગ્યો કે, ‘વનવગડામાં

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ફરવું અધરું છે, ચોક્કસ માહિતી વગર મન ફાવે ત્યાં ભટકવું સારું નહીં. જંગલોમાં ફરતી વખતે જેઠે એક માર્ગદર્શક રાખવો જેઠાએ. ભરખપોરે આવું વિચિત્ર સાહસ અને અને પરિશ્રમ રા માટે કરો છો ? તમારી ગુપ્ત વાતો કહેતા નહિ. પણ આવો બેસો એક ભાખરીનો ટુકડો ખાવ અને પાણી પીઓ ત્યાર પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જવ. માણસને તો અવશ્ય ધીરજ જેઠાએ.' પેલો વણાજારો એટલી બધી આજાજ કરીને વિનંતી કરી રહ્યો હતો. છતાં તેની પરવા કર્યા વીના એમ ને એમ જ આગળ નીકળી ગયા, અને છેવેટે રસ્તામાં ખૂબ જ થાક્યા. એમે બધા બુદ્ધિમાન જ છીએ, પોતાનો માર્ગ પોતે જ શોધી કાઢીશું, બોમિયાની વળી શી જરૂર ? આવો મનમાં ગર્વ હતો. પરંતુ એ જંગલ અતિશય દૂર સુધી ફેલાયેલું હતું, મોટા વિશાળ વૃક્ષોથી છિવાયેલું હતું. સૂર્યનાં કિરણો જ્યાં પહોંચી શકતાં ન હતાં, ત્યાં વળી માર્ગ શોધવાની તો વાત જ ક્યાં ? દિશા ભૂલેલા એમે વાટ ચૂકીને અહીં તહીં વ્યર્થ ભટકવા લાગ્યા, પણ નસીબની બલિહારી તો જુઓ કે ફરી પાછા બરાબર એ જગ્યા પર પાછા આવ્યા. સહનસીબે જે માર્ગે ગયેલા તે જ માર્ગે પાછા ફર્યા. ત્યાં પાછો તે વણાજારો મખ્યો અને બોલ્યો કે, તમે ઊંઘે રસ્તે ચઢી ગયા હતા કે ? કયારેક કયારેક બુદ્ધિનું આવું ખોટું ડહાપણ ચાલતું નથી. કાર્ય નાનું હોય કે મોટું, કોઈ એક તો આંગળી ચીધનારો હોવો જેઠાએ. ખાલી પેટે કોઈ શોધ થઈ શકતી નથી. બુદ્ધિને અવરોધો અફાટ હોય છે. ઈશ્વરીય મહદું મખ્યા સિવાય રસ્તામાં કોઈની સાથે મુલકાત થતી નથી. અન્નનો તિરસ્કાર કરવો નહિ તેમજ પિરસેલી થાળી પાછી ઠેલીવી નહિ. કોઈ જે ભાખરીનો ટુકડો આપવા માંડે અને તે તું ખા, એમ કહે તો તેના શબ્દને પૂર્ણ શુભ શક્કન માનવાથી સર્વ કાર્ય નિર્વિદ્ધને પાર પડે છે, તેવું જાણને. હવે થોડો સમય શાંત ચિત્તે બેસીને જમો અને થોડી ધીરજ ધરો. પણ આ ત્રાણેને આ આપવામાં આવેલો સુવિચાર પસંદ પડ્યો નહિ. તેઓ ફરી પાછા ખાધા પીધા વીના નીકળી પડ્યા. કોઈ શોધ કર્યા સિવાય અન્નનો કોળીયો મોઢામાં મૂકવો નહિ, એવું કહીને તેઓ જાદ્યોપણામાં તણાયા. મને લાગેલી ભૂખ અને તરસથી ગળું સુકાઈ ગળું હતું. વણાજારનો આવો નિખાલસ પ્રેમ જેઠાને મને એનું આશ્રય થયું. એમે તો મોટા ભણેલા ગળેલા વિદ્ધાન છીએ. એમે દ્વારામાયા જણાતા નથી. પૈસાપાત્ર હોવા છતાં કંજૂસ છીએ. કોઈને પણ જમાડ્યા નથી. પરંતુ આ તો એક અશિક્ષિત, કોઈ પણ જતની યોગ્યતા વગરનો, નીચ વર્ણનો વણાજારા જતનો માણસ, તેમ છતાં તેના હદ્યમાં કેટલો ઉમદા પ્રેમ ભર્યો હતો ? તે અપત્તા વીના શાક અને ભાખરી.... ખા એમ કહે છે, અને કોઈ પણ જતના લાભ વીના જે પ્રેમ કરે છે તે જ ખરો જાની છે. તેનો આદર કરવો તે જ મને બ્રહ્મવિદ્યા અથવા તો ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ છે એવું માની લેવાનો ઉપાય સમજન્યો. માટે વણાજારએ આપેલો ભાખરીનો ચોથો ભાગ આદરપૂર્વક ખાઈને તે ઉપર મેં પાણી પીધું, તો એક નવાઈની વાત બની તે જુઓ. (ઓ. ૪૫-૬૫)

કલ્પના પણ ન હતી, એટલામાં ત્યાં ગુરુમહારાજ આવ્યા અને બોલ્યા, ‘વાદ વિવાદ શેનો કરો છો ?’ તેમને એમે જે જે હકીકિત બની હતી તે બધી જ કહી સંભળાવી, ત્યારે તેઓ બોલ્યા, ‘મારી સાથે ચાલોને ? તમને તરત શોધી આપું. જે મારા કલ્યા પ્રમાણે વર્તશે તેની જ ધ્યેય સિદ્ધિ થશે. બીજા ત્રણે એમનું માન્યું નહીં. પણ મેં તેમનો આદરપૂર્વક સ્વીકાર કર્યો. પરંતુ બાકી બધા નીકળી ગયા અને ગુરુ મહારાજ મને સાથે લઈને એક કૂવા ઉપર ગયા. મારા બંને પગે તેમણે દોરડું બાંધ્યું અને માથું નીચે તેમજ પગ ઉપર કરીને મને કૂવામાં પાણીની સપાટી સુધી ઊંઘે માથે સમાંતર લટકાવ્યો. પાણી સુધી હાથ પહોંચે નહિ અને પાણી પણ મોઢાંમાં જથ નહિ એવી રીતે ગુરુમહારાજે મને કૂવામાં સીધો લટકતો મૂક્યો. કૂવાના કાંઠા ઉપર એક ઝાડ હતું, તેની સાથે દોરડાનો બીજે છેડો બાંધીને ગુરુમહારાજ નિરાંતે કયાંક જતા રહ્યા તે મને અભર નથી. લગભગ ચાર, સાડાચાર કલાક પછી તેઓ પાછા ફર્યા અને ઝટપટ મને બહાર કાઢીને પૂછ્યું, ‘તું મજામાં તો છે ને ?’ એ સાંભળીને મેં જવાબ આપ્યો, ‘ખૂબ આનંદમાં મેં જે અપાર સુખ બોગવ્યું એનું હું શું વર્ણન કરું ?’ આ પુરી વાત સાંભળીને ગુરુમહારાજને ખૂબ આનંદ થયો, અને મારા શરીર ઉપર પોતાનો હાથ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કેરવીને તેમણે મને પોતાની પાસે જ રાખી લીધો. (ઓ. ૬૬-૭૪)

અમુક લોકોના મતે ઉપરની વાતનો શબ્દાર્થ ન લેતાં લાક્ષણિક અર્થ લેવો જોઈએ. ઊંઘો લટકાવ્યો એટલે સુખ ક્યાંથી મળે ? ઉલ્ટાનું ત્રાસદ્યાયક અને અસ્વસ્થ થવાય. ત્યારે આનો ખરો અર્થ બાબાના ગુરુ તેમને સમાધિ અવસ્થામાં લઈ ગયા હતા એવો કરવો જોઈએ. સમાધિની સ્થિતિ સુધી પહોંચવા માટે બીજી બાબ્ય વિષયો તરફ દોડનારી ઇન્દ્રિયોને અંદર સમાવી રોકી રાખવી પડે છે અને તે જ બાબાના ગુરુએ તેમને ઉલ્ટા લટકાવીને સિદ્ધ કરી બતાવ્યું. કૂવાડ્યી સંસારમાં પાણીડ્યી વિષયોની પાસે તો બાબાને મૂક્યા હતા, પરંતુ હાથ ન પહોંચે એટલા દૂર પણ રાખ્યા હતા. ઊંઘો લટકાવવાને કારણે અંદર અને બહાર બધી બાજુથી ઝેંચાઈ અને સમાઈ જઈને બાબાને સમાધિ પ્રાપ્ત થઈ હતી અને માટે જ એ ચાર સાડાચાર કલાક માટે બાબા અત્યંત આનંદ નિર્ભર અવસ્થામાં રહ્યા હતા.

પછી ગુરુમહારાજ પોતાના ગુરુકુળમાં લઈ ગયા. શું વાત કરું ત્યાંના પ્રેમાળ ઉમળકાની ! જેવી રીતે એક માદા પક્ષી પોતાનાં બચ્ચાંને માળાની અંદર પોતાની પાંખો નીચે છુપાવી હેઠે છે, તેવી જ માયા ગુરુમહારાજ મારી ઉપર કરતા. શું સુંદર એ ગુરુકુળ હતું ? મા અને બાપનો પ્રેમ ભુલાઈ ગયો. મોહ અને મેમતાનાં બંધન છૂટી ગયાં અને સહેલાઈથી બંધન મુક્તિ મળી. જુતવામાં કઠીન એવી આશાઓ છૂટી ગઈ પરમાર્થ તરફ વળાવનારા પ્રવૃત્તિના પ્રતિબંધો લગાડનારી બેડીઓ તૂટી ગઈ અને મનમાં એવું લાગતું હતું કે ગુરુનાં ગળામાં ગણું પરશોવીને અર્થાત્ બેટીને તેમની આંખોમાં વસી જવું. તેમનું પ્રતિબિંબ જે આંખોમાં ના હોય તો તે ફક્ત એક શુદ્ધ માંસના ગોળા જેવા જ રહેતા અને એના કરતાં વધારે તો હું આંધળો હોત તો સારું થાત. આવી આ ગુરુની શાળા મને મળી. આવી આ શાળામાં પગ પડતાં કયો ફૂટલા નસીબનો મૂર્ખ હોય જે પાછો જય ? મારું ધરબાર, મા, બાપ તે બધું ગુરુમહારાજ જ થઈ ગયા. મન સાથે બીજી બધી જ્ઞાનનિદ્રયો પોતાનાં સ્થાન છીડીને ધ્યાન કરવાની પ્રવૃત્તિ માટે આંખોમાં આવીને અટકી ગઈ. ગુરુમહારાજ આ એક માત્ર દ્રષ્ટિથી ધ્યાન રહેવું જોઈએ અને બીજી બધી વસ્તુઓ પણ ગુરુ જેવી જ લાગવી જોઈએ. ગુરુ વગર બીજું કંઈ પણ દેખાય જ નહિ. એને જ એમનું ‘અનન્ય અવધાન’ એવું કહેવામાં આવે છે. આ પ્રકારે ગુરુના સ્વરૂપનું ધ્યાન કરવાથી મન અને બુદ્ધિની ગતિ રોકાઈ જાય છે. માટે છેવટે ગ્રૂઘ્યપૂર્ય બેસીને એક પણ શબ્દ ન બોલતાં તેમને ફક્ત નમસ્કાર જ કરવા. (ઓ. ૭૫-૮૧)

એકાદ વખત જ્ઞાન મેળવવા માટે ગુરુ કરવા જઈએ તો સારા ઉપદેશના નામે શૂન્ય દક્ષિણાના નિભિત્તે પૈસા ગુમાવવા પડે અને છેલ્લે પદ્ધતાતાપ કરવો પડે એવું બને છે. જે ની ગૂઢ જ્ઞાનની વાતો કેવળ ઉપર ઉપરનો વગર કામનો બદલદાર જ હોય છે, જે પોતાના નિષ્પાત્પ પણાનો ડંકો વગાડતો હોય છે અને ઢોંગનું શિક્ષણ તો તેમને નાનપણથી જ મળેલું હોય છે તેવો ગુરુ પોતાના શિષ્યોને તો વળી શો ઉપદેશ કરવાનો ? બહારથી દેખાવમાં કૌટુંબિક અને વ્યવહારમાં અલિપ્ન, પરંતુ અંદરથી મનને શાંતિ જ નથી. જેને પોતાનો અનુભવ નથી, તેની શાળા અને ઉપદેશ નક્કામો હોય છે. જ્યાં પુસ્તકીયા જ્ઞાનનો અતિરેક હોય છે, જ્યાં બ્રહ્મજ્ઞાનનો અનુભવ નથી હોતો, જ્યાં ગુરુ જતે જ અભિમાનનો પાઠ પોતાના જ મોઢેથી બોલતો હોય, ત્યાં શિષ્યોનું પોતાનું કલ્યાણ ક્યાંથી થવાનું ? જેના બોલ માર્મિક અને હૃદયમાં સીધા જ ઉત્તરી જતા અને બોકાતા નથી હોતા જેનો સાક્ષી કે પુરાવો મન માનતું નથી, એવાનું ગુરુત્વ શું કામનું ? (ઓ. ૮૨-૮૭)

આ પ્રકારે મારી પાસેથી ઉપાસના અને સેવા કરાવી અને મને બ્રહ્મજ્ઞાનનો ખજનો બતાવ્યો. મારે જરાપણ શોધ કરવી પડી નહિ કે અર્થ જણવા માટે પ્રયત્ન પણ કરવો પડ્યો નહિ. બધો જ અર્થ આપોઆપ જતે જ પ્રગત થઈ ગયો, વિના પ્રયત્ને કે પ્રયાસે મળી ગયો. ગુરુકુળાની આવી લીલા હોય છે. શોધવાનું તો તેની જ જગ્યાએ રહ્યું અને નીચે માથું અને ઉપર પગ કરીને ગુરુમહારાજે મને ઊંઘો લટકાવ્યો, તેનો આનંદ મને કેવો થયો તે તેમને જ ખબર ! સંતનાં વર્તન સાવ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ઉંઘા જ હોય છે. તેમની વર્તણૂક જગત કરતાં નિરાળી હોય છે. બ્રહ્મજ્ઞાન જ્ઞતે જ અનુભવીને પ્રાપ્ત કરવાનું હોય છે માટે જ ત્યાં શ્રદ્ધા આ એક આધાર હોય છે. અને ગુરુકૃપા તે એક જ સાધન હોય છે. કર્મકાંડી માણસને કર્તવ્યનો એક પોતાનો અનેરો મિન્જલ હોય છે. જ્ઞાનીને પોતાના જ્ઞાનનો ગર્વ હોય છે અને લાયકને દંભનો થાક હોય છે. અહીં શ્રદ્ધા વીના ચાલતું નથી. પંડિતોની આંખો ગર્વથી આંધળી થયેલી હોય છે. તેઓ અભિમાનનાં પુતળાં જેવા હોય છે. પણ જ્ઞાનીઓ તેમને જેઠિને જ ભાગતા હોય છે. તેમના સહવાસમાં તેઓ રહેતા નથી. તેથી સંગનો મેળ ખાતો નથી. જેને આત્મજ્ઞાન થયેલું હોય, એવું જે કહેતા હોય છે કે, ‘મારા સિવાય બીજો દેવ કોણ ?’ હું જ્ઞતે જ જ્ઞાનથી અને ચૈતન્યથી પરિપૂર્ણ છું. ભક્ત પોતાના ભક્તિભાવને કારણો પોતાના ઉહાપણની ઊંફાસ મારતો નથી. તે પોતાનું શરીર, મન, ધન પોતાના સ્વામીને સુપ્રત કરી હોય છે, અને પોતાનું સર્વસ્વ ગુરુને સ્વાધીન કરે છે. આ એક મારી જ કારીગરી છે, આ મારા જ સામર્થ્યની મોટાઈ છે, આ મારો જ ઉત્તમ બુદ્ધિવૈભવનો પ્રભાવ છે વગેરેની એને મગરૂરી નથી હોતી. જે કંઈ બને છે તે ઈશ્વરકૃપાથી જ બને છે, તે જ ઉતારે છે અને તે જ ચઢાવે છે. એ જ લડે છે અને એજ લડાવે છે, કર્તા અને કરાવનારો પણ તે એકલો જ છે. ભક્ત ગુરુને મસ્તકે કટૂત્વ મૂકીને જ્ઞતે ખૂબ નમ્રતા સ્વીકારે છે. તે હંમેશાં દેવને સ્વાધીન હોય છે. તેને સ્વતંત્રતા નથી હોતી. તે જ્ઞતે કંઈ પણ કરતો નથી. (ઓ. ૮૮-૮૮)

આ ચારેય વિદ્વાનો શોધ શેની કરી રહ્યા હતા તે બાબતનું કહેવું જ રહી ગયું. તે બાબતનું સ્પષ્ટીકરણ શ્રોતાઓએ હવે સાંભળવું. વિદ્વતાનો ધર્મં માથામાં ચેઢેલો હતો એવા કર્મકાંડ અને વેદપારંગત એ બધા પુસ્તકિયા જ્ઞાનનો બબ્ડાટ કરતા હતા. તેવામાં દેવની જ વાત નીકળી. પોતાના જ્ઞાનના યોગથી દેવ કેવો, કઈ રીતે, કયા માર્ગથી, કઈ યુક્તિથી આપણને જઈણી મળી જય તે જ તેમનો ઉદ્દેશ હતો. આ બધા બુદ્ધિવાળાઓમાં એક શ્રી સાઈ પોતે પણ હતા, તેઓ વૈરાગ્ય અને વિષેકની મૂર્તિ હતા. તેઓ તો સાક્ષાત્ પરબ્રહ્મ હતા. પછી તેમણે આ મૂર્ખપણું શા માટે સ્વીકાર્યું ? એવી શ્રોતાઓના મનમાં શંકા જરૂર ઉત્પન્ન થશે. તો આ કેવળ લોકશિક્ષણ માટેની ઈચ્છા ન હોવા છતાં અમુક આચરણો સ્વીકારવા પડે. ભક્તોનો ઉદ્ધાર કરનારા સાઈસમર્થમાં ઓછાપણું કે હીનતા કેવી રીતે આવી શકે ? પોતે અવતારી પુરુષ હોવાને કારણે એક વણજારાને પૂજય માનીને નિશ્ચયપૂર્વક અન્ન બ્રહ્મનો સ્વીકાર કરીને તેનો મહિમા ગાયો. અન્ન બહ્યેતિ વ્યજાનાત् । તૈતીરીય ઉપનિષદમાં વલ્લી ૩, અનુવાદ ૨ અન્નને બ્રહ્મ કહ્યું છે. કારણ કે બ્રહ્મ પ્રમાણે જ બધાં ગ્રાણીઓ અન્નનાં પરિણામભૂત વીર્યથી ઉત્પન્ન થયા છે. અન્નને કારણે જ તેમનું જીવન સુરક્ષિત રહે છે, અને મરણ પછી તે પાછા અન્ન સ્વર્દ્ધે પૃથ્વીમાં જ વિલીન થઈ જય છે. માટે જ તે અન્નનો જે અનાદર કરે છે એનું કેવું નુકશાન થાય છે, એમ કહીને ગુરુ વીના કોઈપણ પ્રકારનું જ્ઞાન કોઈને પણ પ્રાપ્ત થતું નથી. તે વિષેની બુદ્ધિમાનોની કથા કહી સંભળાવી. માતા, પિતા, આચાર્ય તેમના ઉપદેશ સિવાય ધર્મનું જ્ઞાન શક્ય નથી હોતું. અને તે પણ અધ્યાયન કરવા પર આધાર રાખતું હોય છે અને વિધિપૂર્વક સંપાદન કર્યા વીના વ્યર્� હોય છે. આ બધાનો આશીર્વાદ મેળવવો પડે છે. ‘માતૃવાન, પિતૃવાન અને આચાર્યવાન થા’ આ શ્રુતિનું વચન પ્રખ્યાત છે. જે આ પ્રમાણે છે માતૃદેવો ભવ । પિતૃદેવો ભવ । આચાર્ય દેવો ભવ ॥ તૈતીરીય ઉપનિષદ, વલ્લી ૧, અનુવાદ ૧૧ માતાપિતા અને ગુરુને દેવસ્વરૂપ માની સદાયે તેમને પ્રણામ કરવા, તેમની સેવા કરવી અને એમની આજ્ઞાઓનું પાતન કર્યે જવું. આ ત્રણેય વસ્તુનું પાતન અથવા તો યજા, વેદોનું વાંચન અને દાનધર્મ કરવું આ જન્મ અને મરણને ટાળનારું તદન સહેલું સાધન છે. આ બધા ચિત્ત શુદ્ધિનાં સાધનો છે. તેના વીના આત્માઙ્ગી બ્રહ્મની સંપત્તિ મળતી નથી. અને તેના સિવાય જીવનું વ્યર્થ છે તેમ સમજવું. શરીર, ઈન્દ્રિય, મન અને બુદ્ધિ તે જેને સમજ શકાતાં નથી, તેવો જે સમજવામાં અધરો છે તે આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર ગુરુકૃપાથી જ થાય છે. જ્યાં ‘પ્રત્યક્ષ’ અથવા ‘અનુમાન’ આ બંને પુરાવા માન્ય રાખવામાં આવતા નથી. આ વસ્તુ હાથની હથેળી પર મુકેલી ચીજના માફક ગુરુ સિવાય બીજું કોણ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

બતાવી શકે ? ધર્મ, અર્થ અને ત્રીજો પુરુષાર્થ કામ તે પ્રયત્નોથી સાધી શકાય છે પણ ચોથો પરમાર્થ ગુરુ સિવાય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો તે બધી રીતે અર્થહીન ત્રાસ છે. (ઓ. ૮૮-૧૧૨)

શિરડીના દરબારમાં જ્યોતિષીઓ પણ આવતા હતા અને બાબાને મુજરો ભરતા હતા તથા મોટા મોટા લોકોનું ભવિષ્ય કહેતા હતા. ધન, ધાન્ય અને વैભવ બોગવનારા, રાજ રજવાડાઓ, યોગીઓ, વૈરાગીઓ, ભિક્ષા માંગિને પેટ ભરનારા ગોસાવીઓ બાબાનાં દર્શન માટે ખૂબ જ આતુર રહેતા હતા. જ્યું, તપ અને વ્રત કરનારાઓ સંન્યાસીઓ, યાત્રિકો, યાત્રાળુંઓ, ગાયકો અને નર્તકો, પોતાના રસાલા સાથે શિરડીમાં બાબાનાં દર્શને આવતા. મહાર એટલે હરિજન જેવાઓ પણ શ્રી સાઈના દરબારમાં નમસ્કાર કરવા માટે આવતા હતા. તેમજ કહેતા હતા કે આ... જ એક ખરા માયબાપ છે કે, જે જન્મોનાં કાળચકોમાંથી છોડાવે છે. જેના ગળામાં આત્મલિંગ બાંધેલું છે, જેનાં ભાલ પર વિભૂતિ ચોપડેલી રહેતી, જેની રંધ્યા વગરનાં ધાન્યની ભિક્ષા ઉપર જ આંખ રહેતી તેવા તે સ્થિર સ્વરૂપની મોજ માણસા જેવી હતી. મનમાં કપટ રાખીને મીઠાસથી બોતનારા લબાડ જફુગરો પણ આવતા, અમુક પંથો કે જે પ્રેમથી દેવીઓ માટે રચેલાં ગીતો ગાતાં નૃત્ય કરતાં અને કથા કહીને ઉત્સવ મનાવતાં અને છેલ્લે બાબા પાસે ખૂબ પ્રેમથી ભવાની દેવીના નામની ભિક્ષા પણ માંગતા. આંધળા, લંગડા, લૂલા, અપંગ, જેગીઓ, શિખધર્મના અનુયાધીઓ, ભાઈ અને ચારણો, મશાલચીઓ, નાથપંથીઓ બાબાની ભક્તિને કારણે પ્રેમથી ખેંચાઈને આવતા. દુગીદુગી, ડફી જેવાં વાંઝિંગ્રો વગાડનારા, જતજતના કસરતના ખેલ અને કરતબ કરી બતાવનાર ડોંબારી નટ લોકો પણ આવતા. ત્યાં આ પ્રેમળ વણાજારો પણ લાગ જેઠને આવી પહોંચ્યો, ધન્ય ધન્ય સાઈના સ્વરૂપને. તેઓ વૈરાગ્યની જીવતી જગતી મૂર્તિ હતા. તેઓ નિર્વિષયી નિઃસંગ અને નિર્સર્વાથી હોવાને કારણે ભક્તો ઉપરની તેમની પ્રેમ કરવાની રીતને કોઈ ઉપમા જ આપી શકાય તેમ નથી. (ઓ. ૧૧૩-૧૨૧)

હવે પહેલાની મુખ્ય કથાની સંગત અનુસાર આખ્યાનની શરૂઆત કરીએ. શ્રોતાઓએ ધ્યાન આપવું. સાઈબાબા ક્યારેય ભૂખ્યા રહેતા નહિ અને કોઈને પણ રહેવા દેતા નહિ. ઉપવાસ કરવાવાળાનું ચિત્ત ક્યારેય સ્વસ્થ નથી હોતું. તો પછી પરમાર્થ કેવી રીતે સાધી શકાય ? ભૂખ્યા પેટ ઇશ્વરને પામી શકાતો નથી. પોતાના આત્માને પહેલા સંતુષ્ટ કરો. આ શિખામણની વધુ એક વાત શ્રોતાઓ માટે હું વર્ણન કરી રહ્યો છું. બપોરના સમયે જ્યારે પેટમાં આગ લાગેલી હોય છે ત્યારે ચિત્તવૃત્તિને અન્નપ્રથમનું એક વિશિષ્ટ સ્થાન સ્પષ્ટ થાય છે અને અન્નની તીવ્ર ઠિચ્છા ઉત્પન્ન થાય છે. આવા અધર પ્રસંગે જે અન્નનો કોળિયો પણ મળે નહિ તો આ સુકાઈ ગયેલી ઇન્દ્રિયોના સમુહની પોતાની કામ કરવાની કુશળતા દરેક રીતે ખતમ થઈ જાય છે. પેટમાં જે અન્નની ભીનાશ ન હોય તો ઇશ્વરને કઈ નજરથી જેવો ? અને કયા મોઢે એની સ્તુતિ કરવી ? કયા કાને તેને સાંભળવો ? સાર લઈએ તો ઇન્દ્રિયોની સંપૂર્ણ શક્તિ હોય તો જ ઇશ્વરની ભક્તિ થઈ શકે છે. અન્ન વગરનો ભક્ત અશક્ત થાય, એટલે એની પરમાર્થની ગતિ આગળ વધતી નથી. તેવી જ રીતે અતિશય આહાર કે ખાઉધરાપણું પણ હિતકારક નથી. મિત આહાર (ઓછો ખોરાક) એ જ ખરેખર સુખકારક હોય છે. ઉપવાસનો અતિરેક તો હંમેશા કોઈક બયંકર દુઃખનું કારણ બનતું હોય છે. ભગવદ ગીતા અ. ૬, શલોક ૧૬ અને ૧૭માં કહ્યું છે તેમ નાત્યશ્રતસ્તુ થોગોડસ્તિ ન ચૈકાન્તમનશ્રત: ॥૧૬॥ યુક્તાહારવિહારસ્ય યોગો ભવતિદુઃખા ॥૧૭॥ અતિશય ખાનારાને તેમજ બિલકુલ ન ખાનારાને આ યોગ સધાતો નથી. જેનો આહાર અને વિહાર સપ્રમાણ અને જેઠિતો હોય છે તેને જ આ યોગ દુઃખોનું હરણ કરવાનો એટલે કે સુખદાધ નીવડે છે. (ઓ. ૧૨૨-૧૨૯)

એક વખત એક બાઈ દાદા કેળકર સ્વ. ગણેશ દામોદર કેળકર રાવભણ્ઠાદ્વાર સાઈના સસરા પાસેથી પત્ર લઈને ઉત્તાસ્તિ થઈને સાઈબાબાનાં દર્શને શિરડી આવીને તેણે મનમાં નિશ્ચય કર્યો હતો કે, મહારાજની પાસે ત્રણ દિવસના ઉપવાસ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કરીને રહેવું. પરંતુ આ તેનો મનસુખો તેની પાસે જ રહ્યો. બાબાની હમેશની રીત પ્રમાણે પરમાર્થનો વિચાર કરનારને પહેલાં કર્મભરે ભાખરી બાંધવી જ જેઠાએ પરંતુ આ બાઠની રીત ઊંઘી હતી. જેના મનમાં ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા હોય તેણે ભાખરીનો ટુકડો પહેલાં ખાઈ લેવો. જીવને સમાધાન થયા વગર દેવને કેવી રીતે પૂજુ શકાય? ભૂષ્યા પેટે ઈશ્વર મળશે તે કલ્પનામાં પણ થનાર નથી. ઉપવાસ, વ્રત વગેરેના વિચારો બાબાશ્રીની સામે જરાએ ચાલતા નહિ. અંતર્જાની મહારાજને આ બાઈ આવવાની હતી તેની ખબર આગલે દિવસે જ પડી ગઈ હતી, અને તે પ્રમાણે દાદા કેળકરને કહ્યું પણ હતું ‘આ હોળીના તહેવાર પર મારાં બાળકો ભૂષ્યાં રહેશે કે? હું તેમને કેવી રીતે રહેવા દઈશ? હું અહીંથાં છું શાને માટે?’ સાઈબાબાના મુખેથી આવા ઉદ્ગારો બોલાયા નથી. અને તેના બીજી દિવસે જ પેલી બાઈ શિરડી આવી પહોંચી. તે બાઈની અટક ગોખલે હતી. ઉપર જણાવ્યા પ્રમાણે તે પાક્કો નિર્ધાર કરીને આવી હતી. દાદાને ત્યાં પોતાનો સરસામાન મૂક્યો અને તેમને એક પત્ર આપ્યો. કાશીબાઈ કાનેટકરે, પોતાના નજીકના સંબંધને કારણે દાદા ઉપર પત્ર લખ્યો હતો અને આ બાઈ માટે બાબાનાં દર્શનની સગવડ કરી આપવા વિનંતી કરી હતી. શિરડી આવી પહોંચતાં તરત જ તે ગોખલેબાઈ બાબાનાં દર્શને ગઈ. દર્શન કરીને તે પણ ખબર ત્યાં બેદી હુશે, એટલામાં જ બાબાએ તેમને ઉપરેશ કરવાની શક્યાત કરી. કોના મનમાં શું છે તે બદ્યું સાઈનાથ મહારાજ જણતા જ હતા. ભૂમંડળમાં એવી કોઈ વસ્તુ ન હતી કે જેની બાબાને ખબર ન હતી. ‘અન્ન અને અન્ન ખાનર તે બંને વિષણુ ભગવાનના ડ્રાઇ છે. વિષણુ સહૃત્રનામમાં કહ્યું છે અન્નમન્નાદ એટલે તે અપવિત્ર અથવા વજ્ય નથી. પછી વ્રત, ઉપવાસ નિર્દેખ, નિરાહાર, નિરાપ, આનો ગેરવ્યાજભી ઉપયોગ આપણે શા માટે કરવો? ઉપવાસ વગેરેની આપણાને શું આવશ્યકતા?’ બાબાએ પોતે ફરીથી તેને કહ્યું, ‘જી, પેલા દાદા ભટને ઘેર, અને પુરણપોળી આરામથી બનાવ. તેનાં છોકરાંઓને જમાડ અને તું પણ પેટ ભરીને ખા.’ આશ્રમથી એ હતું કે તે વખતે હોળીનો તહેવાર હતો. ગોખલેબાઈનો ન ધારેલો અહીં આવવાનો વિચિત્ર યોગ હતો, અને તે જ સમયે દાદાનાં પત્ની રાજસ્વલા થયા હતા. ગોખલેબાઈની ઉપવાસ માટેની તીવ્ર ઉત્કંઠા જળવાઈ નહિ અને ઉપરથી રસોઈ કરવાનો વારો આવ્યો. છીતાં બાબાની આજ્ઞા તેણે ખૂબ પ્રેમથી પાળી. બાબાનાં ચરણમાં વંદન કરીને દાદાને ઘેર જઈને પુરણપોળીની રસોઈ બનાવી. બધાંને પીરસી અને પોતે પણ જમ્યાં. કેટલું સુંદર આ આખ્યાન! અને કેટલો સુંદર એનો ગર્ભિત સારાંશ! આમ ગુરુવચનમાં દઢ વિશ્વાસ મૂક્યો કે પછી પોતાના ઉદ્વાર માટે શેની વાર? (ઓ. ૧૩૦-૧૪૮)

આવી જ બીજી એક કથા સાઈસમર્થને યાદ આવી હતી, જે તેમણે પોતાના ભક્તોને પ્રેમથી કહી સંભળાવી હતી. એ કથા શ્રોતાઓએ આદ્ધરપૂર્વક સાંભળવી. જેના મનમાં પરમાર્થની તીવ્ર ઈચ્છા હોય, તેમણે કષ્ટ સ્વીકારવા જેઠાએ અને જબરજસ્ત અભ્યાસ કરવો જેઠાએ. થોડા અંશો સાહસ પણ કરવું જેઠાએ. આવા ઉત્તમ કથાકૃપી ચરણતીર્થનાં અમૃતનું પોતાના કલ્યાણ માટે ભક્તોએ કાયમ સેવન કરવું. સંતોનાં ચરણમાં વિનમ્ર થવાથી પોતાનું અંત:કરણ પૂનિત થાય છે. એક વખતે જ્યારે હું નાનો હતો ત્યારે, પેટે પાટો બાંધીને આજીવિકા માટે કામ ધંધો શોધવા નીકળ્યો હતો. ચાલતાં ચાલતાં બિંગામે આવ્યો અને થોડી વિશ્રાંતિ લેવા બેઠો. ત્યાં મારો ફકીરનો વેશ ન્યારો હતો, જેને લીધે મને ખૂબ આનંદ મળેલો. ત્યાં મને જરીનું એટલે કે, સોના ચાંદીના તારથી કપડા ઉપર નક્શીકામ અને કસબ કરવાનું કામ મળેલું. મેં પણ વિશ્રાંતિ લીધા વીના કામ કર્યું અને ફકીરનું પરાકમ જુઓ. મારા તે બધાં જ કષ્ટોનો મને ફાયદો થયો. મારી પહેલાં ચાર હોશિયાર અને નામના મેળવેલા છોકરાઓએ કામ કર્યું હતું. મારાં કામની સાથોસાથ તેમનાં કામની પણ ગણતરી થઈ. એકને પચાસ ઢૂપિયા મળ્યા, બીજને એકસો અને ત્રીજને દોઢસો મળ્યા પણ મારો પગાર બધા જ કરતાં બમણ્યો થયો. આવી મારી હોંશિયારી જેઠાને મારા માલિકના મનમાં ખૂબ જ આનંદ થયો. તેણે બીજી છોકરાઓ કરતાં મારી ઉપર વધારે સ્નેહ બતાવ્યો અને મારા કામનાં વખાણ કર્યા. મને માથા ઉપર બાંધવાનો ફેટો અને શરીર ઉપર પહેરવાનો ગૌરવ આપે તેવો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પોશાક આપ્યો. પણ મેં તેને તેવો ને તેવો સાચવીને મૂકી દીધો. કોઈનું આપેલું કેટલા દિવસ ચાલે ? કેટલુંયે મળે તો અપુરતું જ હોય છે. મારી સરકાર કે જે મોટા પરમેશ્વર અથવા ગુરુ છે તે આપવા માંડે તો તે પ્રલયકાળના અંત સુધીનું એટલે કચારેય ન ખૂટે તેવું હતું. મારા સરકારની આપવાની રીત સામે બીજાઓએ આપેલાની શી કિંમત ? તેની કચાં બરાબરી કરી શકાય ? અમર્યાદાને મર્યાદાનું ભૂષણ કેવી રીતે હોઈ શકે ? મારી સરકાર તો લઈ જ લઈ જ કહેતા હતા, ત્યારે અહીંયા જે તે મને આપો આપો કહે છે. એટલે મારી સરકાર બ્રહ્મજ્ઞાન લઈ જ એવું કહેતા હતા, ત્યારે લોકો મારી પાસે આ લોકના સુખ જેવાં કે ધનસંપત્તિ, સંતતિ અને માનસન્માનની જ માંગણી કરે છે. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતાં સાશ્વત સુખ મળે છે તે તેમને સમજાતું નથી. અને ધારો કે સમજન્ય તો પણ તેને માટે જાતે કષ ભોગવવાની તેમની તૈયારી નથી હોતી. કોઈ પણ મારા બોલવા તરફ ધ્યાન આપતું નથી. કોઈ પણ મને વ્યવસ્થિત સાંભળવા તૈયાર નથી. મારી સરકારનો ખજનો તો ઉભરાઈ રહ્યો છે અને કોઈ ભરવા માટે ગાડું પણ લાવતું નથી. ખોઢી લો કહું છું તો કોઈ ખોદતું નથી. કોઈને પણ પ્રયત્ન કરવો નથી. હું કહું છું કે, ધન ખોઢો અને ગાડાંનાં ગાડાં ભરીને લૂંટી જવ. ખરી માનો દીકરો હોય તેણે તેનો બંડાર ભરી લેવો. ધ્યાનમાં રાખો, માટીની થઈ જરો માટી. મૃત શરીર કચાં તો માટીમાં મળી જય છે, કચાં તો તેની રાખ થઈ જય છે. પવન જરો અને પવન સાથે પ્રાણવાયુ ઊડી જરો. આવો લાભ ફરી પાછો માંગતા યે મળવાનો નથી. (ઓ. ૧૪૮-૧૬૪)

મારા ફકીરનાં કલા કૌશલ્ય, મારા પરમેશ્વરની લીલા, અને મારી સરકારનો તાળો મેળવવાની રીત કંઈ ન્યારી જ છે. હું તો કચારેય કચાંયે જાઉં છું અને કચાંય જઈને બેસી જાઉં છું. છતાં આ જીવ માયામાં રાયતા ભક્તોના પ્રેમમાં ઓતપ્રોત છે અને વગર કારણનો ગોથાં ખાયા કરે છે. માયા છોડવી ખૂબ અધરી છે. તેણે મને તો ગરીબદાસ બનાવી દીધો છે. મારા માણસોની હું તો રાતદિવસ ચિંતા અને યાદ કરતો એક સરખો બેસી રહું છું. (ઓ. ૧૬૫-૧૬૮)

હેમાદપંત સાઈભાબ્દાના શરણે આવ્યા છે. આ કથાનું વર્ણન અપૂર્વ છે. સાઈ જાતે જે કરાવે છે, તેમાં મારાં ‘હું પણાં’ની જગ્યા કચાં ? સાઈ પોતે જ આ કથાના કહેનારા, તે જ વાંચનારા, તે જ સાંભળનારા, તે જ લખનારા, તે જ લખનારા, અર્થ સમજાવીને કહેનારા પણ તે જ છે. સાઈ જાતે જ આ કથાની ભૂમિકા તૈયાર કરે છે અને બાબા પોતે જ આ કથાની મધુરતા પણ છે. તે જ શ્રોતા અને તે જ વક્તા પણ થતા હોય છે. અને સ્વાનંદ ભોગવનાર પણ તેઓ જ છે. પછી આવી સાંભળવામાં આવતી મધુરતા પરમાર્થ જોડવા માટે ઓછી ઊડી પડવાની કે ? જે ભક્તો આ સર્વ પ્રકારનાં આવાં સુખ ભોગવતા હોય, તેઓ અસતમાં ભાગ્યવાન હોય છે. હવે પછી આગલા અધ્યાયનો સાર ‘સાઈભાબ્દાની ઊડીનો અપાર મહિમા’ છે. સજજન શ્રોતાઓ ! હું ઊળી ફેલાવીને વિનંતી કરી રહ્યો છું, કે આપ સર્વે આદરપૂર્વક તે અધ્યાય સાંભળશો. હેમાદપંત અતિ નમ્રપણે કહે છે કે સાઈસમર્થને મારી દ્વારા આવી અને તેમણે જ પોતાનું અપૂર્વ, રસપૂર્ણ કથાથી તૈયાર થયેલ સત્ત ચરિત્ર મારી પાસેથી બોતાવ્યું છે. (ઓ. ૧૬૬-૧૭૪)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાદપંત રચિત,
શ્રી સાઈસમર્થના સત્યચરિત્રના ‘ગુરુ મહિમા-વર્ણન’ નામનો બત્તીસમ્બો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણ.



॥ અધ્યાય તૃતી ||

ઉદ્દી પ્રભાવઃ

(ઇથર પ્રાપ્તિના માર્ગમાં ગુરુના મહાત્મનું વર્ણન)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

જેમની માત્ર ફૃપાદાચિથી જ પાપના પર્વતો તરત જ બળીને આખ થઈ જય છે, તેમજ કલિયુગની ખરાબ પ્રવૃત્તિઓ ધોવાઈ જય છે, તેવા સંતોને અને સજજનોને પ્રણામ કરીએ. તેમના ઉપકારોનો બહલો જન્મ જન્માંતરો પછી પણ વાળી શકાતો નથી. તેમનું બોલવું સાધારણ હોય છતાં આપણા હિતનો ઉપદેશ કરે છે તેમજ શ્રેષ્ઠ અવિનાશી ચુખ પ્રાપ્ત કરી આપે છે. આ આપણનું અને પેલું બીજનું એવું તેમની બુદ્ધિને માનતી નથી. સંસ્કૃતિના બેદભાવનો વિચાર તેમના મનમાં કયારે પણ નથી આવતો. પાછલા અધ્યાયમાં ગુરુના મહિમાનું થોડું ઘણું વર્ણન થયું. હવે આ અધ્યાયમાં શ્રોતાઓએ ઉદ્દીનો મહિમા સાંભળવો. સાઈબાબા માંગી માંગીને ફક્ત દક્ષિણા લેતા હતા, તેમાંથી દીન તથા નભળા વર્ગમાં દાન કરતા અને જે પૈસા વધે તેનાથી બાળવાનાં લાકડાંનો ભારો ખરીદતા અને તેનો ઢગલો કરતા. સૂક્ષ્મ લાકડાંને પોતાની સામેની ઘૂણીમાં બાળતા અને તેની જે રાખ નીકળતી તેને બાબા ઉદ્દી તરીકે ભક્તોને આપતા હતા. શિરડી ક્ષેત્રમાંથી પોતાના ગામ પાછા ફરતી વખતે ભક્તો બાબાની આક્ષા માંગતી વખતે આ આપવાનો રિવાજ હતો. તે બધા જ ભક્તો જણતા હતા એટલું જ નહીં પણ ‘ઉદ્દી આપો’ એમ બાબા બોલતા તેથી ભક્તો સમજ જતા કે પાછા જવાની અનુમતિ મળી ગઈ છે. બાબાની આ પ્રસાદી મળો એટલે ઘરે પાછા ફરવાનો ઉલ્લાસ વધી જતો. આમ પણ, શિરડીમાં હો ત્યારે બપોરે, સાંજે કે સવારે ઉદ્દી આપ્યા વગર બાબા કોઈને પાછા જવા હેતા નહીં. આ જ બાબાનો દરરોજનો કાર્યક્રમ રહેતો. (ઓ. ૧-૬)

પણ ઉદ્દીનો ગુણધર્મ શો ? મસ્નિજદમાં ચોવીક કલાક અખંડ ઘૂણી શા માટે ? સાધુઓની જમાત ધુમાડા નીકળતા અંગારાની સામે બેસતી તો બાબા ધુમાડો એકાગ્રતાથી બેસતા. આ ઉદ્દી આપવાનો રોજનો કાર્યક્રમ શા માટે ? ઉદ્દી એટલે વિભૂતિ આપવામાં બાબાશ્રીનો ઉદેશ શું હોઈ શકે ? તે દ્વારા તે શું સૂચ્યવવા માગતા હતા ? તો આ જગતમાં દેખાતું બધું જ રાખ જેવું મિથ્યા છે તે મનમાં નક્કી જાણવું. આ મનુષ્યદેહ પણ પંચમહાભૂતોથી સંલિપેલા ભોગ ભોગવવા માટે બાકી વધેલો લાકડાનો ડુકડો જ છે. ભોગ પૂરો થતાં આ બિલકુલ હલનથલન વગરનો શૂન્ય થઈને પહુંશે અને તેની આખરે રાખ થઈ જવાની. તમારી અને મારી પણ આ જ પરિસ્થિતિ થવાની છે. તે બાબત બધાને યાદ રહે અને મને પણ રાતદિવસ જાગૃતિ રહે માટે આ ઉદ્દી હું આપતો હોઉં છું. આ સંપૂર્ણ વિશ્વ એ એક માયાનો દેખાવ જ છે. ફક્ત ભ્રષ્ટ એ જ સત્ય છે. અર્થાત્ સત્તતત્ત્વ એટલે પરમેશ્વર એ જ સાચો વાસ્તવિક છે અને ભ્રષ્ટાંડ તે સત્ય નથી. તેનો ખરો સંકેત તે આ ઉદ્દી છે. આ દુનિયામાં પત્ની, પુત્ર, સગાંવહાલાં કોઈ કોઈનું નથી. આપણે નન્દ આવ્યા છીએ ખાલી હાથે અને ખાલી હાથે જ જવાના છીએ, તે વાતનું સ્મારક એટલે ઉદ્દી છે. આ ઉદ્દી શરીર ઉપર ચોળવાથી મનનાં અને શરીરનાં દુઃખો નહિ જેવા થઈ જય છે. આ ઉદ્દીનું ગૂઢ સારતત્ત્વ એટલે ‘વિવેકપૂર્ણ વૈરાગ્ય’ છે. જે કંઈ આપી શકાય તે દક્ષિણામાં આપીને પ્રવૃત્તિમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થાય એટલે ધીમે ધીમે નિવૃત્તિ વૈરાગ્યનાં

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

લક્ષ્મણો આપણને સમજલવા લાગે છે. વૈરાગ્ય મળી જય પણ તેની સાથે વિવેક ન હોય તો તે વૈરાગ્યની માટી થઈ જય છે. માટે ઉદ્દીનો ઉપયોગ કરવો. વિવેક અને વૈરાગ્ય આ બંનેને ભેગા બાંધીને સાથે રાખવા એટલે ઉદ્દી અને દક્ષિણાનો મેળ બેસાડવો એવો થાય. આવું કર્યા વીના સંસારઢી નહીની પેલેપાર પહોંચવું ખૂબ જ અધ્યરું છે. (ઓ. ૧૦-૧૬)

નાનાંમોટાં અનેક માણસો બાબાનાં દર્શન માટે આવતા હતા, અને બાબાનાં ચરણોમાં વંદન કરીને પાછા જતા હતા. ત્યારે બાબા તેમને ઉદ્દી આપતા. મસ્તિષ્ઠમાં ધૂણી રતદિવસ પ્રજ્વલિત રહેતી. તેમાંથી મૂઢીભર રાખ આપીને બાબા બધાને રવાના કરતા. પ્રસાદ સમજુને રાખ આપતા, પોતાના હાથે સામેના માણસના કપાળ ઉપર ચોપડી આપતા અને તેની સાથે જ તે જ હથ માથા ઉપર મૂકીને ભક્તનું કલ્યાણ ઠરછતા હતા. રક્ષા, અંગારો, રાખ, વિભૂતિ, પવિત્રભસ્મ ઉદ્દી અર્થાત્ ઉદ્ઘ એટલે એક વૃક્ષમાંથી નીકળતો ચીકણો સુગંધીત પદાર્થ, કે જેને અન્નિ ઉપર નાખતા એ સળગી ઊંઠે છે અને તેમાંથી સુગંધીત ધૂમાળો નીકળે છે, તેની રાખ થાય છે. આ બધા શબ્દો જુદા છે, પણ તે બધાનો અર્થ એક જ છે. તેને પ્રસાદની માફક બાબા કોઈ પણ પ્રકારની મર્યાદા વીના વહેંચતા હતા. ‘આ સંસાર ઉદ્દી જેવો છે, એક દિવસ એવો આવશે જ્યારે આપણે પણ આ ઉદ્દીની જેમ જ રાખ થઈ જઈશું.’ એ જ ઉદ્દીનો એક મહિન્નાં સાર છે. કમળની પાંખડીઓ પરના પાણીના ટીપાની જેમ આ દેહ નાશવંત હોવાથી ખરી પડે છે. માટે તેનું મમત્વ છોડી હેવું. તે જ બાબાનો ઉદ્દી વહેંચવાનો અર્થ હતો. વિશ્વનો આ બધો પસારો રાખની રંગોળી જેવો છે તે ચોક્કસપણે જાણલે. જગતના મિથ્યાતત્ત્વનો વિચાર કરો, અને ઉદ્દી જ એક ખરું અસ્તિત્વ છે. એ વાત પર વિશ્વાસ રાખો. ઉદ્દી એટલે ફક્ત માટી જ છે. જે જે વસ્તુઓનાં નામ અને આકાર છે તે દેરેક વસ્તુઓની એક દિવસે આવી જ ગતિ થવાની છે. આ જગતમાં જે વસ્તુઓની સ્થિતિમાં અંતર બદલાવ અથવા વિકાર દેખાય છે તે માત્ર નામ પૂરતો જ છે. તેનો અનુભવ માટીના સતત ટકવાના અને કથારે પણ ન બદલવાના ગુણોને લીધે જેવાનો મળે છે. (ઓ. ૨૦-૨૭)

બાબા ધણીવાર રંગમાં આવી જઈને ગીત ગાતા સાંભળ્યા હતા. તે બાબતને લગતી ઉદ્દી વિષેની એક મજેદાર નાનીસરખી ગીત પંક્તિ શ્રોતાઓએ દ્યાનથી સાંભળવી. ‘રમતે રામ આયોજુ આયોજુ | ઉદ્દિયાંકી ગોનિયા લાયોજુ ||ધ્રુવ્યા’ મનની લહેર આવતાં આટલી બે જ લીટીઓ ખૂબ જ મધુર અવાજમાં આનંદથી તેઓ ધણીવાર ગાતા. બાબાએ આ ગણ ગણવામાં રામનું નામ કેમ લીધું? કૃપણ કે બીજ કોઈ દેવોનું નામ કેમ ન લીધું? જાણે કે બાબાને એવું કહેવું હતું કે એમની ઉદ્દી રામના બાણ જેવી એકદમ અક્સીર અને ચોક્કસ પરિણામકારક છે. તેનો અનુભવ આપણામાંથી ધણા લોકોને આને પણ થઈ રહ્યો છે. દૂંકાણમાં બાબાની આ કલ્યાણકારક ધૂણીની ઉદ્દીની કેટલી ગુણો ઉત્પન્ન કરી! તેની ગણાત્રી કરવાનું સામર્થ્ય કોઈનામાં નથી. આવો બાબાનો ઉદ્દી વહેંચવા પાછળનો ગૂઢ પરમાર્થ બાબતનો બાવાર્થ સાંભળીને શ્રોતાઓ ઉદ્દીને પોતાના જીવના શુદ્ધ સ્વાર્થ અને ફાયદાના અર્થે સંસારની વ્યવસ્થા સારી રીતે ચલાવવા માટેના હેતુથી વિચારવા લાગ્યા. તેથી માર્ગ બતાવવા માટે પરમશ્રેષ્ઠ છે. તેઓ ભક્તોના કલ્યાણનો સ્વાર્થ સાધી આપે છે. આ ઉદ્દીના યોગક્ષેમની કથા તો અગણિત કહી શકાય એટલી છે, પણ ગ્રંથનો વિસ્તાર વધે નહીં માટે તેને દૂંકાવી દેવામાં આવી. (ઓ. ૨૮-૩૩)

એક વખતે નારાયણ મોતીરામ જની નામના ઔદ્દિચ્ય ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણ રસોઈઓ નાસિકમાં રહેતો હતો. તેવા જ એક બાબાના અન્ય રામચંદ્ર વામન મોડક નામના બાવિક ભક્ત હતા, જેમને ત્યાં આ નારાયણ જની નોકરી કરતો હતો. બાબા જ્યારે હૃતાત હતા ત્યારે આ નારાયણ જની પોતાની માતાને બાબાના દર્શન માટે શિરડી લઈ ગયા હતા. તે દરમિયાન બાબાએ પોતાની મેળે જ નારાયણની માને પહેલેથી જ ઈશારો સૂચવી દીધો હતો કે, ‘હવે પછી નોકરી સાથે નારાયણનો સંબંધ રહેવાનો નથી, આ ગુલામી હવે બસ થઈ. એના કરતાં તો સ્વતંત્ર ધંધો રોજગાર સારો.’ ત્યાર પછી

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

થોડા જ દિવસો વીત્યા હશે ત્યાં ભગવાનની દ્યાથી નારાયણનું પરાવલંબન પૂર્ણ થયું અને તે જે કરતો હતો તે નોકરી ધૂટી ગઈ. તેમને સ્વતંત્રતા ગમવા માંડી અને પોતાની હિંમતથી જમવા તથા રહેવાની વ્યવસ્થા સાથેનો ધંધો શડ્ કર્યો. તે લોળુંગ બોર્ડિંગનું નામ રાખ્યું ‘આનંદાશ્રમ’ અને તેમાં પૂરેપુરુ મન પરોવીને મહેનત કરતાં દિવસે દિવસે તેમનું નામ પ્રચલિત થઈ ગયું. આ કારણે નારાયણને ઘણો જ સંતોષ થયો. આમ બાબાશ્રીનું કહેવું માનતાં ઘણો જ ફાયદો થતાં તેમની સાઈચરણોમાં શ્રદ્ધા ખૂબ જ વધી ગઈ અને તેનું ઢ્રેપાંતર દદ ભક્તિના સ્વરૂપમાં થયું. અનેક નવા અનુભવો જીવનમાં પેદા થતાં તેમની બાબા પ્રત્યેની ભક્તિ કાયમની થઈ ગઈ. શ્રી બાબાના કહેવાનો અર્થ પાર પડ્યો, શ્રોતાઓને એક નવી વાર્તા સાંભળવા મળી, તેમજ તેમનો પણ બાબાના પ્રેમમાં વધારો થયો. સાયેસાચ બાબાની કરણી અપૂર્વ હતી. બાબા હંમેશા પોતાને માટે કંઈ કહેતા હોય એવું બોલતા, પણ ખરેખર તે બીજાને જ લાગુ પડતું. ધ્યાન દઈને જેનારા, સાંભળનારાઓ માટેનો આ દરરોજનો અનુભવ હતો. (ઓ. ૩૪-૪૩)

નારાયણ જાનીને જેમ જેમ અનુભવો થતા ગયા તેમ તેમ તેમની ભક્તિ અને પ્રેમનો વૈભવ વધતો ગયો. હવે અન્યની એક અતિશય ભક્તિભાવવાળી વાત સાંભળો. એક વખત તેમના પરમભિત્રને અચાનક એક વિંછીએ ઊંખ માર્યો, અને અપાર વેદના થવા લાગી. ઊંખની જગ્યા ઉપર લગાવવા માટે બાબાની ઉદ્દી ખૂબ જ અક્સરી છે. પણ શોધતાં તે મળી નહીં. એક બાજુ પેલા મિત્રથી દૃઢ સહન થતું ન હતું અને બીજુબાજુ ઉદ્દી મળતી ન હતી. તેવા સમયે નારાયણે બાબાની છબી પાસે જઈને તેમની કરુણાની ભીખ માંગી તેમની છબીની આગળ એક સળગી રહેલી અગરભત્તીની રાખ નીચે પડેલી હતી તેને નારાયણને તદ્દુરૂર્તિ ઉદ્દી જ માની લઈને તેમાંથી એક ચપટી જેટલી લીધી. એક ચપટી ભરી સાઈનામનો મંત્ર બોલતા ગયા અને દુઃખની જગ્યાએ લગાવતા ગયા. જેવી ભાવના તેવો જ અનુભવ થાય છે. શ્રોતાઓને નવાઈ લાગશે પણ રાખ ચોળતાની સાથે જ આવી ભયાંકર વેદના અદ્દય થઈ ગઈ અને તે બંને મિત્રોમાં બાબા પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ આવ્યો. (ઓ. ૪૪-૫૦)

આ તો એક અગરભત્તીની રાખ એક પીડાતી વ્યક્તિને લગાડવામાં આવી હતી. પણ ઉદ્દી સમજુને રસ્તા ઉપરથી ધૂળ પણ લઈએ તો પણ આવો જ અનુભવ થાય છે. આ પ્રકારની માટીના સ્પર્શથી જેઓનો રોગ કે દુઃખાવો હોય અથવા કોઈ બીજાના રોગ કે દુઃખાવા ઉપર પણ પ્રયોગ કરવામાં આવે તો પણ તેનો ઈલાજ થાય છે. એક વખત એક ભક્તની છોકરીને ગાંઠીયો જવર થયાની બાતમી બીજી ગામથી અચાનક મળતાં છોકરીનો બાપ ફિકરમાં પડી ગયો. બાપ વાંદરા ખાતે રહેતો હતો. અને પેલી છોકરી બીજે ગામ હતી. પોતાની પાસે ઉદ્દી ન હોવાને કારણે તેણે નાનાસાહેબ ચાંદોરકરને સર્દેશો મોકલાવ્યો, ‘આપ બાબાને પ્રાર્થના કરો, અને મારી આ ચિંતા દૂર કરો.’ આવી નાનાસાહેબને વિનંતી કરીને પ્રસાદૃપી ઉદ્દી મોકલવા માટે જણાવ્યું. સર્દેશો લઈને જે જઈ રહ્યો હતો, તેને નાનાસાહેબ રસ્તામાં જ મળી ગયા. પોતાની ધરવાળી સાથે તેઓ તે સમયે કલ્યાણ જવા માટે નીકળ્યા હતા. નાનાસાહેબને થાણા સેટને આ સર્દેશો મળ્યો. બાબાની ઉદ્દી પાસે ન હતી, માટે તેમણે રસ્તા ઉપરની માટી ઉંચકી અને સાઈસમર્થનું દ્યાન કર્યું. અને પાછા વળીને પોતાની પત્નીના કપાળ પર તેમણે ચપટી માટી લગાડી દીધી. અહીંથા પેલો ભક્ત નીકળ્યો અને તેની છોકરી જે ગામમાં હતી ત્યાં જઈ પહોંચ્યો. ત્યાં પહોંચતા જે હકીકત તેને જાણવા મળી તે સાંભળીને તેમને ખૂબ જ આનંદ થયો. પેલી બાળકીને ત્રણ દિવસ સુધી સતત ખૂબ જ તાવ આવ્યો હતો અને તેને લીધે તે ઘણી જ અશક્ત થઈ ગઈ હતી. તેના આગલે જ દિવસે તેને થોડા આરામ થયો હતો. તપાસ કરતાં સમજયું કે, નાનાસાહેબે જે સમયે ત્યાં ઉદ્દી સમજુને ધૂળનો ચાંલ્લો પોતાના પત્નીને કર્યો હતો અને બાબાને અંતરમનથી પ્રાર્થના કરી હતી એ જ ક્ષણથી પેલી છોકરીને તાવ ઉત્તરવા માંડ્યો. આ દુઃખાવાની કથા યોગ્ય પ્રસંગે અને સમયે સવિસ્તારથી આગળ ઉપર કહેવામાં આવશે. હાલ પૂરતી આ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ઉદ્દીની નાની સરખી ચટકદાર વાત અહીં હાલ પૂરતી આટલી જ છે. (ઓ. ૫૧-૬૨)

એ જ પ્રેમાળ નાનાસાહેબ ચાંદોરકર ઈ.સ. ૧૯૦૨ થી ૧૯૦૪ની આસપાસના સમયે મામલતદાર હતા ત્યારે પોતાના ભક્તોના કલ્યાણ માટે તત્પર એવા બાબાએ કેવા ચમત્કાર કર્યા હતા તે હવે સાંભળો. આ ઉદ્દીના મહિમાનો તો કોઈ પાર જ નથી. આ બીજે ચમત્કાર પણ હું હવે કહી સંભળવું છું. શ્રોતાજીનોએ સાંભળવા માટે તૈયાર થવું, તમને ખૂબ જ આશ્વર્ય થશે. નાનાની દીકરી પરણેલી હતી. તેનું નામ મૈનાતાઈ હતું અને તેનાં લગ્ન પૂનાના કુવળેકર કુંભમાં થયા હતાં. તે પ્રસુતિ માટે પોતાનાં માબાપને ઘરે આવી હતી. પ્રસુતિનો સમય થઈ ગયો હતો. ત્યાં તેને અસત્ય પ્રસુતિની પીડા શડ થઈ. તેથી જમનેરથી નાનાસાહેબ સાઈસમર્થને અનેક રીતે યાદ કરીને યાચના કરી રહ્યા હતા. જમનેરની આ પરિસ્થિતિનો જ્યાાલ શિરડીમાં કોઈને ન હતો. પણ સર્વજ્ઞ અને સર્વગત સાઈબાબા માટે આ જગતમાં કંઈ પણ છૂંપું ન હતું. તેમની પોતાના ભક્તો સાથે અંતર મનથી એકતા હતી. નાનાની આવી પરિસ્થિતિ જેઠને બાબાનું મન દ્રવી ઉઠ્યું અને તેમણે ખરેખર શું કર્યું તે હવે જુઓ. બાબાને નાનાને ત્યાં તરત જ ઉદ્દી મોકલવાનું મનમાં વિચાર આવ્યો. એટલામાં શિરડીના ગોસાઈ રામગીર બુવાના મનમાં પોતાને ગામ જવાની ઈચ્છા થઈ તેમનું ગામ ખાનદેશમાં હતું. બધી તૈયારી બાદ તેઓ દર્શન કરવા માટે બાબાની પાસે મસ્નિદ્રમાં આવ્યા. બાબા હચાત હતા ત્યારે પણ શિરડી છોડતાં પહેલાં ભક્તો બાબાની આજા મંજ્યા વીના કે પણ લાગ્યા વીના કોઈ પણ કામે જતા નહીં. લગ્ન હોય કે જનોઈ અથવા કોઈ મંગલ કાર્ય હોય, આમ જ કરવા ધ્યાયું હોય કે તેનું પ્રયોજન કર્યું હોય, પહેલાં બાબાની સંમતિ લેવી પડતી. તેમની સંપૂર્ણ આજા મેળવ્યા વીના કે આશીર્વાદ અથવા ઉદ્દી પ્રસાદ લીધા વીના કાર્ય નિર્વિદ્ધપણે પાર પડવાનું નથી તેવી દ્વારે ભક્તોની દ્રદ ભાવના હતી. આવી આ શિરડીગામની પદ્ધતિ હતી, તેને અનુસરીને રામગીર બુવા બાબાનાં ચરણોમાં પડીને આજા લેવા આવ્યા હતા. તે બોલ્યા, ‘બાબા હું ખાનદેશ મારા ગામ તરફ જઈ રહ્યો છું. મને આપના ઉદ્દી આશીર્વાદ આપો અને આ દાસને જવાની અનુમતિ આપો.’ રામગીરબુવાને બાબા પ્રેમથી ‘બાપુગીર’ એ નામથી બોલાવતા હતા. તેને બાબાએ કહ્યું, ‘તું તારે ગામ આનંદથી જ. પણ રસ્તામાં થોડો આરામ તેજે. પહેલા જમનેર મુકામે જાજે. નાનાસાહેબ ચાંદોરકરને ઘેર ઉત્તરજે. નાનાના સમાચાર મેળવ્યા પછી તું આગળ તારા ઘરની વાટ પકડજે.’ પછી ત્યાં બાબાની નજીક બેઠેલા માધવરાલ દેશપાંડને બાબાએ કહ્યું, ‘શામા, પેલી માધવ અડકરે રચેલી આરતી કાગળ ઉપર લખીને નાના ખત ગોસાઈ બાપુગીર સાથે મોકલે.’ બાપુગીરને તે આરતી અને ઉદ્દી થોડી પડીકામાં બાંધી આપી અને કહ્યું કે, ‘આ પડીકી અને આરતી નાનાને પહોંચ્યતી કરજે તેમજ તેમના અભરાંતર પૂછીને તારે ગામ જાજે.’ રામ જનાર્દનને રચેલી સંતકાનેશ્વરની આરતીની રચના કરી અને ત્રીજી જની જનાર્દન. માધવ આડકર સાઈનાં ચરણોમાં આસકત હતા. તેમની આરતીની રચના ખૂબ જ પ્રસાદિક છે. અને તે સિવાય બાબાનાં ભજનો અપૂર્ણ રહ્યાં હોત. બાબાને ગમતી આ આરતી હતી.. જે ઉદ્દી સાથે બાબાએ નાનાસાહેબને મોકલાવી હતી. એ આરતી શ્રોતાઓએ મન મુકીને સાંભળવી જેઠાએ. તેની ફળશ્રુતિની વાત આગળ ઉપર જણાઈ આવશે. (ઓ. ૬૩-૮૨)

આરતી

આરતી સાઈબાબા । સૌખ્યદાતા જીવા ।
ચરણરજનતળી । ધાવા દાસાં વિસાંવા । ભક્તાં વિસાંવા ॥દ્વા॥

શ્રી સાઈનું સત્ય ચિત્ર

હે સાઈબાબા ! હું તમારી આરતી ઉતારું છું. આપ સર્વ પ્રાણીઓના જીવને સુખ આપનારા છો. તમારાં ચરણની ધૂળનાં રજકણો નીચે આ સેવકને આશ્રય આપો. આ ભક્તને આશ્રય આપો. આ ધૂપદ છે એટલે આરતીના પ્રારંભે અને દૂરે પંક્તિ ફરી ફરીને બોતવામાં આવે છે.

જાળુનિયાં અનંગ । સ્વરસ્વરૂપી રાહે દંગ । મુમુક્ષ જના દાવી ।

નિજડોળાં શ્રીરંગ । ડોળા શ્રીરંગ ॥ આરતી ॥૧॥

કામવાસના બાળીને તમે સદા પોતાના આત્મસ્વરૂપમાં મસ્ત રહો છો અને મોક્ષની ઈરછા કરવાવાળા લોકોને તેમની આંખોમાં તમે શ્રી કૃષ્ણના રૂપમાં દર્શન આપો છો. હે સાઈબાબા ! હું તમારી આરતી ઉતારું છું ॥૧॥

જ્યા મની જૈસા ભાવ । તથા તૈસા અનુભવ । દાવિસી દ્યાધના ।

ઔસી તુઝી હી ભાવ । તુઝી હી ભાવ ॥ આરતી ॥૨॥

હે અત્યંત દ્યાળુ સાઈનાથ જેના મનમાં જૈવી શ્રદ્ધા અથવા વિશ્વાસ કે ભાવ હશે તે જ પ્રમાણે તેને તમે અનુભવી બતાવો છો. એવી તમારી આ માયા અથવા ચમત્કારિક કરણી છે. હે સાઈબાબા ! હું તમારી આરતી ઉતારું છું ॥૨॥

તમુચે નામ ધ્યાતા । હરે સંસૂતિવ્યથા । અગાધ તવ કરણી ।

માર્ગ દાવિસી અનાથા । દાવિસી અનાથા ॥ આરતી ॥૩॥

તમારા નામનું ચિંતન કરતાં સંસારનાં માનસિક અને શારીરિક હૃદ્દોનો નાશ થાય છે. તમારી લીલાઓની કોઈ મર્યાદા નથી. જેને કોઈ સહાય કરનારું નથી, તેને તમે જ ઉત્ત્રતિ અને સુખનું માર્ગદર્શન કરનારા છો. અનાથોને રસ્તો બતાવો છો. હે સાઈબાબા ! હું તમારી આરતી ઉતારું છું ॥૩॥

કલિયુગીં અવતાર । સગુણ બ્રહ્મ સાચાર । અવતીર્ણ જહલાસે ।

સ્વામી દત્ત દિગંબર । દત્ત દિગંબર ॥ આરતી ॥૪॥

નિર્ગુણ અને નિરાકાર એવા બ્રહ્મ એવા તમે, આ કલિયુગમાં ગુણ અને આકાર સહિત, પ્રત્યક્ષ પ્રગટ થયેલા સ્વામી દત્તદિગંબર તમે જ છો. હે સાઈબાબા ! હું તમારી આરતી ઉતારું છું ॥૪॥

આદાં દિવસાં ગુરુવારીં । ભક્ત કરિતી વારી । પ્રલુપદ પહુંચયા ।

ભવભય નિવારી । ભય નિવારી ॥ આરતી ॥૫॥

દર આઠ દિવસે ગુરુવારે સર્વ શક્તિમાન એવા દેવ તમને અને તમારાં ચરણોનાં દર્શન માટે ભક્તજનો જત્તા કરે છે. તેમના તમે સંસારના ડર દૂર કરો છો. હે સાઈબાબા ! હું તમારી આરતી ઉતારું છું. ॥૫॥

માર્ગ નિજ દ્રવ્યહેવા । તવ ચરણ રજસેવા । માગણે હેચિ આતાં ।

તુમહાં દેવાધિહેવા । દેવાધિહેવા ॥ આરતી ॥૬॥

મારી સંપત્તિનો બંડાર એટલે, આપનાં ચરણોની સેવા કરવી તે જ છે. હે દેવોના દેવ ! આપની પાસે ફક્ત હું એટલું જ માગું છું. હે સાઈબાબા ! હું તમારી આરતી ઉતારું છું. ॥૬॥

ઈચ્છિત દીન ચાતક । નિર્મલ તોય નિજસુખ । પાજવે માધવા યા ।

સાંભાળ આપુલી હી ભાક । આપુલી હી ભાક ॥ આરતી ॥૭॥

આ ગરીબ ચાતકરૂપી પદ્ધતિ, પોતાના આત્મકૃપ સુખ માટે નિર્મળ પાણીની ઈરછા, કરી રહ્યું છે આ માધવને તે પીવડાવો અને આપે આપેલ વચ્ચનને ખરું પડવા દો. હે સાઈબાબા ! હું તમારી આરતી ઉતારું છું. ॥૭॥

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સાઈબાબાની આ આરતીનું મહત્વ વિશેષ છે. શિરડીમાં દરરોજ બપોરની ભધ્યાહન આરતીમાં અને સાંજની ધૂપ આરતીના સમયે આ ગવાય છે. બાબાને આ આરતી ઘણી જ ગમતી હતી, એ અંગે કોઈ શંકા નથી. એ સિવાય કે, તેમણે પોતે શ્યામા પાસે એક કાગળ ઉપર લખાવીને સંકટમાં ઘેરાયેલા નાનાસાહેબને આટલે બધે દૂર ડેઠ જમનેર સુધી મોકલાવી હતી. તેનો ગુણ અને પરિણામ શું આવ્યું તે આપણને આગળ ઉપર જણાશે. આજદિન સુધી આ આરતી ગાવાથી અનેક ભક્તોનાં સંકટો પળભરમાં દૂર થઈ ગયા છે, એવું ઘણા ભક્તોએ અનુભવેલ છે.

આ આરતી બાબાએ જાતે મોકલાવી એનો ભીજે પણ એક અર્થ નીકળે છે, આ આરતીમાં જે જે વિધાનો છે તે બધાં બાબાને માન્ય હતાં. દાખલા તરીકે આરતીની આ ચોથી પંક્તિ જુઓ ‘કલિયુગી’ અવતાર સગુણ બ્રહ્મ સાચાર | અવતીર્ણ જહીલાસે | સ્વામી દત્તદિગંબર ||૪૩|| આ ઉપરથી આપણે બાબાને જે પરબ્રહ્મ અથવા તો સાક્ષાત્ દત્તના અવતાર માનીએ છીએ, તે ભાવનાનો પણ ખુલાસો થાય છે.

આરતીની ર્ચના અત્યંત પ્રસાદપૂર્ણ છે એમાં જરા પણ શંકાને સ્થાન જ નથી. તેમજ તેમાં દર્શાવેલા ભાવો અન્ય ભક્તિપૂર્ણ છે એ પણ ખરું બાબાની ભક્તિને લીધે ‘સૌખ્ય’ પ્રાપ્ત થાય છે, તેમજ ‘સંસ્કૃતિવ્યથા’ દૂર થઈને આ વિશ્વાસ હોવાને કારણો ફક્ત માગવાથી જ તેમની અંદર ‘ચરણરજ સેવા’ અને નિર્મળ આત્મસુખ પણ મળે છે. કેટલી ઉચ્ચ ભાવના ! બાબાની આરતી ગાયા વીના સાઈબાબાનું ભજન અપૂર્ણ જ રહેશે. ત્યારે મને પોતાને એવું લાગે છે કે, ભક્તોએ દિવસમાં એકાદ વખત આ આરતી ગાવી જ જેઠાએ, એવો નિયમ રાખવો જેઠાએ.

રામગીરબુવાએ બાબાને કહ્યું, ‘બાબા ! મારી પાસે હાલમાં તો ફક્ત બે ઢિપિયા જ છે. આટલામાં તો હું જમનેર કેવી રીતે જઈ શકવાનો છું ?’ તે સાંભળી ને બાબાએ જવાબ આપ્યો, ‘તું આરામથી સ્વસ્થપણે જા, તારી બધી વ્યવસ્થા થઈ જશે.’ બાબાનો આવો વિચાર સાંભળીને અને તેમની આજા મેળવીને તથા વંદન કરીને તરત ઉદ્દી પ્રસાદ લઈને રામગીરબુવા પોતાને આપેલા કાર્યમાં મન્ન થઈ ગયા અને જમનેર જવા માટે નીકળી ગયા. જમનેર જવા માટે તે સમયે આગગાડીની વ્યવસ્થા ન હતી તેમજ કોઈ સારી સગવડ પણ ન હતી. માટે બુવાને ચિંતા થતી હતી. આગગાડીનો પ્રવાસ કરીને તેઓ જલગાંવના સ્ટેશન પર ઉત્તર્યા અને ત્યાંથી આગળનો ૪૪ કિ.મી. નો રસ્તો પગપાળા જ કાપવાનો હતો. જમનેર પહોંચવા માટે કોઈ પણ સગવડ ન હતી. એટલે જલગાંવ આવતા એક ઢિપિયો અને ચૌદ આના આગગાડીનાં ભાડાંના થયા હતા. બાકીના બે આના જ બચ્ચા હતા. આવી પરિસ્થિતિમાં ચિંતા કરતો કરતો રામગીરબુવા જણગાંવ સ્ટેશનના દરવાજ પાસે રિકિટ આપીને સ્ટેશનની બહાર આવ્યો, ત્યાં જ બુવાની સામે એક સિપાહી જેવો માણસ ઉતારુંનોની પૂછપરછ કરતો હતો કે શિરડીના બાપુગીર કોઈ છે તે મને મહેરભાની કરીને જણાવો.

વાચકોએ અહીંથા દ્યાન આપવું કે તે સિપાહીએ ‘રામગીર’ કહીને પૂછ્યું નહીં પણ શિરડીના ‘બાપુગીર’ કહીને પૂછ્યું. ઉપરની ઓવી. ઇમાં જણાયા પ્રમાણે તેને આ નામથી ફક્ત બાબા જ બોલાવતા હતા. તો આ તપાસ કરનારો સિપાહી તે કોણા હોઈ શકે એ વાચકોએ નક્કી કરવાનું રહ્યું.

તે સિપાહીનું પૂછવું ફક્ત પોતાને માટે જ છે, એવું જણાયા નામથી રામગીરબુવા આગળ આવ્યા અને બોલ્યા, ‘હું એ જ છું. તારે શું કહેવું છે ?’ એના જવાબમાં પેલો સિપાહી બોલ્યો, ‘નાનાસાહેબ ચાંદોરકરે તમને લેવા માટે મને મોકલ્યો છે. ટાંગામાં બેસીને જલદી ચાલો. તેઓ તમારી રાહ જેઠ રહ્યા છે.’ બુવાને ખૂબ જ આનંદ થયો અને મનમાં બોલ્યા, ‘શિરડીથી નાનાને સંદેશો મળ્યો લાગે છે. માટે જ સમયસર આ ટાંગો મોકલ્યો છે. ચાલો એક મોટી ચિંતા રજી.’ સિપાહી હોશિયાર લાગ્યો. તેની ઢાઢી મૂછો બરાબર ઠસ્સેદાર હતી અને કપડાં પણ વ્યવસ્થિત પહેરેલાં હતાં. ઘોડાગાડી પણ સુંદર દેખાતી હતી. જેવો ટાંગો તેવો ઘોડો પણ હતો. એ કંઈ ભાડાંની ઘોડાગાડી થોડી હતી ? કાર્યના ઉત્સાહમાં તે બીજી બધી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ઘોડાગાડીઓ કરતાં આગળ નીકળી ગયા. રતના સાડાદશ કે અગિયાર વાગતાં ટાંગો જે તેજ ગતિથી દોડતો હતો તે એક નાણા પાસે આવીને ઊભો રહ્યો, ત્યાં એ ટાંગાવાળાએ ઘોડાને પાણી પીવડાવવા માટે ટાંગાથી છૂટો કર્યો અને બોલ્યો, ‘હું તરત પાછો આવું છું. પછી આપણે સ્વસ્થતાથી થોડું કંઈ આઈએ. હું થોડું પાણી પણ લઈ આવું છું. થોડો સમય થોબીને તથા કેરી, પેંડા, ગોળપાપડી ખાઈને તથા પાણી પીને આગળ જઈએ. આપણે ઘોડાને પણ થોડો આરામ આપીને નીકળીએ.’ ટાંગાવાળાનો પહેરવેશ મુસલમાની લાગતો હતો. તેનો આવો વાર્તાલાપ સાંભળીને રામગીરના મનમાં શંકા ઉત્પન્ન થઈ. ‘આ ખાવાની વસ્તુઓ મારે શા માટે આરોગવી ?’ માટે રામગીર પેલા સિપાહીને તેની જત પૂછ્યો. ત્યાં પેલા ટાંગાવાળાએ જવાબ આપ્યો, ‘તમને શંકા શેની આવે છે ? અરે, હું તો હિન્દુ છું, ગઢવાતના ક્ષત્રિયનો દીકરો છું. જતનો હું રાજપૂત છું. આ ફાલાર પણ નાનાએ તમારે માટે જ મારી સાથે મોકલ્યો છે. મનમાં વગરકામની શંકા કરતા નહીં. સ્વસ્થમનથી આ આપેતી વસ્તુઓ આરોગો.’ બુવાને જ્યારે વિશ્વાસ બેઠો ત્યારે બંનેએ સાથે બેસીને નાસ્તો કર્યો. ટાંગાવાળાએ ઘોડાને જેઠ્યો અને આગળ સમય થતાં જ સૂર્યોદય સમયે પ્રવાસ પૂરો કર્યો. ગામમાં પેસતાં જ નાનાની કચેરી-હુલેલી દેખાવા માંડી. ઘોડાને વિશ્રાંતિ મળી અને રામગીરબુવાના મનમાં હારા થઈ. લધુરંકા માટેની બેચેની વધતા તેઓ એક ખૂણામાં ગયા. પાછા ફરીને જુવે છે તો તે જગ્યાએ ગાડી કે ઘોડો કોઈ દેખાયું પણ નહીં. જગ્યા તો બધી ખુલ્લતી હતી. રામગીર મનમાં વિચાર કરવા લાગ્યા, ‘અરે આ તે શું ચમત્કાર છે ? ડેઢ સુધી મને આટલે દૂર લાવીને, તે ગયો ક્યાં ?’ પછી બુવા નાનાને મળવા માટે ઉતાવળે કચેરીમાં ગયા. પરંતુ નાનાસાહેબ તો પોતાને ઘેર છે તેવી જણ થતાં રામગીર ત્યાં જવા માટે તૈયાર થયા. રસ્તામાં પૂછતાં પૂછતાં રામગીર ચાલ્યા અને નાનાસાહેબના મકાનની ભાળ સહેલાઈથી મળી ગઈ. તેમણે તેમના ઘરની બહાર ઉલેલા માણસ સાથે અંદર સંદેશો કહેવડાવ્યો અને ઓટલા ઉપર બેસી ગયા. ત્યાં જ નાનાએ તેમને અંદર બોલાવ્યા. એકબીજા સાથે મુલાકાત થઈ અને રામગીરબુવાએ ઓળીમાંથી ઉદ્દી અને આરતી બહાર કાઢીને નાનાની સામે મૂક્યા અને હુકીકત કહી સંભળાવી. નવાઈની વાત તે હતી કે ઉદ્દી જ્યારે હથમાં લીધી તે સમયે નાનાની દીકરી મૈનાતાઈ પ્રસૂતિની પીડાથી દુઃખી થતી હતી. તેને બિચારીને ખૂબ તકલીફ થતી હતી. તે સંકટના નિવારણ માટે એકબાજુએ નવચંડી યજન અને દુર્ગાસપ્તશતીનો પાઠ ચાલી રહ્યો હતો. આ સ્તોત્ર સાતસો જ્લોકોનું છે તથા માર્કિય પુરાળામાં છે. તે જેઠીને રામગીરબુવાને ખૂબ નવાઈ લાગી. ખૂખ્ખી હેરાન પરેશાન વ્યક્તિને જેવી રીતે પક્વાનથી ભરેલી થાળી મળો અને ચકોરપક્ષીના મોટાં જેમ ચંદ્રના કિરણનું અમૃત ટપકે તેવા જ નાનાના હાલ થયા. તેમણે બાબાએ મોકલાવેલી ઉદ્દી પોતાની પત્નીને બોલાવીને જલ્દીથી આપતાં કહ્યું કે ઉદ્દીને પાણીમાં ઓગાળીને મૈનાને પિવડાવ અને પોતે આરતી ગાવા બેસી ગયા. થોડીક જ ક્ષણોમાં અંદરથી સંદેશો આવ્યો કે ઉદ્દીનો ખ્યાલો હોઈ લગાડતાની સાથે જ છોકરીને આરામ થયો. તેની વેદના તરત જ શરીર ગઈ અને કોઈ પણ પ્રકારના વિધન વીના તેની સુવાવડ સુખેથી થઈ. તેનો છૂટકારો થઈ ગયો અને બધાની ચિંતા દૂર થઈ ગઈ. રામગીર નાનાસાહેબને પૂછ્યું. ‘પેલો ઘોડાગાડીવાળો કર્યા ગયો ? મને તમારી કચેરી પાસે ઉતારીને ત્યાર પછી તે દેખાયો નથી. મારે માટે તમે જે ટાંગો મોકલ્યો હતો એ ટાંગો ગયો ક્યાં ?’ નાના બોલ્યા, ‘મેં કોઈ ઘોડો કે ગાડી મોકલી નથી. આપ આવવાના હતા એની પણ મને ક્યાં ખબર હતી ? તો હું ટાંગો કેવી રીતે મોકલાવું ?’ રામગીરબુવાએ ટાંગાની અને ટાંગાવાળા સિપાહીની બધી જ વાર્તા કહી સંભળાવી અને નાનાસાહેબ બાબાનું વાતસત્ય જેઠને દંગ થઈ ગયા. કયો ટાંગો અને વળી કયો સિપાહી ? શિરડીમાં બેઠાંબેઠાં અનેક પ્રકારના ચમત્કારિક ખેલો કરીને બતાવનારા આ સાઈમાઉલી જાતે ભક્તોના પ્રેમને ખાતર સંકટના સમયે ખેંચાઈને આ રીતે દોડી આવતા હતા. (અં. ૮૩-૧૧૬)

હવે આગળ આવેલી ઓવી ૫૦ ના સંદર્ભમાં નાસિકના નારાયણ જનીની કથા આગળ ચલાવીએ. કેટલોક સમય

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

વીત્યા પછી બાબા નિર્વાણ પામ્યા. ઈ.સ. ૧૯૭૮ વિજ્યાદાશમીનો તહેવાર અને તે શુભ દિવસ જેઠિને તેમણે પોતાનો દેહ પૂછીને અર્પણ કર્યો. પછી તેમની સમાધિ બાંધવામાં આવી. એ પહેલાં બાબાની હૃતિમાં નારાયણરાવ વર્ષમાં બેએક વાર બાબાનાં દર્શન માટે સમય કાઢતા. સમાધિ લીધા પછી બાબાને ત્રણ વર્ષનો ગાળો વીતી ગયો પણ શિરડી જવા માટે કંઈ યોગ આવતો જ નહિ. આથી સમાધિનાં દર્શન કરવાની તેમને પ્રખળ દ્રચ્છા થઈ. પણ યોગ્ય અવસર હવે મને મળવાનો નથી, જેથી તેઓ ખૂબ જ અધીરા થઈ ગયા. બાબાએ સમાધી લીધે માંડ એક વર્ષ થયું હશે અને તે અરસામાં નારાયણરાવ કોઈ વિચિત્ર બીમારીમાં સપદાયા. તેમણે ઘણી બધી દ્વારા કરી, ધરગથ્થુ ઉપાયો પણ કરી જેયા પણ તે કોઈ લાગુ પડ્યા નહીં. ભલે નારાયણરાવ દુઃખી અતિશય ત્રાસ્યા હતા પરંતુ રાતદિવસ તેમનું ધ્યાન બાબામાં લાગેતું જ રહેતું. ગુરુમહારાજને તો વળી મરણ ક્યાંથી? તેમણે નારાયણરાવને દર્શન આપ્યા. એક રાતના સ્વાન આવ્યું કે એક ભોયરામાંથી બહાર આવીને સાઈબાબાએ તેમને આશ્વાસન આપ્યું, ‘મનની ચિંતા તું છોડી દે. આવતીકાલથી તારી બીમારી ઓછી થતી જશે અને એક જ અઠવાડિયામાં તું જાતે જ ઊરી બેસી શકીશ.’ ત્યાં આઠ દિવસ વીત્યા, બાબાના બોલેલા અક્ષરે અક્ષર સાચા પડ્યા. તે જ પ્રમાણનો અનુભવ તેમને થયો. તેમજ કહેલા સમયમાં પોતે ઊરીને બેઠા થયા. તેથી તેમના મનમાં અત્યંત સંતોષ થયો. ત્યારપછી કેટલાયે દિવસો વીત્યા પછી એ નારાયણરાવ સમાધિના દર્શને આવ્યા ત્યારે તેમણે પોતે આ થયેલા અનુભવનું વર્ણન કર્યું હતું. (ઓ. ૧૨૦-૧૨૬)

બાબા દેહધારી હતા અને અત્યારે સમાધિસ્થ છે છતાં તેમનો પ્રભાવ આપણે આજે પણ સર્વ અનુભવીએ છીએ તો બાબાનું મૃત્યુ થયું હતું તે કેવી રીતે માની શકાય? બાબા તો જન્મ અને મરણથી પર હતા. તેઓ તો ચર અને અચર બંનેમાં સદાને માટે ઓતપ્રોત રહેતા. અનિન જેવી રીતે લાકડામાં ગુપ્ત રહે છે અને બહારથી દેખાતો નથી છતાં ઘર્ષણની કિયાથી સળગીને પ્રકાશમાન થાય છે. તેવી જ રીતે આ આપણા સાઈને નજરે જેઠ શકાતા નથી પણ ભક્તનો આર્તિનાદ સાંભળીને ખરી વિકટ વેળાએ બાબાને પુકારતાં તે તરત જ પ્રગટ થાય છે. એક વખત પણ જે આપણે સાઈની નજર સામે પ્રેમથી નજર મેળવીએ તો બસ, તેઓ જન્મભર તમારા ગુલામ થયા છે તેમ સમજવું. બાબા તો અંતરમનની યાદ અને પોકારવાથી હુંકાર ભણે છે અને તે તો અનન્ય પ્રેમના ભૂખ્યા છે. તેમને સમય, સ્થળ કે અન્યનાં બંધન નથી. દરેક પળે તેઓ સતત સભગ ભક્તો માટે ખડેપગે ઊભા જ રહે છે. કેમકે ક્યાંથી તેઓ કંઈ કણ દ્વારા તે કયારેય સમજલતું નથી. એવી કોઈ યોજના કરીને ભનમાં અનેક પ્રકારના ખરાબ વિચારો પેદા થાય. આવા સમયે તેમનાં ચરણકમળમાં દિશિ સ્થિર કરતાં ધ્યાન ધારણ વધશે અને મન એકાગ્ર થઈને સાઈનું ચિંતન થશે. આ બધું સાઈ જાતે જ કરાવે છે અને કાર્ય પણ નિર્વિદ્ધપણે પાર પાડે છે. સંસારના કામધંદા કે વ્યવહાર છોડવા પડતા નથી. કોઈ પણ વસ્તુની હવસ આપોઆપ છૂટી જય છે. આવી ટેવ મનને પાડતાં કોઈ પણ જાતના પ્રયાસ વગર જ કાર્ય સિદ્ધ થાય છે. આ દેહ કર્મ કરનારા લોકમાં એટલે કે મૃત્યુલોકમાં જન્મ લઈને આવ્યો છે, ત્યારે કર્મ તો થવાના જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે સ્ત્રી, પુત્ર, સંપત્તિ અને ધરબારનો સંગ્રહ દ્રચ્છા અનુસાર સારી રીતે માણી લો અને જે કાંઈ થાય તે થવા હો. આપણે આપણા સદ્ગુરુનું ચિંતન કરવાની દ્રચ્છા રાખવી. જેથી મનના સંકલ્પ વિકલ્પ નષ્ટ થઈને, નસીબથી આવી પડેલાં વિદ્ધનો પણ ટળી જશે. ભક્તોના ભક્તિપ્રેમને જેઠિને વિદ્ધા, બુદ્ધિ, પરાક્રમ વગેરે ગુણોથી શ્રેષ્ઠ શ્રી સાઈ તેમને એક એક અનુભવો બતાવીને ભક્તિનો મહિમા વધારતા જ રહે છે. બાબા મનફાયે તેવો વેશ અને રૂપ ધારણ કરે છે અને મનફાયે ત્યાં પ્રગટ થાય છે. બાબા પોતાના ભક્તોનાં કલ્યાણ માટે કોઈ પણ જગ્યાએ ફર્યા કરતા હોય છે. ભક્ત માત્ર ભાવપૂર્ણ હોવો જેઠિએ. આ જ અર્થની બીજી પણ એક કથા શ્રોતાઓએ મનથી સાંભળવી. સંતો પોતાના ભક્તો માટે રાતદિવસ કેવું સહન કરે છે તે જુઓ. કર્ણદ્વાર ખુલ્લાં કરો, હૃદયમંદિરનાં દ્વાર ખોતી નાખો અને આ કથાને અંદર પ્રવેશ કરવાનો મોકો આપો, જેથી કરીને આ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કથા તમારા સંસારના ભય અને સંકટો દૂર કરી શકે. (ઓ. ૧૩૦-૧૪૨)

જર્મન પ્રણ સાથે ઈ.સ. ૧૯૧૪ થી ૧૯૧૮માં થયેલા પ્રથમ વિશ્વયુદ્ધ કે જે અતિશય વિનાશક હતુ તેનો થયેલા વિનાશક યુદ્ધનો થોડાં જ વર્ષો પહેલાં અંત આવ્યો હતો. તે સમયે અંગ્રેજ સરકાર શત્રુ વિરુદ્ધ લડવા માટે પોતાનું લશકર સજજ કરવાના હેતુથી, આપણા ભારતના શહેરોમાં ચારે બાજુએથી લશકરની ભરતી કરી રહી હતી. ઈ.સ. ૧૯૧૭ની સાલમાં એક ભક્તની થાણા જિલ્લામાં નિમણૂક થઈ અને એક આશ્ર્વયકારક ઘટના બની. તેમનું નામ આપણાસાહેબ કુલકણી હતું. તેમને સાઈમાં સંપૂર્ણ શ્રદ્ધા બેઠી તે પણ શ્રી બાબાનો પ્રભાવ જ ગણાય. તેમની લીલા તો અગાધ છે. ઘણાં વર્ષો પહેલાં અપ્પાસાહેબને બાળાસાહેબ ભાટે તરફથી બાબાની એક છબી મળી હતી. તે તેમણે એમના પૂજના સ્થાનમાં મૂકી. કાચા, વાચા અને મનથી તેઓ સંપૂર્ણ પૂજની સામગ્રી સાથે રોજ નિયમથી તે છબીની પૂજા કરતા હતા અને નૈવેદ્ય ઘરાવતા હતા. મનમાં કાયમ વિચારતા કે આ દુનિયામાં નિયમ અનુસાર બોગવવા પડતા સુખુઃખના બોગ કયારે પૂરા થરો? મનનું ધારેલું કયારે પાર પડરો? અને મારા સાઈમાલિકના પ્રત્યક્ષ દર્શનનો યોગ કયારે આવરો? તેની તેમને વિંતા હતી. (ઓ. ૧૪૩-૧૪૮)

સાઈબાબાની છબીનાં દર્શન પણ તેમનાં પ્રત્યક્ષ દર્શન બરાબર જ ગણાય છે. મનમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો યોગ્ય સમય આવતાં તેની પ્રતીતિ થઈ જ જય છે. આ વિષેનું વર્ણન શ્રોતાઓએ આદરથી સાંભળવું. એક સમયે મુંબદીમાં રહેતા બાળાબુવા સુથાર નામના કીર્તનકાર કે જેમને લોકો ‘આજના તુકારામ’ ગણાવે છે, તેઓ શિરડી ગયા હતા. તેમની બાબા સાથેની પહેલી મુલાકાત હતી. તે પહેલાં તેઓ બાબાને કદી મળ્યા નહતા. એકબિજની નજર મળતાં જ શ્રી બાબાએ તેમને સ્પષ્ટ કહ્યું હતું કે, ‘ચાર વર્ષથી હું તને ઓળખું છું.’ બાળાબુવા આશ્ર્વયમાં પડી ગયા. ‘બાબા આમ કેમ કહી રહ્યા છે?’ બાબાએ શિરડી તો કયારેય છોડ્યું નથી, અને મેં પણ તેમનાં પહેલી જ વાર દર્શન કર્યા છે. મેં મારી સગી આંખે આજે પહેલીવાર જ તેમને જેયા છે. છતાં તેમને મારી ઓળખાણ ચાર વર્ષથી કેવી રીતે હોઈ શકે? આવો વિચાર કરતાં બુવાના મનમાં વીજળી ઝબકી, અને યાદ આવ્યું. ‘ચાર વર્ષ પહેલાં જ એક બાબાની સુંદર છબીને જેઠિને મેં પહેલી જ વાર તેમને નમસ્કાર કર્યા હતા.’ તે વાત યાદ આવતાં બુવાને બાબાએ કરેલી વાત અને શાઢોની સચ્ચાઈ ઉપર વિશ્વાસ બેઠો. તેઓ બોલ્યા ‘જુઓ આ સંતોની વ્યાપકતા તેમજ ભક્ત વાતસ્યતા!’ ચાર વર્ષ પહેલાં મેં તો માત્ર તેમની છબીને જ પ્રણામ કર્યા હતા. નજરોનજર તો મેં તેમને આજે જ જેયા છે. છતાં બાબાએ તે નાની અમસ્તી ઓળખાણ બરાબર ધ્યાનમાં રાખી અને ભૂત્યા નહીં. હું તો તે વાત કયારનોય ભૂતી ગયેલો. ભૂતી ગયો હતો તે વાક્ય બોલવું યોગ્ય નથી. પણ બાબાનો કહેવાનો અર્થ મને બરાબર સમજયો જ ન હતો. છબીને પ્રણામ કરવાથી તેની ઓળખાણ રહે છે એ વાત સમજવી મારી શક્તિ બહારની હતી. મારી ઓળખ તો બાબાના ધ્યાનમાં હતી. સ્વચ્છ પાણી કે આયનામાં જેમ આપણને સૂર્ય કે ચંદ્રનું ચોખ્યું પ્રતિબિંબ દેખાય છે તે જ પ્રમાણે છબી પણ એક પ્રતિબિંબ જ છે. મૂળ પદાર્થનું અથવા તો વ્યક્તિનું પ્રતીક એટલે તાદ્દ્ય બતાવવા માટે આગળ ધરેલી પ્રતિકૃતિ અથવા તો મૂર્તિ જ છે. માટે સંતોનાં છબીનાં દર્શન તેમના પ્રત્યક્ષ કરેલાં દર્શન જ હોય છે. સંતોની પણ બધાને આ જ શિખામણ છે. (ઓ. ૧૫૦-૧૬૨)

બાળાબુવાને આ અનુભવ કરવીને સાઈબાબાએ હિન્દુ ધર્મમાંની મૂર્તિપૂજને માન્યતા આપી છે. એટલું જ નહીં, પણ પૂજનમાં મુકેલાં ચિત્રોમાં અથવા તો મૂર્તિમાં તે દેવનું અથવા તો સંતનું ચૈતન્યયુક્ત અસ્તિત્વ હોઈ શકે છે, તે આ અનુભવ વડે બાબાએ સૌને સિદ્ધ કરી બતાવ્યું છે. અધ્યાય દમાં તો, બાબાસાહેબ તર્ફિંદે તેમની છબીને ધરાવેલ સાકરનું નૈવેદ્ય બાબા દરરોજ ખાતા હતા. તે પણ બાબાએ તેમને અને તેમની પત્નીને તથા છોકરાને અનુભવ સાથે

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

સાબિત કરી બતાવ્યું હતું. ‘શું કરું માઈ આજે । ગયો હું બાન્દ્રામાં જેવો રોજ । ખાવા માટે પીવા માટે કંણ પણ ન હતી । ભૂષ્યા પેટે જ મારે પાછા આવવું પડ્યું ॥૧૦૭॥ માલિક ઘરે મળ્યા નહીં । આંતરડી મારી કકળી ભારી । તેવો જ હું અન્ન વિના । ખરા બપોરે પાછો ફર્યો ॥૧૦૮॥’ મુસલમાન, પ્રિસ્તી વગેરે ધર્મોના લોકો જેઓ મૂર્તિપૂજલમાં માનતા નથી, તેઓ હિન્દુઓના પથથર અને કાગળના કોતરેલા દેવોની માન્યતાની હાંસી ઉડાવતા હોય છે. પરંતુ તેમને આ સમજતું નથી કે મનમાં જે ખરી ભાવના હોય તો પથથર અથવા કાગળ પણ પ્રત્યક્ષ દેવ અથવા સંત જ ભાસે છે. મનુષ્યપ્રાણીને બુદ્ધિ અને મન હોવાને લીધે, પશુપક્ષીઓની માફક પથથરને પથથર અને કાગળને કાગળ ન માનતા પોતાના મનથી અથવા બુદ્ધિથી પોતાને ફાવે તે ડ્રપ તેમાં જેઠ શકે છે. મુસલમાન પ્રિસ્તી વગેરે મૂર્તિપૂજલમાં ન માનનારાઓ પણ વ્યવહારમાં આમ જ કરે છે. પોતાની પ્રિય વ્યક્તિની છબી પ્રેમથી પોતાની છાતી સાથે ચાંપીને તેનું ચુંબન લેતાં હોય છે. પણ એ છબી વાસ્તવિકમાં તો એક કાગળનો ટુકડો જ નથી હોતો કે ? પ્રિસ્તી લોકો ભગવાન ઈસુના વધ-સ્તંભનું લોકીટ ગળામાં લટકાવીને તેનું ચુંબન નથી લેતા કે ? મુસલમાનો પણ પીરની દરગાહ ઉપર ચાદર અને ફૂલ ચઢાવીને બંદગી નથી કરતાં કે ? તે પણ એક પ્રકારની મૂર્તિ પૂજન નથી શું ? પણ કહે છે ને કે, પોતે કરે તે સાચું....

હિન્દુ ધર્મમાં પણ પરમેશ્વરને નિરાકાર અને નિર્ગુણ જ માન્યો છે. પરંતુ પરમેશ્વરને નિરાકાર અને નિર્ગુણ માનીને તેનું ચિંતન અથવા તો ધ્યાન કરવું માણસ જાતને અધુરું લાગે છે. તેમજ સાધારણ માણસ માટે શરૂઆતમાં તેના સગુણ અને સાકાર ડ્રપનું ધ્યાન કરવા માટે પ્રતિકૃપે તેની છબીની અથવા તો મૂર્તિની પૂજન કરીને ઉપાસ્ટ પરમેશ્વર પ્રત્યેનો પોતાનો પ્રેમ, ભક્તિ વગેરે વ્યક્ત કરી શકે છે. આગળ જતાં તે ધીરે ધીરે નિર્ગુણ ભક્તિ તરફ પ્રગતિ કરે છે અને પરમેશ્વરનું નિર્ગુણ નિરાકારનું ધ્યાન ધરવા માટે સમર્થ થાય છે.

હવે પહેલાની કથા સાંભળવા માટે શ્રોતાઓએ મનમાં સાવધાની વર્તવી જેઠાએ અને તેમણે પાછલો સંદર્ભ ધ્યાનમાં લેવો જેઠાએ. અપ્પાસાહેબ કુતકણિનું રહેઠાણ થાણામાં હતું. તે દિવસે તેમને ભિવંડીની કામગીરી આવી પડી અને આઠ દિવસમાં હું પાછો આવીશ એમ કહીને તેઓ ધેરથી નીકલ્યા. બે દિવસ માંડ થયા હશે ત્યાં તો એક આશ્ર્યકારક ઘટના બની. તેમના ઘરના બારણો એક ફૂલીર આવ્યા. તેમને બધાને તો શ્રી બાબા જ લાગ્યા. અપ્પાસાહેબની પત્ની અને બાળકોની આંખો પેલા ફૂલીર ઉપર સ્થિર થઈ ગઈ. તેઓ આશ્ર્યમાં ગરકાવ થઈ ગયા. તેમને લાગ્યું કે બાબા જને જ આવ્યા છે. એના પહેલાં તેમનું પ્રત્યક્ષ દર્શન કોઈને પણ થયું ન હતું. પરંતુ છબીનું સરખાપણું જેઠાને તેઓ શ્રી બાબા જ છે, તે જાણીને તેમને જિજાસા ઉત્પન્ન થઈ. તે સૌ એ પેલા ફૂલીરને પૂછ્યું, ‘શિરડીના સાઈબાબા તમેજ કે ?’ પેલા ફૂલીર જે કહ્યું તે શ્રોતાઓએ ધ્યાન દઈને સાંભળો. ‘હું પોતે સાઈ નથી, પણ હું તેમનો આજાકારક બંદ્દો છું, તેમની આજાથી તમારી અને તમારાં બાળકોની પૂછિપરછ માટે આવ્યો છું.’ પછી તેમણે દક્ષિણા માંગતાં પેલા છોકરાઓની માતાએ તેમને એક ડ્રપિયો આપ્યો અને તેમનું સન્માન કર્યું. તે ફૂલીર પણ તે બાઇને ઉદ્દીનું પડીકું આપ્યું. સાઈબાબાની વિભૂતિ પડીકામાં બાંધી પેલી બાઇને હાથમાં સુપ્રત કરી અને બોલ્યા, ‘આ બાબાની છબી પાસે મૂકી દો, તમે સુખી થશો.’ આમ પોતાનું કાર્ય પૂર્ણ કરી, સાઈ મહારી રાહ જેતા હશે એમ કહીને પેલા ફૂલીર પોતાના રસ્તે આગળ ચાલવા માંડ્યા. જે રસ્તેથી તે આવેલા તે રસ્તે પાછા વળી ગયા. (ઓ. ૧૬૩-૧૭૪)

હવે અહીંથાં શું બન્યું તે જુઓ ! સાઈની લીલા અજબ છે ! અપ્પાસાહેબ જે ભિવંડી ગયા હતા, તે આગળ ન જતાં પાછા ફર્યા. તેમનો ધોડો માંદો પડતાં આગળ જઈ શકાયું નહીં અને તેઓ બપોરે પાછા થાણા આવ્યા. તેમને તે દરમ્યાન બનેલી સર્વ હકીકત સમજાઈ. અપ્પાના મનમાં તો એ બાબતનો વસવસો રહી ગયો, કે આ આવેલા ફૂલીરનાં દર્શન

શ્રી સાઈનું સત્ય ચાટિત્ર

કરવાનાં રહી ગયાં. તેમજ પત્નીએ દક્ષિણામાં ફક્ત એ ડ્રિપિયો જ આપ્યો તેની તેમને શરમ લાગી. ‘જે હું હાજર હોત તો ફીરને દરા ડ્રિપિયાથી ઓછું ન આપત.’ એવું તેઓ બોલ્યા. પછી મનમાં ખૂબ બેદ કરીને પેલા ફીર મસ્લિદમાં મળરો એમ સમજુને જમ્યા વગર તેઓ એમની શોધમાં નીકળી પડ્યા. મસ્લિદ, તકિયા વગેરે જે ઠેકાણે પ્રવાસીઓ ઉત્તરતા હોય છે એ બધી જ જગ્યાએ અપ્પાએ પેલા ફીરની તપાસ આદરી. શોધતાં શોધતાં તેઓ થાક્યા પણ ખરા. તેમને પેલા ફીર કયાંય નજરે પડ્યા નહીં. પછી નિરાશ થઈને, ખૂબ લાગી હોવાને કારણે તેઓ ઘેર આવીને જમ્યા. તેમને ખબર ન હતી કે, ખૂબ્યા પેટે શોધ કરવા નીકળવું નહીં. પહેલાં પોતાના જીવાત્માને સંતુષ્ટ કરવો અને ત્યાર બાદ જ કોઈ પણ વસ્તુની શોધ કરવી. આ અર્થની બાબાની વાત આ તત્વની પૂર્તિ કરવે છે. પરંતુ અહીંથા તે વાત ફરીથી શા માટે કહેવી? શ્રોતાઓને એ અધ્યાયની ખબર જ છે. પાઇળના અધ્યાયમાં ‘ગુરુમહિમા’ (ગરિમા) નામની એક સરસ કથામાં પોતાના ગુરુનું વચન દ્યાળું શ્રી સાઈએ પોતાના જ મોટે કહ્યું છે કે, ‘કાર્ય નાનું હોય કે મોટું। શોધ ન થાયે ખાલી પેટે। કોઈ હિવસ અપ્રને પીઠ ન બતાવવી। પિરસેતી થાળી ધકેલવી નહીં॥પણા’ આનો અર્થ અપાને તેઓ જ્યારે જમ્યા પછી નીકળ્યા ત્યારે જ સમજયો. ચિત્રે નામના મિત્રને સાથે લઈને તેઓ લટાર ભારવા માટે નીકળ્યા. તે થોડા જ ડગલાં આગળ ગયા હશે ત્યાં પોતાની તરફ ધ્યાનથી જેતાં અને પોતાની સામેથી આગળ વધતા એક ગૃહસ્થને ખૂબ જ ઉતાવળેથી આવતા જેયા. તેઓ પાસે આવીને ઊભા રહેતાં. અપાસાહેબે ધીમેથી ધ્યાન દઈને તેમની તરફ જેતાં તેમને એક ગૃહસ્થ સવારના આવ્યા હોય એવું લાગવા માંડયું ‘જેમને પહેલેથી જ શોધી રહ્યો છું’, એ જ ફીર આ હોવો જેઠાએ. કેમ કે છબીના ચિત્ર જેઠે તે બરોબર જ મળતો આવતો હતો. તેમને જેઠાને અપાસાહેબને નવાઈ લાગી. અપા મનમાં આવા તર્કવિતર્ક કરવા લાગ્યા. એટલામાં તો પેલા ફીરે હાથ લંબાવ્યો અને અપાએ તેમના હાથમાં એક ડ્રિપિયો મૂક્યો. ફીરે બીજે ડ્રિપિયો માંગતાં તે પણ આપ્યો. ફીરને તેમણે બીજે ડ્રિપિયો પણ આપ્યો. ઇતાં ફીર વધારે માંગવા માંડયો. આશ્રય અને નવાઈ તો હવે લાગે છે. વધારે દક્ષિણા માંગતાં અપાએ ફીરને કહ્યું કે તમે ઘેર આવો છો ને? એક ડ્રિપિયો વધારે આપીશા.’ ફીરે કહ્યું, ‘સારું’ અને તેઓ ઘરે જવા માટે પાછા ફર્યા. ઘરે પહોંચતાં જ અપા સાહેબે ત્રણ ડ્રિપિયા કાઢીને હાથમાં મૂક્યા. હવે બધા મળીને નવ ડ્રિપિયા થયા છીતાં ફીરને સંતોષ થયો નહીં. તેમને વધારે દક્ષિણાની માંગણી કરતાં અપા બોલ્યા, ખરેખર હવે બસ દશની જ નોટ રહી છે, અને છૂટા ડ્રિપિયા બધા ખલાસ થઈ ગયા છે. તે સાંભળી ફીર બોલ્યા, ‘નોટ જ આપી હેને! અને અપા સાહેબે તેમજ કર્યું. દરા ડ્રિપિયાની નોટ આવતાં જ પેલા ફીર છૂટા નવ ડ્રિપિયા પાછા આપી દીધા અને આવ્યા હતા તે રસ્તે જ પાછા ઉતાવળે જતા રહ્યા. (ઓ. ૧૭૫-૧૮૫)

આ કથાનો સાર જેઠાએ તો જે બક્તોનો જેવી રીતે ઉદ્ધાર થતો હોય તે પૂરો કરવો તે સાઈનું વ્રત જ છે. શ્રોતાઓની સાંભળવાની ઉત્સુકતા જેઠાને, આવા જ અર્થની બીજી એક કથા પ્રસંગ અનુરૂપ યાદ આવતાં, તે કથાને શ્રોતાઓએ ખૂબ આશ્રયથી સાંભળવી. દહણણું ગામમાં રહેતા હરિભાઉ કર્ણિક નામના, સાઈના એક દાસ અને ભાવિક ભક્ત હતા. ઈ.સ. ૧૯૧૭ની સાલમાં ગુરુપૂર્ણિમાનો પવિત્ર દવિસ જેઠાને શિરડીની યાત્રા કરવા માટે તેઓ આવ્યા હતા. તેમની પણ એક નાનીસરખી વાર્તા કહું છું. યથાવિધિ પૂજન કરીને તથા ભાબાને દક્ષિણા અને વસ્ત્ર અર્પણ કરીને અને તેમની આજ્ઞા લઈને નીચે ઉત્તરતાં તેમના મનમાં એક વિચાર આવ્યો કે ફરીથી મસ્લિદમાં જઈને બીજે એક વધારાનો ડ્રિપિયો બાબાને આપવો. પરંતુ તે વિચાર તેમણે પહુંચો મૂક્યો. અને તે ડ્રિપિયો પાછો ગજવામાં મૂકી દીધો. જે ગૃહસ્થે માધવરાવ દેશપાંડે પાછા જવાની આજ્ઞા અપાવહાવી હતી. તેમણે ઉપરથી જ ઈશારો કર્યો કે હવે એક વખત આજ્ઞા થઈ એટલે આગળ ચાલ્યા જવું. તેમના દશારા ઉપર વિશ્વાસ મૂકીને કર્ણિક કંઈ પણ બોલ્યા વીના ચાલ્યા ગયા અને મિત્ર સાથે રસ્તામાં નાસિકમાં રોકાયા. કર્ણિક કાળા રામની મૂર્તિવાળા મંહિરમાં જતા હતા ત્યારે તેમને અચાનક સંત નરસિંગ મહારાજ નજરે ચઢ્યા.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

મહારાજ ભલે ભક્ત પરિવારથી વીટળાયેલા હતા. છતાં એકાએક ઉભા રહ્યા અને કણ્ઠિકની બોચી પકડીને બોલ્યા, ‘મારો ડ્રિપિયો આપ.’ તેથી કણ્ઠિક આશર્યમાં ગરકાવ થઈ ગયા. તેમણે ખૂબ જ પ્રેમથી તેમને એક ડ્રિપિયો આપ્યો. મનની ઈચ્છા પૂરી કરનારા આ સાઈ ડ્રિપિયાનો સ્વીકાર કરી રહ્યા છે એવું જ કણ્ઠિક અનુભવ્યું. સાઈ સ્વીકારતા હતા એ પણ ખું નથી. ધ્યાનમાં ન હોવા છતાં પણ ગમે તેમ આયોજનો ગોઠવીને બળજબરીથી તેઓ શિરડી ખેંચી લાવતા અને દક્ષિણા માંગતા હતા. એવી જ આ વાત બની. (ઓ. ૧૯૬-૨૦૭)

મનની સ્થિતિ હંમેશા ડામાડોળ હોય છે. પ્રારંભમાં એક વિચાર આવે છે પછી વિચારોની લહેરો પર લહેરો ઉઠે છે. અને તેની પાછળ જે સારી ભાવના હોય અને તેની જ જે સારી ઉપાસના કરવામાં આવે તો તે એટલી જ કલ્યાણકારી સાબિત થશે. તેનું જ ધ્યાન કાયમ રાખવું. તેનો જ પાકો નિર્ધાર કરવો. તેનો વારંવાર જ ઉંડો વિચાર કરવો, અને તે ભૂલાય નહીં માટે પ્રયત્નપૂર્વક આપણે બોલેલા બોલ પાળવા. અપ્પાસાહેબ મનમાં બોલી ગયા જે હું હોત તો દશની નીચે। ના થઈ હોત વાત ॥ પણ વખત જતાં આગળ પાછળનું તેઓ ભૂલ્યા હોત. માટે તે શબ્દ બોલતાં જ બાબાએ તે ડ્રિપિયા પૂરા લઈ લીધા અને ભક્તની અન્યથબી જગતને બતાવી દીધી. નહીં તો પેલા ફીકીર પાસે દશની નોટની સાથે મળીને ડ્રિપિયા ઓગણીસ થયા હોત તો તેણે અપ્પાને નવ ડ્રિપિયા પાછા કેમ આપ્યા? તેનું કારણ કે અપ્પાની દસ ડ્રિપિયા આપવાની અતૃપ્ત ઈચ્છા હતી માટે. બાબાનો હસ્તસ્પર્શ થયેલા નવ ડ્રિપિયા જે પૂતળીઓના હાર જેવા માટે નવધા ભક્તિની જેડની યાદ આપવાની બાબાની આ રીત છે. અધ્યાય ૪૨માં દેહ વિસર્જનની કથા સાંભળતા જણાશે કે બાબાએ જને દેહન્યાગ કરતી વખતે લક્ષ્મીબાઈને નવ ડ્રિપિયાનું દાન કરેલું. તેની ઉપરથી બાબાની દાન કરવાની અને અભિનવ રીત વાંચકોને સમજશે. અપ્પાસાહેબની પત્નીએ કાયા, વાચા અને મનથી એક જ ડ્રિપિયો દાનમાં આપ્યો હતો, છતાં પેલા ફીકીર તેને અતિશય સમાધાન વૃત્તિથી સ્વીકાર્યો અને વધારે કોઈ માંગણી પણ કરી નહીં. પરંતુ પોતાની પત્નીને આપેતી દક્ષિણા અપ્પાને ઓછી લાગી. અને જે હું હોત તો પેલા ફીકીરને દશગણું આપ્યું હોત એવું તેઓ મનમાં બોલેલા. આ પ્રકારે દશ ડ્રિપિયા આપવા, અપ્પાસાહેબ વચનબદ્ધ થયા તે સંપૂર્ણપણે ન આપતાં તે વચનમુક્ત અને ઋણમુક્ત કેવી રીતે થઈ શકવાના? આ ફીકીર કોઈ બીજી જેવો સાધારણ કોઈ બિખારી ન હતો કે કાંઈ પણ હાથમાં મુક્તાં પાછો વળી જય. દિવસ પણ બદલાયો ન હતો. અને અપ્પા દશ ડ્રિપિયા વિષે બોલ્યા તે જ દિવસે તેઓ પાછા આવ્યા. પરંતુ તે કોઈ અન્યથો ફીકીર હશે તેમ સમજને અપ્પા શંકામાં રહ્યા. આરંભમાં તેણે માગણી કરતી વખતે અપ્પા પાસે જ ડ્રિપિયા હતા છતાં તેમને તે આખી રકમ ફીકીરને આપવા માટે વાપરી નહીં. માગેલ રકમ આપવા માટે પુષ્કળ આનાકાની કરેલી. પહેલાં તેમણે ચિત્રે પાસેથી ઉછીના ડ્રિપિયા લીધા, પછી ઘરે પાછા ફરતાં કહ્યું કે એક માત્ર ઝા. દસની નોટ જ બાકી રહી છે અને છુટા પૈસા ખલાસ થઈ ગયા છે પરંતુ ફીકીર પોતાની હઠ છોડી નહીં. અપ્પા ઉપર જે પ્રેમ ન હોત તો બાબા ફીકીરનો વેશ ધારણ કરીને શા માટે આવ્યા હોત અને દક્ષિણા માંગવાનું નિમિત્ત ન કરત તો આ કથામાં માધુર્ય કેવી રીતે વધત? અપ્પાસાહેબ તો માત્ર નિમિત્ત છે. તમારી મારી પણ આ જ દશા થઈ હોત. ભલે શક્યાતમાં આપણો ધ્યેય સારો હોય છતાં તે વખતે પ્રસંગ અનુસાર આપણો વર્તાવ બદલાઈ જય છે. મોઢે આપણે બધું જ બોલવા માટે તત્પર હોઈએ છીએ. પણ દાન આપતી વખતે મનમાં શંકા થતાં મન ડામાડોળ થાય છે અને જીવ ઉપર નીચે થઈ જય છે. મક્કમતા તો ભાગ્યે જ કોઈનામાં હોય છે. હિતવાળું અને થોડું બોલનારો તથા બોલ્યા પ્રમાણે વર્તનારો અને પોતાના બોલ ખરા કરી બતાવનારો એવો હરિનો લાલ કોઈ એકાદો જ હોય છે. (ઓ. ૨૦૮-૨૨૪)

જે ભક્ત અનન્યપણે ભક્તિ કરનારો હશે તેને જે જેઠાએ છે અને તેની જે ઈચ્છા હશે પછી એ આ લોકની હોય કે પરલોકની સાઈ તે આપવા માટે સમર્થ છે. અપ્પાસાહેબ ભલેને હોશિયાર હતા, અંગેલ ભાષાના જણાકાર હતા, છતાં

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સરકાર તેમને શરૂઆતમાં ચાલીસ ડિપિયા જ પગાર આપતી હતી. એ પગાર ત્યારબાદ બાબાની એ છબી મળતાં આસ્તે આસ્તે વધતો ગયો. ચાલીસ કરતાં તો ખૂબ ઊંચા પગાર ઘોરણે તે હવે પહોંચ્યા હતા. બાબા એક આપતાં દશ ગજું આપે છે, દશ ગજી સત્ત અથવા તો અધિકાર આપે છે. આ તો બાબાનો બધાને જ થતો અનુભવ છે. તે સિવાય આવી નિષાને લીધે પરમાર્થની દષ્ટિ વધવા લાગે છે. તે કોઈ સાધારણ કે સામાન્ય વાત છે ? સાચે જ બાબાનું કૌશલ્ય અનેક પ્રકારની વિચિત્રતાઓથી ભરેલું હતું. આગળ અપાસાહેબે બાબાની આપેલી ઉદ્દી મંગાવી જેઠ તો તે એક પડીકી હતી. તેને ઉધાડીને જેતાં તેમાંથી ઉદ્દીની સાથે ચોખાના દાણા અને ફળ પણ નીકળ્યાં ત્યારે અપાસાહેબે એનું એક તાવીજ બનાવી દીયું, અને પૂજયભાવથી તેને પોતાના હાથ પર બાંધ્યુ. ત્યારબાદ બાબાના પ્રત્યક્ષ દર્શન કર્યા પછી બાબાએ જે વાળ આપ્યો હતો, તે પણ અતિ પ્રેમથી તે તાવીજમાં મુકી દીધો. (ઓ. ૨૨૫-૨૩૨)

બાબાની ઉદ્દીના મહિમાનું શું વર્ણિન કરવું ? ઉદ્દી તો શંકરશંભુનું પણ આભૂષણ છે. અંતઃકરણમાં શ્રદ્ધાભાવ રાખીને કપાળ ઉપર જે કોઈ લગાડશે તેનાં વિધનો તાત્કાલિક દૂર થઈ જશે. હાથપગ ઘોરિને અને સ્નાન કર્યા પછી જે ઉદ્દી શરીર પર ચોળશે અને બાબાના તીર્થની સાથે એનું પાન કરશે તે પુણ્ય સંપાદન કરી પવિત્ર બનશે. આ સિવાય પણ આ ઉદ્દીનો વિશેષ ગુણ એવો છે કે તેને શરીર ઉપર લગાડતાં કે મોઢામાં મુક્તાં ભક્તને પૂર્ણ આયુષ્ય મળે છે. તેનાં પાપનો સંદંતર નાશ થાય છે. અને સદાસર્વદા તેને સુખ સમાધાન પ્રાપ્ત થાય છે. (ઓ. ૨૩૩-૨૩૫)

એવી આ મધુર કથારૂપી અમૃતની મિજબાની સાઈભાબાએ આપાને આપી ત્યાં આપણે તો ન બોલાવેલા અચાનક પદારેલા મહેમાન છીએ. છતાં પંગતમાં બેસીને પેટ ભરીને જ્યબંનું. મહેમાન અને ધરમાલિક બંને માટે એક જ પ્રકારના આદરસ્તકારપૂર્વકની મિજબાની છે. રસ અને સ્વાદમાં બેદભાવ નથી. આત્માનંદરૂપી ભોજન લઈને આપણે સૌએ તૃપ્ત થવું, હેમાઠપંત સાઈચરણમાં શરણે આવેલા છે. આટલું જ શ્રવણ હવે બસ. આગલા અધ્યાયમાં ઉદ્દીનું આનાથી પણ વધારે મહત્ત્વ સમજવવામાં આવશે. ઉદ્દીને ઘસવાથી અને સાઈના દર્શન કરવાથી, હાડકામાં ઉદ્દી ઉત્તરેલો તાવ, તેમજ, જૂનું ચાંદુ જડૂળથી કેવી રીતે સારું થયું હતું, તેવી જ રીતે કૃમિ જેવા વાળાના જંતુઓથી થતા રોગની હકાલપદ્ધી અને ગાંઠીયા તાવ એટલે કે પ્રેરણનો ઈલાજ કેવી રીતે થયો હતો તે ધ્યાન દઈને સાંભળજો. (ઓ. ૨૩૬-૨૩૮)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા, ભક્ત હેમાઠપંત રચિત,
શ્રી સાઈસમર્થના સત્યચરિત્રનો ‘ઉદ્દી-પ્રભાવ’. નામનો તેત્રીસમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણા.



॥ અધ્યાય ૩૪ ॥

ઉદ્દી મહિમા

(વાખ્યાની ઉદ્દીનું માહાત્મ્ય)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

પાછલા અધ્યાયમાં ઉદ્દીનું સચોટ માહાત્મ્ય વર્ણિવામાં આવ્યું છે. આ અધ્યાયમાં પણ તેને વિષે જ કહીને ઉદ્દીના ગુણોનું અને લક્ષણોનું વધારે વિવેચન કરીએ. પાછલી કથાના અનુસંધાને ઉદ્દીના પ્રભાવ વિષે હવે શ્રોતાઓએ સુખપ્રાપ્તિ માટે તેને સ્વસ્થ ચિત્તે સાંભળવું. સુધરવામાં અને સહન કરવામાં અતિશાય તકલીફવાળો હાડકાનો ઊંડો ઉત્તરેલો તાવ, અને ચાંદાનો અસાધ્ય રોગ, જેમાં કોઈ પણ પ્રકારના ઉપાયોથી એકદમ આરામ થતો ન હતો. તેને સાઈબાબાએ પોતાના હાથે ઉદ્દી ચોળીને લગાવાથી જઈમૂળથી સારો કર્યો હતો. આવી આ ઉદ્દીની અનેક વાતાઓ છે. આ તો એના નિર્દેશન માટે તેમાંની એક કથા કહી રહ્યો છું. જે ખૂબ જ અનુભવવાળી હોવાને લીધે શ્રોતાઓને સાંભળતા અવશ્ય નવાઈ લાગશે. નાસિક જિલ્લાના માલેગાંવ નામના ગામમાં એક ડૉક્ટર હતા. તેમના ભાણાને અમુક પ્રકારનો વિચિત્ર દુઃખાવો રહેતો જે કોઈ પણ પ્રકારનાં દવાદાર્થી મટતો જ ન હતો. પોતે ડૉક્ટર હતા, મિત્ર પણ ડૉક્ટર હતો. બંને શક્તિક્ષિયા વગેરેમાં અનુભવી અને નિષ્ણાત હતા. તેમણે અનેક પ્રકારના ઉપાયો કર્યા પછી તેઓ થાક્યા અને શું કરવું તે માટે બુદ્ધિ બહેર મારી ગઈ. કંઈ સૂજ પડે નહિ. તે રોગનું નામ હતું હાડકાનું અસાધ્ય ચાંદુ. એ રોગ મહાભયંકર અને સહન કરવામાં તથા દર્દીને સારુ થવા માટે ખૂબ જ વ્રાસદાયક હતો. તેને દવાદાર્થા ગુણ બિલકુલ લાગતા ન હતા. દેશી અને વિદેશી બંને પ્રકારના ઉપચાર થઈ ચૂકેલા. તેમણે જે યોગ્ય લાગ્યું તે બધું જ કરી જેયું. બાકી કાંઈ પણ રાખ્યું નહીં. પણ કોઈ ઉપચારને યશ મળ્યો નહીં. ભાણો ઉભરમાં નાનો હતો, અને તેનાથી હવે વેદના સહન થતી ન હતી. અસહ્ય દર્દીને તેનો જીવ આકળવિકળ થતો હતો. તે જોઈને તેનાં સગાસંબંધીઓ પણ દુઃખી થતાં હતાં. બધા ઉપાયોથી પરાકાશા આવી ગઈ. પરંતુ રોગ કાખૂમાં આવતો ન હતો. ત્યારે પોતાની અંદરના માણસો મિત્રમંડળ અને સગાઓને પણ થવા લાગ્યું કે હવે ઈશ્વર ઉપર છીડો અને તેમની આરાધના કરો. પણ હેવો કે કુલગુરુ કોઈ આ બાબતમાં પોતાની કમાતા બતાવી શક્યા નહીં. (ઓ. ૧-૧૦)

એટલામાં તેમના કાન પર વાત આવી કે, શિરડી મુકામે કોઈ એક પ્રખ્યાત મુસલમાન સાધુ જેવો એક ઓલિયો રહે છે. શિરડીના આ મહા સંતશ્રેષ્ઠ અને યોગી મહારાજ ફક્ત દર્શન માત્રથી દુઃખાવા દૂર કરી નાખે છે. આથી તેના માબાપને સાઈના દર્શાની દૃઢા જગ્યત થઈ અને મનમાં નક્કી કર્યું કે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને અને ઈશ્વરનું નામ લઈને આ પણ એક છેલ્લો ઉપાય કરી જોઈએ. ‘લોકો કહે છે કે પેલા મોટા ફીર પોતાના હાથે ઉદ્દી લગાડે તેથી ભયંકર અસાધ્ય રોગ પણ ભાગી જય છે. આ વાતનો અનુભવ કરવામાં આપણાં શું જય છે? ચાલો એનાં પણ ચરણોમાં જઈને તેમને નમસ્કાર કરીએ. છેલ્લે આ ઉપાય પણ અજમાવી જોઈએ. કદાચ તેનાથી તેને સારું પણ થઈ જય અને સંકટ ટળે. તેમાંથી ઉગારવાનો આ એક જ માર્ગ દેખાઈ રહ્યો છે.’ એ છોકરાના માબાપ ઘરવખરી વગેરે ઠેકાણે મૂકીને તથા સાઈદર્શન માટે ઉત્સુક થઈ તે જઈથી શિરડી આવી પહોંચ્યાં અને બાબાના દર્શન કર્યાં અને ચરણોમાં કર્યાં અને ચરણોમાં

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

બેસીને પોતાના છોકરાનું દુઃખ કહી સંભળાયું. તે બાબા સામે ઊભા રહીને દ્યામણા મુખે હાથ જોડી બાબાને આજીજ કરવા લાગ્યા. ‘આ રોગથી અમારું બાળક પીડાય છે. એનું દુઃખ અમારાથી જેવાતું નથી. હવે આગળ શું કરવું તેની સમજ પડતી નથી. તેની સારા થવાની અમને કોઈ આશા દેખાતી નથી. હે સાઈ સમર્થ ! અમે આ અમારા છોકરાની આવી દુર્દશા જેઠને ખૂબ જ ચિંતામાં ઘેરાયેતા અને થકેતા છીએ. તો તેના માથા ઉપર આપનો અભયવચનનો હાથ મૂકીને એનું દર્દ સારું કરો. આપનો મહિમા સાંભળીને અમે અહીં આવ્યા છીએ. અમને બસ આટલું જીવતદાન આપો.’ આ સાંભળીને કરુણાની મૂર્તિ સાઈ તેમને આશ્વાસન આપતાં બોલ્યા, ‘આ મસ્ઝિફના આશ્રમે જે કોઈ આવે છે, તેમની ક્યારેય દુર્દશા થતી નથી.’ હવે તમે ચિંતા કરતા નહીં. આ ઉદ્દીને એના જખમ ઉપર લગાવી દો. ચાર છ દિવસોમાં ફરક જણાઈ આવશે. દેવ ઉપર ભરોસો રાખો. આ મસ્ઝિફનથી. ‘દ્વારાવતી’ એટલે શ્રીકૃષ્ણની દ્વારકા છે. તમને પણ એનો અનુભવ થશે. ‘જે કોઈ આ મસ્ઝિફના પગથિયાં ચદશે તેને આરામ નહીં થાય એવું ક્યારે પણ બનશે નહીં. એનો તો બેડો પાર થયો જ સમજને.’ (ઓ. ૧૧-૨૫)

પછી બાબાની આજ્ઞા થતા પેલા દુઃખથી પીડાતા છોકરાને પોતાની સામે બેસાડીને બાબાએ તેના પગ ઉપર પ્રેમથી હાથ ફેરવીને તેની સામે કૃપા દર્શિથી જેયું. આ દર્દ તો ફક્ત શારીરિક જ હતું. પણ તે દૈવયોગથી આવેલું હોય કે ભયંકર માનસિક હોય, બાબાના દર્શનથી જ એ જહમૂળથી હૂર થતું. શ્રી સાઈનું ખૂબ દર્શન થતાં જ પેલા છોકરાનું બધું દુઃખ, અને દર્દ પોતાની જગ્યાએ જ રહી ગયું. તેમજ તેમના અમૃતતુલ્ય શર્ષદો સાંભળીને પેલા અસાધ્ય ચાંદાના રોગવાળા છોકરાને ખૂબ જ સારું લાગ્યું. આખો પરિવાર ત્યાં લગભગ ચાર પાંચ દિવસ સુધી રહ્યો. પેલા છોકરાનો અસાધ્ય રોગ ધીમે ધીમે સુધરવા લાગ્યો અને સાથે સાથે સંતુષ્ટ થઈને અને આનંદિત મને પોતાના ગામ પાઇએ. હાડકામાં ઉંડો ઉત્તેલો સડો, આ રીતે મટાડવો તે કોઈ નાનો સૂનો ચમત્કાર ન કહી શકાય. ઉદ્દી અને કૃપા દર્શિનો આ ઉપચાર અપૂર્વ ના કહેવાય ? આમ સહ્ભાગે મહાપુરુષોનાં દર્શન થયાં અને તેમનું આશ્વાસન અને કલ્યાણકારી આશિવર્યનોનો લાભ થયો. તેથી પેલા છોકરાને તેના દુઃખનું સંપૂર્ણ નિવારણ થયું. આમ થોડા દિવસો પસાર થતાં અને ઉદ્દી ચાંદા ઉપર દરરોજ ધસતાં તે જખમ ધીરેદીરે સુકાવા અને ભરાવા લાગ્યો. સમય જતાં પેલા છોકરાને સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થયું. (ઓ. ૨૬-૩૩)

તે છોકરાના ભાઈએ એટલે કે કાકાના છોકરાએ આ વાત માલેગાંબમાં સાંભળી અને સાઈદર્નની ઉત્સુકતા થઈ. મુંબદી પાછા વળતાં આ દીચ્છા પૂરી કરીશું એવું નક્કી કર્યા પછી જ્યારે તે મુંબદી જવા નીકળ્યા તે સમયે માલેગાંબ અને મનમાંડ પાસે કોઈએ તેના મનમાં સંશયના બીજ રોચ્ચાં અને શિરરી જવાનો કાર્યક્રમ તેણે મોકુફ રાખ્યો. સત્કાર્યોની આવી જ શરૂઆત હોય છે. શરૂઆતમાં કુત્સિત લોકો કાંઈ આવું જ બોલીને આ રીતે અદ્યાણો ઊભી કરતા હોય છે. પણ જે આવા લોકોનું કહ્યું માનતા નથી તેમને જ સત્કાર્યો પાર પાડવાને લીધે મરણોત્તર સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. તે કાકાનો દીકરો સાઈનાં દર્શન કરવાનું છોડીને છેક મુંબદી પહોંચી ગયો. વ્યવસાયે તે ડોક્ટર હતો. વધેતી રજાઓ તેણે અલિબાગમાં પસાર કરવી એવો મનમાં વિચાર કર્યો. આવો કાર્યક્રમ નક્કી થયા બાદ સતત ત્રણ રાત્રી ઊંઘમાં તેણે અવાજ સાંભળ્યા, ‘હજુ તને મારી ઉપર વિશ્વાસ નથી કે ?’ આવી આકાશવાણી અથવા ગેબીવાણી સતત ત્રણ દિવસ સુધી સાંભળવાથી ડોક્ટર મનથી આશ્ર્વયચક્તિ થયો અને એ અવાજમાં ખેરખર કોઈ સર્ચાઈ છે અને અર્થ છે એમ સમજુને તેણે શિરરી જવાનો નિશ્ચય કર્યો. પણ એક રોગીને વિષમ જવર-ટાયફ્ઝેટિડ થયો હતો તેનો આ ડોક્ટર પાસે જ ઈલાજ ચાલતો હતો. આ દર્દને આરામ થતાં ડોક્ટરે તરત જ નીકળવાનો વિચાર કર્યો. પરંતુ બીમારનો તાવ વધ્યો. કરેલ ઉપચારનો ગુણ ન મળતાં તાવ સહેલે ઉત્ત્યો નહીં, અને આ કારણે શિરરી જવાનું ઢેલાતું જતું હતું. ડોક્ટરે નિશ્ચય કર્યો કે જે આજે આ બીમારને ફરક પડવા માંડશે તો હું એક પણ ક્ષણ ન વેદ્ધિતાં તરત

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

શિરડી જવા માટે પ્રયાણ કરીશ. આવો પાકો નિર્ધાર કરતાં થોડા જ કલાકોમાં તાવ પણ ઉત્તરી ગયો અને એનો ધ્યેય પણ સફળ થતા ડૉક્ટર શિરડી જવા માટે નીકલ્યો. નક્કી કર્યા પ્રમાણે તે શિરડી ગયો અને મનથી અને શ્રદ્ધાથી બાબાની ચરણોમાં વંદન કર્યા. બાબાએ પણ તેના અંતર્ગત મનના અનુભવોની ખાત્રી કરાવી આપી, અને પોતાની સેવામાં તેનું ધ્યાન દઢ કર્યું. બાબાની અગાધ લીલા અને ભહિમા જેઠિને ડૉક્ટર ખૂબ જ વિસ્મય પામ્યા. લગભગ તેઓ ચાર દિવસ શિરડીમાં રહ્યા અને ખૂબ આનંદિત મને પાછા વલ્યા. આ વાતનો માંડ પંદર દિવસ વિત્યા હશે એટલામાં એમની બીજાપુર બઢતી સાથે બઢતી થઈ. હાડકાના સડાની તકલીફ ને કારણે સાઈદર્શનની કલ્પના ઉદ્ભવી અને સંતદર્શનનો ચસકો લાગતાં અંતે તેને સાથે સુખનો ભંડાર મળ્યો. (ઓ. ૩૪-૪૭)

એક વખતે બાબાના ભક્ત ચિંહબરમ્ પિલ્લે વાળાના દર્દથી (Guinea worm) પીડાતા હતા. એક પર એક એવા સાત મોઢાંઓ નીકલ્યાં હતા. જેના કારણે પિલ્લે કંટાળી ગયા હતા. સાઈબાબાને પિલ્લે ઉપર ખૂબ જ પ્રેમ હતો. બાબા તેમને ‘ભાઉ’ એવા હાલા નામની બોલાવતા હતા અને હમેશાં ખૂબ ઉત્સૂકતાથી તેમના ખબરાંતર પૂછતા. સવારે અને સાંજે મસ્જિદના કઢેરા પાસે તેમની કાયમની જગ્યા હતી અને બંને જણ એકબીજાની વાતોમાં ખૂબ જ રંગાઠ જતા. બાબાને ચલતું પીવા માટે ભાઉની જરૂર પડતી. બીડી પીતા પણ ભાઈ જેઠાં, અને કોઈ પણ વાતનો નિર્ણય કરતાં તેમને ભાઉની જ જરૂર પડતી. તેઓ જે પાસે ન હોય તો બાબાને જરા પણ ગમતું નહીં, આવી એ બંનેની વાત હતી. વાળાની વ્યથા શારીરિક અને માનસિક રીતે સહન ન થતાં, તેઓ ખૂબ જ અશક્ત થઈને અપંગ જેવા થઈ ગયા હતા. આ રોગના દુઃખાવાના ત્રાસથી પોતાના જીવન ઉપર તેમને કંટાળો આવવા માંડ્યો. આવા સંલેગોમાં પણ પિલ્લેના મુખમાં એક સરખુ સાઈનામ જ રહેતું. હવે આ યાતના બસ હવે બહુ થઈ. આના કરતાં તો મરણ સારું એવું વિચારિને તેઓ બાબાના શરણમાં આવ્યા. તેમણે બાબાને સર્દિશો મોકલાવ્યો, ‘આ દુઃખ બોગવીને હવે હું કંટાળ્યો છું, શરીર ઉપર કેટલા જરૂર ? તેને સહન કરવાની મારામાં હવે શકિત રહી નથી. જંગીભર આવું શુદ્ધ વર્તન રાખવા છતાં આવા વિચિત્ર દુઃખની પરિસ્થિતિ મને જ કેમ ? ખોટાં કર્માનો સહારો કયારેય મેં લીધો નથી, તો આ પાપ મને જ શા માટે ? બાબા ! આ વાળાની વેદના હવે મારાથી સહેવાતી નથી. એના કરતાં તો ભલે મને મરણ આવે, આ યાતના હું આગળના જન્મમાં બોગવી લઈશ. બોગ બોગવ્યા સિવાય માણસનો ધૂટકો નથી. એ ને બોગવતાં બાકી રહી ગયાં તો બીજા જરૂર મેં તે બોગવા પડે છે. પરંતુ પ્રારંધના બોગ કયારેય ધૂટતા નથી. આ હકીકત મારા જેવા જરૂર બુદ્ધિનાને પણ ખબર છે. હું સુખેથી બીજા દરશ જન્મ લઈશ અને ત્યાં મારાં કર્માનાં ફળ બોગવીશ, આ જન્મનો અંત કરવા માટે આટલું મને વરદાન આપો. આ જન્મનું જીવનું હવે બસ મને આ જન્મમાંથી છોડાવો. આ દુઃખ સહન કરવું તે મારા વશની વાત નથી. બસ આટલું જ માંગુ છું.’ ડૉક્ટર પિલ્લેની આવી પ્રાર્થના સાંભળીને અનેક સિદ્ધિ પ્રાપ્ત થયેલા યોગોના રાજ યોગીરાજ સાઈબાબાના અંત:કરણમાં દ્યા ઉપજુ અને પિલ્લે માટે અને તેના સમાધાન માટે, બાબાએ જે કૃપાર્થી અમૃતનો વરસાદ વરસાદ્યો તે હવે સાંભળો. (ઓ. ૪૮-૬૦)

પછી ડૉક્ટર પિલ્લેની અતિશય દુઃખી અવસ્થા જેઠિને તેને દૂર કરવા માટે ભક્તોની ઈરછા પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ સમાન સાઈબાબાએ શું ઉપાય કર્યો તે જેઠાં. કાકાસાહેબે લાવેલા પિલ્લેના સર્દિશાને અને તેની બધી હકીકત જણીને બાબા બોલ્યા, ‘તેને જેઠિને કહો કે, તું મનમાં જરાય ચિંતા કરતો નહીં.’ અને પિલ્લેને બીજે સર્દિશો મોકલાવ્યો, ‘દરશ જન્મની પંગુતા શા માટે જેઠાં છે ? કોઈ જુદ્દી જ પદ્ધતિથી તેના હિસ્સા પાડીને દરશ દિવસોમાં જ આ બોગને બોગવી લઈએ.’ મોકા સ્વાર્થ અથવા તો પરમાર્થ આપવા માટે તો હું સમર્થ બેઠો છું. તેમ છતાં આ તારી છેવટની ઈરછા કેમ ? મરણનું સંકટ તું શા માટે ઈરછે છે ? પિલ્લેને ઉચ્ચકીને અહીં લઈ આવો. આ બોગ બોગવીને સહન કરીએ તેવા ડરથી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ગભરાતા નહીં. અને પીઠ ઉપર ઉંચકીને લઈ આવો. આવી સ્થિતિમાં ડૉ. પિલ્લેને મસ્ટિજદમાં લાવ્યા અને બાબાએ પોતાનો તકિયો કાઢીને તેમને આપ્યો. ફરીરખાબા જમણી બાજુએ બેસતા હતા તે જગ્યાએ પેલો તકિયો મુકાવડાઓ અને બોલ્યા, ‘આવ ચૂંપચાપ અને ટેકીને પડી રહે નકામી ચિંતા કરતો નહીં. સ્વસ્થ રીતે પગ લાંબો કર એટલે તને આરામ થશે. એકત્ર થયેલું પ્રારંભ ભોગવ્યા વગર બીજે કોઈ રસ્તો નથી. ખરો ઉપાય તો આ જ. ગમતું કે ન ગમતું, સુખ અથવા દુઃખ, અમૃત કે ઝેર આ જ્લેડકાંઓનો પ્રવાહ તો સતત વહેતો જ રહે છે. તેનો માણસે હર્ષ કે શોક કરવો નહીં. નસીબમાં જે કાંઈ હોય તે સહન કરતા જલ્દ. પરમેશ્વર આ જગતનો શાસનકર્તા છે, અને તે જ પાછો સંરક્ષણકર્તા પણ છે. અલ્લા માલિક વાતી હૈ એનું ચિંતન સદ્ગ્રાહી કરવું અને કરતા રહેવું એટલે એ બધી જ ચિંતા પોતાની ઉપર લઈ લે છે. મન, ધન, શરીર અને વાચા આ બધું તેના ચરણોમાં મૂકી લીન થઈ જવું. તેનું નિરંતર સ્મરણ કરતા રહેવાથી તેની અગાધ લીલાઓનો પ્રત્યક્ષ અનુભવ થશે.’ (ઓ. ૬૧-૭૧)

એ સાંભળતા ડૉ. પિલ્લે બોલ્યા, ‘નાનાસાહેબ ચાંદોરકરે વાળા ઉપર પાટો બાંધ્યો છે, પણ એનાથી કોઈ ફેર પડ્યો નથી.’ બાબા તરત બોલ્યા, ‘નાનો તો મૂર્ખ છે ! ગાંડો છે ! તું એ પાટો છોડી નાખ નહિતર મરી જઈશ, હવે એક કાગડો આવશે અને ચાંચ મારીને કાળું પાડશે અને પછી જ તું સારો થઈશ.’ આમ વાત ચાલતી હતી એટલામાં અબદૂલ દીવામાં તેલ પૂરવા માટે ઉત્તાવણે ઉપર આવ્યો. અચાનક શું બન્યું તે જુઓ ! અબદૂલ મૂળ નાંદીનો રહેનારો હતો. તે બાબાની સમાધિ પહેલાં નવ, દશ વર્ષ પહેલાં આશરે ઈ.સ. ૧૯૦૮માં બેરી છોકરાંને છોડીને આવ્યો અને કાયમ માટે શિરડીમાં રોકાઈ ગયો. તેના કહેવા પ્રમાણે તેઓ જ્યારે નાંદી હતા, ત્યારે ત્યાંના ફરીર અમર્દીન નામના ગુરુના સ્વર્જમાં આવીને બાબાએ બે કેરી આપેલી અને તે અબદૂલને આપીને અબદૂલને શિરડીમાં પોતાની પાસે મોકલવા માટે કહ્યું અને હિસાબે જ અબદૂલ બાબાની પાસે આવ્યો.

અબદૂલ શિરડીમાં આવ્યો અને બાબાના બધાં જ કામ કરવા લાગ્યો. શિરડીની સીમામાં આવેલા નાળા પાસે જઈને બાબાની કફીની વગેરે ધોતો. તેમજ મસ્ટિજદ અને આજુભાજુની જગ્યાનું સફાઈકામ, દીવાઓમાં તેલ પૂરીને દરરોજ સળગાવવા વગેરે કામ કરતો. આટલું જ નહિ બાબાના લેંડીબાગ જવા આવવાના રસ્તા ઉપર પહેલાં મળમૂત્રના ઢગલા બાજુમાં કાઢીને રસ્તો પણ સાફ રાખતો. માટે જ બાબા તેમને પ્રેમથી ‘હુલાલખોર’ – ભંગી કહેતા હતા. બાબા માટે નહાવાનું અને પીવાનું પાણી ભરી લાવવું. તેમજ લેંડીબાગમાંના નંદાટીપણે કાયમ પ્રજ્વલિત રાખવાનું કામ પણ અબદૂલનું જ હતું.

બાબાની શિખામણને લીધે અબદૂલ રાતના સૂતો પણ નહીં. મસ્ટિજદમાં હંમેશા બાબા પાસે બેસીને એ હંમેશા કુરાન વાંચતો હતો. તેમની પાસે એક ચોપડો હતો. તેમાં બાબા જે કંઈ બોલતા તે લખી લેતો. તે જ તેમનું કુરાન હતું. શિરડીમાં આવ્યા બાદ તેની પત્ની અને મા તેને બોલાવ્યાં હતાં, પસ્ંતુ તે બાબાના મોહમાં પડ્યો હોવાથી કદ્દીએ પાછો ગયો નહીં. ખરેખર અબદૂલનો વૈરાગ્ય અપ્રતિમ હતો. (ઓ. ૭૨-૭૮)

એક તો પહેલેથી જ આ મસ્ટિજદ નાની, સાંકડી અને અડચણોથી ભરપૂર હતી અને તેમાં પાછી ભક્તોની ભીડ રહેતી. તેમાં વળી પિલ્લાઠીની ગરબડ. અબદૂલ સાચવી સાચવીને પગલાં ભરવા લાગ્યો. પોતાના કામમાં તે મથ્ર હતો. તેનું બધું ધ્યાન દીવા તરફ હતું. તે જ કારણે તેનું પિલ્લે તરફ દુર્લક્ષ થયું અને એક વિચિત્ર પ્રસંગ બન્યો. અબદૂલ પણ એમાં શું કરે જે થવાનું હોય છે તે જ થાય છે અને થાય વગર રહેતું નથી. તેનો કોઈ ઉપાય નથી હોતો. પિલ્લેનો પગ લંબાવેલો હતો, ભૂતમાં અબદૂલનો પગ તેમના પગ પર પડ્યો. એક તો તેમનો પગ પહેલેથી જ સૂર્યેલો હતો અને તેમાં વળી અબદૂલનો પગ પડ્યો. પિલ્લેનો જવ કકળી ઉઠ્યો અને તેમણે મોટેથી એક ચીસ પાડી. તે ચીસ માથામાં સોંસરી પેસી ગઈ. પછી બે હાથ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

જેડીને કાકલૂદી કરતા શબ્દોમાં ભાબાને તેઓ કેવું વિનવવા લાગ્યા તે સાંભળો. વાળાનું મોઢું ફૂટતાં બગાડ બહાર વહેવા લાગ્યો. પિલ્લે દુઃખના માર્યાં એક બાજુથી મોટે મોટેથી રડતા જથ્ય અને બીજુ બાજુ આમ ગણગણતા જથ્ય.

કરમ કર તું મેરે હાલપર કરીમ । તેરા નામ હે રહેમાન ઔર રહીમ ॥

(યા અલ્લા ! મારી પરિસ્થિતિ ઉપર તું ફૂપા કર. તારું નામ દ્વારાણું અને દ્વારા છે.)

તૂ હી દોનો આલમકા સુલતાન હૈ । જહાંમેં નુમાયા તેરી શાન હૈ ।

(તું જ બંને જહાંનો સમ્રાટ છે. અને આ જગતમાં એક તારું જ મોટાપણું ખુલ્લેઆમ દેખાય છે.)

ફિના હોનેવાલા હૈ સભ કારોબાર । રહે નૂર તેરા સદા આશકાર ।

(આ બધો કારબાર નષ્ટ થવાનો છે, ફક્ત બધાને દેખાનારી તારી જ શોભા કાયમ રહેવાવાળી છે.)

તું આશિક કા સદા મદદગાર હૈ । (ભક્તોને તું સદા મદદ કરનારો છે.) (ઓ. ૭૫-૮૦)

પિલ્લેને રહી રહીને સાણકા મારવા માંડ્યા. તેમનો જીવ દુઃખથી કંપી ઉઠ્યો. અને શારીરિક રીતે બિલકુલ અસર્મથ થઈને પડી રહ્યા. બધાએ તર્ક કર્યો કે આ સાઈબાબાનો જ ખેલ છે. ભાબા બોલ્યા, ‘ભાઉ જેયું હવે ગાવા લાગ્યો ને ?’ પિલ્લેએ પૂછ્યું ‘પેલો કાગળો હજુ ચાંચ મારવા માટે આવવાનો બાકી છે કે ?’ ત્યારે ભાબા બોલ્યા, ‘તું જી, સ્વસ્થ વાડામાં પડી રહે. હવે ફરી પાછો કાગડો ચાંચ મારવા આવવાનો નથી. એ જ કાગડો જે આવીને તારા પગ ઉપર પગ મૂકીને ગયો, એ જ કાગડો ચાંચ મારીને ઉડી ગયો અને તારો વાળો સહંતર ચોપ્યો કરી નાખ્યો.’ કયો કાગળો અને કદ્ય વાત ! થનાર વસ્તુ હતી તે ભાબાએ પોતાની સમક્ષ જ કરાવી. કાગડો અબદુલના રૂપે પ્રગટ કર્યો અને પોતાના શબ્દો સાચા ડેરવી બતાવ્યા. ભાબાના શબ્દો તે ફક્ત શબ્દો ન હતા એ તો ખ્રબદ્ધેવે મનુષ્યના લલાટ પર લખેલ કયારેય ઓદૃંબ ન પડનારું ભવિષ્ય છે. તે પૂર્વે કરેલાં કૃત્યોનાં અથવા તો આચરણોનાં દરાવેલાં પરિણામોનું કંઈ ચાલવાનું નથી, એવી વ્યવસ્થા કરી છે. થોડા જ સમયમાં ભાઉને આરામ લાગવા માંડ્યો. ઉદ્દી ચોપડવી અને ઉદ્દી જ મોઢામાં મૂકવી એ જ બસ દવા અને તેનો ઉપાય હતો. રોગનો જઇમૂળથી નાશ થયો. આમને આમ દશ દિવસ વીત્યા. તેમના જખમમાંથી ભારીક તંતુઓ જેવી (રેશા જેવી) સાત જીવતી ઠયળો બહાર નીકળી, પિલ્લેની ભયંકર વેદનાનો અંત આવ્યો, અને દુઃખાવો તો બિલકુલ મટી ગયો. આવો આ ચમત્કાર જેઈને પિલ્લેના મનમાં ખૂબ આશ્રમ થયું. ભાબાનું ઉદાર આચરણ જેઈને આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. ભાબાનાં ચરણોમાં ત્યાં જ પિલ્લેએ બાથ ભરી લીધી, માનસિક ઉદ્વેગને કારણે તેમનો કંઈ ભરાઈ આવ્યો, અને હોઠ સિવાઈ ગયા. એક શબ્દ પણ બહાર નીકળી શક્યો નહીં. (ઓ. ૮૧-૮૦)

બીજે એક ઉદ્દીનો અનુભવ કહીએ, આ ઉદ્દીના પ્રભાવની વાર્તા અહીયાં પૂરી કરીએ. જેના મનમાં જેવી શ્રદ્ધા હોય છે તેવો જ અને ઉદ્દીનાં ગુણનો અનુભવ થાય છે. તે જ ગ્રંથના આ અધ્યાયનું મહત્વ છે. એક વખત માધ્યરાવના નાનાભાઈ ભાપાજી ઉપર સંકટ આવી પડતાં ઉદ્દીને કારણે જ તેમનું કલ્યાણ થયું. એવું આ ઉદ્દીનું સામર્થ્ય છે. એનાં હું કેટલાં વખાણ અને વર્ષાન લખું ? ગ્રંથિ જવર-ગાંધીયો તાવ લેણ વગેરે રોગો ઉપર ઉત્કૃષ્ટ દવા બીજી કોઈ નથી. સાઉલવિહિર ઉપર ભાપાજીનાં પત્નીને તાવ ચઢ્યો અને સાથળ ઉપર ગાંધો નીકળી. ભાપાજી મનથી ગભરાયો. રતના સમયમાં આવું ભયંકર ડર ઉત્પન્ન કરનારું દર્દ વધી ગયું. આ દર્દને લીધે તેની પત્ની ખૂબ હેરાન થઈ રહી છે તેમ સમજુને ભાપાજીના મનમાં અનેક શંકાઓ થવા લાગ્યી. તેની ધીરજ ખૂટી ગઈ અને રાતોરાત ત્યાંથી નીકળી ગભરાતા કાંપતા શિરડીમાં આવી ગયા. બીજે દિવસે પોતાના મોટાભાઈને બધી વાત કહી સંભળાવી. તેને બે ગાંધો નીકળેલી દેખાય છે અને સખત તાવથી ફંફડી ઉઠી છે. તેથી હેરાન પરેશાન થઈ ગઈ છે. ચાલો, તમે તેની ખબર કાઢવા માટે અને નજરોનજર

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

જેવા માટે. મને તો કાંઈ લક્ષણ સારાં દેખાતાં નથી. બાપાજુના આવા દ્વામણા શબ્દો સાંભળીને માધવરાવનું મન હાલી ઉઠ્યું. તેમના મોનું પાણી પણ ઊડી ગયું અને તેમના મનનું ડેકાણું રહ્યું નહિ. માધવરાવ ખૂબ વિચારશીલ માણસ હતા. ગાંધનું નામ પડતાં તેમના દિલમાં ઘડક પેસી ગઈ. ગ્રંથિ જીવરની તહફડાટ એક ઝટકામાં જીવલેણ સાબિત થાય છે તેની બધાને જ ખબર છે. (ઓ. ૮૧-૮૮)

પ્રસંગ સારો હોય કે નરસો, કાર્ય શુભ હોય કે અશુભ હોય, પણ બાબાનો મત જાણવો એવો સીધો સાદો રિવાજ શિરડીમાં હતો. પછી તેઓ જે જે કહેતા તે પ્રમાણે સૌ વર્તતા. ભક્તોનાં સંકટો તેઓ જ દૂર કરતા હતા. આવા કેટલાક અનુભવોનું કેવી રીતે અને કેટલાનું વર્ણન કરું ? આવી જ કાયમની પ્રથા પ્રમાણે, માધવરાવે એવો જ વિચાર કર્યો અને બધી હકીકત બાબાને સાચાંગ નમસ્કાર કરીને કહી સંભળાવી. તેઓ બોલ્યા, ‘સાઈનાથ ! આપનો જ્ય જ્યકાર થાઓ. અમારા જેવા અનાથો ઉપર દ્વા કર. હવે આ કેવું સંકટ અમારી ઉપર નાખ્યું છે ? ન હતી ત્યાંથી આ ઉપાધી ઊભી થઈ છે. તારા સિવાય બીજી કોની પાસે ફરિયાદ કરવા જઈએ ? આ બાપાજુની પત્નીની યાતના દૂર કર અને તેને આશીર્વાદના બે શબ્દો કહે. આ આવી પડેલા સંકટોમાંથી અમને બચાવ. તારા વીના અમને સહાયતા કરનાર બીજે કોણ છે ? તેનો આ પ્રાણધાતક જીવર સારો કર અને પોતાનું વ્રત સંભાળ.’ માધવરાવે સાઉલિલિર જવાની આજા માંગી, ત્યારે બાબા બોલ્યા, ‘આજે ને આજે ત્યાં જતો નહિ. પણ આજે કોઈની સાથે તેને ઉદ્દી મોકલાવી આપ. કેવી ગાંધો અને કેવો તાવ ! અલ્લા માલિક આપણો બાપ છે. તેનું દર્દ આપોઆપ સાચું થઈ જશે. અને તે કોઈ પણ સંદેહ વગર સુખદૃપ થઈ જશે. માત્ર સવારે સૂર્યોદય થયા પછી જ તું સાઉલિલિર જઈ આવજે. હમણાં જવાની ઉતાવળ જરાપણ કરતો નહીં. અહીંયાં જ સ્વસ્થાથી રહે. કાલે જઈ આવજે. વગર કામની તકલીફ શા માટે લે છે ? શ્રદ્ધાથી ઉદ્દી લગાડવી અને મોઢામાં મૂકવી. શા માટે ગભરાવાનું ?’ બાબાના આ શબ્દો સાંભળીને બાપાજુ થોડા ગભરાયા. તેમના મનમાં નિરાશા પેદા થઈ. આમ તો માધવરાવને ઉપયોગી વનસ્પતિ અને દેશી ઉપયારોની જાણકારી હતી. પણ તેનો ઉપયોગ કરી શકાય એવું હતું નહીં. એક માત્ર સાઈક્લ્યુપા વગર ઔષધને પણ ગુણ આવતો નથી આ વાતની ઊડી સ્કૂલ માધવરાવને હતી. તેમણે બાબાની આજા શિરોમાન્ય રાખી, ઉદ્દી મોકલાવી આપી, અને પોતે સ્વસ્થ મને ત્યાં જ શિરડીમાં રહ્યા. બાપાજુ એકલા નિરાશ થઈને પાછા ફર્યા. (ઓ. ૧૦૦-૧૧૨)

માધવરાવના કદ્યા પ્રમાણે બાપાજુએ પોતાની પત્નીને આખા શરીરે ઉદ્દી ચોળી આપી અને પાણીમાં ઓગાળીને પીવડાવી દીધી. થોડા જ સમયમાં તેને રેબજેબ પરસેવો છૂટવા માંડ્યો અને ગાઢ ઉંઘ આવી ગઈ. સવારે સૂર્યોદય થતાં તેને ખૂબ જ સાચું લાગ્યું. નહીં તાવ કે ના રહી પેલી એરી ગાંધો. બાપાજુ તો આશ્રયમાં દૂબી ગયા. અહીંયાં શિરડીમાં માધવરાવ સવારનું દૈનિક કાર્ય પતાવી, મસ્લિદમાં બાબાના દર્શન માટે આવ્યા. બાબાની આજા માંગી ઉદ્દી આશીર્વાદ લઈ બાબાને દંડવત્ પ્રણામ કરી સાઉલિલિર જવા માટે ઉભા થયા અને પગથિયા ઉત્તરતા જ બાબાએ આજા કરી, ‘રામા ! ઊભો ઊભો જ મળીને પાછો નીકળી જને ત્યાં વાર લગાડવામાં માલ નથી.’ પોતાના ભાઈની પત્ની વિહૂળ થઈ હશે. તે બાપડી ગાંધોની બળતરા અને દુઃખાવો સહન કરતી હશે. આવું વિચારીને માધવરાવને રસ્તામાં ચિંતા થઈ રહી હતી. બાબાએ તરત પાછો ફરજે એવું કહ્યું છે, એ કાંઈ સુચવવા તો નહેતા માંગતાને ? આ કોઈ બાબાનો ઈશારો તો નથી ને ? એવું મનમાં સમજુને ગભરાયેલા માધવરાવ રસ્તો જલ્દીથી ચાલીને કાપવા માંડ્યા. જે બાઈને રાતે ગ્રંથિજીવરનો આટલો સખત તાવ હતો તેને ચૂલા ઉપર ચા મૂકતો જેઈને માધવરાવને આશ્રયનો પાર ન રહ્યો. તેઓ પોતાના નાનાભાઈ બાપાજુને બોલ્યા, ‘આ તો રોજના કામમાં વ્યસ્ત દેખાય છે !’ તે સાંભળીને બાપાજુ બોલ્યા, ‘આ બધી કમાત બાબાની ઉદ્દીની જ છે. ત્યાંથી પાછા ફરીને તરત જ મેં તેને ઉદ્દી પીવડાવી દીધી. અને આખા શરીરે ચોળતાની સાથે તેનું શરીર

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પરસેવાથી તરબોળ થઈ ગયું. અને રાતભર ધસધસાટ ઉંઘ પણ આવી હતી. પછી જ્યારે સવાર થઈ ત્યારે તે નીરોગી અને સરસ ઊભી થઈ. ગાંઠો તપાસવા ગઈ તો ખરેખર તે ઓગળી ગયેલી દેખાઈ અને તેની જરાપણ નિશાની દેખાતી ન હતી. ખરેખર આ શ્રીસાઈનાથનાં જ પરાકમો છે.' (ઓ. ૧૧૩-૧૨૪)

આવી સ્થિતિ જેઠને શામાને 'ઉભા ઉભા જઈને જ પાછો આવજે' એવું જે બાબાએ કહ્યું હતું તેની યાદ આવી. તેમને મનમાં એટલી બધી નવાઈ લાગી કે બાબાએ આવું કહીને, 'પહોંચતા પહેલાં જ તારું કામ પતી ગયું હશે,' એવું પોતાને સુચયવું હતું. પછી માધવરાવે ચા પીધી અને પાછા શિરડી જવા માટે નીકળ્યા. શિરડી પહોંચતાની સાથે જ મસ્ટિફામાં જઈને તેમણે બાબાનાં ચરણોમાં નમસ્કાર કર્યા અને કહ્યું, 'દેવા આ શું તારા બેલ ! તું જ મનમાં ખળભળાઈ મચાવે છે, બેઠા હોય ત્યાંથી ઊભા કરીને દોડાવે છે. અને પાછળથી બધુ શાંત પણ કરી નાખે છે.' તે સાંભળતા બાબાએ જવાબ આપ્યો, 'દેવની ગતિ અને તેની વર્તન પદ્ધતિ સમજવામાં ખૂબ જ અધરી છે, જે ! મેં ખરેખર કંઈ પણ કર્યું નથી અને કરાવતો પણ નથી. પણ લોકો મને ખબર નથી પડતી એનું કર્તૃત્વ મારે શિરે જ શા માટે મારે છે ? દૈવયોગથી જે જે કર્મો બનતાં હોય છે, તેનો હું તો માત્ર એક આંખે જેનારો સાક્ષી જ છું. કર્તા હર્તા તો એક અનંત પરમેશ્વર જ છે. તેમજ અસિમ કૃપા કરવાવાળો પણ એના સિવાય બીજો કોઈ નથી. હું દેવ પણ નથી, અને દીશ્વર પણ નથી. હું 'અનલ હક્ક (અના-લ-હક્ક)' એટલે પરમેશ્વર છું એવું નથી. હું 'થાએ હક્ક' એટલે પરમેશ્વરને યાદ કરનારો છું. અલ્લાનો હું દીન ગુલામ છું ! 'બંદા લાચાર હૈ.' અહંકાર છોડીને અને પરમેશ્વરનો આભાર માનીને તેની ઉપર જે જવાબદારીઓનો ભાર નાખે છે તેનો બેડો પાર થાય છે. એવો બક્ત પોતાનો હેતું સિદ્ધ કરી શકે છે. અહીંયાં બેડો પાર થવાનો અર્થ એટલે તરાપો છે. જે લાકડાનાં પાઠિયાં જેડી જેઠીને પાણી ઉપરથી તરીને પાર ઉત્તરવાનું એક સાધન છે.' (ઓ. ૧૨૫-૧૩૧)

આવો જ એક દીરાનીનો એટલે કે પારસી ગૃહસ્થનો મહિન્યનો અનુભવ સાંભળો. તેની નાની છોકરી જેને હજુ માતાનું ધાવણ ચાલુ હતું. તેને દર કલાકના અંતરે બોલવાની શક્તિ ક્ષીણ થઈ જતી, અને તેની સાથે સાથે એને આંકડી-તાણ (Fit of Epilepsy) આવીને મોઢામાંથી પુષ્કળ ફીણ નીકળતાં તે બેભાન બની જતી. અને તે શરીરથી ઘનુષ્ય જેવી વાંકી વળીને મરવા પડી હોય તેવી બેશુદ્ધ થઈ જતી. તેને માટે કેટલાયે ઉપાયો કર્યો પણ કોઈ ઉપાય ફાયદાકારક નિવાયો નહિ. સમય જતાં આગળ ઉપર તે ગૃહસ્થના એક મિત્ર ઉદ્દીના પ્રભાવનું વર્ણન કરીને કહ્યું, 'આ અલૌંડિક અને રામભાણ ઇલાજ તથા ઔષધ આ જગતમાં બીજે કયાંય મળશે નહિ. જલ્દીથી પાર્લા જલ અને કાકાસાહેબ દીક્ષિત પાસેથી બાબાની ઉદ્દી માંગી લાલો. તેમની પાસે ઉદ્દીનો જથ્થો કાયમ રહેતો હોય છે. તે તમને ખૂબ આનંદથી આપશે. તે ઉદ્દી પછી દરરોજ થોડી થોડી શ્રદ્ધાથી અને સંપૂર્ણ ભક્તિભાવથી સાઈબાબાને યાદ કરીને આ છોકરીને પીવડાવવા માંડો. જેનાથી આવતી આંકડી અટકી જશે. અને તમને બધાને ખૂબ સમાધાન થશે.' આવું સાંભળીને પેલા પારસી ગૃહસ્થ કાકાસાહેબ દીક્ષિત પાસેથી ઉદ્દી લઈ આવ્યા અને છોકરીને નિયમિત પીવડાવવા લાગ્યા. તેથી તેનું આરોગ્ય ખરેખર સુધર્યું. જે આંકડી દર કલાકે આવતી હતી તેનું અંતર સાત સાત કલાકે થવા માંડ્યું. એમ થતાં થતાં થોડો સમય વિત્યો હશે ત્યાં આ બાળકીને સંપૂર્ણ આરામ થઈ ગયો. (ઓ. ૧૩૧-૧૩૬)

વર્ધા પાસે એક ગામમાં એક વૃદ્ધ ગૃહસ્થ રહેતા હતા. તે મૂત્રમાર્ગની પથરીના રોગથી ઉપડતી અતિશાય વેદનાઓથી ખૂબ જ ત્રાસી ગયા હતા. આ રોગનો શાંક્રદિયા વગર કોઈ ઉપાય નથી, માટે કોઈ સર્જનને મળો અને બતાવી જુઓ એવી સલાહ લોકો તેમને આપતા. પેલા પથરીના રોગથી પીડાતા ગૃહસ્થ ખૂબ જ ચિંતામાં પડી ગયા. શું કરવું તેની કંઈ સમજ પડતી નહિ. શરીર અસક્ત થઈ મરણાતોલ દશામાં હતું, અને રોગનો ભયંકર દુઃખાયો તેઓ સહન કરી ન શકે એવો અસહ્ય હતો. એકદમ શાંક્રદિયા કરાવવા માટે ધૈર્ય અને હિંમત જેઠાએ, છતાં આ તકલીફને લીધે તેમના મનને જરાયે શાંતિ ન

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

હતી. પરંતુ સદ્ગ્રામથે તેમનું આ દુર્દેવ કેવી રીતે નષ્ટ થયું તે ચ્યાત્કાર જુઓ. અહીં આમ ઘટી રહ્યું હતું તે જ સમયે એ ગામના ઈમાનદાર કે જેમના કુટુંબને અથવા ધરાનાને આ ગામ, પહેલાં સરકાર તરફથી ઈનામ કે બક્ષિસમાં આપવામાં આવ્યું હતું. તેઓ સાઈભાબાના પરમ ભક્ત હતા, તેઓ ગામમાં આવ્યા છે તે વાતની જાણ થઈ. તેમની પાસે બાબાની ઉદ્દી, સહાને માટે રહેતી તેની બધાને ખબર હતી. રોગથી ત્રાસેલા એવા આ ગૃહસ્થના સગાવહાલાં ઈમાનદાર પાસે જઈને બાબાની ઉદ્દી માંગી લાવ્યા અને તેમને આપી દીધી. તે ગૃહસ્થના દીકરાએ આ ઉદ્દીને પોતાના પિતાને પાણીમાં ઓગાળીને પીવડાવી દીધી. પાંચ દશ મિનિટ મહાપરાણે પસાર થઈ હશે ત્યાં એક આશ્રમ્યકારક ઘટના બની. આ ઉદ્દીનો પ્રસાદ જેવો શરીરમાં ઓગળ્યો, તેવો જ પેલી મૂત્રમાર્ગમાંની પથરી પોતાની જગ્યાએથી સરકી અને મૂત્રમાર્ગ બહાર ફેંકાઈ ગઈ. આમ ખરાબી શરીરમાંથી બહાર નીકળી જતાં પેલા વૃદ્ધને તાત્કાલિક આરામ થયો. (ઓ. ૧૪૦-૧૪૧)

મુંબઈના પ્રબુ કાયસ્થ જતના એક ગૃહસ્થ હતા. તેમની પત્નીને સુવાવડ વખતે બાળકને જન્મ આપવાનો સમય થતા તે હંમેશા મરણતોલ થઈ જતી. કેટલાયે ઉપાયો કરવા છતાં તેનો ઠિલાજ થતો નહિ, તેથી તે બાઈનો જીવ ગભરાયેલો રહેતો. આ કારણે પેલા ગૃહસ્થ બિચારા ધણા જ ત્રાસી ગયા હતા. ‘શ્રીરામ મારુતી’ નામના એક પ્રખ્યાત સાઈભક્ત હતા. તેઓ આ નાથપંથી પુરુષ થાણા, કલ્યાણ, ભિવંડી (મુંબઈ) જેવા આજુભાજુના પ્રહેશમાં થઈ ગયા. તેઓ સાઈભાબાને આધગુરુ આદ્ધિનાથ સમજીને જ માનતા હતા. શ્રીરામ મારુતી ખૂબ નાના હતા ત્યારે સાઈભાબાને મળ્યા હતા. પરંતુ ઈ.સ. ૧૯૧૦ની સાલમાં શિરડી મુકામે મુલાકાત થઈ. તેના આગલા દિવસે જ બાબા ભક્તોને એક સરખું કહ્યા કરતા હતા, ‘કાલનો મારો સોનાનો દિવસ છે, અરે કાલે મારી દિવાળી છે.’ બીજા દિવસે શ્રી રામ મારુતી મસ્નિદમાં આવ્યા ત્યારે બાબાની બપોરની આરતી ચાલી રહી હતી. ક્યારેય નહિ પણ તે દિવસે બાબાએ આરતી વચ્ચેથી જ રોકાવી દીધેલી. તેમજ શ્રીરામ મારુતીને પાસે લઈને પેટ પાસેથી પકડીને ખૂબ લાડ લડાવ્યા હતા. ખૂબ લાંબા સમય બાદ પિતા પુત્રનો મેળાપ થાય તેમ બંને વર્તતા હતા. શ્રી બાબાએ શ્રીરામ મારુતીને પોતાના અર્ધા આસન પર બેસાડ્યા અને પછી ભક્તોને આરતી ફરી શરૂ કરવા માટે આજ્ઞા આપી હતી. આરતી પૂરી થતાં, શ્રી રામ મારુતી નૈવેદનો શરીરો લાવ્યા, ત્યારે સાઈભાબાએ તેમને ‘નાથ’ આ શાબ્દથી એટલે ‘શ્રીરામ મારુતીનાથ’ એમ સંબોધ્યા હતા. અને પેલા અર્પણ કરેલા નૈવેદના શરીરને બીજા બધાનાં નૈવેદ કરતાં પણ વધારે પ્રેમથી આરોગ્યો હતો. રાતના પણ ચાવડી સરધસમાં બાબાએ શ્રીરામ મારુતીના હાથમાં હાથ નાખીને તેમને સાથે જ લઈ ગયા હતા. આમને આમ શ્રીરામ મારુતીને શિરડીમાં ચૌદ દિવસ સુધી રોકી રાખેલા અને ખૂબ મહેનતથી સંદેશો મોકલાવેલો. આ મહાન નાથપંથી સાઈભક્ત શ્રીસંત સાઈભાબાની સમાધિના થોડા જ દિવસો પહેલા એટલે કે તા. ૨૮-૬-૧૯૧૮ના રોજ શ્રીરામસ્વરૂપમાં લીન થઈ ગયેલા. તેમના સ્મરણાર્થે દાદર, થાણા, કલ્યાણના રસ્તાઓને તેમનું નામ આપવામાં આવ્યું છે અને ભાવિકોએ તેમની સ્મૃતિ અજરસ્યામર કરી મૂકી છે. તેમના કહ્યા પ્રમાણે આ ગૃહસ્થ શિરડી જવા માટે નીકળ્યા. પ્રસૂતિનો સમય આવે કે તેઓ બંને મોટી ઉપાધિમાં આવી પડતા. એકવાર તેમને મનમાં વિશ્વાસ બેસી ગયો કે, શિરડીમાં તેમને કરાનો ભય નથી. જે કાંઈ થબાનું છે તે બાબાની સામે જ અને તેમના સાંનિધ્યમાં જ થવા દો. આવો મનથી દદ સંકલ્પ કરીને એ દંપત્તિ શિરડીમાં આવીને રહ્યું. આમ કેટલાયે મહિનાઓ સુધી બંને શિરડીમાં રહ્યાં. બાબાની પૂજા, અર્ચના અને સહવાસને લીધે બંને ખૂબ આનંદિત થયાં. અમુક સમય પસાર થઈ જતાં પ્રસૂતિનો સમય પાસે આવ્યો. આ સંકટ હવે કેવી રીતે પસાર થશે એની ચિંતા તેમને થવા લાગી. જેત જેતામાં સુવાવાડનો દિવસ આવી ગયો. ગર્ભાશયના મુખના રસ્તે અહ્યાણ ઊભી થઈ અને બધા જ વિસામણમાં પડ્યા. બાઈને ખૂબ યાતના થવા માંડી. શું કરવું તેની કોઈને કાંઈ સમજાણ પડે નહીં. તેમણે બાબાની ગ્રાર્થના શરૂ કરી. તેમના સિવાય દયા કોને આવે? પડોશણ દોડીને આવી અને બાબાને ફરિયાદ કરીને ઘ્યાતામાં પાણી લઈ ઉદ્દી ઓગાળીને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તે બાઈને આપી. તે તીર્થ બની ગયું અને પીતાની સાથે જ માંડ પાંચ મિનિટ થઈ હશે એટલામાં તે બાઈનો છૂટકારો થઈ ગયો. પેટમાંનું બાળક નિર્જવ પેદા થયું. ગર્ભિશાયમાં જ તેણો પ્રાણ ત્યજ દીધો હતો. તે બાળકનું નસિબ જ એવું હશે ! બાઈને આગળ ઉપર બાળક થઈ શકશે. હાલ પૂરતી તે ભયમુક્ત થઈ. વેદના વગર પ્રસૂતિ થઈ અને સુખદૃપ તેનો છૂટકારો થયો વેદના વગર અને પ્રથમ વાર પ્રસૂતિ થઈ, એક મોટી ચિંતા ટળી અને બાબાની જન્મભરની તે ઋણી થઈ. (ઓ. ૧૪૮-૧૬૦)

આગળનો અધ્યાય આના કરતાં પણ વધારે સરસ અને શ્રોતાઓના કોડ પૂરા કરનાર એવો હશે. ખોદી ખોદીને અને ફાલતું ચોક્સાઈ કરવાની ખરાબ ટેવ છૂટી જઈને ભક્તિમાં રંગ લાવશો. ‘અમારા સંપ્રદાયમાં નિરાકાર દેવોની ઉપાસના હોય છે. અમે દક્ષિણા આપવાના નથી. નમસ્કાર કરવા માટે ગરફન ઝૂકવતા નથી. આ શરતો મંજૂર હોય તો જ દર્શને આવીશું.’ એવો જે મનો નિશ્ચય છે, તેઓ પણ સાઈનાં ચરણ દાખિભાં પડતાં જ દક્ષિણા સાથે સાચાંગ પ્રણામ કરતા હતા. તે કાંઈ નાનો સરખો ચ્યાતકાર કહેવાય ? ઉદ્દીનો અપૂર્વ મહિભા કહેવાશે અને નેવાસાકરનો ભક્તિપ્રેમ અને અચાનક આવેલા સાપને દૂધ પાઈને તેમણે ગૃહસ્થાશ્રમનો ધર્મ કેવી રીતે પાળેલો તે પણ કહેવામાં આવશે. આવી અનેક ઉત્તમ કથાઓ સાંભળીને ભક્તિ પ્રેમ ઉત્પન્ન થશે અને સંસારનાં હુઃખોનું નિરાકરણ થશે. આના કરતાં બીજું મોટું સુખ કયું હોઈ શકે ? માટે હેમાદ્પંત સાઈનાં ચરણોમાં વંદન કરીને તેમને વિનંતી કરી રહ્યા છે કે, શ્રોતાઓને તમારા ચરિત્રમાં મન મૂકીને ગમતો પ્રેમ સંપાદન કરી આપે. (ઓ. ૧૬૧-૧૬૬)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાદ્પંત રચિત
શ્રી સાઈસમર્થના સત્ય ચરિત્રનો ‘ઉદ્દી-મહિભા’ નામનો ચોત્રીસમ્ભો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણ.



॥ અધ્યાય ઉપ ॥

ચિહ્નિત્સા ખંડનમ્ - વિલૂપ્તિ મંડનમ્

(શંકા અને કુતર્ક ખોળી કાઢી અને ઉદ્દીની શોભામાં વધારો કરવો)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

પાછલા અધ્યાયમાં છેવટે સાધારણ ઉલ્લેખ કર્યો છે અને જે કથાની ગોઠવણી કરી છે તે જ હેચે આગળ કહી રહ્યો છું.
શ્રોતાઓએ તે સ્વર્ણ ચિત્તે સાંભળવી. પરમાર્થનો વિચાર કરતાં ધાર્મિક સંપ્રદાયોના અથવા તો શાખાઓ અભિમાન વચ્ચે
પુષ્કળ અવરોધો લાવે છે. આ અભિમાન જેવું બીજું કોઈ પણ મોટું વિદ્ધ નથી. અમે નિરાકાર ઈશ્વરનું ભજન પૂજન કરનારા
છીએ. તૃપ અને ગુણ સાથેના દેવ યોગ્ય માર્ગથી ભ્રષ્ટ કરનાર છે. સાધુ સંતો પણ માણસો જ હોય છે ને? પછી તેમની સાથે
નમસ્કાર કરતી વખતે માથું શા માટે નમાવવું? તેમને દંડવત્ત પ્રાણામ કરવા નહીં અને, તેમને દક્ષિણા આપવી નહીં. તેમની
સામે ગર્દન જરા પણ ઝૂકવવી નહીં. આ ભાડકિની ફૂર મજનક છે. શિરડીના સંબંધમાં કોઈ કંઈ અને કોઈ ગમે તેવી અનેક વાતો
કરે છે. પરંતુ તે બધી વાતો વિશ્વાસ મૂકવા જેવી હોતી નથી. કહેવાય છે કે શિરડીમાં જે કોઈ જતા તેમની પાસે સાઈબાબા
દક્ષિણા માગતા હતા. સાધુ જે દ્રવ્ય ભેગુ કરવા માંડે તો તે સાધુત્વનું પતન કહેવાય. અંધશ્રોદ્ધા જરા પણ સારી નહીં. પ્રત્યક્ષ
અનુભવ કર્યા પછીથી જ કેવી રીતે વર્તવું તેનો નિર્ઝય પોતે પોતાની રીતે નક્કી કરવો. અમે બાબાને દક્ષિણા આપવાના નથી.
જેના મનમાં દ્રવ્યની લાતસા હોય છે એવાનું સાધુત્વ અમને સમજનું નથી. નમવા માટે અમને તે યોગ્ય લાગતા નથી. અમે
શિરડી જઈને તેમની મુલાકાત લઈશું. એમનાં ચરણોમાં નમસ્કાર કરવાના નથી કે નથી દક્ષિણા આપવાના. જે જે કોઈ આવા
ખરાબ મંતવ્યો સાથે શિરડી જવા માટે નીકળે છે અને પોતે કરેલા નિશ્ચયની સારી એવી યાદ પણ રાખતા હોય છે, છતાં અંતે
શ્રી સાઈમહારાજનાં દર્શન કરતાંની સાથે જ તેમનાં ચરણોમાં ફળી જ પડે છે. જેમણે બાબાને જેયા તે પોતાની જગ્યાએ
શિરડીમાં જ સ્થાઈ થઈ ગયા, અને શિરડી છોડી કહી પાછા પણ ન ફર્યા, તેઓ સાઈનાં ચરણમાં જ ખોવાઈ ગયા. દાંતમાં
તણખલું રાખીને જેમ કોઈ શરણે આવે છે તેવી જ રીતે કેટલાક બાબાને વિકાર કરનારા લોકો પોતાના પહેલાના બધા મક્કમ
નિર્ધારો ભૂલી જઈને સાઈબાબાને પગે પડીને વંદન કરતા હતા. ધાર્મિક સંપ્રદાયોનું અભિમાન ભૂલી જઈને જ્યાં આ લુધને
સૌથી વધારે સુખ મળે છે તેવા આ પાંત્રીસમા અધ્યાયનું શ્રોતાઓએ ખૂબ આદરપૂર્વક શ્રવણ કરવું. તેમજ અપ્રત્યક્ષ રીતે
ઉદ્દીનો પ્રભાવ જાળનાર બાળા પાઈલ નેવાસકરને થયેલો ચ્યામત્કાર તથા સાપને સાઈ જ માનીને એનો આદર કેવી રીતે કર્યો તે
પણ સાંભળો. (ઓ. ૧-૧૪)

હે શ્રોતાજનો! મારી ઉપર દ્વારા કરો. હું તો માત્ર હુકમનો દાસ છું. આદરપૂર્વક આજાનું પાલન કરવું એટલું જ જાણું છું.
તેમાંથી જ આ અક્ષરોમાં લખેલ ચરિત્ર તૈયાર થયું છે. બાબાના ચરણોમાં દશ્િ સ્થિર કરતાં ત્યાંથી જે કાચ્યોની લહેરો ઉઠ છે
તે હું ચરિત્રઝીપી પવિત્ર કુંભોમાં ઉપરાઉપરી ભરી રહ્યો છું. અમે કાચ્યોનાં બચ્ચાં કેવળ નજર નાખવાથી અથવા તો અમને
નીરખનારા દશ્િથી પોસાયેલા છીએ. અમે તરસથી કે ભૂખથી બ્યાકુળ થયેલા કયારેય ન હતા. તેમજ હંમેશા ને માટે સંતુષ્ટ
હોઈએ છીએ. દશ્િનું એક સુખ હોય કે મળે તો તે અમને અગ્રની પણ ગરજ સારે છે. ફક્ત સાઈની નજર જ અમારી ભૂખ અને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તરસ નહિ જેવી કરી નાખે છે. તે નજરની વાત કરીએ ? અમારી સંપૂર્ણ નજરનો વિષય દ્વારાના સાગર શ્રી સાઈ મહારાજ છે. તેમને જેવામાં દરથી, દશા અને દર્શન આ ત્રણેયના સમૂહનું નામોનિશાન ભૂસાઈ જય છે. તેવી જ રીતે અમને શરીરની ચામડી અને સ્પર્શ આ બંને જગ્યાઓ ઉપર સાઈ જ પ્રગટ થયેતા દેખાય છે, નાક અને વાસમાં સાઈનો જ નિવાસ નજરે પડે છે. કાન પર શબ્દો પડતાં સાઈનું જ રૂપ આંખો સામે ઊભું રહે છે અને શ્રાવ્ય, શ્રાવક સાંભળનારો અને શ્રવણની ત્રિપુટી એકદમ ઓગળી જય છે. જુબ જ્યાં સ્વાદ ચાખવા આગળ પાછળ હાલે છે ત્યાં સાઈ જ સમરસ થઈ જય છે અને પછી રસના, રસ અને રસસ્વાદ આ ત્રિપુટીના વિચારોનું કેવું મોટું અચરજ થાય ! આ જ વાત કર્મન્દિરોની છે. તે ઈન્દ્રિયો ફક્ત જે એક સાઈની જ સેવા કરે તો બધાં કર્મો નાશ પાતીને નિર્જર્મ ફાળે આવે છે. (ઓ. ૧૫-૨૩)

હવે આ ગ્રંથ લંબાયો છે, અને સાઈના પ્રેમને લીધે વિષય છોડીને ભજતી જ વાતો તરફ સરી ગયો. પાછલા અધ્યાયની સંગત તરફ ધ્યાન આપીએ, અને આ આપણી કથા આગળ ચલાવીએ. એક ભાણસ જે મૂર્તિ પૂજનમાં ન માનનારો, નિરાકાર અને નિર્ગુણ ઈશ્વરની ઉપાસના કરનારો ફક્ત તપાસ કરવાનું વિચારી તે તે શિરડી જવા માટે ઉત્સુક થયો. તે બોલ્યો, ‘શિરડી જઈને અમે ફક્ત પેલા સાધુનું દર્શન કરીશું. અમે અમારી ગરદન જરા પણ ઝૂકવાના નથી અને દક્ષિણા પણ આપવાના નથી. આ બે શરતો જે માન્ય હોય તો જ અમે શિરડી આવવા તૈયાર છીએ.’ મિત્રે તેની શરતોની માન્યતા રાખતાં, તેઓ તેમની સાથે શિરડી જવા માટે નિશ્વિત મને નીકળ્યા. તેમના મિત્ર હતા કાકામહાજની જેમનું નામ હતું સ્વ. લક્ષ્મણ ગણેશ મહાજની. અધ્યાય ૬-૧૨-૧૩માં એ વિષેની માહિતી આપી છે. તેમની સાઈ સંત પ્રત્યેની ભાવના ખૂબ પવિત્ર અને નિર્મળ હતી. પરંતુ આ તેમનો મિત્ર શંકાશીલપાત્ર હતો. બંને જણા શનિવારે રત્ને મુંબદ્ધથી નીકળીને રવિવારે સવારે શિરડી આવી પહોંચ્યા. બંને સાઈના દર્શન માટે મસ્ઠિદમાં ગયા. તો ત્યાં તે સમયે શું બન્યું તે સાંભળો. મસ્ઠિદના પગથિયાં ઉપર પગ મૂકતાં જ પેલા મિત્રને દૂરથી જેઠીને બાબાએ ‘કેમ આવ્યા જ’ આ પ્રમાણે મધુર સ્વરે બોલાવ્યો. બાબાના આવા પ્રેમભર્યા શબ્દો સાંભળીને પેલા મિત્રને એટલું ચોક્કસ સમજયું કે આ શબ્દોના ઉચ્ચારણથી વિશેષ કરીને તેને પોતાના સ્વર્ગવારી પિતાની યાદ આવી. ‘કેમ, આવ્યા જ’ આ શબ્દોનું ઉચ્ચારણ કરતાં બાબાએ જે લહેકો કાઢીને બોલાવ્યા તે જેઠીને પેલો મિત્ર તો મનમાં દંગ થઈ ગયો. પેલા મધુર, મોહક, પ્રેમાળ અવાજની રીત જેઠીને તેને પોતાના પિતાશીની યાદ તાજ થઈ અને તેમના અવાજનો સંપૂર્ણપણે ભાસ થયો. તથા તે અનુકરણ આબેહૂબ લાગ્યું. ‘શું એ શબ્દોની આકર્ષણ શક્તિની વાત કરું ! કાકાના મિત્રને મોટો અચંબો થયો અને બોલ્યા, ‘આ તો મારા પિતાના શબ્દો છે. અને આ અવાજ પણ ખાતીથી કહી શકું કે તે મારો ઓળખીતો જણાય છે.’ પોતાના પિતાશીના મોઢાના તે શબ્દોને સાંભળી પેલો મિત્ર મનથી દ્રવી ઉઠ્યો. તેમજ શિરડી આવતા પહેલા મન સાથે કરેલો બધો નિશ્વય ભૂતી જઈને તેણે બાબાના પગ પર પોતાનું માયું મૂકી દીધું. પછી બાબાએ ફક્ત કાકા પાસેથી જ દક્ષિણા માંગી, જે એમને આપી. બંને બાબાની આક્ષા લઈને પાછા ફર્યા અને પોતાને ઉત્તારે જઈ આરામ કર્યો. આરામ કરી રહ્યા પછી મોડા બાપોરના કાકામહાજની બાબા પાસે ગયા, ત્યારે એમના મિત્ર પણ સાથે હતા. આ બંનેને મુંબદ્ધ જવું હતું તેથી બાબાને વાત કરી, કે બાબા અમને રજ આપો તો મુંબદ્ધ જઈએ. તે સમયે ફરીથી બાબાએ દક્ષિણા માંગી અને તે ફક્ત કાકા પાસેથી જ. બાબા બોલ્યા, ‘સત્તર ઝિપિયા મને આપ.’ પરંતુ પેલા પાસે ઊભેલા મિત્ર પાસે કંઈ પણ માંગ્યું નહિ. માટે તેના મનમાં થોડો ખેદ થયો. તેણે કાકાને ધીમા સ્વરે પૂછ્યું, ‘તમારી પાસેથી જ બાબા દક્ષિણા કેમ માગે છે ? સવારે પણ તમારી પાસે જ માંગી ! હું તમારી સાથે જ છું, છતાં મને કેમ અળખામણો ગણે છે ?’ કાકાએ પણ ધીમેથી જવાબ આપ્યો, ‘બાબાને જ આ પૂછ !’ એટલામાં બાબાએ જ કાકાને પૂછ્યું, ‘આ તમે શું કહી રહ્યા છો રે ?’ એ સાંભળતાં જ પેલા મિત્રએ સામેથી જ બાબાને પૂછ્યું, ‘દક્ષિણા આપું કે ?’ એ સાંભળી બાબા

શ્રી સાઈનું સત્ય ચિહ્ન

બોલ્યા, ‘તારા મનમાં દક્ષિણા આપવાની ઈચ્છા ન હતી, માટે માંગી નથી. હવે જે તને દક્ષિણા આપવાની ઈચ્છા હોય તો તે આપ.’ બાબાની દક્ષિણા માળવાની રીતનો પેલા વ્યક્તિને સખત વિરોધ હતો, એ જ હવે બાબાએ દક્ષિણા ન માંગી છતાં દક્ષિણા આપું કે, એવું સામેથી પૂછે છે, તેથી કાકા મહાજનીને ખૂબ જ નવાઈ લાગી. પછી બાબાએ પેલા મિત્રને કહ્યું, ‘જવું છે ! થોડીવાર અહીં બેસ.’ અને પાસે બેસાડી તેની ભેદભાવયુક્ત ભાવનાઓને દૂર કરવા માટે પ્રેમાળ ઉપદેશ આપ્યો. ‘તમારી અમારી વચ્ચેની તેલની દિવાલ પાડી નાંખો, જેથી કરીને એક બીજાને અરસપરસ મળવાનો માર્ગ મોક્કો થશે.’ બાબા તેલ અથવા તો ‘નારાયણ તેલી’ એવું હંમેશા એકાદી દુષ્ટ વૃત્તિને અનુલક્ષીને આવું કહેતા હતા. (ઓ. ૨૪-૪૭)

પછી બાબાએ તે લોકોને જવા માટે આજા આપી. ત્યારે આકાશ વાદળોથી ઘેરાયેલું જેઠને માધવરાવે બાબાને કહ્યું, ‘તેમને વરસાદ નડશે’ ત્યારે બાબાએ જવાબ આપ્યો કે તેમને સ્વસ્થ ચિત્તે જવા દો. રસ્તામાં વરસાદ તેમને ક્યાંય નડતરફ થશે નહિ. ગભરાવવાની કોઈ જરૂર નથી. પછી તેઓ બંને સાઈબાબાનાં ચરણોમાં વંદન કરી ને ઘોડાગાડીમાં જઈને બેઠા. વીજાળીઓ ચમકવા લાગી, ધૂભૂસ છવાઈ ગયું અને ગોદાવરી નહીમાં પાણીનું પૂર આવ્યું. આકાશ વાદળોના ગાડગાઠથી ગર્જવા લાગ્યું અને અંતે હોડીમાં પ્રવાસ કરવાનો વારો આવ્યો. બાબાએ આશ્વાસન આપ્યું હતું. તે પ્રમાણે કાકામહાજનીના મનમાં સંપૂર્ણ વિશ્વાસ હતો. પરંતુ પેલા મિત્રના મનમાં વિચાર આવવા લાગ્યા કે પ્રવાસ સુખેથી થવાનો નથી. વગર કામના આપણે પાછા જવા માટે નીકળ્યા. હવે રસ્તામાં પુષ્ટળ તકલીફ પડવાની. પણ બાબાની કૃપાથી તેઓ સુખેથી પહોંચ્યા અને આગગાડીમાં જઈને બેસી ગયા. તે પછી વરસાદ તો વાજતે ગાજતે ચાલુ જ હતો, છતાં તેઓ મુંબદી સુખરફ પહોંચી ગયા. ધરે પહોંચી બારી બારણાં ઉધાડતાં અંદર ગોંધાઈ ગયેલી બે ચકલીઓ મૃત:પ્રાય દશામાં તેમણે જેઠ. તેમાંની એક જેમ તેમ કરીને ઊડી ગઈ. આવું દરથ જેઠને પેલા મિત્રને ખૂબ જ ખરાબ લાગ્યું. ‘હે પ્રભુ ! આ બિચારા પક્ષીઓ અન્ન જળ વીનાના ગોંધાઈ ભર્યા. શિરડી જતાં પહેલાં ઝડપા ઉપરની હવા માટેની એકાદ નાની બારી ઉધાડી રાખી હોત તો આવું કદાચ ન બન્યું હોત. મારા હાથે આ બિચારી ચકલીઓનું મોત થયું. બેમાંથી જે એક નીકળીને ઊડી ગઈ તેને જેતાં એમ લાગ્યું કે બાબાને તેની કાળજ કરી હતી અને તે કારણે જ તેમણે અમને ખુશી ખુશીથી તરત જ જવાની પરવાનગી આપી. નહીં તો કદાચ તે પણ બિચારી ગોંધાઈને મરી ગઈ હોત. અન્ન જળ વગર તે જીવે પણ કેવી રીતે ? આથુભ્ય પૂરું થતાં આવી જ સ્થિતિ થતી હોય છે. આ એક માત્ર સુરક્ષિત રહી અને બચી ગઈ.’ આ મિત્રનો બીજો એક સરસ અનુભવ સાંભળવા યોગ્ય છે. શિરડી જવાનું બન્યું તેના ઘણા મહિનાઓ પહેલાં તેને જરાયે રહ્યો નહિ. અને થોડા દિવસમાં તો દુઃખાવાનું નામોનિશાન પણ ન રહ્યું. (ઓ. ૪૮-૬૦)

આવી જ એક બીજી કથા જેમાં સંતની શોધ કરવા જતાં મનમાં ન હોય છતાં તેમનાં ચરણોમાં નમસ્કાર કરવા માટે ગર્દન કેવી ઝૂકાવવી પડે છે તે હવે સાંભળો. તેવી જ રીતે દક્ષિણા આપવાનો વિચાર પણ ન હોવા છતાં મોહપાશમાં જરૂરાઠ ને પોતાનો પાડો નિશ્ચય તોડીને તે કેવી રીતે આપવા તૈયાર થયા તે સાંભળો. મુંબદી મુકાબે રહેનારા સોલિસિટર ધરમસી જેઠાબાઈ ટક્કરને પૂર્વ કર્માનાં પુણ્યોના બણે સાઈને મળવાની ઈચ્છા જગૃત થઈ. કાકામહાજનીના શેઠ તે આ જ. આ બંને વચ્ચે ખૂબ અંગત ધર જેવો પરિચય હતો. શેઠના મનમાં વિચાર આવ્યો કે શિરડી જઈને શ્રીસાઈની પ્રત્યક્ષ મુલાકાત અને દર્શન અવશ્ય કરવાં જેઠિએ. કાકામહાજની આ ટક્કરની પેઢી ઉપર મુખ્ય કારભારી હતા. કાકા એક પછી એક રન્ધાઓનો ઉપયોગ કરીને શિરડી જવા માટે તૈયાર રહેતા અને પાછા અમુક ચોક્કસ સમયે પાછા પણ ન ફરતા. આઠ આઠ દિવસ શિરડીમાં કાઢી નાખતા અને કહેતા કે પાછા આવવા માટેની સાઈની પરવાનગી ન હતી. આ કોઈ કામ કરવાની રીત થઈ ? આવા કેવા તે સંત ? આ તો અમારા જેવા સામેનું બંડ કહેવાય જે અમને પસંદ નથી. માટે સાઈની

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તપાસ કરવા માટે હોળીના તહેવારની રજાઓમાં રેઠ ધરમસી શિરડી તરફ જવા માટે નીકળ્યા. રેઠણ ખૂબ અભિમાની હતા અને પોતાની મોટાઈ અને ઐશ્વર્યનો તેમને ગર્વ હતો. સંત પણ આખરે તો માણસો જ છે ને? પછી વળી તેમની સામે ગઈન શા માટે ઝૂકાવવી જેઠાએ? સાઈનો પ્રભાવ અને અધિકારનું સ્થાન જેઠાને ભલભલા શાસ્ત્રીઓ અને પંડિતો થાકીને હાર માની ગયેતા. ત્યાં આ બિચારા ધરમસીનો તો વળી શો હિસાબ? અને તે બાબા સામે કેટલું કટવાના હતા? પરંતુ અંધશ્રેષ્ઠ સારી વસ્તુ નથી, આપણે જાતે જ ખાત્રી કરવી જેઠાએ. આવો વિચાર કરીને તેમણે શિરડી જવાની તૈયારી કરી. ઉપર ઓવી ૨૪-૬૦ની વચ્ચે વર્ણન કર્યા પ્રમાણે મિત્ર કાકા મહાબ્લનીનો સંગાથ નક્કી કરીને ધરમશી જવા માટે નીકળ્યા. રેઠ રસ્તામાં કાકાને કહ્યું, ‘તમે શિરડીમાં જઈને ત્યાં જ રહી પડો છો. પણ આ વખતે આણું ચાલરો નહીં. મારી સાથે જ પાછા ફરવું પડશે. એ બાબતનું અવશ્ય ધ્યાન રાખજો.’ ત્યારે કાકા મહાબ્લની બોલ્યા, ‘તે અમારા હાથની વાત જ નથી.’ તે સાંભળી ધરમશીએ બીજે પણ એક માણસ સાથે પ્રવાસમાં લીધો. કેમકે કયાંક કાકા વખતસર પાછા ન ફર્યા, તો પ્રવાસમાં સંગાથ વીના ધરમશીને ચાલતું નહીં, માટે એક ત્રીજી સાથીદારને પણ લીધો. અને તેઓ ત્રણે શિરડી જવા માટે ઉપડ્યા. (ઓ. ૬૧-૮૪)

આ જગતમાં બીજાને ઉપયોગી થઈ પડનારા હિતેચુંછુઓ અને ભક્તોના અનેક પ્રકાર હોય છે. તેમના મનનો સંશાય અને અનિશ્ચિતતા દૂર કરવા માટે બાબા આવા માણસોને ચૂંટી ચૂંટીને શિરડી બેંચી લાવતા. પછી જ્યારે તેઓ પાછા જતા ત્યારે પોતાના અનુભવો તેઓ બીજાને કહેતા હતા અથવા તો લોકોને સારા માર્ગ પર લાવવા માટે કોઈ બીજાને કામે લગાડી દેતા. થોડામાં કહીએ તો, જે કોઈ શિરડી જતા હતા તે બધા બાબાના દર્શાનથી તૃપ્ત થઈ જતા હતા. શરૂઆતમાં તેમના મનની ભાવનાઓ ગમે તે હોય પણ છેવટે તેઓ મોટો આનંદ પ્રાપ્ત કરીને જ ત્યાંથી નીકળતા હતા. માટે જેઓને જજાસાની ટેવ હતી, તે પણ શિરડી જતા. પરંતુ ખરી વાત તો કંઈ જુદી જ છે. ખરેખર તો તેઓ બાબાનું જ કાર્ય કરી આપતા હતા બાબા તેમને જેમ આપતા ત્યારે જ તેઓ ધર્મની બહાર પગ મૂકી શકતા હતા. બાબા તેમની નૈસર્ગિક વૃત્તિઓને જગાડીને, તેમને માટે પરમાર્થનો માર્ગ ખુલ્લો કરી આપતા. બાબાની કલાઓ અને યોજનાઓની કોને ખબર હોઈ શકે? તેને જ્ઞાનવાનો જે પ્રયત્ન કર્યો તો દરશા બેસી નથી. માટે અભિમાન છોડીને તેમનાં ચરણોમાં દંડવત્ત પ્રણામ કરો, એટલે સુખનો સાગર ઊભરાવા લાગરો. (ઓ. ૭૫-૮૦)

દેવ, બ્રાહ્મણ કે ગુરુ, એના બારણે ખાતી હાથે ન જવું જોઈએ, માટે કાકાએ રસ્તામાંથી અંદાજે એક કિલો દ્રાક્ષ વેચાતી લીધી. જે દ્રાક્ષમાં બી ન હોય એવી પણ મળતી હોય છે પણ એ સમયે બી સાથેની દ્રાક્ષ મળતી હોવાને લીધે તે વેચાતી લીધી. ગામગપાટા મારતા ત્રિપુટી શિરડી આવી પહોંચી અને તેઓ બાબાનાં દર્શન માટે મસ્તિષ્ઠમાં ગયા. તે સમયે ત્યાં બાબાના ભક્ત બાબાસાહેબ તર્ફથી ત્યાં બેઠા હતા. તેમને ફૂતુહલથી જોઈને ધરમશીએ શું પૂછ્યું તે જુઓ, ‘અહીંયા શું છે? કેમ આવો છો? એ સાંભળી તર્ફથી બોલ્યા, ‘દર્શન ખાતર જ આવું છું’ ત્યાં ધરમશીએ ફરીથી પૂછ્યું, ‘અહીંયા ચમત્કારો થાય છે એવું સાંભળ્યું છે.’ તે સાંભળી તર્ફથી એ જવાબ આપ્યો, ‘મારી તો આવી કોઈ ભાવના નથી. જેના મનમાં જેવી તીવ્ખ ઈચ્છા હોય તે જ પ્રમાણે તેમની મનોકામનાઓ અહીંયા પૂર્ણ થતી હોય છે.’ કાકામહાબ્લનીએ બાબાનાં ચરણોમાં માથું મુકીને તેમના હાથમાં દ્રાક્ષ અર્પણ કરી. મંડળી જમેલી હતી અને બાબાએ તેની વહેંચણી શરૂ કરી. બીજાનોની માફક બાબાએ ધરમશીને પણ દ્રાક્ષ આપી. આવી પ્રસાદમાં મળેલી બી વાળી દ્રાક્ષ તેમને ગમતી ન હતી. એમને તો બીજ વગરની દ્રાક્ષ ખાવાનો શોખ હતો, આવી બી વાળી દ્રાક્ષ ખાવામાં તેમને ચીડ હતી. જતાંની વારમાં જ અડચણ ઊભી થઈ. એ કેવી રીતે આવી. તેમને તે ગમતું ન હતું. પણ બાબાએ આપેલી વસ્તુનો અસ્વીકાર કરવો તે પણ યોગ્ય લાગ્યું નહિ. ડૉક્ટરે પણ દ્રાક્ષ ખાવા માટે મનાઈ ફરમાવેલી. પોતે જાતે ધોઈને ખાવી તે તેમને ઢીક લાગ્યું.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આવા અનેક પ્રકારના વિચારો એમના મનમાં ઉઠવા લાગ્યા. પછી એમણે એ દ્રાક્ષ મોઢામાં નાખી ચાવીને બીજનો કૂચો પોતાના ગજવામાં નાખ્યો. સાધુની આ પવિત્ર જગ્યા એઠી વસ્તુઓ નાખીને અપવિત્ર કરવી તે તેમને ગાંધું નહિ. પછી શેઠળના મનમાં એક વિચાર આવ્યો કે, ‘આ બાબા સાધુ હોવા છતાં આવી બીજવાળી દ્રાક્ષ મને ગમતી નથી તેની એમને ખબર કેમ પડતી નથી ? બળજબરીથી થોડી પણ મને શા માટે આવા આપે છે ?’ તેમના મનમાં આવા વિચારો ચાલતા હતા એવામાં બાબાએ બીજી થોડી વધારે તેમાંની જ દ્રાક્ષ આવા માટે તેમને આપી. પણ બી સાથેની દ્રાક્ષ ભાવતી ન હોવાથી તે મોઢામાં ન નાખતાં, મુઢીમાં ભરીને સંભાળીને પકડી રાખી. એટલામાં બાબા બોલ્યા, ‘ખાઈ જારે’ અને ત્યાં શેઠળએ આજાનો અમલ કર્યો. બાબાએ ખાઈ નાખ એવું કહ્યું અને ધરમશરીએ તેને મોઢામાં નાખી તો એ બધી જ બી વગરની લાગી અને આથી ધરમશરીને ખૂબ જ નવાઈ લાગી. આવી બી વગરની દ્રાક્ષ અચાનક મોઢામાં આવતાં તેઓ આશ્રમભાં ગરકાવ થઈ ગયા. કેટલું વિલક્ષણ આ સામર્થ્ય, આ સંતો માટે શું અશક્ય છે ? મારા મનની ઈચ્છા સમજુને શ્રીસાઈએ જે દ્રાક્ષ મને આપી તે બધી જ બીજ સાથેની અને ધોયા વગરની હોવા છતાં પણ બી વગરની અને હિતકારક નીકળી.’ ધરમસી મનથી છક્ક થઈ ગયા. શંકા કુશંકા બાજુ પર રહી. બધુયે અભિમાન બરફની માફક ઓગળી ગયું અને સંત માટે પ્રેમ ઉત્પન્ન થયો. પહેલાં કરેલા બધા તર્ક વિતર્ક, સંકલ્પો નકામા થઈ ગયા. હદ્દ્યમાં સાઈબાબા પ્રત્યેનો પ્રેમ ઊભરાયો અને શિરડી આવવાની જે ઉત્સુકતા હતી તે દ્રબ્દ થઈ ગઈ. બાબાસાહેબ તર્ખે પણ ત્યાં સાઈબાબા પાસે જ બેઠેલા હતા. એમાંની થોડી દ્રાક્ષ સાઈબાબાએ તેમને પણ આપી હતી. ધરમસીએ તેમને પૂછ્યું ‘તમારી દ્રાક્ષ કેવી હતી ?’ તર્ખેએ કહ્યું, ‘દ્રાક્ષ તો બી વાળી હતી’ એવો જવાબ આપ્યો. ત્યારે તો ધરમસીના મનમાં આશ્રમનો પાર ના રહ્યો અને શ્રીબાબા એક મહાન સંત છે અને ચંમતકારિક પુરુષ છે, એવી શ્રદ્ધા સંપૂર્ણ બેસી ગઈ. એ શ્રદ્ધાને વધુ ચકાસવા માટે ધરમશરીને બીજી એક કલપના સૂર્જી કે જે સાઈબાબા ખરેખરમાં સિદ્ધ કે અવતારી પુરુષ હોય તો હવે પછી દ્રાક્ષ વહેચલામાં પહેલી કાકા મહાજનીને જ મળવી જેઠિએ. પંતુ શેઠળના મનમાં ઉપર મુજબની કલપનાઓ આવતાં જ બાબાએ દ્રાક્ષ વહેચલાની શરૂઆત કરી. અને તે શરૂઆત કાકા મહાજનીથી જ કરી. શેઠળની નવાઈનો પાર જ ન રહ્યો. આવો સંતત્વનો ઈશારો, અને બીજના મનના વિચારો જાણવાની શક્તિ જેઠિને ધરમસીને, સાઈબાબાને અવતારી પુરુષ માનવાના પુરાવા મળી ગયા. (ઓ. ૮૧-૧૦૫)

માધવરાવ દેશપાંડિ ત્યાં પાસે જ બેઠેલા હતા. તેઓએ પછી બાબાને સમજલવતા કહ્યું કે, આ ધરમસી કાકા મહાજનીના માલિક-શેઠ છે. તે સાંભળીને બાબાએ કાકા મહાજનીને આનંદ થાય એવો એક સ્પષ્ટ જવાબ આપ્યો, ‘આ વળી કેવો કાકાનો માલિક ? એનો માલિક તો કોઈ બીજો જ છે. (એટલું હું જતે જ છું)’ બીજી એક આશ્રમની વાત. બાબાને ત્યાં ઘૂર્ણીની પાસે ઊભા રહેલા એક રસોઈયા જેઠે કેવી ગમત કરી તે જુઓ. બાબા બોલ્યા, ‘આ શેઠળ અહીં સુધી કંઈ મારે માટે આટલું કષ્ટ વેઠિને આવ્યા નથી. આ અપ્યા માટે પ્રેમ ઊભરાયો હતો માટે જ શિરડી આવ્યા હતા. ધરમસીને ખાવા પીવા માટે ઉત્તમ પ્રકારની સગવડ જેઠિતી હતી, અને તેને માટે શિરડી આવતાં અગાઉ જ તેમણે તેની ખાત્રી કરીને તેની બ્યવસ્થા કરી રાખી હતી. સાઈબાબા એ જાણતા હતા અને તે માટે જ તેમણે આ ટોણો માર્યો હતો. બીજા કોઈને પણ આ વાત સમજાઈ નહિ. પણ ધરમશરી આ વાત મનોમન ચોક્કસ સમજુ ગયા. આવું બધું જ સંભાષણ થયું, ધરમસી પોતાનો નિશ્ચય ભૂલી ગયા, અને બાબાને ચરણે પડ્યા. પછી ત્યાંથી તેઓ વાડામાં પાછા ફર્યા. ત્યારબાદ બપોરની મદ્યાહન આરતી થઈ. ધરે પાછા ફરવાની તૈયારીઓ ચાલી અને બાબાની આજા લેવાનો સમય થતાં મંડળી મસ્નિજાદ તરફ નીકળી. ધરમશરીએ કાકાને કહ્યું, ‘હું તો બાબાની આજા માંગવાનો નથી, તમે જ માંગજો. તમને જ એની જરૂર હોય છે.’ એ સાંભળીને ત્યાં ઊભેલા માધવરાવ ધરમશરીને બોલ્યા, ‘કાકાનું કંઈ નક્કી જ નહિ, એક અઠવાડિયા વગર તેમને પરવાનગી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

મળવાની નથી માટે, તમે જ પૂછી જુઓ.' ત્યાર બાદ તેઓ ત્રણોય મસ્નિફામાં જઈને બેઠા, અને માધવરાવે આજી માંગતા બાબાએ જે વાત કહેવાની શક્ક કરી તે હવે સ્વર્ણ ચિત્તે સાંભળો, 'એક અસ્થિર સ્વભાવનો, ચંચળ બુદ્ધિવાળો ગૃહસ્થ હતો. ઘરે અને ધન ધાન્યની છોળો ઉંડતી હતી. કોઈ શારીરિક કે માનસિક દુઃખ પણ ન હતું. છતાં તેને વગર કામની ઉપાધીઓ વહેરી લેવાની આદત હતી. વગર કારણનો તે માથે ભાર લઈને ફરતો અને અહીં તહીં તે દોડ્યા કરતો. વચ્ચે કોઈકવાર તે હળવો થતો અને ફરી પાછો જેવો હતો તેવોને તેવો જ થઈ જતો. એના જીવને સ્વર્ણસ્થતા જ ન હતી. એની આવી વિચિત્ર અસ્વર્ણસ્થતા જેઠેને મારા મનમાં દ્વારા ઉત્પન્ન થઈ, અને હું બોલ્યો, 'જ્યાં મન ફાવે તેવી એક જગ્યાએ તારો બોને હળવો કરી નાખ. વગર કામનો આમતેમ શા માટે બટકે છે? એક જગ્યા પર સ્વર્ણ બેસ.' ધરમશીને આ વાત ખટકી ગઈ. આ ઈશારો પણ આપણા તરફનો જ છે તે સમજન્યું. કોઈ પણ પ્રકારના કારણ વગર ધરમશીને હંમેશા ખોટી ચિંતા કરવાની ટેવ હતી. અને તેને લીધે તેઓ પોતાનું બેનું વગર કામનું દુખાડતા હતા. વિપુલ સંપત્તિ અને માનમોભો હોવા છતાં તેમનું મન અશાંત રહેતું. પોતાની પાછળ કોઈ કાલ્પનિક મોંદું દુઃખ વહેરી લઈને તેના વિચારમાં તેઓ હંમેશાં દુઃખી અને ચિંતામણ રહેતા. કેટલું યથાર્થ આ ચિત્રણ છે? અમારા પૈકીના કેટલાય લોકો નોકરીમાંથી સારું પેન્શન મેળવીને નિવૃત્ત થયા, અને છોકરાં છૈયાના લગ્ન પણ પતી ગયાં, છતાં સમય જતો નથી તેમ સમજને ફરીથી કોઈ નોકરી કે બ્યાસાય કરવો છે અને પાછા પેસા કમાવા છે તે લોભથી વગર કામનો ત્રાસ અને ચિંતા વહેરી લેતા હોય છે. અસરમાં આ સમય શાંતિથી દુષ્ટે આપેલી સુખ સંપત્તિનો આનંદથી અને યથાર્થોગ્ય રીતે ભોગવવાનો અને દુષ્ટ ભજનમાં મન પરોવવા માટેનો છે. સાઈબાબાના મુખેથી આ વાત સાંભળીને શેઠળ મનમાં વિચાર કરવા લાગ્યા કે, આ તો બાબાએ મારા જ મનની બધી વાત કરી છે. માટે તેમણે એ ખૂબ આદરથી સ્વીકારી. કાકાને આટલા જલ્દીથી પાછા ફરવાની પરવાનગી મળશે, એ તો અશક્યતાની પરકાણાની ઘટના હતી. પરંતુ તે પણ વગર પ્રયાસે સહેલાઈથી મળતાં ધરમશીના મનામં સંતોષ થયો. ધરમશીની ખૂબ જ ઈચ્છા હતી કે કાકામહાજની પોતાની સાથે જ પાછા આવે અને બાબાએ એમાં પણ અનુમતિ આપીને તે પાછા એમની સાથે જ જય એમ ગોઠવાઈ ગયું. શેઠળની આ ઈચ્છા પણ પાર પડી. શેઠળની માનેલી આ પણ એક બાધા હતી. બાબાને એનો પણ સંકેત કેવી રીતે થયો હશે? બાબાના સાધુત્વને શોધવાની ધરમશીની આ એક નવીન રીત હતી. અને તેમાં તે વાતનો તેમને સંતોષ થયો. ધરમશીના બધા જ સંશયો દૂર થયા, અને સાઈ એક અનન્ય સંત છે અને અવતારી પુષ્પ છે તે વાતની સ્પષ્ટતા થઈ ગઈ. જેના મનમાં જેવો ભાવ હોય છે બાબા તેને તેવો અનુભવ કરાવતા. જે મારો જવા માંગતો હોય તે મારો સાઈ પોતે જ ભક્તોને વાળતા. તેમણે મેળવેલી પાત્રતાની બાબાને જાણ હોય છે અને પરમાર્થ પણ તેમને તે પ્રમાણે જ પ્રાપ્ત થાય છે. ભક્ત ભક્તિયુક્ત અંત:કરવાળાઓ હોય કે મજલિક મશકરી કરનારો, બાબા બંને ઉપર સરખી જ કૃપા કરનાર હતા. એકને ટાળવો અને બીજને પાસે લેવો એવું કૃપાળું સાઈમાઉલીને-માડીને આવડતું ન હતું.' (ઓ. ૧૦૬-૧૨૭)

એ બેઉ જગ્યારે નીકળતા ત્યારે શ્રી બાબાએ કાકા મહાજની પાસે ૧૫ ડ્રિપિયાની દક્ષિણા માંગી અને તેની સાથે કહ્યું કે, 'મને જેણે ૧ ડ્રિપિયાની પણ દક્ષિણા આપી હશે તેને મારે દશ ગણું પાછું વાળવું પડે છે. હું કોઈનું કાંઈ પણ મફતમાં લેતો નથી. હું દ્રેકની પાસે અમસ્તો દક્ષિણા માંગતો નથી. 'જેમની તરફ મારો મસ્નિફાનો ફીકીર આંગળી ચીંધે છે એની જ પાસે હું દક્ષિણાની વાત કરું છું.' એ ફીકીર પણ જેની પાસે ઝાણ વસુલ કરવાનું હોય, તેની પાસે જ અહીં દક્ષિણાની માંગણી કરે છે અને દાતા તે આપીને જાણે કે ભવિષ્યમાં તે ઊગી નીકળશે તે હેતુથી તેનાં બી વાવે છે. ધનવાનોનું ધન પરોપકારી કૃત્યો અને શાસ્ત્રોકત ધાર્મિક વિધિઓ કરવામાં જ ખર્ચથી તો જ તેને એ કલ્યાણકારક સિદ્ધ થાય છે. સદ્ગારથી વર્તતાં અને ઉદ્દારપણાથી દાન કરતાં તે ફળ નિશ્ચિત મળે છે. તે જ માણસને જ્ઞાન થાય છે અને દુષ્ટ પ્રાપ્તિના માર્ગનો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

બોધ મળે છે. ખાસ કરીને લોકો સ્વ કષ્ટથી કમાયેલા ધનને તે પોતાના મનગમતા ભોગ ભોગવવા માટે છે એમ સમજુને તેને ધર્મકૃત્યથી ત્યજુને વીના કારણો ફાવે તેમ ખર્ચ કરી નાખે છે. પાછ પાછ કરીને મહેનતથી લેગું કરેલું ધન જે મનુષ્ય વિષય સુખોના ઉપભોગ માટે વાપરતો નથી તે મનુષ્ય સુખી થાય છે. ના દત્તં ઉપતિષ્ઠતિ આ વેદ શાસ્ત્રોનું વચન બધા જ જણે છે. આચ્યા વીના મળતું નથી. પહેલાં આપેલું સામે આવીને ઊભું રહે છે. માટે જ બાબા દક્ષિણા માંગતા હતા. રામ અવતારમાં રામે સ્વીઓની સોનાની મૂર્તિઓનું બેસુમાર દાન કર્યું હતું. જેનું ફળ કૃષ્ણાવતારમાં શ્રીકૃષ્ણને સોળ હજર ગણું મળ્યું. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વિહીન બલે એવો જે લાયાર ભક્ત નીતિથી ચાલનારો હોય તો પહેલાં તેનામાં વૈરાગ્ય ભાવ ઉત્પન્ન કરીને પછી બાબા તેને ભક્તિ અને જ્ઞાન આપતા હતા. બાબા જે દક્ષિણા જેમની પાસેથી લેતા, તે જ વૈરાગ્યનું પ્રથમ લક્ષણ છે. પછી તેને ભક્તિમાર્ગે દોરી જઈને જ્ઞાનમાર્ગમાં પારંગત કરતા. ‘અમે વળી શું કરીએ છીએ ? એક લઇએ છીએ અને દશગણું આપીએ છીએ અને કુમે કુમે જ્ઞાનના માર્ગ તરફ વળીએ છીએ.’ બાબાનું આવું કહેવું સાંભળતાંની સાથે જ ધરમશરીનો લોભ ધૂટયો અને તેણે બાબાની પાસે પહોંચી જઈને બાબાના હાથમાં ઢાંચા પંદરની દક્ષિણા મૂકી દીધી. શિરડી જતાં પહેલા કરેલા પોતાના નિશ્ચયને તેઓ ભૂલી ગયા અને આ આખો જ પ્રસંગ અપૂર્વ ચ્યામ્પટારિક સાબિત થયો.’ (ઓ. ૧૨૮-૧૪૦)

પહેલાના અધ્યાય ૧૪માં (ઓ. ૧૦૦-૧૫૫) હેમાડયંતે બાબાની દક્ષિણા લેવાના વિષય ઉપર સવિસ્તાર વર્ણન કરેલું છે. તેમાં બાબા પહેલા કોઈની પણ પાસેથી કંઈ લેતા ન હતા. કોઈ પણ ભૂલે ચૂકે એક તાંબાનો પૈસો પણ બાબાની પાસે મૂકે તો તે રકમથી તેઓ તંબાકુ અથવા તો વેચાતું તેલ લઈ આવતા. ત્યારબાદ કોઈને વળી મનમાં આવ્યું કે સંતના દર્શને ખાલી હાથે કેવી રીતે જવાય માટે તેઓ દક્ષિણા લઈને જવા લાગ્યા. અને વિધિપૂર્વક તેમનું પૂજન કરવાની પ્રથા શરૂ થઈ. પૂજની રસમ દક્ષિણા આચ્યા વીના થઈ શકતી નથી માટે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ‘વધારે ધન’ પ્રાપ્ત કરવાના બહાને લોકો ખૂબ જ દક્ષિણા આપવા લાગ્યા. ભક્તોના પ્રેમની સામે અને તેમના આગ્રહની સામે પૂજની આરતી પ્રમાણે દક્ષિણા પણ નકારી શકાય નહીં. ત્યારે બાબાએ તેનો ઉપયોગ કોઈ જુદી જ રીતે ભક્તોના કલ્યાણ માટે કરવાની શરૂઆત કરી. અને બાબા પોતાની મેળે જ દક્ષિણા માંગવા લાગ્યા. તે પણ વારંવાર અને ઘણી વધારે તે એટલે સુધીકે આપનારાના બધા જ પૈસા ખલાસ થઈ જતા. તેથી માંગે તેટલી દક્ષિણા આપી શકાય છે તેવો જે અહંકાર હોય તે ખંડિત થતો. કદાચ જેની પાસે બાબાએ રકમ માંગી હોય તેટલી ન હોય તો તેને કહેતા જ, બીજન પાસેથી માંગી લાવ આગ મજબૂર કરતા અને તે પણ નભ્રતાથી માંગજે એવો પાઠ શિખવાહતા.

બાબા પાસે દક્ષિણા ખૂબ આવતી પણ તે બધી તેઓ વહેંચણીની રકમ કોઈ કોઈ વખત એમને મળેલી દક્ષિણા કરતાં પણ ધણી જ મોટી થઈ જતી. બાબાનો આ રાજશાહી ઠાડ જેઠિને, સરકારે તેમની ઉપર આયકર – Income Tax લગાડવાની દસ્તિ તપાસ કરવા માટે એક પોતીસ અધિકારીની નિમણૂક કરી હતી. બાબા બધા પાસે એક સરખી દક્ષિણા માંગતા નહિ. તેઓ કહેતા, ‘દક્ષિણામાં જેમણે મને એક ઢાંચ્યો આપ્યો છે, તેને મારે દર અથવા તો સો ગણો બદલો પાછો વાળબો પડે છે. હું કદાપિ કોઈની પાસે મફતમાં લેતો નથી.’ બાબા અંતર્જાની હતા. કોઈએ જે અમુક પ્રકારની બાધા રાખી હોય તો એ બાધાને પૂરી કરાવવા માટે એટલી જ રકમની દક્ષિણા તેઓ માંગતા. પરંતુ કોઈની પાસેથી વગર કારણો તેઓ દક્ષિણા માંગતા નહિ અને જે માંગ્યા વગર કોઈ તેમને દક્ષિણા આપતા તો તે સ્વીકારતા નહિ અને પાછી આપી દેતા. કોઈ જે ભક્તના સંપ્રદાયની ઢાંચ્યો પ્રમાણે તેના મનમાં દક્ષિણા આપવાનું નહિ હોય તો તેની પાસે તેઓ કદાપિ માંગતા પણ નહિ. પણ આગળ જતાં તેમના અલૌકિક સામર્થ્યથી પ્રભાવિત થઈ તેઓ પોતાની મેળે જ દક્ષિણા આપવા તૈયાર થઈ જતા. ભક્તો પાસેથી કયારેક અમુક ચોક્કસ રકમ હક્કથી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

માંગવામાં બાબાનો ગૂઢાર્થ રહેતો. મુખ્ય ઉદ્દેશ એ જ કે દક્ષિણા માંગીને બાબા ભક્તોને દાનધર્મ કરવાનું શિખવતા અને પૈસાનો વ્યય કરવા બાબતની શિખામણ પણ આપતા હતા. પુરાણોમાં અને ઉપનિષદોમાં દાન કરવાનું મહત્વ અનેક ઠેકાણ કહેલું છે. આ જન્મે કરેલાં આવાં પુણ્ય કર્મોનું ઉત્તમ ફળ આવતા જન્મે જ મળતું હોય છે. રામ અવતારની વાત તો આપે આગળ જોઈ જ છે. એ સિવાય દક્ષિણા આપવાથી ભક્તોનો ઘન ઉપરનો લોભ ઓછો થઈ જઈ, તેમાંથી વૈરાગ્ય ઉત્પત્ત થાય તેવી બાબાની ઈચ્છા હતી. કારણ તે વૈરાગ્ય ઉત્પત્ત થયા બાદ જ આગળ ઉપર ભક્તિ તથા જ્ઞાનનો માર્ગ સુલભ થાય છે. કોઈ પણ દિવસ દક્ષિણા માગવા પાછળનો બાબાનો હેતુ પોતાને માટે દ્રવ્ય લાલસા કે બેગું કરવા માટેનો ન હતો પણ ભક્તોનું યેનકેન પ્રકારે કલ્યાણ સાધવા માટે જ તેઓ આમ કરતા હતા. નહિ તો હેઠ છોડતી વખતે તેમના ભિસ્સામાંથી માત્ર સોળ ઝિપિયા જ કેમ મળ્યા હોત ?

ધરમસીને લાગ્યું, આપણે પહેલાં વગર કામની જ બડાઈ હાંકી. સારું કર્યું કે પ્રત્યક્ષ સામસામે જ મળવાનું થયું. તેને લીધે સંતસાધુ કેવા હોય છે તે સમજયું. તેની પ્રતીતિ થઈ અને તેની આસક્તિ વધી. મનમાં વ્યવસ્થિત વિચાર કર્યા વીના નમસ્કાર કરવા માટે અમે આવવાના ન હતા, તેમ છતાં અમે સામે ચાલીને જ આવ્યા. ખેખબર સાધુ સંતોની કરણીની કોઈ ખબર પડતી નથી જેમના મુખમાં સદાને માટે 'અત્લા માલિક' એવો જલ્પ અંદ ચાલતો હોય તેને માટે અશક્ય એવી કઈ વસ્તુ હોઈ શકે ? અંતે તો ફક્ત સાધુના ચ્યામ્પટકાર જેવાને જ આતુર હતા. અમારો આખોય નિશ્ચય નકામો થયો. અમે એક માણસને દંડવત્ત પ્રણામ કર્યા અને તેમણે ન માગવા છતાં અમે અમારી મેળે જ તેમને દક્ષિણા પણ આપી. અમારી બધી જ બડાઈ વ્યર્થ ગઈ. અને જાતે જ અમારું મસ્તક સાઈનાં ચરણોમાં પૂજયભાવે અર્પણ કરી દીધું. આના કરતાં વધારે તો આશ્રયની વાત કઈ હોઈ શકે ? કોઈ નમસ્કાર કરે કે ન કરે, કોઈ દક્ષિણા આપે કે ન આપે પણ આનંદના ગઢ એવા અને દ્વાયા અને કરુણાના સાગર જેવા પરિપૂર્ણ સાઈમહારાજ કર્દી પણ કોઈનો તિરસ્કાર કે અવગણના કરતા ન હતા. પૂજન કરો તો પણ કોઈ આનંદ થતો ન હતો અને તેમને ટાળવા પ્રયત્ન કરો તેમાં તેમને જરા પણ બેદ થતો નહિ. જ્યાં હર્ષ જ નથી ત્યાં વિષાદ કેવો ? સાઈ મહારાજની સ્થિતિ દેરેક પ્રકારનાં સુખ, દુઃખ, રાગ, લાભ, મોહ વગેરે જેવા વિકારોથી અલિપ્ત હતી. કોઈના મનમાં કોઈ પણ ઉદ્દેશ હોય પરંતુ તે એકવાર દર્શને આવ્યા કે તેમની ભક્તિ પોતાનાં ચરણોમાં સ્થિર કરી દેતા હતા. આવી ગજબની સાઈબાબાની અતૌકિક શક્તિ હતી. પછી ઉદ્દી પ્રસાદ અને આશીર્વાદ લઈ ધરમશી અને કાકા મહાજની વિના સંકોચે મુંબદી પાછા ફર્યા. (ઓ. ૧૪૧-૧૫૦)

બાબાશ્રીની આવી કોઈથી પણ ન સમજી શકાય તેવી મહાન ઘ્યાતિ હતી કે પાછા વળતાં તેમની આજ્ઞા લેવી જ પડતી અને તે આજ્ઞાનું ઉલ્લંઘન થતાં હંમેશા વિધનોને નોતરવા જેવું થતું. પોતાના મનથી ત્યાંથી પાછું ફરવાનું થાય તો માત્ર પશ્યાતાપ અને ફજેતી જ નસીબમાં આવતી તેમજ ભયંકર અડચણોમાંથી પસાર થવું પડતું. જેનું નિવારણ કરવું પણ મહામુશ્કેલ કામ હતું. તેવી આ શિરડીથી પાછા નીકળવા માટેની વાત હતી અને અમારી પણ એ જ સ્થિતિ હતી. 'હું ના બોલાવું ત્યાં સુધી કોઈની અહીંથા આવવાની શક્યતા નથી.' એવું બાબાનું કહેવું હતું. 'મારી ઈચ્છા વીના ધરનો ઊંબરો પણ કોણ ઓળંગી શકે ? પોતાની સ્વેચ્છાએ મારાં દર્શન કોને થઈ શકે ?' અને શિરડીમાં કોનાથી આવી શકાય ? અમારી બધી હીતચાલ કૃપામૂર્તિ શ્રીસાઈસમર્થની ઈચ્છાને આધિન હતી. તેમના મનમાં જ્યારે કૃપા કરવી છે તેવું લાગતું ત્યારે જ દર્શન થતાં. શિરડીની આવનજીવન આ પ્રમાણે રહેતી. સાઈમહારાજની મરજ વગર કોઈને પણ ઉદ્દી અને આશીર્વાદ સાથે નીકળવાની આજ્ઞા મળતી નહીં. શ્રીબાબાને સાછાંગ નમસ્કાર કરીને આજ્ઞા માંગીને અને જતી વખતે ઉદ્દી સાથે આશીર્વાદ મળ્યા કે લોકો તેને જ પાછા નીકળવાની પરવાનગી સમજતા. (ઓ. ૧૫૧-૧૫૭)

હવે ઉદ્દીનો એક અપૂર્વ અનુભવ શ્રોતાઓને હું કહી રહ્યો છું. અને ત્યાર પછી નેવાસકર પાઠીલના ભક્તિના પ્રભાવની

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અને મહાન મહાનુભાવ કે જે વિદ્યા, બુદ્ધિ, પરાક્રમ વગેરે ગુણોથી શ્રેષ્ઠ છે તે સાઈ ફૂપાની વાત કરીશ. વાંદરામાં એક કાયસ્થ પ્રભુ જાતના ગૃહસ્થ રહેતા હતા. અતિશાય પ્રેતનો કરવાં છતાં તેમને રાતના શાંતિથી ઉંઘ આવતી નહીં. જરા પણ આંખ મીચતાં જ તેમને તેમના મૃત્યુ પામેલા બાપ દરરોજ એકાએક તેમના સ્વખનમાં આવીને તેમને જગૃત કરતા. પહેલાં બજેલી સારી નરસી વાતો, મનની ગુપ્ત ઝેંચતાણવાળી વાતો અને વિચારો તથા ગાળો અને શાપની સાથે તેઓ શબ્દોનો મારો કરતા. રોજ આવું બનતું અને રોજ ઉંઘમાં ખ્લેલ પડતી. તેમને કોઈ પ્રકારનો ઉમંગ થતો ન હતો. તેમજ પાછળ પડેલો બોગ પણ છોડતો નહિ. તેને કારણે તે ગૃહસ્થ કંટાળેલા. તેમને આ બાબતનો કોઈ ઉપાય પણ સૂર્જતો નહિ. એક સાઈ ભક્તને તેમણે આ બાબતનો શો ઠિલાજ કરવો તેવું પૂર્ણતાં તેમણે કહ્યું, 'અમને બીજે કોઈ પણ ઠિલાજ ખબર નથી. સાઈમહારાજ અમારે માટે તો એક મોટા મહાત્મા છે. તેમની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, તો તેમની ઉદ્દી પોતાનો પ્રભાવ દેખાડશો.' એ સાઈભક્તે જે કાંઈ કહ્યું અને જેવી રીતે કહ્યું તે પ્રમાણે કરતાં તેમને અનુભવો પણ સારા જ થયા. તે ખરાબ સ્વખન ફરી આવ્યું જ નહિ. કર્મ, ધર્મ વશ તેમનો આ મિત્ર સાઈસર્મર્થનો છાત્ર હતો. તેણે ઉદ્દીના આશ્રમ્યકારક પ્રભાવના મહિમાનું વર્ણન કરીને તેમને પણ થોડી ઉદ્દી કપાળ ઉપર લગાવતાં તે બોલ્યા, 'રત્ને સૂર્ય જતા પહેલાં થોડી માથે લગાવજે, અને બાડીની પડીકી તમારા ઓશિકા નીચે મૂકી બાળાનું સ્મરણ કરજે. હદ્યમાં સાઈ પ્રત્યેનો ભક્તિભાવ રાખજે. પછી જુઓ આ ઉદ્દીનો પ્રભવ ! આ ઉદ્દી જ પીડાને તાત્કાલિક દૂર કરશે, આવો આ ઉદ્દીનો સહજ ગુણ છે. ઉદ્દીની પડીકી તે રાતે જ કહ્યા મુજબ ઓશિકા નીચે મૂકીને સાઈનું સ્મરણ કરતાં કરતાં તે ગાઢ નિદ્રામાં પોડી ગયા. દુષ્ટ સ્વખનોનો અંત આવ્યો અને તેમનું નામોનિશાન મટી ગયું. તે ગૃહસ્થ ઘણા જ આનંદિત થયા. તેમના આનંદની હું શું વાત કરું ? તે ઉદ્દીની પડીકી કાયમ પોતાના ઓશિકા પાસે રાખવા લાગ્યા અને સતત સાઈબાબાનું સ્મરણ કરવા લાગ્યા. ત્યાર પછી બજીરમાંથી બાબાની એક સુંદર મજની છબી લઈ આવ્યા અને ગુરુવારનો દિવસ જેઠેને ઓશિકા તરફની ભીત પર એ લગાવી દીધી. તેની ઉપર પુષ્પોની માળા ચદાવી આદરથી તેમની પૂજન કરી. તે આ છબીનું હરતાં ફરતાં દર્શન કરવા લાગ્યા. દર ગુરુવારે તેઓ ફૂલોનો હાર ચઢાવતા, નિયમિત મનમાં ને મનમાં પૂજન કરતા તેમની સર્વ પીડાઓનું નિવારણ થયું. આમ નિયમિતપણે અને કડક પાલનથી તેમને કાયમની સુખ શાંતિ થઈ. નિદ્રાભંગ અને દુઃસ્વખનું દુઃખ તેઓ સહાને માટે ભૂલી ગયા.' (ઓ. ૧૫૮-૧૭૩)

આ તો એક ઉદ્દીનો ઉપયોગ થયો. હવે વધુ એક આશ્રમ્યકારક અપૂર્વ ઉપયોગ વણવું છું. કોઈ પણ સંકટના પ્રસંગે આ ઉદ્દીનો પ્રયોગ કરવાથી માંગ્યા પ્રમાણેનું ફળ એ આપે છે. બાળાળ પાટીલ નેવાસકર નામના એક બાબાના પરમ ભક્ત હતા. બાબાની અસાધારણ સેવાચાકરી કરીને તેમણે ખૂબ શારીરિક જહેમત ઉઠાવી હતી. તે શિરીમાં નિયમિત આવતા જતા રહેતા. બાબાનો લેંડીબાળનો ફેરી રસ્તો સાફ્ફૂક રાખવાનું કામ તેમનું હતું. તેમના પછી આ સેવા એવી જ રીતે ચાલુ રાખવાનું કામ રાધાકૃષ્ણબાઈના નસીબે હાથમાં આવ્યું. બધાઓમાં પૂજનીય એવા ઉચ્ચ જ્ઞાતિના ભાલણ કુટુંબમાં જન્મ થયો હોવા છતાં આવું હલકું કામ કેવી રીતે કરવું એવા મૂર્ખ વિચારો પણ એમના નિર્દોષ મનને કયારેય સ્પર્શથી ન હતા. તેઓ વહેલી સવારે ઉઠી તથા હાથમાં જાડુ લઈને બાબાનો જવા આવવાનો રસ્તો જે સ્વર્ચ કરતાં. કેટલી ધન્ય તેમની સેવા અને ચાકરી ! તેમની આ સ્વર્ચ અને ઝટપટ કામની ચટ કોનામાં આવી શકે ? કોણ તેમની બરોબરીમાં કામ કરી શકે ? (ઓ. ૧૭૪-૧૭૯)

આ બાઈનો ઉલ્લેખ પહેલાના અદ્યાય ૬ ઓ. ૬૮, ૮૭ અને અદ્યાય ૧૮માં ઓ. ૨૨૫-૨૪૦ વર્ચે આવેલો છે. જુવાન વયે તે બાળ વિદ્યા દેખાવમાં શ્યામવર્ણનાં હતાં અને ડે. સ્વ. નાનાસાહેબ ચાંદોરકર સાથે ૧૬૦૫ થી ૧૬૦૬ની સાલમાં પંદરપૂરથી પોતાની સ્વયંપ્રેરણાથી શિરીમાં આવ્યાં હતાં. 'તેમનું મૂળ નામ સુંદરબાઈ ક્ષીરસાગર હતું. પરંતુ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તેઓ કોઈ પણ વ્યક્તિને બૂમ પાડીને બોલાવતી વખતે ‘રાધાકૃષ્ણા’ કહીને બોલાવતા હતા માટે તેમનું નામ ‘રાધાકૃષ્ણાભાઈ’ પડી ગયું હતું. તેઓ કાયમ એક પિતળની ઘુટણથી ચાલતા બાળકૃષ્ણાની મૂર્તિ પાસે જ રાખતાં. તેમના સ્નાન, ખાનપાન વગેરેની સેવા કરવી અને ઉઠતાં બેસતાં તેમની પાસે જ રહેવાનો તેમનો ફૈનિક સેવાનો કુમાર હતો. સાઈબાબા પણ તેમને ‘રાધાકૃષ્ણા’ કહેતા અને રોજ બપોરે પોતે જમવા બેસે તે પહેલાં તેમને બે ભાખરી અને થોડુંક ચાખવા પૂરતું શાક મોકલી આપતા. બાબા હાજર હોય ત્યારે તે માઈ કદી પણ મસ્ઝિદમાં જતાં નહિ. તેઓ સહાય બજન કરતાં રહેતાં, અને બની શકે તેટલી સંત સેવા કર્યા કરતાં. તેમના અવાજમાં ખૂબ જ મીઠાશ હતી અને તેઓ સિતાર પણ સારી રીતે વગાડી શકતાં હતાં.

રાધાકૃષ્ણમાઈ શિરડીમાં આવ્યા પછી જ બાબાની પૂજા આરતીની શરૂઆત થઈ. તેમજ બાબાની ચાવડીમાંની એક દિવસના આંતરે સરધસની શરૂઆત પણ થઈ. આ બધાં કાર્યોની વ્યવસ્થા કરવાનો કારભાર રાધાકૃષ્ણમાઈ પાસે જ રહેતો હતો. મોટા આયના, હાંડાઓ, જુભરો અને તસ્વીરો ચાવડીમાં લગાડવાનું અને સજવટ કરી સુશોભિત કરવાનું કાર્ય આ માઈ જ કરતાં. રામનવમી, ગુપૂરુર્ણિમા જેવા અન્ય ઉત્સવો માટે ચાંદીનાં વાસણો, કિંમતી વસ્ત્રો અને આભૂષણો ગેસના નાના મોટા દીવાઓ અને તેમને લગાવવાનું તથા સાફ્સ્ક્રૂફ કરવાનું કામ પોતે કરતાં હતાં સેવામાં કોઈ વસ્તુની જરૂરિયાત હોય. તો શ્રીમંત ભક્તોને માઈ વાત કરે એટલે વ્યવસ્થા થઈ જતી. ટૂંકાણમાં કહીએ તો શિરડી સંસ્થાનને શરૂઆતમાં ઉત્તમ રીતે ધાઈમાઈથી તૈયાર કરવામાં તેમનો બહુ જ મોટો ફાળો હતો.

રાધાકૃષ્ણમાઈનું દરરોજનું મુખ્ય કામ એટલે મસ્ઝિદથી લેંડીબાગ સુધી બાબાને જવા આવવા માટેનો રસ્તો સાફ કરવાનું હતું. આ નિઃસ્વાર્થ સેવા તેમણે ઉપર જણાવ્યા પ્રમાણે પોતાના છેલ્લા શ્વાસ સુધી હસ્તા મોઢ અને ખૂબ જ આનંદથી પાર પાડી હતી. તેમની પાસે પૈસા ન હતા, પણ તેમણે પોતાના તન અને મન એ સર્વ બાબાને આર્પણ કર્યા હતાં. તેમની ભક્તિ એટલી શ્રેષ્ઠ હતી કે સ્વ. કાકાસાહેબ દીક્ષિતે એક ડેકાણે તેમનો ઉલ્લેખ ‘પ્રેમળ ભક્તિની શિક્ષિકા’ તરીકે કર્યો છે. તે જરાયે અતિશયોકિતભર્યું નથી. માટે જ બાબાએ ઇન્દ્રૌરના જસ્તીસ રેગે તેમજ ગુજરાતના વામનરાવ પેટેલ જેઓ પાછળથી સાઈશરણાનંદ તરીકે ઓળખાયેલા. તેમને ભક્તિનો માર્ગ શિખવા માટે આ બાઈ પાસે મોકલ્યા હતા. સ્વ. કાકાસાહેબ દીક્ષિત, સ્વ. બાપુસાહેબ બુટી, સ્વ. ડૉક્ટર પિલ્લે વગેરે આ બાઈની ઓરડીમાં જઈને હમેશાં બેસતા હતા. તેમની આધ્યાત્મિક પ્રગતિ સાચેસાચ ખૂબ ઉચ્ચ કક્ષાની અને શ્રેષ્ઠ હતી. સાઈબાબામાં સતત ધ્યાનસ્થ રહેવાને કારણે તેમને ઘણી બધી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ હતી.

આવાં એક મહાન સાઈભક્ત હૃદ્દેવથી ખૂબ જલ્દી જન્મના પાંત્રીસમે વર્ષે સને ૧૯૧૬માં શિરડી મુકામે સ્વર્ગસ્થ થઈ ગયાં. તેમની ભક્તિ અને આધ્યાત્માનો અધિકાર જાણીને શિરડી તેમજ બહારના ભક્તો તેમને ‘આઈ’ અથવા તો ‘માઈ’ આ શબ્દથી સન્માનિત કરતા હતા. તેમણે ઉછેરેલ તુલસી વૃંદાવન દ્વારકામાઈના સભામંડપમાં દીશાન ખૂણામાં આજે પણ દાદિમાન થાય છે.

થોડો સમય વિત્યા બાદ, એ રસ્તો સાફ કરવાની કામગીરી અબ્દુલની ખરી સેવા તો બાબાની સમાધિ પછીની છે. બાબાના નિર્વાણ બાદ લગભગ છત્રીસ વર્ષ સુધી તેઓ જીવ્યા. પણ તે વર્ષો દરમિયાન તેમણે કયારેય શિરડી છોડ્યું નહીં. તેમજ નાંદેં પોતાની પત્ની અને બાળકો પાસે કદી ગયા નહિ. સાઈમહારાજના દેહત્યાગ બાદ મહાણસાપત્રિ જેવા ભક્ત તો ટુંક સમયમાં જ સ્વર્ગવાસી થયા. જ્યારે માધવરાવ દેશપાંદે-શામા અને તાત્યા કોતે પાટીલ જેવા બાબાના હંમેશના સખાઓ સારાં એવાં વર્ષો સુધી જીવ્યા હતા. આ મહાનુભાવોના ધરભાર અને સંસાર શિરડીમાં જ હોવાથી તેઓ સંપૂર્ણપણે તેમાં ખોવાઈ ગયા. ફક્ત અબ્દુલ જ સંસ્થાનની નજીક રહીને, બાબાની

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સમાધિને સાફ્સ્કુલ કરવી, ફૂલ હાર ચઢાવવા ધૂપ અગરભત્તી કરવી આવી અનેક પ્રકારની સેવા કરતો રહ્યો. શિરડી દર્શને આવનાર ભક્તો પણ અબ્દુલને માન આવશ્ય આપતા, અને આદરથી ‘અબ્દુલ બાબા’ કહીને સંભોધિત કરતા. ભક્તોને તેઓ ઉદ્દી પ્રસાદ વહેંચતા. તેમનું મૃત્યુ સને ૧૯૪૮ની સાલમાં થયું. તેમની ઝૂંપડી ચાવડીની સામે આજે પણ હ્યાત છે. તેમની સમાધિ લેંડીબાગ જવાના પ્રવેશદ્વાર પાસે જમણી બાજુએ આવેલી છે. (ઓ. ૧૮૦)

આવો મહાન ભાગ્યશાળી બાળાજી પાટીલ પણ સંસારમાં રહેવા છતાં એક વૈરાગી જેવો હતો. તેમનો ત્યાગ કેટલો મોટો હતો તેની કથા હવે સાંભળો. પોતાના ખેતરની કાપણી થયા બાદ તે બધું જ ધાન્ય મસ્નિજાહમાં લઈ આવતા અને ત્યાં જ આંગણામાં મોટો ઢગલો કરીને બાબાનાં ચરણોમાં અર્પણા કરતા હતા. બાબા જ પોતાના સર્વસ્વ માલિક છે એવું માનીને સાઈબાબા તેમાંથી ઉંચીને જેટલું ધાન્ય તેમને આપતા તેટલું જ ઘરે લઈ જતા અને તેમાંથી જ પોતાનું ગુજરાન ચલાવતા. બાબા સ્નાન કરતા, હથ પગ મોઢું ધોતા તે પાણી ચોકડીમાંથી બહાર આવતું, તે પાણી પીને બાળા પાટીલ રહેતા હતા. તે નિયમ તેઓ જીવ્યા ત્યાં સુધી કાયમનો પાય્યો. હજુ પણ તે નિયમ આજ દીન સુધી તેમનો પુત્ર વ્રત રૂપે થોડા ધણા અંશે ચલાવતો આવ્યો છે. પુત્ર પણ સતત દર વર્ષે ધાન્ય મોકલતો અને તેમાંથી બનાવેલી જવારની ભાખરી દિવસમાં ચાર વર્ષત બાબા તેમના નિર્વાણ સુધી આતા હતા. એક દિવસ શું બન્યું તે જુઓ. બાળાજી નેવાસકરના મૃત્યુ બાદ એમનું પ્રથમ શ્રાદ્ધ આવ્યું. રસોઈ તૈયાર થઈ ગઈ અને પીરસનારા પિરસવા લાગ્યા. આ પ્રસંગમાં આવનારાઓનો અંદાજ કાઢીને જમણ તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ જમવાના સમેય ધાર્યા કરતા જમનારની સંઘ્યા નણ ધણી વધારે થઈ ગઈ. નેવાસકરના છોકરાની વહુ આ જેઠિને ગભરાઈ ગઈ. તેણે પોતાની સાસુના કાનમાં ધીમે ધીમે આ વાત કહેવા લાગ્યી, ‘હવે ચોક્કસ ફનેટી થવાની. તેને કેમ કરીને ટાળી શકાય?’ પણ નેવાસકરની વિધવા પત્નીની નિષ્ઠા ખૂબ જ પાકી હતી. ‘આપણા સાઈસમર્થ જ્યારે બેઠા છે તો વળી ચિંતા શા માટે કરવાની? તું બિલકુલ બયમુક્ત થઈને જ’ એવું આશ્વાસન આપીને એક મૂઢી ભરીને ઉદ્દી લીધી અને જમવા માટે તૈયાર કરેલ વસ્તુઓમાં થોડી થોડી ભભરાવી. ત્યાર બાદ તે દરેક વસ્તુને કપડાથી ઢાંકી દીધી. પછી પોતાના છોકરાની વહુને કહુંકે, ‘તું જ, અને હવે ખુશીથી પિરસ અને અંદરથી લેવા પૂર્તં રસોઈ જ કાપડ ઊંચુ કરને. ફરી પાછું પહેલાં હતું તેવું ઢાંકી દે જે. આટલું તું સંભાળને. આ સાઈના ધરનું જ અન્ન છે. એમાંનો એક કણ પણ આપણો નથી. તેની લાજ તેઓ પોતે જ રાખશે. જે કોઈ ઉણપ આવશો તો તે તેમની જ કહેવાશે.’ જેટલો પેલી સાસુને વિશ્વાસ હતો, એનો અનુભવ પેલી વહુને પણ થયો. બધા જ મહેમાનો તથા સર્વે બીજા કોઈ પણ જતની અદ્યાણ વીના જમ્યા. તમામ જમી પરવાર્યા અને કહેણું તે પ્રમાણે જ થયું. વાસણોમાં જે રંધ્યુ હતું તે અન્ન બધું જ બાકી રહ્યું. આવો હતો ઉદ્દીનો પ્રભાવ સંતનો આ સહજ સ્વભાવ છે. જેના મનમાં જેવો ભાવ અને શ્રદ્ધા હોય તેવો જ તેમને અનુભવ થાય છે. (ઓ. ૧૮૧-૧૮૮)

ઉદ્દીના મહિમાની વાત નીકળતાં નેવાસકરની ભક્તિ જેઠિને તેમની એક વધારાની વાત યાદ આવી તે હવે સાંભળો. એકવાર તો લાગ્યું કે વિષયાંતર તો થવાનું નથી ને? પણ પછી વિચાર કર્યો કે જે થવાનું હોય તે થાય, પણ પ્રસંગ અનુસાર યાદ આવેલી આ વાત કરવી જ જેઠિએ. એ વિશ્વાસ સાથે હું આ કથા કહી રહ્યો છું. તે જે અયોગ્ય લાગે તો શ્રોતાઓ મને ક્ષમા કરે. એક વર્ષતે રધુ પાટીલ નામનો શિરડીનો રહેવાસી એક મહેમાન તરીકે નેવાસ ગયો હતો, અને બાળાજી નેવાસકરના ધરે જ ઉત્તો. એક રાત્રે જ્યારે ઢોરઢાંખર ગમણાણમાં ખીલે બાંધેલા હતા ત્યારે એક મોટો નાગ અચાનક કુંફાડા મારતો ગમણાણમાં ઘૂસી આવ્યો. આ પરિસ્થિતિ જેઠિને બધાની બુદ્ધિ બહેર મારી ગઈ. કોઈને કંઈ સૂક્જ પડે નહિ. અહીંયા પેલો નાગ ફેણ ઉંચી કરી કુંડાળુ કરીને બેસી ગયો. ઢોર બધાં ભાંભરવા લાગ્યાં અને ખીલેથી છૂટવા માટે જેર કરવા લાગ્યાં. તેમને છોડ્યા વગર બીજો કોઈ આરો જ ન હતો. જે કોઈ ઢોરનો પગ તે નાગ ઉપર પડે તો પણ ઉપાધી થવાની હતી.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નેવાસકરની ભાવના એકમ દદ હતી કે શ્રીસાઈમહારાજ જ પ્રગટ થયા છે. દૂરથી જ નાગને જેઠિને નેવાસકરને અતિ આનંદ થયો. તેમનું આપું શરીર પુલકિત થઈ ગયું અને તેમણે તે નાગને દંડવત્પ્રાણામ કર્યા અને બોલ્યા, ‘સાઈમહારાજની ફૂપાદિથ થઈ, અને નાગઙું મળવા આવ્યા છે.’ પછી એ નાગ માટે વાટકો ભરીને દૂધ લઈ આવ્યા. શું એ બાળાજી પાઠીલના મનની ભાવના કે તેમને લેશ માત્ર બીક લાગી નહીં! ઉલ્ટાનું પેલા નાગને ઉદેશીને તેઓ શું કહેવા લાગ્યા તે સાંભળો, ‘કેમ બાબા ફૂંફાડા મારો છો? અમને કેમ બિવડાવો છો? આ અર્પણ કરેલ દૂધની વાટકી લો, અને સ્વસ્થ ચિત્તે દૂધ પીવો જેણ! પેલા આવડા મોટા નાગનું પેટ વાડકી દૂધથી કેવી રીતે ભરશો, એમ વિચારી નેવાસકર ઘરમાં જઈને દૂધની તપેલી લઈ આવ્યા. અને મનમાં જરાપણ ડર રાખ્યા વીના તેમણે પેલી દૂધની તપેલી આગળ ધરી. બીક તો ફક્ત મનની કલ્પનાને લીધે જ લાગતી હોય છે. બાવાળાએ આગળ દૂધ મૂક્યું, અને ખૂબ પાસે નહિ કે ખૂબ દૂર પણ નહીં, તે રીતે જઈને બેસી ગયા. તેમના ચહેરા ઉપર નાગનું ઔષ્ણ્ય હતું. નાગનું દર્શન મોટે લાગે ભયસૂચક છે. બધાના વિચારો કંઇ એકસરખા થોડા હોય છે? બધા મૂંજવણમાં પડ્યા અને બોલવા લાગ્યા, ‘આ સંકટ કેવી રીતે દૂર કરીએ? બહાર જય તો પણ ડર અને ઘરમાં ધૂસે તો પણ એને ત્યાંથી બહાર કાઢવો અધરો.’ આ કારણે બધા એની હૃલચાલ ઉપર ચાંપતી નજર રાખીને બેઠા. અહીં પેલા નાગે દૂધ પીવાનું શરૂ કર્યું અને પીને તૃપ્ત થયો. તે બધાની નજરો ચૂકવીને કઈ તરફ નીકળી ગયો તેની કોઈને પણ અભર પડી નહીં. બધાને તેની ખૂબ નવાઈ લાગી. છતાં બધી જ જગ્યાએ તેની તપાસ કરી પણ ક્યાંચ તેનો પત્તો લાગ્યો નહિ. મોટાભાગના લોકોના જીવને ટાઢક વળી. પણ ખૂબ નેવાસકરના મનમાં એક ખટકો રહી ગયો. ‘શરૂઆતમાં જેવો ગમાણામાં ધૂસતાં દેખાયો હતો, તેવી જ રીતે જતી વખતે પણ જે નજરે પડ્યો હોત તો ખૂબ જ સાચું થતા.’ એ જ એમના મનની એક ઠચ્છા હતી. (ઓ. ૧૯૭-૨૧૫)

બાળાજી પાઠીલને બે પત્નીઓ હતી. છોકરાં છૈયા નાનાં હતાં. તેઓ સૌ કચ્ચાએક કચ્ચારેક નેવાસથી બાબાનાં દર્શન માટે શિરડી આવતાં હતાં. બાબા તે બંને સ્ત્રીઓને કપડાંલતાં સહ આશીર્વાદ આપતા હતા. આવો આ બાળાજી મહાભાગ્યવાન ભક્ત હતો. જે વિદ્ધાન અને જ્ઞાની ભક્તોથી સાધી શકાતું નથી, તે સાદા અને ભોળા, આ અભણ ભક્તે મેળવી લીધું હતું. (ઓ. ૨૧૬-૨૧૭)

સચ્ચાચિત્રનો આ માર્ગ પરંપરાગત છે અને સરળ છે, જ્યાં જ્યાં તેનો પાઠ થાય છે, ત્યાં ત્યાં દ્વારકામાઈનો મઠ હોય છે. અને ત્યાં જ સાઈ પણ પ્રગટ થાય છે. ત્યાં જ ગોદાવરીના તટ છે અને ત્યાં જ શિરડી પણ છે. ત્યાં જ ધૂણી સામે બેઠેલા સાઈમહારાજ ભક્તોના સંકટોનું નિવારણ કરતા હોય છે. જ્યાં પણ સાઈના ચરિત્રનું વાંચન થાય છે, ત્યાં સાઈનો સદાને માટે વાસ હોય છે. અને આ ચરિત્રનું જ્યાં વારંવાર વાંચન થતું હોય છે, ત્યાં તે દેરેક રીતે પ્રસન્ન થાય છે. આવું જ્યાં સાઈનું સ્મરણ થતું હોય, તેમના નામનો જ્યાં દરરોજ જ્યાં થતો હોય, ત્યાં બીજી જ્યાં થતો અથવા તપકે સાધનાની કે ધ્યાન ધરવાની કોઈ ખટપટ રહેતી નથી. સાઈ ચરણોમાં સંપૂર્ણ પ્રેમ રાખીને જે કોઈ સાઈની ઉદ્દી નિયમથી લગાવે છે, અથવા મોઢામાં મૂકે છે, એવાઓની દેરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમના ચારેચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપોઆપ સંધાર જય છે. તેઓ ફૂતાર્થ થાય છે અને સ્વાર્થ અને પરમાર્થ તથા અનેક વિષયોનું ગહન તાત્પર્ય સ્પષ્ટ દેખાવા માંડે છે. ઉદ્દીના સ્પર્શથી કે તેના સંપર્કમાં આવવાથી પણ મહાપાપો જેવાં કે, બ્રાહ્મણની હત્યા, દારુનો નશો, ચોરી, ગુરુપત્ની જેણે જલીય સંબંધ રાખવો વગરે જેવા પાપ કરનારાના સહવાસને પણ શાસ્ત્રમાં પાંચ મહાપાપો કહેવામાં આવ્યાં છે. સર્વ ઉપાયો એટલે કે મહાપાપો કરતાં થોડાં ઉત્તરતી કક્ષાનાં નાનાં મોટાં પાપોનો જહમૂલથી નાશ થાય છે. અને આંતરિક તથા બ્રાહ્મ નિર્મણતા પ્રાપ્ત થાય છે. (ઓ. ૨૧૮-૨૨૪)

શ્રી સાઈનું સત્ય ચિત્ર

ઉદ્દી લગાડવાનો મહિમા ભક્તોને ખબર છે, પરંતુ શ્રોતાઓનું કલ્યાણ થાય માટે તેનું વર્ણન વિસ્તારથી કરેલું છે. ‘વિસ્તારથી વધારેલું છે.’ આ ભાષા બરાબર નથી. મને પોતાને તેના મહિમાની યથાર્થતા ખબર નથી. છતાં શ્રોતાઓના હિત ખાતર દુંકાણમાં તેનું વર્ણન કરેલું છે. માટે સાઈને વંદન કરીને શ્રોતાઓને હું એજ પ્રાર્થના કરું છું કે, પોતે જ અનુભવ કરીને જુઓ. મારું ફક્ત આટલું કહેવું છે. સાંભળો, અહીં તર્કવિતકનું કામ નથી. બસ ફક્ત અત્યંત પૂજ્યભાવ જોઈએ. બુદ્ધિ, ચાતુર્ય અને ચાલાકી અહીં કામ લાગતી નથી. અહીં પરમ શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા વગર જે ફક્ત તર્કવિતક કરનાર, વાદવિવાદ કરનાર, અથવા તો ચકાસણી કરનાર જ હોય, એવાને સંતો પાસેથી ઉત્તમ ઉપદેશ પ્રાપ્ત થતો નથી. શુદ્ધ મનના ભાવિકોને જ એનો લાભ મળે છે. કથામાં વધારે કે ઓછું તે બધામાં સાઈની જ પ્રેરણા માનીને, દોષ, દષ્ટિ ન રાખતાં, સાઈસચરિત્રને જરૂર વાંચવું. આ નિભિતે રસિક વાંચક વૃદ્ધના મનમાં સાઈભાબાની પરમ પથદર્શક અને પ્રેમાળ મૂર્તિ સતત યાદ રહી જય માટે સ્થાપના થાઓ. કયાં ગોવા અને કયાં શિરડી ? ત્યાંની ચોરીની સુંદર અને આનંદ આપનારી કથા સાઈભાબા સ્પષ્ટ કરીને કહેશો. માટે હેમાડપંત મનમાં સાઈચરણોમાં માથું મૂકીને શ્રોતાઓને વ્યવસ્થિત ધ્યાન આપીને સાંભળવાની નાતાથી વિનંતી કરી રહ્યા છે. (ઓ. ૨૨૫-૨૩૩)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા, ભક્ત હેમાડપંત રચિત.

શ્રી સાઈસમર્થના સત્યચિત્રનો ‘ચિકિત્સા ખંડનમ् - વિભૂતિ મંડનમ्’ નામનો પાંત્રીસમો અધ્યાય

અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણા.



પાંત્રીસમાં અધ્યાયની આલોચના

પાછલા ત્રણ અધ્યાય ૩૩, ૩૪, ૩૫માં સાઈભાબાની ઉદ્દીનો અપાર મહિમા અને ગુણોનું વર્ણન અનેક કેકાણે આવેલું છે. તો હવે એનું બેગુ આલોચન કરવું ઉપયોગી થશે. જેને રક્ષા, વિભૂતિ અથવા તો અંગારો એવું પણ કહેવામાં આવે છે, તે બાબાની ઉદ્દીના ગુણોના બે ભાગ પડે છે. એક પ્રાપંચિક અને બીજે પારમાર્થિક.

(૧) પ્રાપંચિક :- આમાનો મુખ્ય ગુણ એટલે માણસોને થતા કોઈ પણ રોગને જડમૂળથી સારો કરવો. ઉદ્ઘારણ તરફે ગાંઠિયો તાવ, પ્રસુતિ વેહના અને ગર્ભગદ્ધારની અહચણો, સાપ અથવા તો વીંધીનો ડંખ, ખરાબ સ્વખને લીધે નિદ્રાભંગ અથવા તો બિલકુલ નિદ્રાહીન દશા, હાડકામાં ઊંડો ઉત્તેલો સડો અને જઘમ વાળો, આંકડીના જટકા, મૂત્રમાર્ગની પથરી અથવા તો પેટમાંની કે છાતીમાંની ગાંઢ વગેરે. માત્ર શ્રદ્ધા અને સભૂરી જોઈએ. શ્રદ્ધા એટલે બાબાની આ ઉદ્દીથી રોગ સારો થશે જ તેવો અટલ વિશ્વાસ અને સભૂરી એટલે રોગને સુધારા ઉપર આવતાં ગમે તેટલો વિલંબ થાય છતાં

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ધીરજ ન છોડતાં તેની રાહ જેવાની તૈયારી રાખવી જોઈએ તે અને રોગ જે વધી જન્ય તો શ્રદ્ધામાં જરા પણ કેર ન પડવા હેતા, બીજા કોઈ ઉપયારો તરફ જરા પણ ન વળાય એવો અર્થ નીકળે. અખંડ પ્રજ્ઞલિત એવી ભાબાની આ ઘૂણીમાં ઉદ્દીની પાછળ ભાબાની દેવીશક્તિ આવેલી છે. પણ પ્રસંગ આવતાં ભક્તોની દદ શ્રદ્ધાને કારણે તે અગરબતીની રાખમાં અથવા તો રસ્તા પરની ઘૂળમાં પણ એ દૈવી શક્તિ ઉત્પન્ન થઈ શકે છે. રોગી સિવાય પણ અન્ય કોઈ દૂરની વ્યક્તિને લગાડવાથી તેનો પ્રભાવ પ્રગટ થઈ શકે છે. કદાચિત એવું બને કે જે રોગને ઉદ્દી લગાડી અને સાઈભાબા ઉપર જરા પણ શ્રદ્ધા નથી, અથવા તો કદાપિ તેમનું નામ પણ જેણે જાણ્યું નથી તે ભલે આ બધી વાતોથી અજ્ઞાત હોય તેવા રોગી ઉપર પણ આ ઉદ્દીનું પરિણામ જોઈને એ રોગી સારો થતો હોય છે. આવા પ્રસંગો ભાગ્યે જ સમજે કે ઉદ્દીભવે, તો એની પાછળ ઉદ્દી આપનારની શ્રદ્ધા અથવા તો ભાબાની દૃઢા અને ફૂપા જ હોય છે.

સંસારમાં ઉપયોગી થનાર ઉદ્દીનો બીજે એક ગુણ એટલે ધરની બહાર કામે જતાં પહેલાં કપાળ ઉપર ઉદ્દીનો ચાંલ્લો લગાડીને જવાથી લગભગ દરેક વિધોમાંથી મુક્તિ મળે છે. તેવી જ રીતે દરરોજ પૂજન અર્થના બાદ નિયમિત રીતે ઉદ્દી લેપ અથવા તો સેવન કરવામાં આવે તો, તેવો જીવાત્મા પુણ્ય સંપાદન કરીને પવિત્ર થાય છે. અને તેને દીર્ઘયુષ્ય મળે છે. તેની બધી દૃઢાઓ પરિપૂર્ણ થાય છે, અને સુખ સંતોષ પ્રાપ્ત થાય છે. અંતે કોઈ પણ પ્રકારના સંકટ સમયે, પછી તે અંદાજ કરતાં પણ વધારે મહેમાનો આવીને ફિજેતી થવાનું સંકટ હોય, કે બીજા કોઈ પ્રકારનું દુઃખ હોય તો ઉદ્દીનો પ્રયોગ કરવામાં આવે તો એ ચોક્કસ ફળ આપે છે.

(૨) પરમાર્થિક :- પરમાર્થના કામમાં એટલે કે દીક્ષિત પ્રાપ્તિના સાધના માર્ગમાં સર્વ પ્રથમ વાત શરીર અને મનની શુદ્ધતાની હોય છે. ઉદ્દી શરીર પર લગાડવાથી પાણીથી સ્નાન કરવા માટે તથા પૂજન માટે શરીર શુદ્ધ થાય છે એમ શાસ્ત્રોએ માન્યું તો છે જ. પણ તેની સાથે સાથે તેને કારણે મન શાંત અને પવિત્ર થઈને આંતરિક અને બાહ્ય નિર્મણતા પ્રાપ્ત થવામાં મદદ મળે છે. તેમજ ઉદ્દીના સ્પર્શ માત્રથી મહાપાપો અને ઉપાયો જરૂરાભૂતીના નાશ પામે છે. ભક્તોને માટે મોક્ષનો માર્ગ સરળ થાઈ જય છે. એટલું જ નહીં, પણ પરમાર્થ માર્ગનો ગુણ્યાર્થ તેને સ્પષ્ટપણે સમજીય છે, અને પરમાર્થ સાધ્ય થઈ કૃતાર્થ થાય છે.

બધામાં મુખ્ય તે એ કે ઉદ્દી વહેંચવામાં ભાબાને શું સુચવવું હતું તેને જે ધ્યાનમાં લેવામાં આવે તો પરમાર્થ માર્ગે તેનો મોટો લાભ મળે છે. ઉદ્દી એટલે તો રાખ અથવા માટી. સંસાર પણ આ ઉદ્દી જેવો જ છે. વિશ્વનો આ બધો પસારો નાશવંત છે અને છેવટે રાખોડી જ થવાની છે. આપણો દેહ પણ ભોગ ભોગવા માટે પંચમહાભૂતોનો લાકડાનો જ બનેલો છે. ભોગ પૂરા થતાં જ તે મનુષ્ય મૃત્યુના ખોળે સુવે છે. અને તેની બિલકુલ રાખ થઈ જય છે. પત્ની, પુત્ર, મામા, ભાણેજ, ભત્રીનું વગેરે અહીં કોઈનું કોઈ નથી. નન્દ આવ્યો છે, અને નન્દ જ જવાનો છે. તે યાદ કાયમ મનમાં રાખો. દેહનું અને સંપત્તિનું ખોટું અભિમાન અને લોભ રાખતા નહિ. આ પ્રકારનો ઉદ્દીનો સુચિત અર્થ ધ્યાનમાં રાખવાથી પરમાર્થને પોષણ મળશે અને વિવેકપૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન થશે.

કયારે કયારે લહેરમાં આવી જતાં બાબા સુંદર સ્વરમાં નીચે આપેલું ધૂપદ ગાતા હતા.

રમે રામ આયોજ આયોજ | ઉદ્દીયાકી ગોનિયા લાયોજ |

તેમાં ખોટું શું છે ? ભાબાની સમાધિ બાદ છેલ્લા ૮૮ વર્ષોમાં આ અખંડ પ્રજ્ઞલિત ઘૂણીમાંથી ઉદ્દીના કેટલાયે થેલા ભરાયા હશે. અને ભાબાએ સ્થાપેલ ઘૂણીની ઉદ્દીએ અગણિત ભક્તોનાં કલ્યાણ કર્યા જ હશે ! ધન્ય છે એ ઉદ્દીને અને ધન્ય છે એ ભાબાના ભક્તવાત્સલ્યને !!!



॥ અદ્યાય ત્ર્ય ॥

સાઈ સર્વ વ્યાપકતા તત્ આશીર્વાદ સાક્ષ્યતા

(સાઈબાબાની બધી જ જગ્યાએ હાજર રહેવાની શક્તિ અને તેમના આશીર્વાદ સફળ થવા)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

હવે પાછલા અધ્યાયના અનુસંધાનમાં એટલે કે ચોરીના એક સુંદર વાર્તા કહીશ એવું મેં આખાસન આપેલું તેને સાંભળવા માટે મનને એકચિત કરો. આ કથા નથી, પણ મનને સંતોષ આપનાર મનની તૃપા મટાડનાર જવન છે. તે પીવાથી શ્રોતાઓની તરસ અધિક વધશે. તેને દૂર કરવા માટે બીજી પણ એક કથા કહેવામાં આવશે. જેને સાંભળવાથી શ્રોતાઓને આનંદ પ્રાપ્ત થશે. એવી આ મનોરંજક કથા સંસારમાંના શ્રમ, આધિ, વ્યાધીઓનું નિવારણ કરે એવી છે અને સુખી અવસ્થાની પ્રાપ્તિ કરી આપે છે. જે ભાગ્યવાનના મનમાં પોતાનું કલ્યાણ કરવાની કામના હોય તેમણે આ સાઈની કથાનું વર્ણન સાંભળવા માટે આદરપૂર્વક તૈયાર રહેવું. સંતનો મહિમા તો અપરંપાર જ હોય છે. તે મહિમાનું ખરેખરું વર્ણન કરતાં કોઈને ફાવશે નહિ, તો પછી મારો કથો અધિકાર ગણાય ? તે બાબતની મને સંપૂર્ણ જાણકારી છે પરંતુ વક્તાનું આટલું વર્ણન પણ સાઈને માટે પૂરતું જ રહેશે. તે ચતુર સાઈ કોઈની પણ પાસે પોતાના ગુણનું વર્ણન કરાવીને ભક્તોને સંભળાવે છે. તે આ પરમેશ્વરઙ્ઘી સરોવરમાં વિહાર કરનારો સાઈરૂપી હંસ ‘હંસ: સોહં’ વૃત્તિનો એટલે કે ‘હું જ પરમાત્મા છું અને જે પરમાત્મા છે તે જ હું છું.’ આવી બુદ્ધિવાળો એટલે કે પરમાત્માથી હું કોઈ બિન્ન નથી એવો બીજી કોઈ ભાંજગડમાં પડતો નથી. અને બ્રહ્માંપી મોતીનો ચારો ચરવાની ઉત્સુકતાવાળો તથા અત્યંત સાહસ ધરાવનારો છે. જેને નામ કે ધામ નથી, જેની પાસે અપરંપાર વૈભવ છે અને જે પોતાની આંખના ઈશારથી રંકને રાજ બનાવી શકે છે, તે આ તત્ત્વજ્ઞાનનો અવતાર અર્થાત્ ઈશ્વરના ખરા સ્વરૂપનો અને જ્ઞાનનો મૂર્તિમંત અવતાર છે. પોતે બધાથી અલિપ્ત રહીને અનેક પ્રકારની ર્યનાઓ કરીને જતે અનુભવી હોવાને કારણે ભક્તોને પ્રત્યક્ષ પરમેશ્વરનાં દર્શન કરાવે છે. એ જેમના ઉપર ફ્રેચાવંત થાય છે, તેમને જુદા જુદા ઝપમાં દર્શન આપે છે. બાબા આવા અપૂર્વ પ્રસંગો ઉભા કરે છે. તે બાબતનું સુંદર વર્ણન સાંભળો. તેમના મહાત્મ્યનું એકાગ્રતાથી ચિંતન કરીને મનમાં મક્કમ નિર્ધાર કરી તેમની ગ્રેમેથી સ્તુતિ અને ભજન કરે છે તેને કોઈ પણ વસ્તુની કભી પડવા દેતા નથી. એવા ભક્તની પૂર્ણ પણે સાઈ સંભાળ લે છે. તેમને પોતાની કથાનો ખૂબ ચસકો છે. માટે જ તે મને સતત યાદ હેવડાવીને શ્રોતાઓ અને વક્તાઓને નિભિત બનાવીને ભક્તોના મનોરથ પૂરા કરે છે. જેણે સંસારમાંના વ્યવહારોનો ત્યાગ કરીને પરમાર્થ તરફ સદાને માટે મન અને અંત:કરણ પરોવ્યું છે, અને હાથમાં ચક ધારણ કરનારા શ્રી વિષ્ણુને એટલે કે પરમેશ્વરને જેણે વશ કર્યો છે, તેણે અસંખ્ય પ્રાણીઓનો ઉદ્ધાર કર્યો છે. જેમની ભક્તિ દેશના અને પરદેશના આમ બધા જ લોકો કરે છે, જેમનો ભક્તિરૂપી ઝડો ઊંચો આકાશમાં ફરફરતો રહે છે, એવો તે ગરીબ અને દુર્બળને બોલાવતો હોય છે, અને તે બધાના મનોરથ પૂરા કરતો હોય છે. હવે આ પરમ પવિત્ર સાઈચરિત્ર ધ્યાન દઈને સાંભળો, જેથી કરીને શ્રોતાઓ અને વક્તાઓના કાન અને મુખ એ બધું પાપમુક્ત થઈ, પાવન થશે. (ઓ. ૧-૫)

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

એકવાર ગોવામાં રહેનારા બે ગૃહસ્થો સાઈભાબાના દર્શન માટે આવ્યા. તેઓ દર્શન કરતાં કરતાં આનંદવિભોર થઈ સાઈચરણોમાં તલ્લિન થઈ ગયા. બંને સાથે જ દર્શને આવ્યા હતા પણ સાઈભાબાએ ફક્ત એકની જ પાસે દક્ષિણા માગી. તેને બાબાએ કહ્યું, ‘પંદર ડ્રિપિયા મને આપ.’ અને તેણે આપ્યા પણ ખરા. બીજી ગૃહસ્થ પાસે કંઈ માંગ્યુ નહિ, તે છતાં તેણે પાંનીસ ડ્રિપિયા આપ્યા. પણ બાબાએ તેને પોતાની પાસે નહિ રાખતાં તેને તરત જ પાછા આપ્યા. આ જેઠિને તેને ખૂબ જ આશ્વર્ય થયું. એ સમયે માધવરાવ દેશપાંડે-શામા ત્યાં હાજર જ હતા. બાબાના વર્તનમાં આવો બેદભાવ જેઠિને તેમણે બાબાને પૂછ્યું, ‘બાબા ! આમ કેમ કરો છો ?’ બે મિત્રો સાથે આવ્યા છે અને તમે એકની દક્ષિણા માંગીને લીધી જ્યારે બીજે પોતાના મનથી આપે છે, તો તેને પાછી આપો છો ! સંત પાસે આવો બેદભાવ શા માટે હોવો જેઠિએ ? એકની પાસે જાતે માગો છો ? અને બીજે રાજુખુશીથી આપે છે, તે સ્વીકારતા નથી અને તેને નિરાશ કરો છો ? તમે ઓછા પૈસા તરફ ખુશી દર્શાવો છો અને પુષ્કળ પૈસા તરફ ઉદ્ઘાસીનતા અને અણગમો શા માટે ? તમારી જગ્યાએ જે હું હોત તો આવું વર્તન કરત જ નહિ.’ એ સાંભળતાં બાબાએ જવાબ આપ્યો, ‘શામા ! તને ખખર નથી. હું કોઈની પાસે કંઈ પણ લેતો નથી. આ મસ્ટિફાઈ કોઈની પણ પાસે બાકી નીકળતી રકમ એટલે કે ઉધાર રહેલ રકમ માગી લે છે અને તે આપનારો આપીને પોતાના અણગમાંથી મુક્ત થાય છે. મારે નથી ઘર કે નથી સંસાર મારે પૈસાની શી જરૂર ? હું તો બધી જ રીતે નિશ્ચિંત છું. ઋણ, વેર-શત્રુત્વ અને હત્યા આ કરવાવાળાઓને કયારેય છૂટકારો નથી મળતો. તેનું ફળ કર્તાને આ જન્મે નહિ તો આવતા જન્મે ભોગવે જ છૂટકો છે. સામાન્ય જનતા સ્વાર્થ પૂરતી ઈશ્વરની બાધા રાખે છે અને પછી તેને ભૂલી જય છે. પછી આગળ ઉપર તેમને એમાંથી છોડાવવા મારે ત્રાસ ભોગવવો પડે છે. તમને એની ચિંતા નથી. ફક્ત સમય પૂરતી જ તમે આજીજ કરો છો, અને પછી ભૂલી જાવ છો. મારા ભક્તોમાં જેને કંઈ પણ ઉધાર ચૂકવવાનું બાકી રહેતું નથી તેની ઉપર હું સદાય પ્રસાન્ત રહું છું. શરૂઆતમાં આ ગૃહસ્થ દરીદ્ર અને કંગાળ હતો. માટે તેણે બાધા રાણી હતી કે, મારે જે પહેલો પગાર આવશે તે ઈશ્વરને અર્પણ કરીશ. એ પ્રમાણે તેને પંદર ડ્રિપિયા પગાર મળ્યો. પરંતુ મનની સાથે જે નક્કી કરેલું તે ભૂલી જ ગયો. પછી આગળ જતા પગાર ૧૫૦ થયો, અને ૩૦ નો ૬૦ અને પછી ૧૦૦ ડ્રિપિયા થયો. જે બમણો થયો, ચાર ગણો થયો, અને મનમાં રાખેતી બાધા પણ એટલા જ વેગથી ભૂલાઈ ગઈ. જેતનેતામાં એનો પગાર ૭૦૦ ડ્રિપિયા થયો. તે કર્મ, ધર્મના સંયોગથી તે અહીંથી આવી પહોંચ્યો છે. માટે એની પાસે દક્ષિણાના નિમિસે મેં મારા પંદર ડ્રિપિયા જે લીધા એ મારા જ હતા, તે માંગી લઈને એને મેં કર્ભમાંથી મુક્ત કર્યો છે.’ (ઓ. ૧૬-૨૬)

‘હવે એક બીજી વાત સાંભળો. એક વખતે હું સમુદ્રના કિનારા ઉપર ફરતો હતો, એવામાં મને એક મોટી ભવ્ય હવેલી નજરે પડી, અને હું તેના ઓટલા ઉપર જઈને બેઠો. આ હવેલીનો માલિક બ્રાહ્મણ કુલીન તથા ઘનીક હતો. તેણે મારું ખૂબ જ પ્રેમથી સ્વાગત કર્યું. અને મને પેટ ભરીને આગ્રહપૂર્વક જમાડ્યો. પછી ત્યાં જ એક મોટી સુંદર જગ્યા હતી તેનું આગળનું બારણું ખોલીને મને આરામ કરવા માટે જગ્યા આપી, ત્યાં મને ઉંઘ આવી ગઈ. મને ગાઢ મિંદ્રામાં જેઠિને તેણે અંદર પ્રવેશ કરવા માટે તે ઓરડાની દીવાલમાંના પથથર ખસેડીને દીવાલમાં બાકોનું પાડ્યું અને અંદર પ્રવેશ્યો પછી તેણે મને ન સમજય તેવી રીતે તેમણે મારું ખીસ્સુ કાખ્યુ અને મને પૂરેપૂરો લૂંટી લીધો. જ્યારે હું જગ્યો ત્યારે મને અસલીયત સમજઈ. તે સમયે હું ધૂસકે ધૂસકે રડી પડ્યો. ત્રીસ હજર ડ્રિપિયા ગયા એથી મને ખૂબ દુઃખ થયું. એ બધી ચલાણી નોટો હતી. આવું અચાનક થવાને કારણે મારા મનેન ઘક્કો પહોંચ્યો. ઉલ્ટાનો પેલો બ્રાહ્મણ મને સમજાવવા લાગ્યો. હું બાધાપીધા વીનાનો હ્યામણી હાલતમાં એ જગ્યાના ઓટલા ઉપર બેસી રહ્યો. આમને આમ પંદર દિવસો વિત્યા હશે ત્યાં એ રસ્તા ઉપર એક ફીફીર ફરતો ફરતો અને પૂછ્યતો અચાનક ત્યાં આવી પહોંચ્યો. મને રડતો જેઠિને તેણે મારા દુઃખનું કારણ પૂછ્યું. મેં તેને બધું જ કહી સંભળાવ્યું. તેથી તે બોલ્યો, ‘હું જે

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કહું છું એ પ્રમાણે કરીશ તો તારા દુઃખોનું નિવારણ અવશ્ય થશે. તને એક ફકીર આ બાબતમાં સમજણ પાડશે. તેમનું સરનામું હું તને આપીશ. તું તેમને શરણો જી, એટલે એ તને તારું ધન પાછું મેળવી આપશો. પણ હું તને જે વ્રત કરવા માટે કહું તેનું તારે આચરણ કરવું પડશે. જે ધન તારે પાછું મેળવવું છે, તે જ્યાં સુધી તને મળે નહિ ત્યાં સુધી, તારે સૌથી વધારે ગમતો ખાવાનો પદાર્થ ત્યજબો પડશો, એટલે તારું કામ પતી જશો.’ આ રીતે પેલો ફકીર મને મખ્યો અને તેમના કહેવા પ્રમાણે વર્તતા મને મારું ધન પાછું મખ્યું. ત્યાં સુધી હું તે ઈમારતના ઓટલે બેસી રહ્યો. જ્યારે મને મારું ધન પાછું મખ્યું ત્યારે મેં તે ઈમારત છોડી દીધી અને પહેલાની માઝક હું પાછો સમુદ્રના ડિનારે આવી પહોંચ્યો. રસ્તે ચાલતાં ચાલતાં ડિનારા ઉપર એક આગબોટ મળી. પરંતુ મને તેમાં પ્રવેશ મખ્યો ન નહીં. એટલામાં એક સારા સ્વભાવના સૈનિકે મને બોટમાં જગ્યા કરી આપી. સારા નસીબે પવન ફૂંકાયો અને પેલી બોટ સામે ડિનારે પહોંચી ગઈ. ત્યાંથી હું ગાડીમાં બેઠો અને ઘરે પાછો ફર્યો ત્યારે મારી નજરે આ મસ્તિજ્ઞમાં પડી.’ (ઓ. ૩૦-૪૩)

અહીં બાબાએ વાત પૂરી કરી અને બાબાએ શામાને આજા કરી કે મહેમાનોને તારે ઘેર લઈ જી અને જમાડ, માધવરાવને ત્યાં જ્યારે જમવાની થાળીઓ પિરસવામાં આવી ત્યારે માધવરાવને પૂછપરછ કરવાની લજાસા થઈ. તેમણે મહેમાનને પૂછ્યું કે, ‘બાબાએ કહેતી વાત તમને સમજાઈ ? કંચો બ્રાલણ અને કંચ હવેલી ? એમનો જન્મ તો જાડ નીચે થયો હતો, પછી આટલી બધી સંપત્તિ કર્યાંથી આવી ? જે વળી ચોરે ચોરી લીધી ? માટે મને લાગે છે કે આ જે વાત બાબાએ કહી સંભળાવી તે તમારી બાબતમાં પહેલાં બનેતી હોવી જેઠાએ, અને તમને તે બાબતની ખાત્રી થાય માટે તમે આવતાંની સાથે જ તે વાત કહેવાની શરૂઆત કરી હોવી જેઠાએ.’ માધવરાવની વાત સાંભળીને મહેમાન તો સજજાડ થઈ ગયા. અને બોલ્યા, ‘સાઈબાબા સર્વજ છે. રાગ, દ્રેષ, લાભ, હાનિ વગેરે પરસ્પર વિરોધી વિકારોથી અલિપ્ત રહેનારો આ જીવાત્મા અને પરમાત્મા એક જ છે. આવી સ્થિતિ જેની છે અને જે બધે જ વ્યાપેલા છે એવા આ સાઈબાબા તો પરબ્રહ્મ અવતારી પુરુષ જ લાગે છે. તેમણે જે હમણાં વર્તા કહી તે અક્ષરે અક્ષર સાચી જ છે. અને તે મારી જ વાત છે. ચાલો આ જમણ પૂરું થતાં તે વાત સવિસ્તાર તમને કહી સંભળાવીશ. બાબાને પણ કંધ બોલી ગયા એ સર્વ બની ગયેલી હકીકત છે. પણ અમારી કોઈ ઓળખાણ ન હોવાં છતાં તેમણે આ વાત કેવી રીતે જણી ? આ બધું ખૂબ જ ચમતકારીક છે. જમવાનું પૂરું થતાં માધવરાવની સાથે તમાકુવાળું પાન ચાવતા આ મહેમાનોએ આ વાત આગળ ધ્યાવી. બેમાંથી એક બોલ્યો, ધાટ એજ મારું વતન છે. પરંતુ ભરણપોષણની જવાબદારી ખાતર મારો સંબંધ એ સમુદ્ર ડિનારા સાથે હતો, માટે હું ગોવા ગયેલો. નોકરી મળવી જેઠાએ એવું મનમાં લાગ્યું માટે દત્ત ભગવાનની પૂજન કરી અને અત્યંત પૂજ્ય ભાવથી બાધા રાખી, કે હે પ્રભુ કુટુંબના ભરણ પોષણ માટે નોકરીની જરૂર છે. જે તું મને તે મેળવી આપીશ તો હું તારા ચરણે પહેલો પગાર અવશ્ય અર્પણ કરીશ. દેવયોગથી ભગવાન દત્ત મારા પર પ્રસન્ન થયા. અને થોડા જ દિવસોમાં મારી બાધા ફળી અને શરૂઆતમાં ૧૫ ડિપિયા પગાર મળવા લાગ્યો. સાઈબાબાના કહ્યા પ્રમાણે મારી બઢતી થતી જ ગઈ અને બધાની ચાદ તદ્દન ભૂલાઈ ગઈ. જેથી બાબાએ આ પ્રકારે મને ચાદ કરાવી આપી. કોઈને લાગરો કે દક્ષિણા લીધી, પરંતુ એ દક્ષિણા નથી પણ એ મારું ઉધાર જ છે. જે એમણે મારી પાસેથી ચુક્તે કરાવ્યું છે અને મારી એક ખૂબ જુની પુરાણી બાધાની ચાદ મને તાજુ કરાવી.’ (ઓ. ૪૪-૫૯)

કહેવાનો અર્થ એકે શ્રીબાબા કોઈ પાસેથી પૈસાની બીજ માંગતા ન હતા. જે કંઈ દક્ષિણા નિમિતે માંગતા તે કયાં તો આપનારનું કર્ય હતું અથવા તો તેને આગળ ઉપર અનેકગણો ફાયદો આપવા માટે તથા તેનું કલ્યાણ કરવા માટે જ માંગતા હતા. પેટ ભરવા કે સંપત્તિ બેગી કરવા માટે નહિ. બાબા પોતાના ભક્તોને પણ માંગવા દેતા ન હિ. પૈસાને તેઓ સદ્ગ અનર્થ અથવા તો સંકટ માનતા અને પોતાના ભક્તોને તેના લોભમાં કઢીએ પડવા દેતા ન હતા. મહાણસાપત્ર જેવાં

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ભક્ત સદ્ગ્ય બાબાના ચરણોમાં આસક્ત રહેતા. તે પોતાનો ઉદ્ધર નિર્વાહ માંડમાંડ ચલાવી શકતા હતા, તેમ છતાં બાબા તેને સંપત્તિ ભેગી કરવા દેતા નહીં. સાઈબાબાને દક્ષિણા નિમિત્તે જે રકમ મળતી તે રકમ અનેક સમયે લોકોમાં વહેંચી આપતા. પરંતુ તેમાંની એક કોડી પણ કચારેય સંસારિક દુઃખોથી ઘેરાયેતા મહાળસાપતિને આપતા નહીં. મહાળસાપતિ પણ ખૂબ મોટા સ્વાભિમાની હતા. તેઓ કોઈની સાથે હાથ ફેલાવતા નહિં. સાઈ આટલા બધા ઉદ્ધાર વૃત્તિવાળા હતા છતાં ભગતે એમની સામે પોતાનો હાથ લાંબો કર્યો ન હતો. મહાળસાપતિની આર્થિક સ્થિતિ એટલી બધી સારી ન હતી, છતાં તેમનો વૈરાગ્ય ખૂબ જ ઉચ્ચ કક્ષાનો હતો. એથી હંમેશા તેઓ થોડામાં જ સંતુષ્ટ રહેતા હતા, અને ગરીબીનો ત્રાસ આનંદથી સહન કરતા હતા. એક દિવસે ‘હંસરાજ’ નામના એક દ્વારા વ્યાપારીને થયું કે મહાળસાપતિને મફન્દ કરવા માટે કંઈક આપવું જોઈએ. તેમની આવી ગરીબ પરિસ્થિતિમાં પણ કોઈ ઉપકાર કરે, અથવા તો મહાળસાપતિને કોઈ કંઈ આપે તો તે બાબાને જરાયે ગમતું નહિં. કેમકે બાબાને ભક્તોની દ્રવ્ય તરફની ઉદાસીનતા હંમેશા ગમતી. પછી પેલા વ્યાપારીને શું કર્યું તે જુઓ. ભક્ત મહાળસાપતિ ઉપર દ્વારા કરીને દ્વારા વેપારી હંસરાજે બાબાના દરબારમાં જ્યારે બંને હાજર હતા ત્યારે મહાળસાપતિના હાથમાં થોડીક રકમ મૂકી. પરંતુ મહાળસાપતિએ અતિ નમ્ર થઇને તે રકમ પાછી આપી દીધી અને કહ્યું, ‘બાબાની આજ્ઞા વગર તે મારાથી સ્વીકારય નહિં.’ તેઓ પૈસાના ભૂખ્યા ન હતા, પણ પરમાર્થના ઉપાસક હતા. શરીરથી, વાણીથી અને પ્રેમાન મનથી કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કે લોભ વગર તેઓ સાઈચરણમાં ઓતપ્રોત થયેલા હતા. ત્યારબાદ હંસરાજે બાબાને વિનંતી કરી કે, બાબા આપ તેમને આજ્ઞા કરો કે એ આ રકમનો સ્વીકાર કરે. પરંતુ બાબાએ મહાળસાપતિને એક પણ પૈસાને અહકવા માટે હાથ લાંબો કરવા દીધો નહીં. અને બાબા બોલ્યા, ‘મારા ભક્તોને દ્રવ્યનો લોભ નથી હોતો. દ્રવ્યના વૈભવમાં તેઓ ફસાતા નથી.’ (ઓ. ૬૦-૭૧)

બીજે મહેમાન બોલ્યો, ‘મારી ઉપર થયેતા માર્ભિક સંકેતો પણ મને હવે સમજન્યા. બધી હકીકત હું તમને કહું છું તે હવે સાંબળો. એ સાંબળીને આનંદ થશે. પાંત્રીસ વખ્યોથી મારી તૈનાતમાં રહેતો બ્રાહ્મણ રસોઈયો મહેનતું અને વિશ્વાસું હતો. કમનસીબે તેની મતિ બગડી અને મારા લેગા કરેતા પૈસા ઉઠાવી ગયો. મારા ઘરની ભીતમાં કબાટ છે, તેની પાછળથી ધીમે રહીને ખબર ન પડે એવી રીતે ભીતમાં બાકોકું પાડ્યું અને પથરા ખસેડીને અમે ઉંઘતા હતા ત્યારે ચોરી કરવા માટે પેઠો. બાબા જે બીજીવાત બોલ્યા કે તેમના ઇપિયા ચોરી લીધા તે પણ ખરેખર જ સાચું છે. નોટોનું જ એ બંડલ હતું અને તેની ડિંમત બાબાએ બતાવી હતી એટલી જ હતી. બાબાને તેની કેવી રીતે ખબર પડી? કોણ જાણો? ખૂબ મહેનતે કમાયેલું આ ધન આમ ચોરાઈને ગુમાવી દેતા હું રાતભર રડતો હતો. હું શોધી શોધીને થાકી ગયો. આગળ શું કરવું તે સમજનું ન હતું. આમ પંદ્ર દિવસ આ બાબતે ચક્કરમાં પડ્યો રહ્યો, પણ કોઈ માર્ગ મળે નહીં. એક દિવસ હું ખૂબ વધારે મૂંજવણથી અને દિલગીરીથી ઓટલા ઉપર બેઠેલા હતો ત્યારે એક ફકીર રસ્તા ઉપરથી સવાલે પૂછતો પૂછતો પસાર થતો હતો. તે મારી પાસે આવ્યો અને મારું ઉત્તેલું મો જોઈને તેણે મારા દુઃખનું કારણ પૂછ્યું. આ કારણે મેં તેને બની ગયેતી સર્વ હકીકતથી વાકેદ કર્યો, ત્યાં તેણે આ ઉપાધીના નિવારણનો ઉપાય બતાવ્યો.’ ‘કોપરગાંબ તાલુકામાં શિરડી નામનું એક ગામદું છે, ત્યાં સાઈનામનો એક ઓલિયો રહે છે. તેની તું બાધા રાખ. જે ખાવાની વસ્તુ તને ખૂબ જ ગમતી હોય તેનો ત્યાગ કર અને તે ઓલિયાને કહે કે જ્યાં સુધી મારું કાર્ય નહિ થાય ત્યાં સુધી તે ખાઈશ નહીં. અને કાર્ય પતશે એટલે તારા દર્શને શિરડી આવીશ પછી જ હું તે વસ્તુ સ્વીકારીશ. ત્યારબાદ પંદ્ર દિવસ પસાર થયા હશે તેવામાં પેલા બ્રાહ્મણના મનમાં શું થયું એ તો કોણ જાણો પણ તે પોતે જ આવ્યો અને મારું ધન મને પાછું આપતાં બોલ્યો, ‘મારી બુદ્ધિ અને મતિ ચલિત થઈ હતી માટે મારા હાથથી આમ થઈ ગયું. હવે હું તમારા ચરણોમાં માથું મૂકીને ક્ષમા માગું છું તમે મને ક્ષમા કરો.’ ત્યારબાદ બધું જ વ્યવસ્થિત થયું, અને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સાઈના દર્શનની ઈચ્છા ઉત્પન્ન થઈ. તે પણ આજરોજ પૂર્ણ થઈ. ખરેખર આ સહનસીબે હું ઘન્ય થઈ ગયો. સંકટમાં હું મારા ઓટલા ઉપર હુઃખી અને બિજી થઈને બેઠેલો ત્યારે મને જે સાંત્વન આપવા માટે આવ્યા હતા તે ફકીર ફરીથી દેખાયા જ નહિ. જેના મનમાં મારે માટે ચિંતા હતી અને જેણે મને સાઈની માહિતી આપી તથા આંગળીના ઈશારે શિરડીનો રસ્તો બતાવ્યો તેઓ તો ફરીથી મને મળ્યા જ નહિ. તેમની મને અચાનક જ મુલાકાત થઈ ગઈ, જે મોઢેથી એકસરખા સવાલો કરતા આવ્યા અને છેલ્લે મારી પાસેથી બાધા પૂરી કરાવી. તે ફકીર એટલે જ ખરેખર આ તમારો સાઈ ઓલિયો જ હતો. અને તેના દર્શનનો અમને લાભ મળે માટે જ ઉત્સુક થઈને આવ્યા હતા. કોઈને કંઈ પણ જેઠિંતું હોય ત્યારે જ તેને સંતના દર્શનનો ચટકો લાગે છે. મને સાઈબાબાના દર્શનની જરાય ઈચ્છા ન હતી પણ શરૂઆતમાં આ ફકીરે જ મને પૈસા પાછા મેળવવા માટે અને દર્શન માટે પ્રવૃત્ત કર્યો. તે પૈસા તેની બાધાને કારણે જરા પણ પ્રયત્ન કર્યા વીના મને પાછા મળ્યા. તે કંઈ મારા પાંત્રીસ ડિપિયાના લોભમાં પડે ? પણ આવું થવું કયારેય શક્ય નથી. ઉલ્ટાનું અમે તો અજ્ઞાની માણસો, અમને પરમાર્થ તરફ વાળવા માટે, અમારા કલ્યાણ અર્થે સહાને માટે આ સાઈ અમને તે નિભિતે વ્યવસ્થિત માર્ગ ઉપર લઈ આવે છે. આ કામ માટે જ તેમનો અવતાર છે. નહીં તો અમારા જેવા ભક્તિહીન પામર ! અમારાથી આ સંસાર કયાંથી પાર પડવાનો ? સ્વસ્થપણે આનો વિચાર કરો. ચોરી પકડાઈ જતાં, અને મારા પૈસા પાછા મળતાં મને ખૂબ આનંદ થયો. અને તેને લીધે મારી બાધા ભૂલાઈ ગઈ. પૈસાનો લોભ ખૂબ ખરાબ હોય છે.' (ઓ. ૭૨-૮૫)

એક દિવસ કોલાબામાં હતો ત્યારે મેં સ્વર્ણમાં સાઈને જ્ઞેયા અને તરત જ શિરડી જવા માટે નીકબ્યો. સાઈસમથે તેમના પ્રવાસ માટે કહ્યું હતું કે બોટમાં ચઢવાની મનાઈ કરવામાં આવી હતી. તેમાં એક સૈનિકની ખટપટોથી પ્રવાસનું કષ્ટ ઓછું થઈ ગયું, તે એકદમ સાચું છે. પણ આ બધી તો મારી અડચણો હતી. જ્યારે હું બોટમાં જગૃત થયો ત્યારે એક સૈનિકે મારે માટે વિનંતી કરી. શરૂઆતમાં બોટના અધિકારીએ મને ઝાટકી કાઢ્યો, પણ પાછળથી મને બોટમાં જગ્યા કરી આપીને આભારી કર્યો. સૈનિકો પણ અજ્ઞાયા હતા. છિતાં તેમણે કહ્યું કે તેમની અને અમારી ઓળખાણ છે. તેથી અમને કોઈએ રોક્યા નહિ અને અમે બોટમાં આરામથી બેસી ગયા. આમ આ બોટની સર્વ હકીકત અને પેલા સૈનિકોની વાત અમને અનુલક્ષીને થઈ હોવા છિતાં તે બધી સાઈએ પોતાને માથે લઈ લીધી. આવો અદ્ભુત પ્રકાર જેઠિને મારી બુદ્ધિ બહેર મારી ગઈ. અને મનમાં લાગવા માંડયું કે આ સાઈ જેવા અહીંયાં છે તેવા જ પૂરા વિશ્વમાં સર્વ દેકાણો ફેલાયેતા છે. તેમના વીના એક તસુભર પણ જગ્યા ખાતી હોઈ શકે નહીં. તેમણે અમને જેવો અનુભવ કરાવ્યો તેવો બધાને કરાવતા હોવા જેઠિએ. અમે કોણા, અને કયાંના રહેનાર છિતાં કેટલાં મોટાં અમારાં ભાગ્ય કે તેમણે અમને તેમની પાસે ખેંચી લાવીને સહેલાઈથી આ માર્ગ ઉપર ચઢાવી દીધા. અમારા સહનસીબ વિષે શું કહેવું ? શું અમારી બાધા રાખવા અને શું અમારું ધનનું ચોરાઈ જવું ? શું પેલી બાધાની નવાઈ કે એ ધન પાછું મળવું ? અને શું અમારું આવું ન સમજવા જેવું ગહન ભાગ્ય કે જેમનાં પહેલાં દર્શન થયા ન હતા કે તેમની છબી પણ જેઠિ ન હતી અથવા નામ પણ સાંભળ્યું ન હતું છિતાં તેમને અમારી યાદ આવી તે કેવી રીતે ? જે આમ હોય તો તેમના સહનવાસમાં જેઓ વર્ષોનાં વર્ષ રહ્યા અને રાત દિવસ ખડે પગે તેમની સેવા ચાકરી કરી તે બધા જ ભગવદ્ ભક્ત તો ધન્ય થઈ ગયા. ખરેખર જેમની સાથે સાઈ રમ્યા, રહ્યા, હસ્યા, બોલ્યા, બેઠા, ચાલ્યા, જર્મ્યા, સૂતા, કોધે ભરાયા તે સૌનું ભાગ્ય અતિ શ્રેષ્ઠ છે. મને લાગે છે કે, પરમ ભાગ્યવાન તો તેઓ હતા જેમને પોતાના પુણ્યાઠનાં સત્કૃત્યોથી આ મનુષ્ય દેહ ધારણ કરીને તેમની આ મૂર્તિ પાસે અમને બોલાવી લાવ્યા હોવા જેઠિએ. અનેક જન્મોનાં લેગા થયેલાં પુણ્યોના યોગથી અમને પણ આ શિરડીના દર્શન થયાં છે. ત્યારે સાઈદર્શનની યાત્રા માટે બધું જ કાંઈ અર્પણ કરીને સર્વસ્વ ખર્ચ કરી નાખવાની ઈચ્છા થાય છે. સાઈ મહારાજ એ જાતે એક સાત્ત્વિક

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અવતારી પુરુષ છે. તેમનું વર્તન મહાન વિષણુભક્ત જેવું જ છે. ખરેખર જ્ઞાનદૂપી વૃક્ષના તેઓ અંકુર છે, અને ચૈતન્ય એટલે શુદ્ધ જ્ઞાનદૂપી આકાશમાં શોભનારા સૂર્ય જેવા છે. અમારાં પુણ્ય પ્રતાપે જ અમને આ મસ્નિદ્વભાઈ મળી અને અમારી બાધા પૂર્ણ થઈ. અમને તેમના દર્શન પણ કરાવ્યાં. અમારે માટે તો આ અમારો ભગવાન દત્ત જ છે. તેમને જ આ વ્રત પાળવા માટે કહ્યું, અને અમને જ બોટમાં બેસાડ્યા, અને શિરડીમાં દર્શન માટે પણ તેડાવ્યા. આ રીતે સાઈબાબાએ પોતાની સર્વવ્યાપકતાની, અંતર્યામીપણાની અને સર્વ સાક્ષીત્વની જણકારી આપી. તેમનો હસ્તો ચહેરો જેઠિને મનને ખૂબ આનંદ થયો. સંસારનાં બધાં દુઃખો ખૂલાઈ ગયાં. અને પરમાર્થ સાધવા માટેનો ઉલ્હાસ બહાર છલકાવા લાગ્યો. દૈવીયોગથી અને સહભાગ્યે જે થવાનું હોય તે થાય એવી મનની પાકી ધારણા રહે અને સાઈચરણોમાં અખંડ પ્રેમ મળે તથા તેમની મૂર્તિ આંખોની સામે સહાય રહે. બાબાની લીલા અગાધ અને અગમ્ય છે. તેમના ઉપકરોની કોઈ સીમા નથી એવું લાગે છે. તે દ્વારા બાબા માટે આપું જીવન ખર્ચી નાખવાની દંદા થાય છે. ભક્તિદૂપી જ્યોત પ્રગટાવીને તેમની આરતી ઉતારીએ. (ઓ. ૮૬-૧૧૮)

હવે એક બીજુ વાર્તા પળભર માટે સાવધાન થઈને સાંભળો. સાઈના મુખેથી બહાર નીકળનાર શબ્દે શબ્દ જાહેર કે ખ્રિસ્તેવની ભવિષ્યવાળી હતી. સોલાપુર શહેરમાં રહેનાર સખારામ ઔરંગાબાદકરની પત્તની. સંતાન પ્રાપ્તિની તીવ્ર દૃઢાથી શિરડીમાં આવી. સાઈબાબા તો પવિત્ર સંત પુરુષ છે. તેમનું અગાધ ચરિત્ર સાંભળીને પોતાના સાવકા દીકરાને જેઠે લઈને તે બાઈ બાબાશ્રીના પવિત્ર દર્શને આવી. લશ્વબાદ સત્યાવીશ વર્ષનાં વહાણાં વિત્યા બાદ પણ તે રજસ્વલા થતી હતી. તેને બાળ બચ્યાં થવાનાં કોઈ ચિહ્ન દેખાતાં ન હતાં. દૈવીદૈવીઓની માનતાઓ રાખીને તે પાકી ગયેતી અને મનથી ખૂબ નિરશ રહેતી. આમ એ સૌભાગ્યવતી મનમાં બાબાના દર્શનનો દફ નિશ્ચય કરીને ઘેરથી શિરડી આવી. અને તેના મનમાં વિચાર આવ્યો, ‘બાબા તો સહાને માટે ભક્તોથી ઘેરાયેલા રહે છે. મને એકલા કેવી રીતે મળશો? મારા મનની અંગત વાત તેમને કેવી રીતે કહી શકશો?’ આમ વિચારીને બાઈ ખૂબ ચિંતામાં પડી. ‘મસ્નિદ્વ સાંકડી અને સભામંડપનું આંગણું મોકણું. પણ બાબાની આસપાસ ભક્તવૃન્દ તો વીટળાયેલું જ રહેતું આથી મારો જીવ મુંજાતો કે મારા મનની વાત તેમના કાન શુદ્ધા પહોંચે તેવી એકાંતની પળ કરારે મળશો?’ તે બાઈ અને એનો સાંબળો દીકરો જેનું નામ વિશ્વનાથ હતું. તેઓ બંને બાબાની સેવા કરતાં બે મહિના સુધી શિરડીમાં રહ્યાં હતાં. એક દિવસ બાબાની પાસે વિશ્વનાથ સિવાય અન્ય કોઈ પણ ન હતું, તે જેઠિને તે બાઈએ માધવરાવને શું ચિનંતી કરી એ હવે જેઠિએ, ‘તમે યોગ્ય સમય જેઠિને મારા મનનો આશય બાબાના કાન પર નાખોને? તે પણ જ્યારે બાબા એકલા જ હોય ત્યારે અને ભક્ત પરિવારથી ઘેરાયેલા ન હોય ત્યારે. આ વાત કોઈના કાને ન પડે એવી રીતે તેમને જલ્દીથી આ વાત અવશ્ય કહી દેશો.’ તેમની વાત સાંભળી માધવરાવે જવાબ આપ્યો, ‘આ મસ્નિદ્વ કોઈ દિવસ ખાલી હોતી નથી. દર્શન માટે કોઈને કોઈ હંમેશા આવતું જ રહે છે. સાઈબાબાનો આ દરભાર હંમેશા ખુલ્લો રહે છે. અહીંયા કોઈને માટે કોઈ પણ પ્રકારનો રોકટોક નથી. છિતાં તને એક વસ્તુ કહી દઉં છું. તું મારા બોલવાનો અર્થ ધ્યાનમાં રાખજો. પ્રયત્ન કરવાનું કાચ મારું છે પણ ચશ આપવાણો તો મંગળધામમાં વસનારો પરમાત્મા છે અંતે તો તે જ આરામ આપશો અને ચિંતાનું નિરાકરણ કરશો. તું ફક્ત હાથમાં એક નારિયેળ અને અગરબત્તી લઈને બાબા જ્યારે જમવા બેસે ત્યારે સભામંડપના પથ્થર ઉપર આવીને બેસજે. પછી જમાવનું પતી ગયા બાદ બાબાનો આનંદ મિનજ જેઠિને હું તને ઇશારો કરીશ ત્યારે તું ઉપર આવજો.’ આમ કરતાં કરતાં એક દિવસે દીશરે નક્કી કરેલી એ શુભ ધરીનો યોગ આવી ગયો. સાઈનું ભોજન પત્યા બાદ અચાનક તેને લાગ મળ્યો. સાઈબાબાએ પોતાના હાથ ધોયા. ત્યારબાદ માધવરાવ તેમના હાથ કપડાથી લુછિતા હતા. તે વખતે બાબાએ આનંદમાં આવી જઈને શું કર્યું તે જુઓ. પ્રેમથી માધવરાવના ગાલે ચીમટો ભર્યો. પછી દેવ અને ભક્ત વચ્ચેના જે સંવાદો ચાલ્યા તે સાંભળો.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

માધવરાવ પોતે ખૂબ વિનયશીલ હતા, પણ પોતાને ગુસ્સો આવ્યો હોય તેવો ખોટો દેખાવ કરીને તેઓ બાબાને મશકરીથી બોલ્યા, ‘આ લક્ષણો સારાં છે ? ગાલ ઉપર આમ જેરથી ચીમટો ભરનારો ટીખળખોર દેવ અમારે નથી જોઈતા. અમે તો કંઈ તારથી શરમાવવાના છીએ ? આપણો જે વર્ષોં જૂનો ગાડ સંબંધ છે, તેનું ફળ આજ છે કે ?’ આ સાંભળીને બાબાએ જવાબ આપ્યો કે, ‘છેલ્લા બોતેર જન્મોથી અને પેઢીઓથી મેં તને કોઈ હિવસ હાથ લગાવ્યો છે ? યાદ કરી જ્યે.’ તે સાંભળીને માધવરાવે જવાબ આપ્યો કે, ‘અમને તો દેવ એવા જોઈએ કે જે હંમેશા નીતનવો અનુભવ કરાવે. અમારે તારો માન ભરતબો નથી જોઈતો, કે નથી જોઈતું સ્વર્ગનું વિમાન, ફક્ત તારાં ચરણોમાં અમારી ફૃતજીતા અને ઈમાન જગૃત રહે. એ જ દાન તું અમને આપ.’ ત્યારે બાબા બોલ્યા, ‘તેને માટે તો હું અહીંથા આવ્યો છું. તમને લોકોને ખોરાક ખવડાવતાં ખવડાવતાં મારા મનમાં તમારા લોકો માટે હાલ ઉત્પન્ન થયું છે.’ (ઓ. ૧૧૯-૧૪૩)

આટલું થતા બાબા કઠેરા પાસે જઈ પોતાના આસને બેસી ગયા, અને માધવરાવે પેલી બાઈને ઈશારો કર્યો. પોતાના કામ માટે રાહ જોઈને બેઠેલી પેલી બાઈ તરત જ ઉઠી અને ઉતાવળે ઉતાવળે પગથિયાં ચઢીને બાબાની સામે આવી વિનયપૂર્વક ગર્દન ઝૂકાવીને ઊભી રહી. તરત જ શ્રીફળ અર્પણ કર્યું અને પગે પડીને નમરસ્કાર કર્યો. બાબાએ તે નારિયેળ પોતાના હાથે જ જેરથી કઠેરા ઉપર પણાડ્યું અને બોલ્યા, ‘શામા, આ નારિયેળ ખૂબ અવાજ કરે છે એનું શું કહેવું છે ?’ શામાએ તરત જ એ લાગ જોઈને બાબાને શું કહ્યું તે સાંભળો, ‘મારા પેટમાં પણ આવો ગુડગુડાટ થાય એવું આ બાઈ મનથી માંગી રહી છે. તે એવું જ થવા હે. એના પ્રશ્નનો ઉકિલ અને તારાં ચરણોમાં એનું મન અખંડ દફ થઈ જય તેવું કંઈ કર. તું એ બાઈ સામે ફૂપા દશ્ઠિથી જે અને પેલું નારિયેળ તેના ઘોળામાં મૂક. તારા આશીર્વાદથી તેના એટે સંતતિ થવા હે.’ તે સાંભળતાં બાબા બોલ્યા, ‘નારિયેળથી શું છોકરા થાય છે ? આવી કેવી તારી ખોટી સમજ છે. તમને લોકોને ગાંડપણ જ વળજ્યું છે.’ ત્યારે માધવરાવ બોલ્યા, ‘તારા બોલની કિંમત અમે જાણીએ છીએ. તારા મૂલ્યવાન શબ્દોને લીધે, આપોઆપ બાળકોનો વંશવેલો વધશે. પણ હાલમાં તું ભેદભાવ કરી રહ્યો છે. અને તેને આશીર્વાદ આપતો નથી. અને વગર કામની તું જ્ઞાનોની કરે છે. તેને નારિયેળનો પ્રસાદ આપ જોઉ !’ ત્યારે બાબા બોલ્યા, ‘નારિયેળ ફોડ’ ત્યારે શામા કહે ‘ઘોળામાં મૂક.’ આવી થોડા સમય હું સાતુંસી ચાલ્યા બાદ છેવટે બાબાએ હાર માની લીધી. અને બોલ્યા, ‘જ થશે બાળક’ ત્યારે પાછું ફરીથી માધવરાવે બાબાને પૂછ્યું, ‘કયારે’ ત્યાં બાબા બોલ્યા, ‘બાર મહિના પછી’ એવું કહેતાં જ માધવરાવે એ નારિયેળ વધેરી નાંખ્યું. અર્દોભાગ બંનેએ મળીને ખાદો અને બાકી રહેતો ભાગ તે બાઈને આપ્યો. પછી માધવરાવ તે બાઈને બોલ્યા, ‘મારા બોલની તું સાક્ષી છે. આજથી બાર મહિના પૂરા થાય તે પહેલાં તારા પેટમાં સંતાન રહે નહિ તો હું શું કરીશ તે સાંભળ. આવું જ એક નારિયેળ આ દેવના માથા ઉપર ફોડીને આ દેવને મસ્નિદ્ધમાંથી કાઢી મૂકું નહિ તો મારું નામ માધવરાવ નહીં. આવા દેવને હું મસ્નિદ્ધમાં રહેવા દેવાનો નથી. આ એકદમ સત્ય છે. આનો અનુભવ યોગ્ય સમયે મળી જશે. તેની તું ખાત્રી રાખજો.’ આવું આશ્વાસન મળતાં જ પેલી બાઈને સુખસમાધાન થયું. અને બાબાનાં ચરણોમાં દંડવત્ પ્રજામ કરીને તે સ્વસ્થ મને પોતાના ગામે પાછી ફરી. મારો શામા હંમેશાં મારી ઉપર આધાર અને વિશ્વાસ રાખે છે. પોતાના ભક્તનું મન પણ સાચવવું જોઈએ. તેવા ગાડ પ્રેમથી બંધાયેલા બાબાએ શામા પર જરા પણ ગુસ્સો દાખલ્યો નહિ. ભક્તના શાષ્ટ સાચા દેરવા માટે શરણો આવેલાઓનું પાલન કરનારા ફૂપાના સાગર અને દ્વારા સાઈ ભક્તોને આપેલાં આશ્વાસનો લાડ લડાવીને પૂરાં કરતા. શામા તો મારો લાડકો ભક્ત છે. તે વખાણ કરતી વખતે એ યોગ્ય કે અયોગ્ય જાળતો નથી. ભક્તોના સંકલ્પ પૂરા કરવા તે જ સંતોનું વત હોય છે. બાર મહિના પૂરા થતાં બાબાએ પોતાનું વચન પાયું. ત્યાર બાદ ત્રણ મહિના પૂરા થતાં જ પેલી બાઈને હિવસ રહ્યા. નસીબ જોગે તેને પુત્ર જન્મયો. તે બાળક પાંચ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

મહિનાનો થતાં તે બાધ બાળકને લઈને શિરડીમાં બાબાના દર્શન માટે આવી. તેના પતિએ પણ ખુશ થઈને સાઈચરણોમાં વંદન કર્યો અને ૫૦૦ રૂપિયા દક્ષિણા મૂકીને પોતાના મનથી બાબાનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો. એ જે ૫૦૦ રૂપિયાનો ઉપયોગ કરીને બાબાએ પોતાના શ્યામકર્ણ ઘોડાના તબેલાની બાજુએથી ભીત બંધાવી. (ઓ. ૧૪૪-૧૬૬)

માટે જે સાઈનું નિત્ય ધ્યાન કરવામાં તેને યાદ કરવામાં અને તેનું ચિંતન કરવામાં હેમાડપંતને શાંતિ અને વિસામો મળે છે. પોતાની હુંદીમાં જવાદી જતના બિલાડાના અંડમાં કસ્તુરી જેવો ઉત્પન્ન થતો એક સુગંધિત પદાર્થ હોવા છતાં તેને માટે ચારે બાજુ શા માટે દોડવું કે ભ્રમણ કરવું પડે ? હેમાડપંત સાઈચરણોમાં અખંડ મન્ત્ર રહેતાં અને અમયોદિત સુખનો લાભ લેતા હતા. (ઓ. ૧૬૭-૧૬૮)

આગળનો અધ્યાય આના કરતાં પણ રસાળ અને આનંદ આપનારો છે. બાબાને તેમના પ્રેમાળ ભક્તો મસ્તિષ્ઠમાંથી ચાવડીમાં આનંદથી સરધસ કાઢીને કેવી રીતે લઈ જતા હતા તેનું વર્ણન કરવામાં આવશે. તેમજ બાબાની હંડીની કથા, પ્રસાદ વહેંચવો વગેરે વિનોદી વાતો શ્રોતાઓને હવે પણીના અધ્યાયમાં સાંભળવાની મળશે. જેનાથી એમનામાં ઉત્સાહનો વધારો થશે. (ઓ. ૧૬૯-૧૭૦)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા, ભક્ત હેમાડપંત રચિત,
શ્રી સાઈ સમર્થના સત્ય ચરિત્રના ‘સાઈ સર્વ વ્યાપકતા તદ આરીવાંદ સાફલ્યતા’ નામનો છત્રીસમો.

અધ્યાય અહીં પૂર્ણ થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને અર્પણ.



॥ અધ્યાય ૩૭ ॥

ચાવડી વર્ણનમ્ભ (ચાવડીના સમારંભનું વર્ણન)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

ધન્ય ધન્ય સાઈચરિત્રને ! ધન્ય એનું નિત્ય આચરણ ! તેમની સર્વ કિયાઓ પણ આસાનીથી ન સમજનારી, અદ્ભુત અને જેવી રીતે બન્યું તેનું તાદ્યન વર્ણન કરવું પણ અશક્ય છે. એમનું સાચુ ચરિત્ર તો અંત સિવાયનું અને અગાધ છે. તેમનું જીવનવૃત્તાન્ત પણ ધન્ય છે અને તેમનાં તલવારની ધાર પર ચાતવા જેવાં કાર્ય અત્યંત અધરાં અને કયારેય પાછા ન પડનારા એવા લીધેલા નિત્ય નિયમોનાં વ્રત તો ખરેખર જ ધન્ય છે. (ઓ. ૧-૨)

કયારેક તેઓ બ્રહ્માનંદમાં મસ્ત રહેતા, તો કયારેક આત્મજ્ઞાનમાં તૃપ્ત રહેતા. અને કોકવાર બધુ કરવા છતાં અલિપ્ત રહેતા. આવી કયારેય નક્કી ન થઈ શકે તેવી તેમની સ્થિતિ હતી. કયારેક તેઓ પ્રવૃત્તિ શૂન્ય રહેતા પણ નિદ્રાગ્રસ્ત તો નાહિ જ. પોતાના સ્વાર્થને બદલે મન મૂકીને તેઓ સહાયે આત્મસ્વરૂપે સાવધ રહેતા. કયારેક તેઓ સમુદ્રની માફક પ્રસન્ન રહેતા પરંતુ સમુદ્ર જેવા જ અંત વીનાના જેમાં પ્રવેશ કરવો પણ અધરો એવા અત્યંત ગૂઢ અને ગહન હોવાને લીધે તેમનું આ અગાધ રૂપનું વર્ણન યથાર્થરૂપે કોણ કરી શકે ? પુરુષોની સાથે તેઓ બંધુત્વ રાખતા અને સ્ત્રીઓ તેમની માતા અને ભગીનીઓ હતી. તેઓ અખંડ બ્રહ્મચારી હતા અને તેવી જ તેમની હંમેશાની ઘ્યાતિ હતી. તેવા બાબાના સત્સંગમાં બુદ્ધિની જે અડગ સ્થિરતા પ્રાપ્ત થઈ તે ભરણ પર્યંત રહે. તેમની સેવા કરવાની ઈચ્છા પુષ્કળ રહે અને તેમનાં ચરણમાં ભક્તિ દદ થાઓ. સર્વ પ્રાણીઓમાં ભગવતભાવ રહે. અને સાઈબાબા નામમાં અખંડ પ્રીતિ રહે. તેમના એકેએક કૃત્યો જેઠિને જે કોઈ કારણ શોધવા ગયા તેઓ ગોટાળામાં પડ્યા અને પછી તટસ્થપણે સ્વસ્થ ચિત્ત બેસી રહ્યા. (ઓ. ૩-૬)

કેટલાક લોકો સ્વર્ગનાં સુખો માટે લડતા જગડતા હોય છે અને સ્વર્ગલોકનાં પુષ્કળ ગુણગાન ગાતા હોય છે. તેઓ ભુલોકના જીવનને તુર્ય ગણે છે અને કહે છે કે અહીં તો ભરણનો ડર છે. પરંતુ તેમને એ સમજનું નથી કે, અવ્યક્તમાંથી આકાર લઈને આવનું એટલે જ વ્યક્ત. આ સ્થિતિ જ ન મને કારણો આવેલી કહેવાય અને આગળ તેને કારણો જ અવ્યક્તતરૂપમાં પ્રવેશવાનું તેને મૃત્યુ કહેવાય. અર્ધર્મ, અજ્ઞાન, રાગ, દૈષ આ બધા મૃત્યુ તરફ દોરનાર ફાંસા છે. બધી વસ્તુઓનું જે સંપૂર્ણપણે ઉલ્લંઘન કરે છે, તેને જ સ્વર્ગલોકમાં પ્રવેશ મળે છે. સ્વર્ગ તે વળી બીજું કયું ? સંસારિક સુખોની ઈચ્છા અને આકંક્ષા અને વિશ્વભોગ વિષેની વૈરાગ્યવૃત્તિ પોતાના આત્માનું સ્વરૂપ એ જ વિશ્વવ્યાપી ઈશ્વર છે એ જ્ઞાનવાં તે જ માનસિક દુઃખો વગરનો સ્વર્ગલોક છે. ત્યાં રોગ વગેરે કારણ કે નિમિત્ત નથી હોતું. તેમજ ચિંતા, બ્યાધિ અને દુઃખો નથી હોતાં. ત્યાં કોઈ ભૂખ અને તરસથી આકુળવ્યાકુળ થતું નથી અને જીવનને ઘડપણમાં કોઈ ભય કે દુઃખ નથી હોતું. ત્યાં મૃત્યુનો ભય નથી રહેતો અને અમુક કરવું અને અમુક ન કરવું એવા વિષયોના બંધન સિવાય જીવ ત્યાં બિલકુલ નિર્ભયતાથી વર્તે છે. સ્વર્ગલોકની હિંદ્ય સ્થિતિ તે આ જ. (ઓ. ૧૦-૧૫)

જે તત્ત્વ બ્રહ્મહેવથી માંડીને નાનામાં નાની જ વસ્તુ સુધી દરેક અસ્થિર અને સ્થિર વસ્તુઓમાં પૂર્ણપણે આવેલ છે

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

તે જ તત્ત્વ પરલોકમાં મૃત્યુ પછી-પ્રાપ્ત કરવાને બદલે અથવા તો આ પૃથ્વી ઉપર અભિજ્ઞપણે આવેલું છે. સંસારના વ્યવહારનો ત્યાગ કરેલો હોય તેમ છતાં જે એ જીવ, આત્માને બીજા પદાર્થોથી જુદ્ધો જેવાની વૃત્તિવાળો હોય તો માયા અથવા અજ્ઞાનથી મોહિત થયેલ એ જીવને એ તત્ત્વ બ્રહ્મ એટલે સત્ય અથવા તો જગતનું આદિ કારણ પરમાત્માથી ન વ્યાપેલું એવું દેખાય છે. પરબ્રહ્મ તે મારાથી વેગળું છે અને હું તો કોઈ બિજે જ છું એવું જેનું બેદભાવવાળું જ્ઞાન હોય છે તે હુંમેશાં મરણને આધીન રહે છે. જન્મ મરણના સંસાર ચક્કા ફેરા તેનો પીછો છોડતા નથી. (ઓ. ૧૬-૧૮)

મહા કઠીન એવા યજા, તપ અને દાનને લીધે જેનો લાભ મળે છે તેવું સ્વર્ગ જે વિષ્ણુના ચરણક્રમજના ધ્યાન વિનાનું હોય તો તે શું કામનું ? વિષયોના બોગ બોગવા માટે કેવળ સ્થાન હોય એવું સ્વર્ગલોક અમારે નથી જેઠતું. જ્યાં ગોવિંદનું નામસ્મરણ નથી એવી જગ્યાની અમારે શી જરૂર છે ? સ્વર્ગમાં જીવ કે નર્કમાં જીવ વિષય સુખમાં કોઈ ફરક પડતો નથી. સ્વર્ગલોકમાં દેવોનો રાજ ઈન્દ્ર હોય કે પછી પૃથ્વી પર આવેલો એક સાધારણ ગર્દબ-ગઘેડો હોય, તે બંનેનાં વિષયસુખો એકસરખાં જ છે. ઈન્દ્ર નંદનવનોમાં અને મોટા મોટા ઉધાનોમાં વિહાર કરતા હોય છે, જ્યારે એક ગર્દબ કરચાના ઢગલામાં કે ઉકરડામાં આળોટે છે. તેમનાં જે સુખો જેવા જેઠાંથે, તો તેમા લેશમાત્ર પણ ફરક નથી હોતો. સ્વર્ગના પુણ્યો પણ ખલાસ થતાં આ પૃથ્વીલોકમાં પાછું આવવું જ પડે છે. તેવી જગ્યા માટે વગર કામનો પ્રયત્ન શા માટે કરવો ? એના કરતાં તો આ પૃથ્વી ઉપરનો જ જન્મ ખૂબ સારો ! આ ભૂલોકનું મહત્વ પણ અતિગણન છે. જ્યાં આયુષ્ય એક કલ્પ એટલે કે બ્રહ્મદેવના એક દિવસ કરતાં માણસના (૪૩૨) કોટિ (૨૦) લક્ષ વર્ષો કરતાં વધારે છે. તો એવા બ્રહ્મલોકનું વગર કામનું આટલું મહત્વ શા કામનું ? આ ભૂલોકમાં કણાભર અથવા તો થોડું અમસ્તુ આયુષ્ય પણ વધારે મહત્વનું છે. એક કણામાં નાશ પામનાર આયુષ્યમાં, એક કણા માટે કરેલાં સર્વ કર્મો જે માણસ ઈશ્વરને અર્પણ કરે, તો પણ તેને સુરક્ષા આપનારું અભય સ્થાન પ્રાપ્ત થાય છે. જ્યાં ભગવાનનો ભક્તાલોક નથી, જ્યાં હરિ ગુરુ કથાનું વર્ણન નથી, જ્યાં ભગવંતનું સંગીત, નૃત્ય અને પૂજન નથી, તેવું સ્થાન શું કામનું ? બ્રહ્મ અને આત્મા તેમનાં એકત્વનું અનુભવેલું જ્ઞાન એ જ સાખત અને સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિનું યોગ્ય સાધન છે અને તેને કારણે જ સ્વર્ગલોક કરતાં ભૂલોક વધારે સારો છે. (ઓ. ૨૦-૨૮)

શરીર, વાણી અને મનસહિત પાંચે પ્રાણ ગુરુને સર્વપૂર્ણ કરો. બુદ્ધિ પણ નિશ્ચયપૂર્વક લીન કરીને ગુરુને સર્વસ્વ આધીન થઈ જાઓ. આ પ્રમાણે સદગુરુના શરણો જવાથી, પછી ભવનો ભય રેનો ? સર્વ દુઃખોને દૂર કરનારા ગુરુ જ જ્યાં હાજર છે પછી સંસારના વ્યવહારની વ્યર્� ચિંતા શા માટે કરવી ? અજ્ઞાન કે માયાનો જ્યાં વાસ છે ત્યાં જ પુત્ર પશુ વગેરેનાં માયાનાં બંધનો હોય છે. રાતદિવસ સંસારની ચિંતા રહ્યા કરે છે અને સુવિચાર તો લેશ માત્ર નથી હોતો. આ બધાનું મૂળ કારણ અજ્ઞાનતા છે. તે જ અનેક તત્ત્વની સૂષ્ટિમાં સર્વ પદાર્થ જુદ્ધ જુદ્ધ હોવાને કારણે અને તે બધામાં એક જ અવિનાશી પરમાત્મા નથી હોતો એવું બ્રહ્મ યુક્ત જ્ઞાન ઉત્પન્ન કરે છે. માટે જ આચાર્ય અને વેદ પાસેથી વિદ્ધતાપૂર્ણ પરિપક્વ જ્ઞાન સંપાદન કરવું. અજ્ઞાનનો નાશ થતાં જ આણું જેટલું પણ અનેકત્વનું જ્ઞાન બાકી રહેતું નથી. અને આવા પ્રકારે એકત્વનું એટલે કે સૂષ્ટિમાં અનેક પ્રકારનાં જે વિનાશી પદાર્થો છે, એ બધામાં અવિનાશી પરમેશ્વર વ્યાપી રહેલો છે એવું જ્ઞાન થયું કે જન્મ અને મરણના ફેરા પૂરા થાય છે. જે થોડી પણ બેદભાવવાળી દાખિ ધરાવે છે, તે જન્મ મરણના કણ્ણના ચક્કરમાં પડે છે. અને સર્વનાશ અને ઉત્પત્તિના એકસરખાં વ્યવહારમાં પડી જય છે. તેમાંથી એનો પીછો છૂટ્ટો નથી. (ઓ. ૨૬-૩૪)

જેનું શ્રેય એટલે કે પરમ કલ્યાણનું સાધન એ જ એક માત્ર વિષય છે. તે જ નિઃસંશય વિદ્યા છે. જેનું પ્રેય અર્થાત્ આલોકના સુખોનાં સાધન જે સામાન્ય માણસોને પ્રિય હોય છે તે જ એક માત્ર વિષય છે તેને અવિદ્યા અથવા તો અજ્ઞાન

શ્રી સાઈનું સત્ય ચાટિત્ર

એવું કહેવામાં આવે છે. આ સંસારમાં મૃત્યુનો જ સૌથી મોટો ભય હોય છે. તેનાથી નિર્ભય થવા માટે ગુરુનાં ચરણો બરોબર મજબુત પકડવાં પડે છે. તેઓ જરૂર એકત્વની બુદ્ધિ આપશે. જ્યાં અનેકત્વ પ્રવેશો છે ત્યાં જ માયાનો પણ પ્રવેશ થાય છે. માટે જે જગ્યા ઉપર સંસારના ભયોનું નામ નિશાન નથી હોતું એવા બેદરહિત ગુરુનાં ચરણોની સેવા કરો. તેમના કપાળ ઉપર શુદ્ધ પ્રેમરૂપી ચંદ્રનનું તિલક કરો અને તેમને જ બોળા ભાવદ્ધી પિતાંભર પહેરાવો. તેથી તે પોતાનો ભક્તોને વિશ્વમાં વ્યાપી રહેલા પરમેશ્વરનાં દર્શન કરાવશે. તેમને દઢ શ્રદ્ધાનું સિંહાસન આપો, અષ્ટભાવોથી સુશોભિત એવા પૂર્ણઆનંદ અશ્રુરૂપી જળથી સ્નાન કરાયો, એટલે તેઓ તરત જ પ્રસન્ન થરો. તેની કર્મરે ભક્તિરૂપી કર્મરબંધ બાંધીને પોતાની જતને તેને સ્વાધીન કરો. પ્રેમથી તેની નજર ઉતારો અને પછી તેની આરતી કરો. (ઓ. ૩૫-૪૦)

કોઈપણ જતના કાર્યનો સંપૂર્ણ નાશ, અસ્તિત્વનો આશ્રય અથવા સહસ્રો લઈને જ કરવો પડે છે. પથ્થર લઈને ઘડો ફોડી નાખતાં તેનો આકાર નાશ પામે છે. પણ ઘડાના અસ્તિત્વના અંશ લેશમાત્ર ઓછા થતા નથી. ફૂટેલા ઘડાની ઢીકરીઓ બેગી કરીને ઘડાની ગોઠવણી ફરી કરી શકાય છે. માટે જે કોઈ પણ કાર્યનું નાશ થવું તે અસ્તિત્વનો આશ્રય લીધો હોવાને લીધે કાર્ય સહાય ટકે છે. માટે જ કોઈના પણ મરણનો અંત શૂન્યત્વમાં થતો નથી. કોઈ પણ કાર્ય કારણ વગરનું બનતું નથી. વ્યક્ત ભલે અભ્યક્ત થાય છિતાં તે સહાય અવિનાશી સત્યની સાથે જોડાયેલ હોય છે. અને આ બધું બધે ટેકાણો અનુભવોથી સારું જ દેખાતું હોય છે. સૂક્ષ્મતાની ઓછીવત્તી પરંપરા પણ આ જ બતાવે છે. સ્થૂળ અથવા તો નક્કર એવું જે હોય તેનો વિલય થતાં મૂળમાં તેનું સૂક્ષ્મ સ્વરૂપ બાકી રહે છે. તેનો પણ વિલય થતાં, તેમાંની બાકી સૂક્ષ્મ જે વધે છે એટલે સર્વ ઠંડ્યાઓ, મન અને બુદ્ધિ એની વિષયગ્રહણશક્તિ તદ્દન ઓછી થઈ જય છે. એનો સાર કે, બુદ્ધિ જ્યાં થાકે છે, ત્યાં વ્યક્ત અભ્યક્ત થઈ જય છે. ફક્ત અસ્તિત્વનો ભાવ ઝાંખો પડતો નથી. પણ તે એકલો જ હંમેશ માટે સર્વત્ર જગતો રહે છે. (ઓ. ૪૧-૪૭)

બુદ્ધિ, ઈચ્છાને આશ્રય આપે છે માટે એનો લય થતાં આત્માનો ઉત્કર્ષ તરત જ થાય છે. અને અક્ષયપદ એટલે વિષણુપદ પ્રાપ્ત થતું હોય છે. અજ્ઞાન, માયા, કામવાસના, કર્મ આ બધા મૃત્યુ તરફ ઘસડનારા મુખ્ય ગુણધર્મો છે. આ બધામાંથી પરિપૂર્ણ થઈને પાર પડતાં સંસારનાં બંધનો ઓગળી જય છે અને દરેક જતનાં બંધનો નાશ થતાં આત્મા કોઈ પણ પ્રયાસ વગર પ્રગટ થાય છે. જેવી રીતે વાદળો દૂર થવાથી અવકાશમાં સ્વયં પ્રકાશિત સૂર્ય જતે જ ચ્યાકવા માંડે છે, તેવી રીતે હું શરીર છું. આ માં ધન છે, તેને જ 'દઢ દેહાભિમાન' કહેવાય છે. આ જ હદ્યાંગ્રથિનું દુઃખનું સ્થાન બને છે. જે આ દેહ એકવાર પડે અને કર્મબીજથી બીજે દેહ મેળવે છિતાં તે બીજ પૂર્ણપણે શેષ વગરનો બાળી નાખવાનું માણસ જે ચૂકે તો ફરી પાછો બીજે જન્મ આવ્યો જ સમજે. બીજમાંથી ફરીથી વૃક્ષ પેદા થતું હોય છે તેમ વાસનાના બીજમાંથી બીજ દેહની પ્રાપ્તિ થતી હોય છે. આવું આ ચક જ્યાં સુધી વાસનારહિત શાંત થતું નથી ત્યાં સુધી આત્મા અખંડ ગતિથી ભટકતો જ રહે છે. કામનો અથવા વાસનાનો જ્યારે સમૂળગો વિનાશ થાય છે, ત્યારે જ હદ્યાંની ગ્રંથિઓ મોકળી થઈને મરણાશીલ મજુષ્ય અમર થાય છે. આ જ ઉપદેશ ઉપનિષદ્ધોમાં પણ આપવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે વર્તતા અને ન વર્તતા આ સિવાયની જે સ્થિતિ તેને 'વિરળ' એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છા ન ધરાવનારી સ્થિતિ કહેવામાં આવે છે. આ સ્થિતિ અજ્ઞાન અને વાસનાનો જહમૂળથી નાશ કરનારી હોય છે અને ત્યાં મૃત્યુનું કંઈ પણ ચાલતું નથી. વાસનાનો સંપૂર્ણપણે ત્યાગ એ જ બ્રહ્માનંદની પ્રાપ્તિનું સાધન અથવા તો યોગ છે. (ઓ. ૪૮-૫૫)

જેનું વર્ણન કરી શકાતું નથી, તેને માટે અક્ષરોનો ઉપયોગ કરવો પડે છે. અને જે બોતવાનો વિષય નથી તેને માટે વાચાનો ઉપયોગ કરવો પડે છે. પરબ્રહ્મનું પૂરું જ્ઞાન થવું એટલે સર્વ અનિષ્ટોની નિવૃત્તિ થવી. તેને હિસાબે મનમાં ધારેતી, ઈચ્છેલી, ગમતી વસ્તુઓની પ્રાપ્તિ થતી હોય છે. આ વિધાનને શ્રુતિ અને સ્મૃતિનો પૂર્ણ આધાર છે. 'બ્રહ્મવિદાનોતિ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પરં' (બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરેલો મનુષ્ય પરમપદને પામે છે.) આ જ બ્રહ્મનાંદ સાધવાનો અંતિમ (ચરણ) ઉપાય છે. એનાં કરતાં પણ વધારે શ્રેષ્ઠ બીજો કયો આધાર હોઈ શકે ? 'તરતિ શોકમાત્મવિત્ત' અજ્ઞાન જેને કારણે છે, તેવો સંસારદીપી સાગર પાર કરી જવા માટેનો કિનારો એ જ બ્રહ્મજ્ઞાન. આ જ એક શ્રેષ્ઠ ઉપાય છે અને દેરેક પ્રાપ્તિનું એક સાધન છે. પૂર્ણ શ્રદ્ધા અને ધીરજ તે જ મૂર્તિમંત શિવ અને પાર્વતી છે. માથા ઉપર તેમની ફૂપાનો વરદ્દ હાથ જ્યાં સુધી પડતો નથી ત્યાં સુધી હૃદયમાં વાસ કરી રહેલા વિશ્વંભરને નિરખવો શક્ય નથી. ગુરુશ્રેષ્ઠ સાઈનાથ મહારાજ જેમનું બોલવું અચૂક સત્ય ઠરનાર હતું, તેમણે પણ કહ્યું હતું કે, શ્રદ્ધા સાથે થોડી પણ સભૂરી રાખવામાં આવશે તો તમે એક મોદું ઐશ્વર્ય પ્રાપ્ત અવશ્ય કરી શકશો. (ઓ. ૫૬-૬૧)

આ બધું નજરોથી દેખાતું વિશ્વ એક માત્ર અસ્તિત્વ વગરનો ખોટો ભ્રમ છે, એક સ્વભાવત્ત દેખાવ છે, અને જગૃત થયા બાદ એનો ભ્રમ દૂર થઈ જય છે, એ ચોક્કસ માનવું પડશે. બુદ્ધિની દોડ અને મર્યાદા તેની ઉપર જ આધાર રાખતી હોય છે, અને તેની ઉપર જ આત્માની સ્વરૂપ વિષેની આપણી ખરી ભાવના હોય છે. પરંતુ જ્યાં સત્ત અને અસત્તના અસ્તિત્વનું હોવા નહિ હોવાનું દેકાણું જ નથી એવા તત્ત્વની અથવા તો વાસ્તવિક સ્વરૂપની જે ભાવના તે જ ખરો આત્મા છે. સત્ત અસત્ત વળે પ્રત્યયો સિવાય ખી અને પુરુષના બેદભાવ વગર, કોઈ પણ જલતના વિશેષ ગુણો રહિત એવું આ અનેક શાખાથી વર્ણન થયેત આત્માનું સર્વવ્યાપી મહાન સ્વરૂપ છે. આ આત્મા કોઈપણ પ્રકારના વિશેષ ગુણ વગરનો, તેમજ જન્મ અને મરણ આનાથી તદ્દન અલિપ્ત, અત્યંત પ્રાચીન પુરાણો અને શાશ્વત એટલે કે હંમેશના માટે વિનાશરહિત છે. આ સતત ટકનારો જન્મરહિત સ્વયંભૂ, પુરાતન, આકાશ જેવો સર્વવ્યાપી આરંભ કે ઉદ્ગમ વગરનો અવિશ્િષ્ટ વૃદ્ધિ શૂન્ય અને અવિક્રિય છે. આત્મા જન્મતો નથી કે મરણ પામતો નથી તે જન્મવાનો હતો અથવા તો આગળ ઉપર જન્મવાનો છે એવું પણ નથી. તે અજર, અમર, શાશ્વત અને પુરાતન છે. શરીરનો વધ થયા છિતાં તેનો નાશ થતો નથી. જેને ડ્ર્ય અથવા તો આકાર નથી-અદ્દ્ર્ય. જેને આદિ કે અંત નથી અનાદિ, જેને માપી શકાતો નથી-અમાપ. જેનો કયારે પણ નાશ થતો નથી-અભ્યય. જેને કોઈ પણ પ્રકારની વાસ નથી-અગંધ, જેને સ્વાદ નથી-અસ્વાદ, અને જે કોઈ પણ રીતે પણ ભ્રષ્ટ થતો નથી-અલેપ તેના સ્વરૂપનું વર્ણન કોણ કરી શકે ? તે કોઈ પણ જલતના ગુણો વગરનો (નિર્ગુણ) અને આંખોથી ન દેખાનારો આત્મા અજ્ઞાનને લીધે જણી શકાતો નથી. સમજયો નહીં માટે એ અજ્ઞાનને જ્ઞાન પ્રાપ્ત કરીને ભગાડો. પરંતુ પેલા આત્માને કયારેય શૂન્ય એટલે કે અભાવાત્મક એટલે જરાપણ અસ્તિત્વ વગરની સ્થિતિનો સમજતા નહીં. (ઓ. ૬૨-૬૮)

શું એ સાઈમહારાજની પરમહંસ સ્થિતિ ! શું તે એમનો પોતાનો વૈભવ ! કાળનો તો તેઓ જેત જોતામાં ભગડી મૂકૃતા. પછી એ આપણને પાછો દેખાય કે ? ધન, સુત, દારાના મોહમાં પડેલા આસકત ભક્તોને તો છોડો, તેમની તો શું મોદી વિસાત ? યોગી અને વૈરાગી લોકો પણ દર્શન માટે આવતા અને ચરણકમળોમાં અનુરાગી થઈને રહેતા. કામ અને કર્મનાં બંધનોથી જે સંપૂર્ણપણે મુકૃત છે અને જેણે બધી દુર્ઘાઓ, લોકેષણા, વિલેષણા અને પુત્રેષણાનો ત્યાગ કર્યો છે, તથા જેને દેહ, અને ગૃહ આ વિષયો તરફની ઉદાસનીતા અને વિરક્તિ છે, એવા ભક્ત આ જગ્યાએ ધન્ય થાય છે. જેમને સાઈ એ જ દાણનો વિષય છે તેવાને બીજી કોઈ વસ્તુ આકર્ષણી ખરી કે ? જે કંઈ બધું નજરે પડે છે તેમાં સાઈ વગરની કોઈ પણ ખાલી જગ્યા દેખાવાની જ નથી. જેના મુખમાં શ્રીસાઈનું નામ છે, અને હૃદયમાં શ્રીસાઈ માટેનો પ્રેમ છે એવાને સહાને માટે સુખ અને સમાધાન (સંતોષ) જ પ્રાપ્ત થાય છે. અને તેનું હંમેશા કલ્યાણ જ થતું હોય છે. શ્રીસાઈબાબા પોતે જ એનું રક્ષણ કરતા હોય છે. શ્રવણની પણ આજ વાત, બોલવામાં સાઈ સિવાય બીજો કોઈ શબ્દ જ નહિં. નાકમાં પણ સાઈની જ સુગંધ બરેલી હોય અને જીબ તો સાઈના મધુર રસોથી પીગળતી હોય છે. શું તે સાઈનું, સુહાસ્યમય મુખ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

! જાણો કે સુખોનું અતિશુદ્ધ સુખ ! ધન્ય છે તે ભાગ્યને કે જેમણે તે શબ્દરૂપી અમૃતનું પ્રત્યક્ષ સેવન કર્યું ! શ્રીસાઈબાબા તો કલ્યાણનો ભંડાર હતા. સુખશાંતિનાં જન્મસ્થાન હતા. અને હદ્યથી સદાય જગૃત હોવાને લીધે સત્ય અને અસત્યનો ભેદ જાણનારા અને સંસારિક ઇચ્છાઓ અને આકાંક્ષાઓથી નિવૃત્ત અને વૈરાગી હતા. (ઓ. ૬૮-૭૬)

ગાયના દૂધથી વાષ્પરદાનું પેટ ભરેલું હોય છતાં તે પોતાની મા થી દૂર થતું નથી. માટે તેને દોરડાથી ગમાણના જિલે બાંધી દેવામાં આવે છે. તેવી જ રીતે આ મન સંસારનાં વિષયસુખો બોગવીને તૃપ્ત થથું હોય છતાં તેના મોહપાસમાંથી દૂર થતું નથી, માટે તેને ગુરુનાં ચરણોમાં મજબૂત રીતે બાંધીને રાખવું જોઈએ. ગુરુપ્રેમ અને ગુરુકૃપા પ્રાપ્ત કરવા માટે તેમનાં ચરણ કમળ પરાગને વંદન કરો. અને તેમણે કરેલા કલ્યાણકારી ઉપદેશ તરફ વ્યવસ્થિત ધ્યાન આપો. જેથી કરીને તે પ્રેમ અને ફૂપાનો અનુભવ તમને ડગલેને પગલે થશે. ઇન્દ્રિયોનાં સુખોમાં ગળાદૂબ રહો, પરંતુ મનમાં સાઈબાબા ઉપર જ પ્રેમ રાખો. તે જ છેવેટે સ્વાર્થ અને પરમાર્થના કામમાં આવશે. મંત્રસિદ્ધ પામેલા માંત્રિકનું કાજળ જેવી રીતે પગથી પ્રથમ જન્મેલાને અર્થાત્ માથું નહિ પણ પગ પહેલાં બહાર નીકળીને જન્મ લેનાર જમીનમાંનું દાયારેલું ધન બતાવે છે, તેવી જ રીતે ગુરુનાં ચરણોમાં ધૂળથી ઢંકાયેલાં નયનોમાં આધ્યાત્મિક અને આધિભૌતિક એટલે કે શાશ્વત જ્ઞાન (જ્ઞાન+વિજ્ઞાન) સ્પષ્ટ થાય છે. (ઓ. ૭૭-૮૦)

જે જે સિદ્ધ પુરુષોનાં લક્ષણો કે ગુણધર્મો હોય છે. તે જ સાધકોના એટલે કે મોક્ષ પ્રાપ્તિના પ્રયત્નો કરનારાઓનાં સાધનો હોય છે. એને સંપાદન કરનારા ડાહ્યા માણસોએ ખૂબ મોટા પ્રયત્નો કરીને અભ્યાસ કરવો જોઈએ. દૂધના પેટમાં જ ધી હોય છે, પણ જે તેને ખટાશથી આથવામાં ન આવો તો છાશ અને માખણ પણ કેવી રીતે મળે ? તે ઉપરાંત અમુક અપેક્ષિત સંસ્કાર પણ કરવા પડે છે. દહીમાં પાણી નાખી વલોવ્યાથી છાશ, અને તે છાશને બરાબર વલોવ્યા સિવાય માખણ પ્રાપ્ત થતું નથી. તે માખણાને અજિન ઉપર તપાવ્યા વીના સ્વાદિષ્ટ ધી મળતું નથી. પહેલાં તો સંસ્કારોનું બળ જોઈએ અને પછી પૂર્વ અભ્યાસથી મેળવેલી બુદ્ધિમત્તા જોઈએ. અભ્યાસ વીના ચિત્તની શુદ્ધિ થતી નથી. અને જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ થતી નથી ત્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ મુશ્કેલ છે. માટે જ્યાં સુધી સ્વ સ્વરૂપની સ્થિતિ થતી નથી, ત્યાં સુધી સાધકોએ ચિત્ત શુદ્ધિ કરનાર ભગવંતની ભક્તિ છોડવી જોઈએ નહીં. આત્મજ્ઞાનનું મંદિર ઊભું કરવા, ચારે પ્રકારની ભક્તિનો કળશ ચ્યાકાવવા અને વૈરાગ્યની ધજન ફરકાવવા માટે ઈશ્વરભક્તિ એ પાયાની જરૂર છે. ફૂતરા અને ફૂક્કરો કાદવ કીચ્યડમાં દિવસભર આળોટતા હોય છે. વિદ્ધા ખાય છે અને વિષયભોગ પણ બોગવે છે. પછી એકવાર મનુષ્યને પ્રાપ્ત થયા પછી પણ આ વાતોનું મહત્વ શું ? જેને લીધે ચિત્ત શુદ્ધિ થાય છે, જેને લીધે અખંડ બ્રહ્મસ્થિતિ પેદા થાય છે, એવા સ્વધર્મોનાં આચરણોનું તપ નરદેહ દ્વારા સાધી લેવું. સાધુની સેવા એ મોક્ષનું ઉત્પત્તિસ્થાન છે. અને જીઓનો સંગ તે નરકનું દ્વાર છે, એવા વડિલોનો ઉદ્ગાર વિચાર કરવા યોગ્ય છે. હંમેશા સારું વર્તન રાખનારા શરીરનું પોષણ થાય તેટલું જ અત્ર ગ્રહણ કરનાર અને ધરબાર અને કુંભ ઇત્યાદિ વિષયોની કોઈ પણ જનતની આશા કે આકાંક્ષા વીનાનો જે ભગવદ્ભક્તત છે તે ધન્ય છે. (ઓ. ૮૧-૮૦)

જેઓ સાઈબાબાનું સતત ચિંતન કરે છે, તેમના અનુભવોનું આશ્રય જુઓ. શ્રીસાઈબાબા તેમના ઝાણી થઈને જતે જ તેમનું ધ્યાન કરવા લાગે છે, ધન્ય છે તે નામ:સ્મરણના મહત્વને ! ગુરુ પોતે પણ પોતાના ભક્તોનું સ્મરણ કરે છે. ધ્યાન કરનાર દ્યેય સ્થિતિમાં પ્રવેશ કરે છે, અને પોતાની પહેલાંની સ્થિતિ બિલકુલ ભૂતી જય છે. ‘તમે જાણો તમારી કરણી મને તો રાત દિવસ તમારી જ ચિંતા. આવી શ્રીસાઈબાબાની પ્રેમાળ વાણી હતી. તે મોટા ભાગના ભક્તોને ચાહગાર રહેશે.’ (ઓ. ૮૧-૮૩)

અમારે જ્ઞાનની વાતાવર્ણો નથી સાંભળવી. આ એક સાઈચરિત્ર જ અમારે માટે તો બસ છે. કેટલાયે પાપો અમારા

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

માથા પર ચેદેલાં હોય તેમ છતાં તેમાંથી છોડવનારા બાબા તે અમારા પિતા છે. જે પારાયણો કરવાં શક્ય નથી છતાં તેમાં રહેલ ગુરુભક્તિના પ્રકારણો શ્રોતાઓએ નિત્ય નિયમ પ્રમાણે સાંભળવા અને તેને મૂલ્યવાન સમજને મનમાં સંધરી રખવાં. દિવસ દરમ્યાન પ્રહેર આ ચરિત્ર વાંચવાથી આપણા ગુરુમહારાજની સાથે સાથે શ્રી હરિ પણ ભાવિકોને ચોક્કસ મળશે. આ ગ્રંથ જે દરરોજ નિયમથી, એક પણ દિવસ પડવા ન દેતા વાંચશે, તેમના ઘરમાં લક્ષ્મી અખંડ રહેશે. અને જે કોઈ એક સપ્તાહ માટે કરશે તેમની દરિદ્રતા દૂર થઈ જશે. આ મેં કહ્યું છે એમ કહેતા નહીં. કારણ કે એમ કરવાથી સંશય ઉત્પત્ત થશે. મૂળમાં તો શ્રી સાઈનાથ મહારાજ પોતે જ મારે મોઢેથી બધું બોલાવી રહ્યા છે, ત્યારે જ્યાં ત્યાંથી ઉભી કરેલી કલ્પનાઓ છોડી દેવી. તેઓ તો આ સર્વ ગુણોની કાણ જેવા અને પોતાના ભક્તોને મોક્ષ પ્રાપ્ત કરી આપનારા તથા જેમની કથાઓ કલિયુગમાં બધાં પાપોનું હરણ કરનારી છે, એવા એ સાઈમહારાજને શ્રોતાઓએ કાનથી સાંભળવા અને મનમાં તેમનું મનન કરવું. (ઓ. ૬૪-૬૬)

આવાં સતોની કથાઓની સામે સ્વર્ગલોકમાંના સુખોનો બાપડો શો હિસાબ ? આ રોકંડું અને તરત ફળ આપનાર રસાળ ચરિત્રનું વર્ણન છોડીને સ્વર્ગ સુખ તરફ ભૂલેચૂકે પણ કોઈ શા માટે જુઓ ? સુખ અને દુઃખ એ તો મનના વિકારો છે. સંતોની સંગતમાં બધું જ નિર્બિકર થઈ જય છે. મનની ખરાબ વૃત્તિઓ નાશ પામીને મન શાંત થાય છે અને ચિત્ત, ચૈતન્યની મૂળ શક્તિ પરમાત્મામાં એકદ્વિપ થઈ જતાં ત્યાં સુખ અને દુઃખ માટે કોઈ જગ્યા જ રહેતી નથી. જે સુખ વિરક્ત માણસને એકાંતમાં મળે છે કે ભક્તને ભગવંતની ભક્તિ કરતાં મળે છે, એવું સુખ ઈન્દ્ર હોય કે ચક્વતી રાજ હોય તેને કલ્પનામાં પણ મળતું નથી. પ્રારબ્ધના ભોગ ખૂબ બળવાન હોય છે. અને પૂર્વજન્મનાં કર્મ અનુસાર બુદ્ધિને સૂજે છે. પરંતુ આ દેવી યોગ, ભક્તો સહજ રીતે ટાળી શકે છે. કેટલાય ભગીરથ પ્રયત્ન કરવા છતાં પ્રારબ્ધ કર્મોનાં ફળ ભોગવ્યા વિના ધૂટકો થવો બિલકુલ અશક્ય છે. નક્કી બનનારી ઘટનાઓમાંથી વિયોગ તદ્દન અશક્ય હોય છે. જેવી રીતે દુઃખો ઠિચછા વગર પણ આવતાં હોય છે તેવી જ રીતે સુખ પણ કલ્પના પણ ન હોય તેવી રીતે પાછળ પડતું હોય છે. સંતોને જ માત્ર આ દેહ પ્રારબ્ધની ગતની પહેલેથી જ માહિતી હોય છે. (ઓ. ૧૦૦-૧૦૫)

સાઈબાબાના નામનો અખંડ નામ એ જ અમારું વ્રત, તપ અને દાન છે અને વખતો વખત શિરડી જવું એ જ અમારે માટે તીર્થ યાત્રા છે. તેમને અનન્યપણે શરણે જઈ ‘સાઈ સાઈ’ આ મંત્રનું સ્મરણ અને અનુષ્ઠાન એ જ અમારે માટે ધ્યાન છે, અને પુરશ્વરણ પણ છે. નિષ્કર્પ રીતે અને પ્રેમથી ધ્યાન દઈને તેમનું પૂજન કરી જુઓ અને તેમની ન કલ્પી શકાય એવી લીલાઓનો અનુભવ કરી જુઓ. (ઓ. ૧૦૬-૧૦૮)

હવે આ લાંબીલયક કંટાળો ઉપજીવનારી હકીકતનો આટલો અર્થ પૂરતો છે અમારે તો સત્તવે સુંદર મજની કથા સાંભળવી છે. પહેલાં સૂચિત કરેલ રસાળ કથા સાંભળવા માટે શ્રોતાઓ ઉત્સુક થયા હશે, એવા શ્રોતા વૃંદોના ભાવની કદર કરીને કથાની નવાઈ કહેવા કરતાં, શ્રોતાઓને કથા તરફનું ધ્યાન સારી રીતે રાખવા માટે આ ગ્રંથનો વિસ્તાર સમેતી લઉં છું. કાચ્ય રચા માટેનું વિશિષ્ટ પદ્ધતિનું જ્ઞાન મારા જેવા મંદ બુદ્ધિના પામરને નથી. હાથે ધરેતી મારી આ કલમ પોતાના જ હાથે પકડીને સાઈબાબા જ મારી પાસેથી લખાવી રહ્યા છે તે જ હું લખી રહ્યો છું. સાઈનાથે જે આ બુદ્ધિ ન આપી હોત તો હું ક્યાંથી આ ચરિત્ર લખી શક્યો હોત ? તેમની કથા તેઓ જતે જ બોલાવી રહ્યા છે અને લખાવી પણ રહ્યા છે. હવે કથાના અનુસંધાનમાં ચાવડીનું વર્ણન અને હંડીમાંનો પ્રસાદ વહેચ્યવાનું વર્ણન કરવાનું, એમ આશ્વાસન આપ્યું હતું તો તે વિષે સાંભળો. એ સિવાય પણ એના સંબંધમાં બીજી કોઈ કથા યાદ આવશે તો તે પણ શ્રોતાઓને કહીશ. ધન્ય છે એ સાઈની આશ્રયકારક કથાઓને ! અને ધન્ય છે એ કથા સાંભળવાના પ્રલાભને ! એવું મનન કરવાથી આપણો નીજસ્વભાવ પ્રગત થાય છે. અને સાઈમહારાજનાં ચરણોમાં શુભ મનોવૃત્તિમાં વધારો થાય છે. (ઓ. ૧૦૮-૧૧૫)

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હવે પહેલાં ચાવડીનું વર્ણન કરીએ. એના ડાઢમાઠની થોડામાં ઝપેરેખા જોઈ લઈએ. સાઈબાબા એક દિવસના આંતરે ચાવડીમાં સૂતા હતા. તેનું કારણ એ હતું કે એક વખત ખૂબ વરસાદ પડ્યો તેને કારણે મસ્નિજદમાં પાણી ભરાઈ ગયાં અને બાબાને સુવા માટે જરાયે જગ્યા રહી નહીં. માટે ભક્ત-જનોએ તે રાતે બાબાને પાસે આવેલી ચાવડીમાં એટલે કે પ્રવાસીઓ વગેરેના ઉપયોગમાં આવતી ગામની સાર્વજનિક જગ્યામાં સુવાની વ્યવસ્થા કરી આપી અને બીજે દિવસે સવારે મસ્નિજદમાં પાછા લઈ આવ્યા. ત્યારથી એક દિવસને અંતરે ચાવડી અને બીજે દિવસે દ્વારકામાઠમાં સુવાનો રિવાજ પડ્યો. તેમજ સમય જતા રાધાકૃષ્ણમાઠની ભક્તિ અને અનેરા ઉત્સાહને લીધે ઘનીક ભક્તગણ તરફથી રથ, પાલખી, ધજન, ચામર, રેશમી વસ્ત્રો, દરદાળીના, પૂજનમાં વપરાતાં ચાંદીના વાસણો, ગેસથી સળગતા દીવાઓ વગેરે વસ્તુઓ બેગી થઈ. બાબાનો ચાવડી જગ્યાનો સમારંભ તો રાજ રજવાડાઓના સરધસ જેવો જ શોભાયમાન અને જેવાતાયક બની ગયો. બાબા એક રાત ચાવડી તો બીજે દિવસે મસ્નિજદમાં સૂતા હતા. તેમનો આ રીતનો કાર્યક્રમ ઠેઠ સમાધિ સુધી રહ્યો હતો. ત્યાર બાદ તા. ૧૦-૧૨-૧૯૦૮થી ચાવડીમાં સાઈબાબાની સ્તુતિ તથા પૂજન થવા લાગી. તે ચાવડીના ઉત્સવનું મારી અલ્ય બુદ્ધિ પ્રમાણે વર્ણન કરવાની શરૂઆત કરું જેને બાબાની પરમ કૃપા જ પાર પાડ્યો. ચાવડીમાં સૂતાનો દિવસ આવતા ભજનમંડળીઓ મસ્નિજદમાં બેગી થતી. તેમાં શ્રી પુરુષો કોઈ ખંજરી તો કોઈ કરતાલ વગાડતા. તો કોઈ મૃદુંગ તો કોઈ મંજુરા અને કોઈ સૂર પૂરવા માટે વીણા લઈને બપોરનાં બીજા પ્રહરથી હાજર થઈ જતાં. તે સમયે ભજનોની રમઝટ શરૂ થતી. બાબા સામે બેસતા તેમની જમણી બાજુએ તુલસીવૃંદ, અને તેની પાછળ પાલખી તૈયાર થતી અને બાબાના ડાબા હાથે ભજન મંડળી ભજનની રમઝટ બોલાવતી, જેમને હરિ ભજન માટે આદ્ય રહેતો, એવા ભક્તો મસ્નિજદના સભામંડપમાં જઈથી આવીને હાજર થઈ જતાં. કોઈ હાથમાં મૃદુંગ, ખંજરી, મંજુરા વગેરે લઈને તો કોઈ તાળીઓ વગાડીને તેમાં સાથ પૂરવતા તો વળી ડફ્લી સાથે ભજન અને ધંટનાદથી વાતાવરણ ગુજુ ઉઠતું. સાઈ સમર્થ જણે કે ચુંબકમણિની માફક પોતાની આકર્ષણશક્તિ વહે લોંઘડ જેવા જડ ભક્તોને ન સમજલય તેવી રીતે પોતાનાં ચરણોમાં ઘેંચીને લઈ આવતા. મસાલચીઓ આંગણામાં દીપ પ્રગટાવતા. તો કોઈ પાલખીની સંજલની તૈયારી કરતા. દરવાજામાં ચોપદારો છડી પોકારતા અને બાબાના નામનો જયધોષ લલકારતા. તો કેટલાક જણ ઠેર ઠેર તોરણ, ધજન, પતાકા હવામાં ફરકાવતા અને ઉંચે આકાશમાં નિશાનોના ઝડા ફરકાવતા. નાનાં બાળકો, શ્રીઓ શાણગાર સળુને અને પુરુષો નવાં નવાં વસ્ત્રો ધારણ કરીને આવતાં. મસ્નિજદમાં દીવાઓની ધણી બધી હારમાળા પ્રજ્વલિત રહેતી અને ત્યાં આંગણામાં સંપૂર્ણપણે શ્રુગારિત કરેલો બાબાનો ‘શ્વામસુંદર’ નામનો ઘોડો શોભામાં અભિવૃદ્ધિ કરતો. (ઓ. ૧૧૬-૧૨૭)

તે સમયે તાત્યા પાટીલ બધી મંડળીને મસ્નિજદની બહાર બધાની સાથે નીકળવાનું કહીને અને તૈયારી કરીને બાબા પાસે આવીને બેસતા. બાબા ભલે તૈયાર થઈને બેઠા હોય છિતાં જ્યાં સુધી તાત્યા પાટીલ આવે નહિ ત્યાં સુધી બેસી જ રહે. તાત્યા જ્યારે બાબાની બગલમાં બંને હાથ નાખીને બાબાને ઊભા કરતા ત્યારે જ બાબા ત્યાંથી ચાવડી તરફ જવા માટે નીકળવા. માટે તૈયાર થતા. તાત્યા, બાબાને મામા કહેતા. આવો એમનો પરસ્પરનો પ્રેમ અને તેમની આત્મિયતા હતી. જેના વખાણ કરવા માટે શબ્દો કે ઉપમા નથી. બાબા શરીર ઉપર પોતાની દરરોજની કફીની પહેરીને અને બગલમાં પોતાનો સટકો રાખીને તથા તમાકુ અને ચલમ લઈને તથા ખભા ઉપર પોતાનું કપડું નાખીને જેવા તૈયાર થતા કે તાત્યા તેમના શરીર પર જરી કસખની કીનારોવાળી સુંદર શાલ ઓડાડતા તે શાલ ખાસ માથા ઉપર રહે તેની કાળજી રાખતા. ત્યારબાદ બાબા મસ્નિજદની પાછળની ભીત પાસેથી નીચે પેદેલા બાળવાના લાકડાના ભારાને પોતાના જમણા પગના અંગૂઠાથી પોતાની જગ્યા પર પાછા સરકાવતા. બાબા મસ્નિજદની અંદર હંમેશા પ્રજ્વલિત જ્યોતિને પોતાના જમણા હાથથી બૂજાવીને પછી જ ચાવડી તરફ પ્રયાણ કરતા. બાબાનો પડ્યો બોલ જીલનારા ભક્તોની કાંઈ ઓટ હતી ? પરંતુ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પોતાના ગયા પછી ધૂળીની મોટી જવાળાઓ સળગતી જ રહેતો બળતણના લકડામાં તે ફેલાઈ જય તેથી મસ્ઝિદમાં આગ લાગે માટે બાબા કાળજીપૂર્વક પોતેજ સાવધાનીથી વર્તતા ! આપણે તો સૂતાં પહેલાં ગેસ સિલેન્ડર પણ બંધ કરવાનું ભૂતી જઈએ છીએ. ઘણીવાર બહાર ગામ જતી વખતે ઘરને તાણું વાસી દેવાય પરંતુ ઘરમાં પાણીના નળને ખુલ્લો રાખીને જનારા અનેક લોકો હોય છે. (ઓ. ૧૨૮-૧૩૫)

શ્રીસાઈબાબા મસ્ઝિદમાંથી ચાવડી તરફ જવા નીકળતા કે તરત જ વાદો વાગવાં લાગતાં. હવાઈઓ અને મશાલો ચારેબાજુ ચમકવા લાગતી. કોઈ ધનુષ્ય આકરના અર્ધ ગોળ રણશિંગુ અને વાંજિંગ્રો વગાડતા. તો ઢોલ, ત્રાંસા અને મોટા મંજુરા વગાડતા. કોઈ હાથથી તાળીઓ વગાડતા અને પુઞ્જળ વાદો સાથે ગુંજતા મૃદુંગ અને વીણાના તાલમાં સાઈ નામનો જય જ્યકાર કરતાં ભજન ગાતાં ક્રી પુરુષો હારબંધ ચાલતાં સરઘસમાં ઊંડા, ગરુડની નિશાની વાળી પતાકા સાથે નાચતા ગાતા. દાઢુખાનાના ઘડાકા થતા. વચ્ચે વચ્ચે ત્રાસાં તૂટૂડીઓ અને એક જ સાથે ગુંજતો સાઈબાબાના નામનો જયધોષ થતો. શ્યામસુંદર ઘોડો પણ તાલબદ્ધ રીતે થનગન નાચવાનું શક્ક કરતો. (ઓ. ૧૩૬-૧૪૦)

વાંજિંગ્રોના તાલબદ્ધ સૂરોમાં બાબાની સવારી મસ્ઝિદમાંથી નીકળને જેવી પગથિયા ઉપર આવે કે તરત જ ચોપદાર ‘ઉં રાજાયિશજ યોગિશજ પરથ્રસ્, શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ’ એમ મોટા અવાજે છોડીદારો લલકાસીને છડી પોકારતા, ત્યારબાદ થોડો સમય ત્યાં જ એ જ જગ્યાએ બધી ભક્ત મંડળી ભેગી મળીને અંતઃકરણથી ભજનની રમઝટ બોલાવતી. તો અમુક ભક્તો નિશાન અને પતાકા લઈને આનંદથી આગળ ચાલતા. કોઈ હાથમાં ચામર ધરીને બાબાની બંને બાજુએ ઢાળતા. પંખાઓથી પવન નાખતાં. જવાના રસ્તા ઉપર ચાર ઘડી કરી એક પછી એક ચાદરો બિંધાવતા અને તેના ઉપર બાબાને હાથ પકડી ચલાવતા. તાત્યા કોતે પાટીલ ડાબો હાથ પકડતા અને ભક્ત મહાળસાપિતિ બાબાનો જમણો હાથ પકડીને ચાલતા. બાપુસાહેબ જેગ બાબાના શિર ઉપર છન્ઠ ધરીને ચાલતા. આ પ્રકારે બાબાની સવારી ચાવડી તરફ ચાલી નીકળતી. ભક્તોનો સમુદ્દરાય ધીમી ગતિએ આગળ વધતો, સૌથી પહેલો રાતા રંગનો શ્યામ કર્ણ ઘોડો પગના ધૂંધરા જાણકાસીને ચાલતો અને બાબાનો જય જ્યકાર થતાં તે ચોકમાં આવીને ચાવડીની બાજુમાં ઊભો રહેતો. (ઓ. ૧૪૧-૧૫૦)

તે સમયે ત્યાં ઢોલ, ત્રાંસા, મંજુરા, મૃદુંગ, શહનાઈ, પિપુડી વગેરેનો એક મોટો જ ધોંઘાટ ઊભો થતો. ભક્તો વાદો અને ભજન મોટે મોટેથી વગાડતા અને ગાવાની શક્કાત થતી. સાઈનામના ધોષનો એક મોટો કિલ્લોલ ઉઠ્ઠો અને આકાશ ગુંજુ ઉઠ્ઠું. ક્રી પુરુષો જેઠે જેઠે ચાલતાં. પ્રેક્ષક સમુદ્દર મનમાં હરખાઈને આ દશ્ય નિહાળતા અને તેઓ પણ આ સર્વની સાથે જય જ્યકાર કરતા. આમ ચાવડી તરફ જતા સરઘસની અનુપમ સવારીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થતી. (ઓ. ૧૫૧-૧૫૩)

મળસ્કે અથવા તો સાંજના સૂર્યાસ્તના સમયે કેસરિયા રંગના આકાશમાં જેવું તપેલા સોના જેવું તેજ દેખાય છે, તે પ્રમાણે ચાવડીની સામે ઊભી રહેલી સાઈમહારાજની મુખ્યકૃતિની શોભા દેખાતી. તે સમયેની તેમના મુખની શોભા જાણે કે ઊગતા સૂર્યની લાલીમા નો વિશ્વને ચેતના આપનારી મૂળ શક્તિના ચૈતન્યનો ભાસ થતો. આવી સુંદર અને અમૂલ્ય તક કોણ છોડે ? આવા સમયનાં દર્શન થાય તે મોટું ભાગ્ય જ ગણાતું. મુખ ઉપર તાંત્ર રંગનું તેજ ધારણ કરેલા સાઈ સર્મર્થ ઉત્તર તરફનું મુખ રાખીને એકાગ્ર મને જાણે કે કોઈને બોલાવતા હોય એવું લાગતું. ત્રાસાં અને વાંજિંગ્રોના સૂરોમાં અને લયમાં આ સમયે એકદમ આનંદવિભોર થઈને જમણો હાથ ઉપરાઉપરી નીચે ઉપર કરતા હતા. તે સમયે ભક્ત શ્રેષ્ઠ કાકાસાહેબ દીક્ષિત ચાંદીની થાળીમાં પુઞ્જળ ફૂલો લઈને બાબાના આપા શરીર ઉપર ઘડીએ ઘડીએ પુષ્પવૃષ્ટિ કરતા અને ગુલાલયુક્ત ગુલાબનાં ફૂલો મહારાજના મસ્તક ઉપર ઉછાળી ચઢાવતા. ત્રાંસા, મંજુરા, ઢોલ, નગારા વગેરે વાંજિંગ્રોનો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

એક ઠેકો કડાકા સાથે ગાજતો હતો. શિરડી ગામના લોકો અને બાબાના બીજા બધા ભક્તો આ પ્રસંગે પ્રેમથી દર્શન કરવા માટે આવતા. આ સમયે બાબાની મૃખાકૃતિ એકદમ જુદ્દી જ તાપ્રવર્હી જેવી અને અતિસુંદર લાવણ્યમય દેખાતી. એવું એમનું મુખ ઉપરનું તેજ જેઠિને દર્શનાર્થીનાં નેત્રો આનંદથી સજળ બનીને ઊભરાઈ જતા. મૂળમાં રહેતા તેમના પ્રેમાળ સ્વભાવમાં ઉલ્હાસ પેદા થતાં તેથી સંસારનાં બધાં દુઃખો ભૂલાઈ જતાં. આહા.... હા ! વા.... હ ! શું એ દિવ્ય અદ્ભૂત તેજ ! જણે કે ઊગતો સૂરજ જ જેઠ લ્યો ! સામે ઢોલ, ત્રાસાં મોટા અવાજે ગરજતા, વચ્ચે વચ્ચે રોકાતાં અને બાબા ઢોઢથી પોણા બે કલાક સતત ઉત્તર તરફનું પોતાનું મુખ કરીને, એક જ જગ્યા ઉપર ઊભા રહીને તેમનો જમણો હાથ સતત ઉપર નીચે હુલાવતા રહેતા. કેવડાના ફૂલની અંદરનાં ઓત કેસર પુંકસર જેવો ઉજાજવળ પીળાશ પડતો બાબાનો શરીરનો રંગ અને સાધારણ તાંબા જેવું લાલ રંગનું મુખ ઉપરનું તેજ ! તેમની મુખાકૃતિના તેજની શોભાનું વર્ણન કરવા માટે આ જીભ પણ શક્તિમાન નથી. ફક્ત નજરથી દર્શનાર્થી જ આ લાભ લઈ શકતા. બાબા ઊભા હોય, ત્યાં મહાળસાપત્ર જણે શરીરમાં કોઈ વિચિત્ર સંચાર થતો ન હોય તેમ નાચવા લાગતા. બાબાની એક જ જગ્યા ઉપર સ્થિર થયેલી સ્થિતિ જેઠિને મન આનંદથી ભરાઈ આવતું. જમણી બાજુએ મહાળસાપત્ર ભગત ઊભા રહેતા અને બાબાની કફનીનો છેડો હાથમાં પકડી રાખતા. તો ડાખી બાજુએ તાત્યા કોતે પાટીલ હાથમાં ફાનસ લઈને ચાલતા. કેવો સુંદર ઉત્સવ અને મોજુલો સમારંભ ! શું પવિત્ર ભક્તિ અને પ્રેમનું ગૌરવ ! અસંખ્ય શ્રીમંત લોકો પણ તેની શોભાના દર્શન માટે ટોળે વળતા. બાબાનું ગૌર વર્ણનું ઉજાજવળ મુખચંદ્ર પોતાના તેજમાં ચમકી ઉઠતું અને તે વર્ણવી ન શકાય તેવું શોભતું. ભક્તોની આંખો તેમના પ્રેમમાં આનંદથી ભરાઈ આવતી. ભક્તોનો સમુદ્ધાય બંને બાજુએથી ધીમે ધીમે ચાલતો અને બાબાના પ્રેમમાં ગરકાવ થઈ જતો. હવે પછી આવું સોહામણું દશ્ય ફરીથી આંખોને જેવા મળવાનું નથી. એ દિવસો પણ ગયા, અને એ સમય પણ ગયો. હવે તો મનને મનાવવા માટે ફક્ત તે મધુર યાદો જ રહી છે. (ઓ. ૧૫૪-૧૭૧)

આ પ્રકારે અસંખ્ય ભક્તજનો બાબાને વાંદ્રિનો સૂરાવલીમાં વાજતે ગાજતે લઈ જતા અને ચાવડીમાં આવેલી તેમની બેસવાની જગ્યા પર લઈ આવતા. તેની સાથે સાથે દિવ્ય પૂજના બધા જ ઉપચારો અર્પણ કરવામાં આવતા. ચાવડીની ઉપરની છતમાં સફેદ ચંદ્રવો બંધાતો અને ઝુભરો તથા ગોળાકાર દીવાઓ લટકાવીને તેને પ્રકાશિત કરાતો. તેના પ્રકાશનું પરાવર્તન થાય તેવી રીતે અરીસાઓ લગાડીને ત્યાંના દેખાવને પરાકાશએ પહોંચાડી ને તેજસ્વી કરાતા. બધી ભક્ત મંડળી લેગી થઈ ચાવડીમાં જતી અને તાત્યાબા આસન તૈયાર કરીને બાબાનો હાથ પકડીને તેમને બેસાડતા. આવું તે ઉત્તમ આસન તૈયાર કરીને તેમની પીઠ પાછળ તકિયો ગોઠવી દેતા. તેમજ બાબા જગ્યા ઉપર બરાબર બેસી જતા ત્યારે તેમની ઉપર અંગરખું ઓઢાડતા. તે પછી શરીર ઉપર બીજાં સુંદર વાંદ્રો ચઢાવીને અત્યંત હર્ષથી તેમની પૂજન થતી. વાંદ્રિનોના મોટા અવાજે સાથે આરતી ગવાતી. અને હારતોરા ચઢાવવામાં આવતા. સુંગંઘિત ચંદ્રન લગાવીને હાથ ઉપર અત્યાર ચોળતા અને કિંમતી વસ્ત્રોના શાણગાર કરીને માથે મુગટ પહેરાવતો. કયારેક તો સોનાનો સુંદર સજાવેલો મુગટ તો કયારે કલગીના તોરા સાથે ઝળકતી ભવ્ય રત્નજડિત જરીવાળી પાદ્ધડી પહેરાવતી. ગળામાં હિરા માણેક ચંગકે એવી અનેક સફેદ મોતીઓની માળા પહેરાવતા. આ પહેરવેશ દીવાબતીના તેજમાં જુદ્દો જ તરી આવતો અને ઝળહણી ઉઠતો. કપાળ ઉપર કસ્તુરીની કાળી એક રેખા દોરતા, અને વૈષ્ણવ પંથના રિવાજ મુજબ મધ્યમાં કાળું ટપકું થતું. બંને ખભા ઉપર જંબતી રંગનો મખમલનો જરીનો લસેલો અંગરખો નીચે સરકતો કે બંને બાજુએથી તેને ધીમે રહીને ન સમજય તેવી રીતે રહીને વારફકરી ફેરવીને પહેરાવતા. મુગટ હોય કે પાદ્ધડી તેનો સ્પર્શ થતાં જ ઝેંકી દેશો એવી લોકોને બીજી રહેતી. તેમ છતાં તેમના પ્રેમનું કુતૂહલ પણ એટલું જ સબજ હતું. બાબાના મનને જણાનારા સાઈબાબાને શું આ ભક્તોની સંતાકૂકડી સમજતી ન હતી ? પણ તેમના મુખ ઉપરનો

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

આનંદ ઉત્સાહ જેઠિને શ્રીબાબા મૌન ધારણ કરી રાખતા. બ્રહ્મના કે પરમાત્માના સાક્ષાત્કારને લીધે જ શોભાયમાન છે, તેને જરીથી ભરેલા અંગરખાનું શું ભૂષણ ? જે પોતાની શાંતિમાં ઓતપ્રોત થઈને રહેલો છે, એને મુગટથી શા માટે સજલવો ? ઇતાં ભક્તજ્ઞનો અનેક પ્રકારનાં સુંદર સુંદર અલંકારો બાબાને પહેરાવતા અને કપાળ ઉપર કેસર લેળવેલું મનોહર તિલક પણ રેખાંકિત કરતા. કોઈ હિરામોતીની માળા ગળામાં પહેરાવતા અને ફરી ફરીને તિલક પણ કરતા. ભક્તોના આવા બધા ખેલ બાબા પ્રેમથી સહન કરીને ચલાવી લેતા. (ઓ. ૧૭૨-૧૮૭)

જ્યારે આ પ્રકારે શૃંગાર સજલો, માથા ઉપર મુગટ શોભાયમાન લાગતો, અને ગળામાં મોતીઓનો હાર ઝળકતો ત્યારે કેવી સુંદર અલોકિક શોભા દેખાતી ? નાનાસાહેબ નિમોણકર બાબાની જગ્યા પાસે દંડ ઉપર લગાવેલું જાલરવાળું વર્તુળાકાર અને ગોળ ગોળ ફરે તેવું સફેદ વાત્ર બનાવેલું છત્ર પકડીને ઊભા રહેતા. બાપુસાહેબ જોગ ખૂબ જ પ્રેમથી બાબાનાં ચરણ ધોતા અને અર્ધપાન કરીને ભાવપૂર્વક તેમની પૂજા કરતા. ચાંદીનો થાળ આગળ સરકાવીને તેમાં બાબાનાં ચરણો મૂકીને અતિશય આદર અને પ્રેમથી તેઓ ધોતા અને લૂધીને તે ચરણો ઉપર સુગંધિત લેપ ચોપડતા. પછી કેશરની વાડકી હાથમાં લઈને બાબાના હાથ ઉપર લેપ લગાવતા. તેમજ બાબાની મૂઢીમાં પાનનું બીંદું ભક્તિભાવથી અર્પણ કરતા. આ બધી વિધિઓ ચાલતી હોય ત્યારે બાબાની મુખમુદ્રા અને દણ્ણ અતિ પ્રસન્ન દેખાતી. (ઓ. ૧૮૮-૧૯૨)

બાબા ચાવડીમાં જ્યારે ગાઢી ઉપર બેસતા ત્યારે, તાત્યા બા વગેરે ત્યાં ઊભા રહેતા, અને બાબાને હાથથી પકડીને નીચે બેસાઈને તેમને આદરથી પગે લાગતા. બિલકુલ શુદ્ધ અને નિર્મળ એવી ચાવડીની જમીન, ભાવિકો ઘસીઘસીને સાફ કરતા, સ્ફટિક જેવી સ્વચ્છ ભૂમિમાં બાબાની ભક્તિના રંગમાં રંગાયેલાં નાનાં મોટાં બધાં જ ભેગાં મળતાં. બાબા ગાઢી ઉપર બેસીને અને તકિયાને અઢેલીને બિરાજમાન થતા કે, બંને બાજુઓથી ભક્ત મંડળી ચુભ્મર અને પંખો નાખવાની શરૂઆત કરતી. ત્યાં માધવરાવ દેશપાંડે તમાકુ ચોળીને તરત જ ચલમ તૈયાર કરતા અને તાત્યાબાના હાથમાં આપતા. પણ તાત્યા બા તો પહેલાં તમાકુ ફૂકીને ચેતાવીને તે ચલમ બાબાના હાથમાં આપતા. બાબા પહેલાં જેરથી એકદમ મારીને ભગત મહાણસાપત્રિને આપતા. આ પ્રકારે પેલી ચલમ પૂરી થાય ત્યાં સુધીમાં દેરેકની વચ્ચે ત્યાં ભગત, શામા અને તાત્યા સહ આમતેમ વારાફરતી ફરૂતી રહેતી. આ મારીની રકમ તો એક નિર્જવ વસ્તુ પણ એનું ભાગ્ય કેટલું મોટું ! અમે તો સલ્લવ હોવા છતાં અમને તો તેનો અણસાર પણ મળતો નથી. ખરી સેવા તો એની જ ગણાય. તપશ્વર્ણી પણ કેવી ભારે ! પહેલાં માટી લાતોથી ગુંદાઈ પછી ઢંડી ગરમીમાં ત્રાસ સહન કરીને અનિન્માં પરિપક્વ થઈ. સદ્ભાગ્યે બાબાના હુસ્ત કમળનો સ્પર્શ થથો અને ફરી પાછા અનિન્માં ભૂંબલવાનું થયું. ત્યાર પછી તેના શરીર ઉપર ગેરુનો રંગ ચઢાવવામાં આવ્યો અને છેવટે બાબાના મુખ સ્પર્શનો પણ તેને લાભ મળ્યો. ભક્તગણાં કપૂર, કેશર અને ચંદન હાથમાં લઈને બાબાના ખુલ્લા શરીર પર ચોળતા અને ગળામાં ફૂલોની માળા પહેરાવીને તથા ગુલફસ્તામાં ફૂલો ભરીને તેની વાસ લેવા માટે બાબાને આપતા. જેમનું મુખ સદાય હસતું અને ભક્તો તરફ અત્યંત પ્રેમ અને હ્યાથી નીરખતું હતું. તેને વળી શૃંગારની આસક્તિ કેવી અને અભિમાન પણ શાનું ? આ બધું તો ભક્તોનું માન રાખવા ખાતર જ થતું હતું. જેના શરીર પર ભક્તિફળી અલંકાર છે, જે દિવ્ય શાંતિદ્વારી દાગીનાઓથી શાણગારેલા છે, તેને લૌકિક માળાઓ, મણિ અને દાગીનાઓથી શોફરક પદવાનો છે ? જે વૈરાગ્યનું સાક્ષાત્ ઉદાહરણ છે, તેને ‘પાંચુના’-નીલમના હારની શી જરૂર છે ? પણ તે જે તેમને ભક્તોએ અર્પણ કર્યા હોય તો બાબા તેને ગળામાં અવશ્ય પહેલી રાખતા. તેમજ ભક્તોની મનોકામનાઓ તેઓ પરિપૂર્ણ કરતા. સોના અને નિલમના દિવ્ય હાર અને આઠ કે સોળ મોતીની સેરોનો હાર નીલકમળ જેઠે બેગો થઈને અપૂર્વ રીતે શોભતો હતો. જાઈ, જુઈ અને તુલસીની માળાઓ જેમના ગળામાં પગ સુધી જુલસી રહેતી અને તેમના કંઠમાં મોતીની માળાઓ માન મોભાથી પણ અપૂર્વ તેજથી ઝળહળતી. તેની સાથેસાથે છાતી ઉપર નિલમના પથ્થરોનો સોનામાં મઢેલો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હેમહાર અને કપાળ ઉપર સુંદર મજના કાળા રંગના કંકુના તિલકથી તો બાબા તેજસ્વી શ્રેષ્ઠ વિભણુ ભક્ત તરીકે શોભતા. જેની ઉપર છિત્ર અને ચામર ઢોળવામાં આવતાં. જેના મસ્તકે જરી અને કસખનું શેલું શોભાયમાન થતું, તેમને ફૂકીર થોડો જ કહેવાય ? મોટાભાગે બાપુસાહેબ જેગ મંગળવાધોના ગુંજરવમાં હાથમાં પંચારતી લઈ પ્રેમથી બાબાની આરતી ઉતારતા. પાંચ પ્રકારના ઉપચારોથી પૂજા કરીને શાનદાર ઘમધમતી પંચારતી લઈને અને તેમાં કપૂર મૂકીને તેઓ આરતી ઉતારતા હતા. પછી આ આરતી પૂરી થતાં એક પછી એક ભક્તો આવીને બાબાને સાંચાંગ નમસ્કાર કરી પોતપોતાના ઘર તરફ જવા માટે નીકળી પડતા. ત્યારબાદ ચલતું, અત્તર અને ગુલાબદાની આપિને બાબાની આજા લઈને તાત્યાબા પોતાને ઘરે જવા માટે નીકળતા કે બાબા તેમને કહેતા, ‘મારી ચિંતા રહેવા હે. જય છે તો જ પણ રાતના વરચે વચ્ચેથી આવીને મારી ખબર લેતો રહે’ અને તાત્યાબા ‘ભલે સારું’ એમ કહીને ચાવડી છોડીને પોતાના ઘર તરફ પ્રયાણ કરતા. આમ બધા ઘર તરફ નીકળી ગયા બાદ, બાબા પોતાના હાથે ધોતિયાની ઘડીનું પોટલું છોડીને ધોતિયાની ઘડીઓ પાથરીને પોતાનું બિછાનું પોતે જ તૈયાર કરતા. સાઈઠી પાંસઠ ચોખ્ખી ગડીઓની થખ્પી મારીને પછી બાબા તેની ઉપર આરામ કરતા. (ઓ. ૧૯૩-૨૧૬)

આમ ચાવડીમાં જે કાંઈ બનતું તેનું જ વર્ણન અહીં સુધીની કથામાં થયું. હવે જે બીજી કથા બાકી રહી (હંડીની કથા) તે આવતા અધ્યાયમાં વર્ણવામાં આવશે. શ્રોતાઓ મને ક્ષમા કરે. સાઈબાબાનો મહિમા અગાધ છે. થોડામાં કહું તો બોતવામાં સીમા જ રહેતી નથી, અને તે વધતી જ જય છે. હવે સાઈની હંડીની કથા અને જે જે વાતો રહી ગઈ છે તે બધી આવતા અધ્યાયમાં હું કહીશ. આપ આદરથી ધ્યાન આપજો. ગુરુનું અખંડ સ્મરણ કરવું તે જ હેમાડપંતનો સ્વાર્થ અને પરમાર્થ છે. ગુરુનાં ચરણોમાં સતત નમસ્કાર કરીને તેઓ કૃતાર્થ થયા છે, કારણ કે ચારેય પુરુષાર્થ ગુરુચરણોમાં હોય છે, અને ત્યાં જ સાધ્ય થાય છે. (ઓ. ૨૧૭-૨૨૦)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત,
શ્રી સાઈ સમર્થના સત્ય ચરિત્રનો ‘ચાવડી-વર્ણનમ्’ નામનો સાડત્રીસમો અધ્યાય અહીંથા સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



અધ્યાય ઉત્તનું અર્થ વિવરણ

આ અધ્યાયનો વિષય હેમાડપંતે ‘ચાવડી-વર્જાનમ્’ એમ કહ્યો છે. પરંતુ શરૂઆતમાં ‘સદ્ગુરુ સ્તવન’ અને વેદાંત-નિક્ષપણ કરવામાં તેઓ એવા તો રંગાઈ ગયા છે કે એકંદરે ૨૧૬ ઓવીઓમાંથી એને માટે ૧૦૮ લગભગ અધી ઓવીઓ ખર્ચી નાખી છે. હેમાડપંત કહે છે કે, ‘કાચ્ય પદ્બંધ વ્યુત્પત્તિ । ન જાણું પામર હું મંદમતિ । કલમ મહારી પોતે હાથ ધરી । લખાવે સાઇ તે હું લખ્યું ॥૧૧૧॥’ ત્યારે આ ૧૦૮ ઓવીઓ પણ ફોગટની ફક્ત બદબદ તો નહીં જ હોય. તેમ છતાં તેનો સાર શું છે તે આપણે જોઈએ.

સદ્ગુરુ સ્તવનમાં હેમાડપંત સાઈબાબાને ‘અગાધ’ અને ‘અકથ્ય’ ગુણવર્ણન કરીને તેમની ‘સતસંગતિને લીધે’ પોતાને જે સદ્ગુરુદ્વિ પ્રાપ્ત થઈ, રહે તે જ નિશ્ચિલ સ્થિતિ. અંતકાળની ઘડી સુધી ॥૩॥ ખૂબ જોઈએ સેવાવૃત્તિ । જરૂરે અનન્યભક્તિ । લગવદ્ભાવ સર્વ ભૂતો પ્રતિ । પ્રીતિ અખંડ નામસ્મરણે ॥૮॥ આવી ઠચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

ત્યારબાદ સ્વર્ગ લોકોનું અને સ્વર્ગસુખોનું વિવેચન કરીને તેની નિષ્ફળતા તેઓ દર્શાવી રહ્યા છે. સાચું જેતા સ્વર્ગનાં સુખો ખાતર આપણે બીજે કયાંયે જવું પડતું નથી. તે અહીંથા જ પુઢ્યીલોકમાં માણસને મળી શકે છે. કારણ કે વૈરાગ્યની સાથે આત્મજ્ઞાન પ્રાપ્ત થવું એનું જ નામ સ્વર્ગલોક છે –

સ્વર્ગ સ્વર્ગ તે વળી કયું બીજું । વૈરાગ્ય એ જ સ્વર્ગ લોક છે ।

એ વિરાટ તો આત્મ સ્વરૂપ છે । માનસ દુઃખ વગરનું ॥૧૩॥

જ્યાં નથી રોગાદિ નિમિત્ત । નથી ચિંતા વ્યાધિ દુઃખ ।

જ્યાં ન ક્ષુધાતૃષા વ્યાકુળ । ના કોઈ વૃદ્ધાવસ્થાલયે દુઃખી ॥૧૪॥

જ્યાં નથી મૃત્યુભય । નથી વિધિનિષેધ બેય ।

વર્તે જીવ ત્યાં અત્યંત નિર્ભય । એ જ છે હિન્દ્ય સ્વર્ગસ્થિતિ ॥૧૫॥

લોક વ્યવહારમાં જેને સ્વર્ગ કહેવામાં આવે છે ત્યાં પણ વિષય સુખ કંઈ જુંદુ હોય છે ?

જાવ સ્વર્ગમાં કે નર્કમાં । નથી ફરૂક વિષયસુખમાં ।

જુઓ ઠન્દ્રનાં ગંધેડાનાં । સુખો એક જ પ્રકારનાં ॥૨૨॥

ઠંડ્ર નંદનવને રમે । તે જ ગંધો ઉકરે આળોટે ।

જોતાં સુખ તો એક જ છે । નથી તે જુદાં લેશમાત્ર ॥૨૩॥

સિવાય –

જ્યાંથી પુણ્યક્ષયે પતન । શું કામનો તે કાને ધતન ।

તે કરતાં સારો અહીંનો જન્મ । છે મહાત્વ ગણન ભૂલોકનું ॥૨૪॥

તેવી જ રીતે ધ્યાનમાં રાખો કે –

જે સુખ વિરક્તને એકાંતમાં । વા જે ભક્તને ભક્તિ કરતાં ।

ઠંડ્રને ચક્કવતી હોવા છતાં । ન મળો તેને તે કલ્પાન્તે ॥૧૦૨॥

માટે જ આ ભૂલોકમાં રહીને માણસે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત થતાંની સાથે જ મનની તમામ ઠચ્છાઓ પૂર્ણ કરી શકાય છે.

શ્રી સાઈનું સત્ય ચિત્ર

થતાં પ્રાપ્ત ‘બ્રહ્મ સંવિતિ’ । જાણો એ જ સર્વ અનિષ્ટનિવૃત્તિ ।

તેજ છે મનવાંછિત ઈદ્ધપ્રાપ્તિ । આ શુતિ સ્મૃતિ પ્રામાણ્ય છે ॥૫૭॥

હવે હેમાદ્ર્યંત જે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અથવા તો જેને જ્ઞાનવા માટે તેનું વર્ણન કરી રહ્યા છે કે -

છે આત્મા સર્વવિશોભ રહિત । જરા જન્મમરણ મુક્ત ।

છે તે પુરાણો શાશ્વત । અપક્ષય વિનાનો સર્વદા ॥૬૫॥

છે એ અજનિત્ય પુરાતન । સર્વ ગત જેવું ગગન ।

અનાદિ અને અવિચિદ્ધ । વૃદ્ધિશૂન્ય અવિકિય ॥૬૬॥

જે છે અશાષ્ટ અડ્ર્ય । અનાદિ અનંત અને અનુય ।

અવ્યય અગધ અરસ અલેય । સ્વવર્ગ એ કોણ વર્ણવે ॥૬૭॥

આ પ્રમાણો કોઈ પણ જતના ગુણ વગરનો અને આંખોથી ન જોઈ શકાતો આ આત્મા અજ્ઞાનને લીધે જાણી શકાયો નહીં, છતાં તે અજ્ઞાનને જ્ઞાન પ્રાપ્ત કરીને દૂર કરો. પરંતુ આત્માને કોઈપણ વખત શૂન્ય અથવા તો જરા પણ અસ્તિત્વ વીના સ્થિતિનો કહેતા નહીં.

પછી હેમાદ્ર્યંત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કયા ઉપાય માણસોએ કરવા જોઈએ તે કહી રહ્યા છે. સર્વ પ્રથમ માણસે દીર્ઘ પ્રયત્ન કરીને તેનો અભ્યાસ કરવો જોઈએ, કારણ કે -

છે રહેલ દૂધમાં ધૂત । પણ તે જ બનાવતાં ખટાશયુક્ત ।

ના છાશ ના માખણ । પછી પણ અપેક્ષા સંસ્કારની ॥૮૨॥

દહીને વલોચ્યા વીના । ના મળે કંઈ નવીનત ।

તેને પણ ન કરીએ અગ્નિસંયુક્ત । તો ધી સ્વાદિષ્ટ મળે ના ॥૮૩॥

અભ્યાસ વગર ચિત્તશુદ્ધિ થતી નથી અને ચિત્તશુદ્ધિ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ચિત્તશુદ્ધિ માટે સ્વર્ધમ્ પ્રમાણો આચરણ રાખવું જોઈએ અને ઈશ્વરની ભક્તિ ચાલુ રાખવી જોઈએ -

ભગવદ્ભક્તિનો પાયો જોઈએ । આત્મજ્ઞાન મંદિર ઉઠાવવા કાઢે ।

અણકાવવા કણણ મુક્તિના ચારે । તે વિષ દુર્ગમતા જ્ઞાનની ॥૮૪॥

તેમજ બાબાના નીચેના શબ્દો ઉપર પણ ધ્યાન આપવું જોઈએ -

પૂર્ણ શ્રદ્ધા અને ધીર્ય । એ જ સાકાર ઉમા-મહેશ્વર ।

જેમના નહોતાં શિરે કૃપાકર । હદ્યસ્થ વિશ્વંભર ના દીસ ॥૮૫॥

અજ્ઞાન, માયા, કામ, અને કર્મ એ જ મુખ્ય મૃત્યુનાં લક્ષણો છે. આ બધાની શાંતિ થતાં બધાં જ બંધનો તૂટવા માંડે છે અને આત્મા સહજ રીતે પ્રગટ થાય છે. ‘જેવું કે મેઘ વગરનું આકાશ । સૂર્ય સ્વયં પ્રકાશવા માડે છે ।’ ‘આ શરીર હું છું, આ ધન મારું છે.’ આવું કહેવું તેને દેહાભિમાન કહેવાય છે અને તેને જ હદ્યશર્થિનો મોહ તથા માયાના દુઃખનું સ્થાન છે. આ દેહ જે પેદ અને કર્મબીજથી બીજે દેહ મળે તેમ છતાં તે બીજ પૂર્ણપણે બાળી નાખવા માટે માણસ જે ચૂડી જન્ય તો ફરી પાછો બીજે જન્મ લેવો પડે છે તેમ નક્કી સમજનો. બીજમાંથી ફરી વૃક્ષ થાય છે અને વાસનાના બીજથી બીજે દેહની પ્રાપ્તિ થાય છે. આવું આ ચક જ્યાં સુધી વાસના શાંત થતી નથી ત્યાં સુધી અખંડ ગતિથી ફર્યા કરે છે. કામનો જ્યારે

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પૂરેપૂરો વિનાશ થાય છે ત્યારે જ મરનારની હૃદયગંથિઓ ખીલી જય છે જેથી મૃત્યુ પામનારો અમર થઈ જય છે માટે,
‘વાસનાનો પરિત્યાગ । તે જ બ્રહ્માનંદનો યોગ ॥’ હોઈ શકે -

આ બધું અધ્યું છે, માટે બધામાં સહેલો અને સરળ ઉપાય એટલે ગુરુના શરણે જવું તે છે -

કાયા વાચા મને ધરો । પાંચે પ્રાણ સમર્પણ કરો ।
નિશ્ચયાત્મક બુદ્ધિ થાઓ । લીન ગુરુઆધીન સર્વસ્વે ॥૨૬॥
ગોરસે વાછરું ધરાયે । ન માતા પાસેથી તોયે ખસે ।
તેવું મન બાંધવું જોઈએ । બે છેડેથી દોરીએ ગુરુપગે ॥૨૭॥
થતાં ગુરુકૃપા અનુરાગ । વંદો તે પદકમળ પરાગ ।
કર્યે હીતબોધ જગૃત । લ્યો અનુભવ પહે પહે ॥૨૮॥

પોતાના ગુરુ એટલે શ્રીસાઈમહારાજ માટે હેમાડપંત કહી રહ્યા છે -

ઠન્દ્રીયે વિષયે યથેચ્છ રમતાં । મતી સાઈ ગ્રીતિ રાખો અંતરમાં ।
કામ આવશો તે જ અંતમાં । સ્વાર્થ પરમાર્થ બેઉમાં ॥૨૯॥
મહોમાં શ્રી સાઈનું નામ । હૃદયમાં શ્રી સાઈનો પ્રેમ ।
તેને નિત્ય આરામ ક્ષેમ । સાઈ પોતે તેને રક્ષે ॥૩૦॥
જે અનિમેષ સાઈને ચિતે । અનુભવની તેના નવાઈ છે ।
સ્વયે સાઈ ધ્યાન તેનું કરે । ઋણ ફેડવા તેનું ॥૩૧॥
તમે જણો તમારી કરણી । રાતદિન ચિંતા મહને તમારી ।
એવી બાબાની પ્રેમાળ વાણી । હશે યાદ વણાઓને ॥૩૨॥

અને સાઈચરિત્રના પારાયણનું મહાત્મ્ય વર્ણવતા કહે છે -

નથી જોઈતી અમારે જ્ઞાનકથા । બહુ છે એક સાઈગાથા ।
છો બહુયે પાપ અમારા । સંકટે ત્રાતા અમારા એ ॥૩૪॥
જો ન કરાય પારાયણ । તો આમાનું ગુરુભક્તિ પ્રકરણ ।
હૃદયમાં શ્રોતા ભરે નિત્ય । નિયમપૂર્વક નિત્ય શ્રવણ ॥૩૫॥
દિવસના કોઈ પણ પ્રહરે । ચરિત્ર આ નિત્ય વાંચે ।
ભેટે નિર્ધાર એ ભાવિકને । નિજગુરુ સહ શ્રીહરિ ॥૩૬॥
જે નિરંતર એ વાંચે । લક્ષ્મીઆનંદે । તેને ધરે ।
નિદાન સાનાહ એક જો કરે । તો દરિદ્ર દૂર તેનું થાય ॥૩૭॥
આ હું કહું છું એમ ના માનો । મને એ સંશયથી ના જોશો ।
એ કિલાણ કલ્પના છોડજો । બોલાવે સાઈ મારા મુખે ॥૩૮॥

અને છેલ્લે સાઈની અનન્ય ભક્તિનો સાર સુંદર શબ્દોમાં કહીને આ વિષયનો અંત કરી રહ્યા છે.

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

અખંડ તેમનું નામાવર્તન । એ જ અમારાં વ્રત તપ દાન ।
વખતો વખત શિરડી પ્રથાણ । એ જ તીર્થાટન અમારું ॥૧૦૬॥
'સાઈ સાઈ' એ નામસમરણ । એ જ મંત્રનું અનુજ્ઞાન ।
એ જ ધ્યાન એ જ પુરશ્કરણ । અનન્ય શરણ એમને જવું ॥૧૦૭॥
નિષ્કપટ પ્રેમ અનુસંધાન । એ જ તેમનું ઘરું પૂજન ।
લેવો પછી અંતરે અનુભવ । અતકર્ય કળા એમની ॥૧૦૮॥

પછીના ચાવડીના સમારંભના વર્ણન અંગે તો શું કહેવું ? હેમાડપંતના કવિત્વની બહાર આવી છે. તેનું વર્ણન એટલું આબેહૂબ ચીત્યું છે કે તે સમારંભનો ચિત્તાર આપણી આંખોની સામે આવીને ઊભો રહે છે. અને જાણે કે આપણને પોતાને પણ તે ભક્તિયુક્ત આનંદમાં સહભાગી થયાના અનુભવનો આનંદ થાય છે.

આ બધાં વર્ણનોમાં હેમાડપંત બાબાની ચલમની ખૂબ જ અધરી સેવાનું અને અલૌકિક ભાગ્યનું સુંદર કલ્પના કરીને કેવું વર્ણન કરે છે -

એકદંદે આ અધ્યાય એટલે આધ્યાત્મિક વર્ણનનો અને કાવ્યમય શાખદ ચિત્રને પ્રદર્શિત કરવાનો યોગ છે.



॥ અદ્યાય ૩૮ ॥

હંડી વર્ણન

(વાબાની હંડીનું વર્ણન એટલે મોટા મોકાના વાસણમાં અજ રંધીને ગરીબ ગુરવાને જમાડતા વાબાનું વર્ણન.)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કૃષ્ણદેવતાને વંદન,

શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

સમસ્ત જગતને આનંદ આપનાર, ભક્તોને તેમની ઈચ્છા પ્રમાણે મેળવી અપાવવા માટે, એવા ઉત્સુક અને પોતાનાં ચરણોમાં આશ્રય લેનારા એવા ભક્તના ન્રાણે પ્રકારનાં હુઃ ખ હરનારા, હે ગુરુવર તારાં ચરણોમાં અમારાં કોટી કોટી વંદન. શરણે આવેલાઓને શરણ આપનાર, શરણે આવેલાનો ઉદ્ઘાર કરનાર. હે ગુરુશ્રેષ્ઠ ! લોકો ઉપર ઉપકાર કરવા માટે જ આ પૂર્થી ઉપર અવતાર્યા છો. હે દેવતાવનો નાશ કરનાર, ભક્તોના મન મોહિત કરનાર, સંસારમાંથી છોડવનાર, અત્યંત દ્યાવંત ગુરુવર્ય ! તારો સર્વત્ર જ્ય જ્યકાર થાઓ. કેટલું સુંદર ભાગ્ય કે જેથી કરીને તારા આ ચરણકમળનાં આ આંખોને દર્શન થયાં. અને તમારા સહાવાસનો પરમ લાભ આમ સુખથી ભોગવવા મળ્યો પણ હવે તે સુખની પળો કયાં ? તે ફરીને પાછી આવવી શક્ય નથી. (ઓ. ૧-૪)

ફક્ત બ્રહ્માનું જે બીબું, તેમાં શુદ્ધ આત્મસ્વરૂપનો રસ રેઠીને જે નયનરમ્ય મૂર્તિ આકારમાં આવી તે જ સંત શિરોમણી શ્રીસાઈમહારાજ હતા. સાચ એટલે જ આત્મારામ. તેઓ જ સંપૂર્ણ આનંદનો બંદાર છે. તેઓ પોતે બધી જ ઈચ્છાઓથી પૂર્ણ થયેલા હોવાને કારણે ભક્તોને નિષ્કામ કરી રહ્યા છે. ધર્મ પાળનાર અને તેનું રક્ષણ કરનાર જે બધા ભાત્મણ અને ક્ષત્રિય તેમની અદ્વિતીય શક્તિસહ, સંકટ અને મૃત્યુને પણ હરી લેનાર એવું જેનું થોડામાં કહીએ તો, વર્ણન છે. આ ઓવિનો અર્થ સારી રીતે સમજવા માટે કઠોપનિષદ અ. ૧ વલ્લી. ૨ મંત્ર રૂપમાં આ પ્રમાણે જણાવ્યું છે. યસ્ય બ્રહ્મ ચ ક્ષત્ર ચ ઉલે ભવત : ઓદ્દનઃ મૃત્યુર્તસ્ય ઉપસેવનં ક ઈત્ય વેદ યત્ર સ : ॥ સંહારના સમયે જે પરમેશ્વરનાં ભાત્મણ અને ક્ષત્રિય આ બંને અને સર્વ પ્રાણી માત્ર ભોજન બની જય છે, તથા મૃત્યુ પણ જેનું ઉપસેવન એટલે મો દ્વારા ખવાતી ભાળ કે ચટણી બની જય છે તેવા પરમેશ્વરને યથાર્થપણે કોણ જણી શકે છે ? ઉપનિષદમાંના સર્વ શક્તિમાન પરમેશ્વરના વર્ણનો ઉતારો અહીંથાં લઈને હેમાડયંતે, સાઈબાબા એ સર્વ શક્તિમાન ઈશ્વર જ છે, એમ કહેવા માટે પ્રયત્ન કર્યો છે. જે જન્મ મરણનાં બંધનો તોડી નાખે છે એવા સાઈસ્વરૂપને હું જડબુદ્ધિનો ને અજ્ઞાની સાચાંગ પ્રણામ કરી રહ્યો છું. (ઓ. ૫-૮)

પાછલા અદ્યાયમાં સાઈનાથની ચાવડીનું ખૂબ જ મનપસંદ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. હવે આ અદ્યાયમાં હંડીનું સુખ આપનારું વર્ણન સાંભળો. દૂધ પીતું બાળક ફક્ત ખાવાનું જ સમજે, પણ શું ખાવું તેની તેને ખબર નથી હોતી. દૂધ પીવડાવ્યું કે અત્રનો કોળિયો ખવડાવલો તેની કાળજી તો બાળકની મા જ લેતી હોય છે. તેવી જ મારી સાઈ માવડી-બાબા-મારા હાથમાં કલમ પકડાવીને પોતાના ભક્તોના પ્રેમને કારણે આ પ્રયત્ન વગરની રથના લખાવી રહ્યા છે. શાસ્ત્રમાં દેરેક યુગ માટે મોક્ષપ્રાપ્તિ માટે પ્રમાણ સિદ્ધ સાધનો જણાવ્યાં છે. દાખલા તરીકે કૃત અથવા સત્યાગ્રહમાં તપશ્ચર્યા કરવી, ત્રેતાયુગમાં જ્ઞાન સંપાદન કરવું, દ્વાપરયુગમાં યજ્ઞ કરવા અને કલીયુગમાં દાન કરવું. અર્થાત્ બિક્ષા વહેચ્યવી, મંદિરો બાંધવા માટે ફાળો આપવો વગેરે પરોપકરણાં ફૂત્યો કરવાં. પરંતુ ભૂખનું શમન કરવા માટે જે મુખ્ય

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

રહુસ્ય તે અન્નદાન, નિત્ય નિયમથી કરવું તે કર્મોમાં મુખ્ય કર્મ છે. બપોરના ભાર થતાં આપણો જીવ ભૂખથી અન્ન વગર એળવળવા લાગે છે. જેવું આપણાને થાય છે એ જ સ્થિતિ બીજાં બધાની પણ થતી હોય છે. આટલું પણ જે મનથી સમજે છે, તે ભલો અને સહૃદાણી માણસ ગણાય. શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે વર્તવાના રીત રીવાજમાં પણ અન્નદાન એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એના કરતાં શ્રેષ્ઠ દાન જેવા જેઠાં તો અન્ય કોઈ નથી. અન્ન એ પરબ્રહ્મનું સ્વરૂપ છે. એમાંથી જ પ્રાણી માત્રની ઉત્પત્તિ થાય છે. અન્ન એ જ જીવને જીવાદવાનું સાધન છે. તેમજ મરણ પછી છેલ્લે તે અન્નમાં જ અંતલીન થઈ જય છે. તૈત્તરિયોપનિષદ્ધ વલ્લી ઉ અનુવાક ૨ માં આ વાત આ રીતે કહી છે. અન્ન વ્યાજનાત્ત. | અન્નાદ્રેચ્યવ ખાલ્વિમાનિ ભૂતાનિ જાયનો | અન્નેન જતાનિ જીવન્તિ | અન્ન પ્રયન્તયબિસંવિશાનીતિ || પ્રહસનાં બધાં જ લક્ષણો અન્નમાં જેવા મળે છે. પ્રાણીમાત્ર અન્નમાંથી એટલે અન્નના પરિણામ ભૂત, વીયમાંથી ઉત્પત્ત થાય છે. અન્ન વડે જ તે જીવતા રહે છે અને મૃત્યુ બાદ અન્ન સ્વરૂપે જ આ પૃથ્વીમાં ફરીથી પ્રવેશીને એકરૂપ થઈ જય છે. ભોજન સમયે કે અચાનક આવેલા અતિથિને ગૃહસ્થોએ જમાઈને સંતુષ્ટ કરવા જેઠાં. જે કોઈ ગૃહસ્થ આવેલા મહેમાનોને અન્નજળ વીના પાછા મોકલે છે, તેઓ સન્જાણતાં છતાં દુર્ગતિને આમંત્રિત કરે છે. કપડાં, વાસણો વગેરેનું દાન કરતી વખતે યોગ્ય અયોગ્યનો વિચાર કર્યો પડે છે. પણ અન્નદાન માટે યોગ્યતા કે પાત્રતા જેવાની જરૂરી નથી. કોઈ ગમે ત્યારે દરવાજે આવે એનો અનાદર કરવો આ સારું નથી, એવું વેદાંતમાં અન્નદાનનું મહત્વ સમજવામાં આવ્યું છે. તૈત્તિરીયોપનિષદ્ધ વલ્લી ઉ અનુવાક ૭માં કહ્યું છે કે અન્નં ન નિન્દાત્ત. | અન્નની નિંદા કરવી નહીં. અન્ન બહુ પરિચક્ષીત | અન્નનું અપમાન કરવું નહિ, અન્ન બહુ કુરીત | અન્ન વધારે ઉત્પત્ત કરવું ન કંચન વસતૌ પ્રત્યાચક્ષીત | કોઈ પણ અતિથિને નિરાશ કરીને પાછો મોકલવો નહિ. માટે સાઠિબાબા પણ લોકોને અન્ન આપીને તૃપ્ત કરતા હતા અને રૂઢિ પ્રમાણે ચાલતી રીતનું પાલન કરતા હતા. ધન કે બીજી કોઈ વસ્તુનું દાન કરવાથી અન્નદાન વીના તે અપૂર્ણ જ રહે છે. ચંદ્ર વીના તારાઓના સમૂહની શી શોભા ? અત્યંત સ્વાદિષ્ટ અન્નમાં જેવી રીતે દાળ શ્રેષ્ઠ છે તેવી રીતે પુણ્ય કર્મોમાં અન્નદાન શ્રેષ્ઠ પુણ્યકર્મ છે. કળશ વીના મંદિરનો ધૂમટ શોભતો નથી, કમળ વીના તળાવ શોભતું નથી, તેવી જ રીતે પ્રેમ વીના ભજન, કુમકુમ વીના સૌભાગ્યવતી જી શોભતી નથી. મધુર અવાજ વીના ગીત કંટાળો ઉપજલે છે અને મીઠું નાખ્યા વીના છાશમાં સ્વાદ આવતો નથી. માટે મનુષ્યે અન્નદાન હંમેશા કરવું. તેમાં જીવનની શોભા છે. તેમાં પણ રોગી, અશક્ત, આંઘળા, લૂલા, લંગડા, બહેરા જેવા અયંગોને અને ગરીબ કંગાળોને પહેલાં અન્નદાન કર્યા બાદ જ આપનાજનોને જમાડવા. (ઓ. ૮-૨૩)

હવે અમુક ચોક્કસ અને જીજાસુ લોકો માટે અને શ્રોતાઓના મનના સમાધાન ખાતર બાબાની હાંડી બાબતમાં સાધારણ કલ્પના આવે માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. મન્જિદના આંગણામાં બાબા એક મોટો ચૂલો સણગાવતા હતા અને તેની ઉપર એક પહેલા મોઢાનું તપેલું ચઢાવતા હતા. કયારેક ‘મઠિ ચાવલ’ ગણ્યો ભાત રંધતા. તો વળી કોઈક વખત માંસ સાથેનો મસાલેદાર ભાત-પુલાવ બનાવતા. કયારેક ઘઉંના લોટની ઢોકળી દાળમાં રંધતા. તો કોઈક વખત ચૂલા ઉપર જાડા રોટલા શેકતા અને અમુક વખતે અળવીના પાન ઉપર બેસનનો લેપ લગાવી પણ બનાવતા. કોઈક સમયે ઘઉંના લોટની રોટલી પણ શેકતા અને પથ્થર ઉપર મસાલો પણ વાટીને રસોઈની તૈયારી જતે જ કરતા. બાબા મગના લોટનાં વડાં બનાવીને પણ રંધતા. સ્વર્ગલોકની આશાથી યજા કરનારા લોકો પશુની હત્યા કરીને અને તેની વિદ્યપૂર્વક અન્નિમાં આહુતિ આપીને બાકી વધેલું બ્રાહ્મણો પણ અમુક પ્રાતમાં ખાય છે. તેને શાસ્ત્રોએ માન્ય કરેલ હિંસા ગણવામાં આવે છે. તે પ્રમાણે બાબા પણ મુલ્લાઓને બોલાવીને અને શાસ્ત્રોકત મંત્રોચ્ચાર કરાવીને કુરાનની આખાતો બોલાવીને વિદ્યપૂર્વક ઘેટાં બકરાને હલાલ કરાવતા હતા. રસોઈનાં વાસણો બે પ્રકારનાં નાના અને મોટાં હતાં. ૫૦ માણસોને માટે નાના વાસણમાં, અને ૧૦૦ માણસનું જમણ થાય તેવું મોટું બીજુ વાસણ પણ હતું. આ બંને હાંડી તાંબાની હતી અને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હાલમાં સમાધિ મંદિરના સભામંડપમાં ડાબી બાજુએ અન્ય બાબાની વપરાશની ચીજવસ્તુઓ સાથે પ્રદર્શિત કરેલી છે. ભતતબ એ કે બાબા જરૂરિયાત પ્રમાણે વાસણનો ઉપયોગ કરતા. કરિયાણા માટે પોતે જ તે દુકાને જઈને લાવેલા માલ સામાનનો હિસાબ કરતા. ત્યાં ઉધારીની તો વાત જ ન હતી. મીઠુ, મરચું, જુરુ, મરીમસાલો, ભાજુપાલો, નારિયેળ, કોપરું વગેરે નક્કી કરીને જાતે જ લઈ આવતા અને હાથોહાથ રોકડી રકમ દુકાનદારને આપી દેતા. લાવેલી વસ્તુની સાફ્ફુફી પણ બાબા જાતે જ કરતા અને ઘઉં પણ જાતે દળતા. ચોખા દાળ પણ પોતે જ સાફ્ કરતા. રસોઈ બનાવવા માટેનું કષ્ટ પોતે કોઈ પણ જાતનો કંટાળો લાભ્યા વીના કરતા. ચૂલાનો અભિન પણ પોતે જ જરૂર પ્રમાણે લાકડાં હલાવીને ઓછો વતો કરતા. દાળ પલાળીને પથ્થર ઉપર વાઈને તેમાં મસાલો બેળવી ચટકેદાર ખાદ્યપદાર્થ બનાવતા. લોટની કણકના લુઆ પાડીને તેને વાઈને મોટા રોટલા બનાવતા. તેમજ જુવારના લોટમાં પ્રમાણસર છાસ બેળવીને આંબીલ તૈયાર કરતા. ત્યારબાદ પોતાના હાથે અન્ય ખાદ્યપદાર્થ સાથે તે બધાને પ્રેમથી જાતે જ પિરસતા. (ઓ. ૨૪-૪૧)

રંધેલો પદાર્થ બરાબર સારી રીતે ચઢી ગયો છે કે નહિ તેની ખાત્રી કરવા માટે પોતે પોતાની કફનીની બાંધને અદ્વાર ચઢાવીને અંદર હંડીમાં ગરમાગરમ રસોઈમાં હાથ ધાલી રસોઈ હલાવીને ચકાસણી કરતા. રસોઈ તૈયાર થતાં બાબા ચૂલા ઉપરથી વાસણ પણ પોતે જ નીચે ઉતારતા અને તૈયાર રસોઈનું વાસણ ચૂલા ઉપરથી નીચે ઉતાર્યા બાદ તેને મસ્ઝિદમાં લઈ જતા અને ત્યાં મૂકતા. તે અન્નને મૌલવીઓના હાથે વિધિપૂર્વક ફાતિયો કે જે હલાલ કરેલા જીવના આત્માને શાંતિ મળે તે માટે બોલવામાં આવતો કુરાનનો પ્રાર્થિક ભાગ તે બોલીને પહેલા મહાળસાપતિને અને તાત્યા કોતે પાટીલને પ્રસાદ તરીકે મોકલતા. પછી બાકી વધેલું અન્ન પોતાના હાથે ગરીબ ગુરુબાને પિરસીને તેમને તૃપ્ત કરી બાબા પોતે પણ સુખ સમાધાન પામતા. ભૂખ્યાજનો પણ પેટ ભરિને ખૂબ આનંદથી જમતા. બાબા બળજબરીથી આગ્રહ કરીને પિરસતા. જેમણે આ સંતુષ્ટ કરનારી પ્રસાદી બાળાના હાથે પિરસેલી ખાદી હશે તેઓ તો કેટલા ભાગ્યશાળી આત્મા હશે ? અહીં શ્રોતાઓને એક વાતની નવાઈ લાગશે કે બાબા પ્રસાદ ગળીને ભક્તોને માંસાહારનું અન્ન પણ કોઈ જાતની શંકા વગર શા માટે વહેંચતા હતા ? તો આ શંકાનું નિવારણ કરવું ધણું સહેલું છે. જેમનો આ દરરોજનો ખોરાક હતો, તેવાઓને જ ફક્ત બાબા માંસાહાર પિરસતા. જેમણે જુંફાળીમાં આ આહાર લીધો નથી કે તેનો સ્પર્શ પણ કર્યો નથી તેવાઓને હાથ પણ લગાડવા દેતા નહીં. આવું અવિચારી ફૂત્ય તેઓ કદાપિ કરતા નહીં. જેમને પ્રસાદ મેળવવાની ખૂબ જ લાલસા રહેતી તેમને જ તેઓ આપતા. ગુરુ જાતે પ્રસાદ આપે તે સમયે એ ખાવાલાયક છે કે કેમ તેની શંકા પણ જે શિષ્યના મનમાં ઊભી થાય તો એ શિષ્ય, પોતાના સર્વનાશને નોતરે છે અને નરકનો ભાગીદાર થાય છે. આ બાબતની એક નાની સરખી વાત આ લખતાં લખતાં યાદ આવી. તે શ્રોતાઓએ પોતાના કલ્યાણ ખાતર સ્વસ્થ ચિસે સાંભળવી. (ઓ. ૪૨-૫૨)

એક એકાદશીના દિવસે, બાબા દાદા કેળકરને બોલ્યા, ‘કોરખ્યાથી માટે માટે બકરાનું માંસ મંગાવી આપે છે કે ?’ તેને માટે બાબાએ પૈસા કાઢ્યા અને ગળીને દાદાને આપ્યા. બાબાએ કહ્યું, ‘તું જાતે જ જ અને તારે જ આ કામ કરવાનું છે.’ તેમનું નામ ગળોશ દામોદર હતું. તેમની અટક કેળકર હતી. ઉમરલાયક હોવાને કારણે લોકો તેમને દાદા કહીને બોલાવતા હતા. રાવખલાદૂર હરી વિનાયક સાહેના તેઓ સસરા હતા. જાતે ખાત્માણ હોવાને કારણે ધાર્મિક કર્તવ્યો તરફ તેમનું ધ્યાન વધારે રહેતું. તેઓ સદ્વિચારી અને સારું વર્તન કરનારા હોવાને કારણે તેમનો સાઈચરણોમાં અનિવાર્ય પ્રેમ હતો. તેમણે રાત દિવસ પોતાના ગુરુની સેવા કરતા પણ તેમનું મન કયારેય તૃપ્ત થતું નહીં. બાબાએ તેમને જે આ વિચિત્ર પ્રકારની આજ્ઞા કરી તેનું આશ્રય તેમને કેમ ન થયું તે સમજતું નથી. જેમના શરીરના અવયવો તંદુરસત છે અને જેમની પાસે પહેલેથી જ સારી ટેવોનું સામર્થ્ય છે તેમનું મન કયારેય ચંચળ થતું નથી અને હંમેશાને માટે ગુરુપદોમાં સ્થિર અને શાંત હોય છે. ધન, ધાન્ય કે વસ્તુ ગુરુને અર્પણ કરવાં એ જ કંઈ દક્ષિણા નથી પણ ગુરુની આજ્ઞા વિધિપૂર્વક પાર પાડવી અને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તેમને સંતુષ્ટ કરવા તે જ ખરી દક્ષિણા છે. શરીર, વાણી અને મનથી ઓતપ્રોત થઈને જે ગુરુકૃપા પ્રાપ્ત કરે છે તેની જ શ્રદ્ધા ખરી છે. દાદા પણ બાબાની આ આજ્ઞા શિરોમાન્ય રાખી ઉતાવળો કપડાં બહદીને આવ્યા અને માંસ ખરીદવા તેઓ પેલા ગામ તરફ જવા માટે નીકળ્યા. ત્યાં જ બાબાએ તેમને પાછા બોલાવ્યા અને કહ્યું, ‘અરે આ ખરીદી કરવા બીજને મોકલને, તને આવવા જવાની ખોટી તકલીફ થશે. ખોટી જહેમત ઉઠાવતો નહિ.’ તે સાંભળીને દાદાએ તે મંગાવવા પાંડુ નામના પોતાના નોકરને મોકલ્યો. આ જેઠિને બાબાએ તે પ્રસંગે દાદાને શું કહ્યું તે જુઓ ! જવા માટે તૈયાર થયેલો પાંડુ રસ્તા ઉપર નીકળ્યો ત્યાં જ બાબા બોલ્યા, ‘આજનો દિવસ રહેવા હે, તેને પાછો બોલાવજો.’ (ઓ. પૃષ્ઠ-૬૪)

પછી એક દિવસે બાબાને હંડીનો પ્રસાદ વહેંચવાની લહેર આવી અને ચૂલા ઉપર ઢેગડો ચઢાવ્યો. તેમાં માંસ નાંખ્યું પછી એમાં સાફ કરેલા ઘોયેલા ચોખા ઉમેર્યા અને માપ પ્રમાણે એમાં પાણી ઉમેરીને ચૂલામાં લાકડાં સરખા કરીને ફૂક મારી. આખું શિરડી ગામ બાબાની આજ્ઞા પાળનારું હતું. કહ્યું હોત તો કોઈ પણ આનંદથી તે ચૂલો ફૂકવા તૈયાર થયું હોત, પણ બાબાની આજ્ઞા વીના કોઈની પણ હિંમત ચાલતી નહિ. સાઈબાબાના દાસ તેમની સેવા માટે સદાયે ઉત્સુક રહેતા. ફક્ત તેઓ તેમની આજ્ઞાની જ રાહ જેતા. ખરેખર તો સાઈબાબા એમાં બેફિકર હતા. આ બાબતમાં બેફિકરાઈ એમ કહેવું પણ યોગ્ય નથી. પોતાના હાથે રસોઈ કરવાનો જેને પોતાનો સ્વાર્થ હતો, ફાયદો હતો, તે અપ્રદાન કરવા માટે બીજાનોને તકલીફ શા માટે થવા હે ? જે પોતાના જ નિર્વાહ માટે બિક્ષા માંગવા માટે જીતે જ ઘરે ઘરે ફરીને ચાર ભાખરીના ટુકડા બેગા કરતા હોય તેવાને અપ્રદાન કરવા માટે પોતે જીતે જ ત્રાસ સહન કરે તો જ તેમને સમાધાન થાય માટે જાણી જેઠિને તેઓ કોઈની ઉપર નિર્ભર રહેતા નહિ. સો માણસોની રસોઈ થઈ શકે તેટલો લોટ, ચોખા, દાળ વગેરે બાબા ગાંઠના પૈસાથી રકમ અદા કરીને ખરીદતા. જીતે હાથમાં સૂપડું લઈને તેઓ વાણિયાની દુકાને જતા. પોતાના વ્યવહારમાં તેઓ ડેટલા ચોખા હતા તે તેમની પાસેથી શીખી સેવા જેવું હતું. કોઈ પણ વસ્તુ ખરીદાં પહેલાં તેનો ભાવતાલ નક્કી કરતા. પહેલાં વસ્તુને હાથમાં લઈ તેનો કસ જેઠિને પછી નક્કી કરતા. તેમને કોઈ પણ વ્યાપારી ફસાવી શકતા નહીં. ઉલ્ટાના ફસાવા જનારનું અભિમાન ઉત્તરી જતું. હિસાબ કરવામાં પણ પાકા ગણનીબાજ હતા. એક પૈસો પણ તેઓ ફોગટમાં જવા જેતા નહિ. પણ માતની જે કંઈ કિંમત થતી તે રોકડા જ ચૂકવી દેતા. એટલું જ નહિ પણ માતના પાંચ રૂપિયા થાય તો ઉદારતાથી વાણિયાને દશ રૂપિયા પણ દેતા. પોતાનું કામ જીતે કરવામાં તેમને ખૂબ જ ઉમંગ થતો. બીજાએ કરેલું તેમને ગમતું નહિ. કોઈની ખોટી આશા રાખતા નહિ અને કોઈને ત્રાસ થાય અથવા આપવો પડે તે તેમને ગમતું નહિ. આ એક જે તત્ત્વ બાબાની પાસે હતું અને તેમાં હરહંમેશ તેઓ જન્મતું રહેતા. માટે જ આ હંડીની રસોઈ બનાવવા માટે તેઓ કોઈની પણ સહય માગતા નહિ. હંડી શું ? પણ ઘૂણીની પાસે આવેલી બળતાણના લાકડા મૂકવાની પૂર્વ તરફની ઓરડી લગભગ ત્રણ ચતુર્થાંસ ભીતિને બાબાએ લીપીને તૈયાર કરેલી. એક સેવક મહાદુદ્દી ફસલે ગુંદલી માટીનો ગારો તૈયાર કરી આપતો અને બાબા ભીતી ચણવા માટે ઢિટોના થર ઉપર થર મૂકીને માટીનું લીપણ પોતાના હાથે ભીતો ઉપર કરતા હતા. બાબા જીતે શું નહોતા કરતા ? મસ્નિદુદ્દ પણ પોતાના હાથે જ વ્યવસ્થિત કરતા. પોતાની કફ્ફની અને લંગોટ પોતે જીતે જ સિવતા અને કોઈની જરાપણ આશા રાખતા નહિ. હંડી ગરમ થઈને ઉકળતા પાણીના પરપોટા બહાર આવતા ત્યારે બાબા કફ્ફનીની બાંધો ઉપર ચઢાવીને કોઈ પણ એક હાથે અંદર રંધાઈ રહેલા પદાર્થને ઉપર નીચે કરતા. તપેલું ખદબદ્દું હોય અને અંદરનો પદાર્થ ઉભરાઈને બહાર નીકળી જય એવી સ્થિતિમાં હોય ત્યારે બાબા આવી આશ્રમ્યકારક અગાધ લીલા કરી બતાવતા. કયાં એ લોહી માંસનો હાથ અને કયાં પેલું ભયંકર ઉકળેલું તપેલું ! પણ એમના હાથ ઉપર દાજવાના નિશાની કે મોઢા ઉપર ભય દેખાતો નહિ. જે પોતાના ભક્તોને માથે પડેલા દુઃખ અને સંતાપો તત્કાળ દૂર કરતા તેવા હાથને અગ્રિ પણ કેવી રીતે દુઃખ આપી શકે ? આ ઈશ્વરીય હાથના મહિમાની અજિન દેવને પણ જાણો ખબર હતી. (ઓ. ૬૫-૮૪)

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

વાટવાના પથ્થર ઉપર ભીજવેલી દાળ પસરાવીને બાબા જાતે જ સાફ કરતા અને પછી વાટવાનો પથ્થર લઈને જાતે જ મગની દાળ વાઈને પોતાના હાથે જ મગની વડીઓ બનાવતા. પછી ધીમે રહીને તે ઉકળતી હાંડીમાં મૂકતા અને તે વાસણા તળિયામાં બેસી ન જય માટે તેને એક સરખી રીતે હલાવતા રહેતા તથા રંઘેલો પદાર્થ તૈયાર થઈ જતાં હાથ વડે જ તે વાસણ ચૂલા ઉપરથી નીચે ઉતારીને બધાને પ્રસાદ તરીકે પીરસતા. શ્રોતાઓને મનમાં વિચાર આવશે કે કેમ બધાને ? સાઇ તો મુસલમાન હતા પછી આવું અધર્મનું આચરણ તેઓ લોકો પાસેથી કેમ કરાવતા હતા ? આ શંકાનો એક જ જવાબ છે, સાઈબાબાની પાસે ધર્મ અધર્મનો વિચાર અને તેનો સાચો અર્થ સદાચે મનમાં રહેતો. હાંડીના રંઘેલા ખોરાકનું સેવન બધાએ જ કરવું જેઠાએ તેવો દૂરાથહ તેઓ કયારે પણ રાખતા નહીં. પરંતુ તે મળવો જેઠાએ એવી જે સારી ઇચ્છા જેમના મનમાં ઉત્પન્ન થતી તો તેવાની વાસના તેઓ પૂર્ણ કરતા. તેઓ કયારેય કોઈને ફસાવવાની પેરવી કરતા નહીં. તે સિવાય તેમની જત વિષે કોને જાણકારી હતી ? મસ્જિદમાં રહેતા હતા માટે મુસલમાન મનાતા હતા. પરંતુ તેમની વર્તાણૂંક જેઠાને એવું જરા પણ લાગતું નહિ. તેમજ તેમની ખરી જત કઈ છે તે પણ ખબર પડતી નહીં. ભક્તો જેને દેવ માનતા, જેની સામે ઘૂળમાં આળોટીને દંડવત્ત પ્રાણામ કરતા તેમની જે જતપાત વિષે જાણકારીની ઉત્સુકતા ઘસવે છે તેમની પરમાર્થ પ્રાપ્તિને પણ વિક્કાર છે. આ લોકના વિષયો કે પરલોકના વિષયો પ્રત્યે જેણે કાયમની ઉદાસીનતા સ્વીકારી છે, વિવેક અને વૈરાગ્ય તે જ જેની સંપત્તિ છે તેની વળી જત શા માટે જાણવી ? જેની પોતાની સ્થિતિ ધર્મ અને અધર્મની પણ પેદેપારની અને આગળની છે, જેની વૃત્તિ હંમેશાં નિર્ભળ આનંદરૂપ છે, તેની તો વળી જત કઈ ? આવું જાણવાની ઈન્નેજનરી ઘરાવનારની પરમાર્થ પ્રાપ્તિ તુચ્છ અને નીંદનીય છે. (ઓ. ૮૪-૮૪)

આવું આ બાબાનું ચરિત્ર મારા પોતાના સુખ ખાતર ગાઈ રહ્યો છું. જેને સાંભળવાની તીવ્ર ઇચ્છા હશે, તેની શ્રદ્ધાનું પણ સમાધાન થશે. દાદા કેળકરની વાત અધૂરી રહી ગઈ. તેને માટે આપણે થોડા પાછા જઈએ (જુઓ ઓ. ૫૧-૬૪) દાદા કેળકરને ઉદ્દેશીને ગમ્ભેર કરતાં કરતાં બાબાએ બીજું શું કહ્યું તે તરફ દ્યાન આપો. ‘ઘોસ પુલાવ કર્યો છે ? કેવો થયો છે ? ચાખી જેવો છે ?’ દાદાએ ફક્ત કહેવા આતર, ‘હા.... હા.... સારો છે,’ એવું કહીને તેની ખાલી જ સ્તુતિ કરી. દાદા ઉભરલાયક પણ બાબાના એક જુના અને વરિષ્ઠ ભક્ત હતા. સ્નાન સંદ્યા પૂજન નિયમિત રીતે કરતા હતા અને કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેનો સારો નરસાનો વિચાર પહેલેથી જ કરતા. તેમને ખું પૂછો તો સાંદું લાગ્યું નહિ, ત્યારે બાબાએ પૂછ્યું, ‘તેંબું કદી આંખોથી જેયું નથી, જુભથી કોઈ હિવસ સ્વાદ કર્યો નથી, પછી સારો છે એવું કેવી રીતે કહે છે ? કાઢ પેલા દેગડા ઉપરથી ઢાંકણ અને એમાં હાથ નાખીને જે.’ પછી બાબાએ તેનો હાથ પકડીને દેગડામાં ઓસી દીઘો અને પછી બોટ્યા, ‘હાથ બહાર કાઢ, આ ઝારી લે અને લોકોની થાળીમાં પીરસ. આ સોળા બોળાની લું છોડી દે અને વગર કામની બડાઈ મારવાનું બંધ કર.’ એક શિષ્યને સંત જાતે જ વટલાવવાનો પ્રયાસ કરે તેની કલ્પના પણ અયોગ્ય લાગે છે. સંત તો હંમેશા પૂર્ણપણે કૃપાથી ભરેલા હોય છે. તેમના વર્તાવની તેમને જ ખબર હોય છે. સાચા પ્રેમની લહેર ઉઠ એટલે જેને એક મા વહાલથી પોતાના બાળકને ચુંટલી ભરે છે અને બાળક રડવા લાગે ત્યારે તે જ મા તેને છાતી સરસો ચાંપીને પ્રેમથી વહાલ કરે છે. માંસાહાર કરવાની જેની ઇચ્છા રહેતી તેનું જ મન બાબા પૂર્ણ કરતા. પરંતુ આવું અન્ન ન ખાવું જેઠાએ એવો મન પર કાખૂ મેળવવાનો પ્રયત્ન કરનારને તેઓ માન્યતા આપીને જબરજસ્તી કરતા ન હતા. તેમ છિતાં ગુરુની આજા પાળવાનો વિચારપૂર્વકનો નિર્ણય કદી કહી એટલી હેઠ પહોંચી જતો કે જે જીવનભર આવી વસ્તુને અહુક્યા પણ નથી એવા ભક્તોનો ભરોસો ડગમગવા લાગતો. ખરું જેતાં તો કોઈ પણ ભક્તને બાબા જાતે ખોટા માર્ગ જવા માટે કયારેય પ્રેરિત કરતા ન હતા. (ઓ. ૮૫-૧૦૬)

ઇ.સ. ૧૯૧૦ પહેલાં હાંડીમાં રસોઈ રંઘવાનો યોગ ઉપરા ઉપરી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવતો હતો. પરંતુ

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

જ્યારથી શ્રીદાસગણુ મહારાજની ફેરી મુંબથ શહેરમાં શક્ક થઈ અને તેમના કીર્તનો અને આપ્યાનોથી તેમણે સાઈભાબાનું મહાત્મ્ય પુષ્કળ મોટા સમુદ્ધાયના મનમાં ઠસાયું. ત્યારથી નાના મોટા બધાને બાબાનો મહિમા સમજન્યો અને અસંખ્ય લોકો શિરડીમાં આવતા જતા થઈ ગયા. ત્યાર પછી જ બાબાના પ્રેમને લીધે પૂજન, અર્ચન, આરતી, નૈવેદ્ય અને અનેક પ્રકારના દિવસના ત્રણે પ્રહરોના ખાવા પીવાનાં નજરાણાંની બેટ આવવા લાગી. તેમજ દાળભાત, શીરો, પૂરી, રોટી, ચટણી, કચુંબર, ફળફળાદી, પંચામૃત બેળવીને બનાવવામાં આવતી જીર વગેરે જુદી જુદી ખાદ્ય પદાર્થની સામગ્રી પુષ્કળ પ્રમાણભાં શિરડીમાં આવવા લાગી. ક્યારેય નહિ એવા આ શિરડીમાં અમાર્યાદિત યાત્રાળુઓનો મેળો ત્યાં બેગો થવા માંડ્યો. જે કોઈ ભક્ત શિરડી આવે તે દોડી દોડીને સાઈના દર્શને જથું ત્યારે કંઈ ને કંઈ નૈવેદ્ય અર્પણ કરવા લાગ્યા. આમ ભૂખ્યા લોકોની ભૂખ સહેલાઈથી ભાંગવા લાગી. ‘સાઈભાબાની એક મહારાજ ધીરાજની માફક સેવા ચાકરી થવા લાગી.’ તેમની ઉપર છત્ર અને ચમ્બર ઢોળાવા લાગ્યાં. વાદ્ય અને વાન્ડિનોની સાથે ભક્તોનો સમુદ્ધાય ભજન કીર્તન કરતો વધવા લાગ્યો. શિરડીના રાજ ધિરાજની ઘ્યાતિ ખૂબ ફેલાઈ. ભક્તો તેમની સ્તુતિ સ્તોત્ર ગાવા લાગ્યા. યાત્રાળુ માટે શિરડી એક પરમ પવિત્ર ‘શ્રીક્ષેત્ર’ બની ગયું. અને તે જ કારણે રસોઈ રંધવાનો બાબાનો જે રીવાજ હતો એનો અંત આવ્યો. નૈવેદ્ય અને પ્રસાદ એટલો બધો આવવા લાગ્યો કે, એમાંથી ફરીરો, વૈરાગીઓ, ગોસાઈઓ અને લિક્ષા ઉપર જીવવાવાળા માટે પેટ ભરીને જમી શકાય એટલું અન્ન આવવા લાગ્યું. તેમજ વધવા પણ લાગ્યું. (ઓ. ૧૦૭-૧૧૫)

હવે એક બીજુ કથા કહી રહ્યો છું. જેને સાંભળીને આનંદ થશે. પોતાના આરાધ્યદેવનું અપમાન થતાં બાબા મનથી નાખુશ થતા. બાબા પોતે કોઈ પણ જલતપાત વગરના હોવા છતાં તર્ક અને અનુમાનથી કોઈ તેમને મુસલમાન કહેતા તો કોઈ તેમને બ્રાહ્મણ સમજતા. તેમનું કોઈ ચોક્કસ ડેકાળું ન હતું. અને તે કંઈ જલતના કે કંઈ કોમના છે તથા તેમનો જન્મ કર્યાં થયો, તેમનાં માતપિતા મુસ્લિમ કે હિન્દુ ધર્મ હતા તેની કયાંચે, કોઈને, કરી જ અભર ન હતી. જે તેઓ મુસલમાન હોત તો મસ્ઝિદમાં અખંડ ‘ધૂણી’ પ્રજ્ઞવિલિત રાખીને પૂજન કરવાની રીત તેમણે કેમ ચાલુ રાખી હતી? ત્યાં ‘તુલસીવૃંદ’ શા માટે રહેવા દીધેલું અને ‘ધંટનાદ’ શા માટે થતા હતા? મસ્ઝિદમાં કોઈએ ‘શંખ’ ફૂંકવા દીધો હોતકે? કોઈને ઢોલ મૂદુંગ વગાડવા દીધાં હોતકે? તેમણે ‘હરિનામનો જપ’ શા માટે કરવા દીધો હોત? જે મુસલમાન હોત તો મસ્ઝિદમાં બેસીને પોતાની જલતે ‘અષ્ટગંધ’ ચોપડવા દીધું હોતકે? ત્યાં બધાની સાથે જમવા પણ બેસાત હોતકે? જે મુસલમાન હતા તે તેમના ‘કાન કેમ વિદ્યાયેલા’ હતા? પોતાને ‘દક્ષિણામાં’ મળેલા પૈસાથી ‘મંદિરોનો જણોંદાર’ અને ગાબડ ગુબડ કેમ કરાવતા હતા? તેઓ પોતેજ આ બધો ખર્ચ કેમ બોગવતા હતા? સ્નાન બાદ ‘પિતાંબર’ લપેટીને રહેતા ખરા? સ્વ. માધવરાવ દેશપાંડેના ચિરંજલીવી ઉદ્ઘવે શિરડીમાં મને કહ્યું તે પ્રમાણે શ્રીબાબા નાહ્યાદોયા બાદ થોડો સમય પીળા રંગનું પિતાંબર વીઠાળીને ઊભા રહેતા. તે તેમને પોતાના નાનાપણમાં સગી આંખે જ્ઞેયેલું. આવા સમયે તેમની ગોરી કાંતિ વાળું શરીર ખૂબ જ મનોહર દેખાતું. ક્યારેક ક્યારેક તો એક પગની એડી બીજા પગ ઉપર ચઢાવીને કર્મરે હાથ મૂકીને હસતાં હસતાં ‘શ્રીકૃષ્ણ’ જેવો હાવભાવ કરતા. તે દર્શનની શી વાત કરવી? માથા ઉપરનો કકડો બાંધતા પહેલાં બાપુસાહેબ જેગ બાબાના કપાળ ઉપર અશ્લુગંધથી ‘સ્વસ્તિક’ દોરતા અને તેની ઉપર ‘બિલીપત્ર’ મૂકીને નમસ્કાર કરતા. પછી બાબા પોતાના હાથે એ સફેદ કકડો લઈને પોતાની અદ્ધાથી ખાસ કરીને ‘ડાબે કાને પાઇળ મારે ગાંઠ! જટાની માફક વળ ચઢાવીને॥’ બાંધતા હતા. ઉલ્ટાનું જે એકાદ હિન્દુ ભક્ત પોતાના ઉપાસ્ય દેવની પળભર માટે પણ જે અનાદર કે નિંદા કરે તો તે તેમને જરાયે ગમતું નહીં. એક બોધકથા મને યાદ આવી તે લખતાં લખતાં અતિનભ્રાવે અહીં રજૂ કરું છું. મહેરભાની કરીને સ્વસ્થ ચિંતા તેનું રસપાન કરો. (ઓ. ૧૧૬-૧૨૫)

એક દિવસ એવું બન્યું કે, બાબા લેંડીબાગમાંથી પાછા ફર્યા, અને મસ્ઝિદમાં આવીને બેઠા, ત્યાં દર્શન માટે ભક્તો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આવ્યા તેમાંથી બાબાના ખાસ પ્રેમાળ ભક્ત શ્રેષ્ઠ ચાંદોરકરે પોતાના સાદુભાઈ બિનીવાલાની સાથે દર્શનાર્થે આવ્યા હતા. બંને જણ શ્રીસાઈનાથની સામે આવી નમસ્કાર કરીને બેઠા. પછી ખબરઅંતર પૂછવાનું ચાલતું હતું. તેવામાં એકાએક બાબા ગુસ્સે ભરાયા અને બોલ્યા, ‘નાના! તારા તરફથી આવું કેવી રીતે ભૂતી જવાયું? મારી સાથે આટલા દિવસો ગાય્યા પથી પણ તેં ફક્ત આટલું જ સંપાદન કર્યું? મારી સાથેના સંગાથની તે છેલ્લે આવી જ દરશા કરી? આવી કેવી તારી મતિ ફરી ગઈ। કાળજીપૂર્વક બધું જ મને જણાવ.’ બાબાના આ પ્રકારે બોલ સાંભળીને નાના નીચી ડોક કરીને બાબાશ્રીના ગુસ્સાનું કારણ શું હોવું જેઠાએ તેનો વિચાર કરવા લાગ્યા. પણ કંઈ યાદ આવે નહીં. આથી તેમનું મન ઉદાસ થઈ ગયું. કયાં થાપ ખાદી તે સમજાયું નહીં. ગુસ્સાનું કારણ શું હોવું જેઠાએ એનો વિચાર કરવા લાગ્યા. પણ કંઈ યાદ આવે જ નહીં. પરંતુ એટલું નક્કી કે, કોઈ કારણ વીના બાબા કોઈને પણ દુઃખી કરતા નહીં. તે વાતની તેમને ખબર હતી માટે તેમણે બાબાના પગ પકડ્યા અને અનેક પ્રકારે વિનવવા માંડ્યા. તેમણે છેલ્લો ઉપાય એ કર્યો કે નાનાએ પોતાની જોળી ફેલાવીને ગુસ્સાનું ખરું કારણ પૂર્ણી લીધું. ત્યારે બાબાએ જવાબ આપ્યો, ‘વર્ષોનાં વર્ષો મારા સહવાસમાં રહ્યા બાદ શું આવો તારો વર્તાવ? તારી બુદ્ધિ કયાં ગઈ છે? કોપરગાંબ કયારે આવ્યો? રસ્તામાં જે કોઈ નવાઈની વાત બની હોય તો, તે બધી મારે સાંભળવી છે. વચ્ચે કેમ ઉત્તરી પડ્યો? ટાંગો છેક શિરડી કેમ હક્કાલી મૂક્યો? હક્કિકતમાં તો નાનું મોદું જે કંઈ પણ બન્યું હોય તે તું મને કહે જોઉં! ’ આવું બાબા બોલતાંની સાથે જ નાના મનમાં સમજ ગયા. તેમનું મોદું ઉત્તરી ગયું અને જવાબ આપવામાં સંકોચ થયો. છતાં તેમણે બધું કહી સંભળાયું બાબાની સામે કોઈ પણ વાત છુપાવી શકતી નહીં. અને મનમાં નિર્ધાર કરીને જે જે કંઈ બન્યું હતું તેની પહેલેથી છેલ્લે સુધીની બધી હક્કિકત બાબાને કહી સંભળાવી. સાઈમહારાજ સામે જરા પણ જૂઠાણું ચાલતું નહીં. ‘જૂઠું બોલવાથી સાઈની પ્રાપ્તિ થતી નથી.’ ઓદું બોલવાથી માણસની અધોગતિ થાય છે, અને છેલ્લે તે નરકમાં જઈ દુર્ગતિ પામે છે. ગુરુને ફસાવવો એ મહાપાપ કર્યાનું કર્મ છે અને એવા પાપને માફી કે પ્રાયશ્વિત હોતું નથી. તેમ સમજણે નાનાએ બધી ઘટના કંઈ પણ ન છૂપાવતાં કહી દીધી. તેઓ બોલ્યા, ‘પહેલા ટાંગો શિરડી માટે જ નક્કી કરેલો. તેને કારણે ગોદાવરી નહીના કાઢે આવેતી દત્તની મૂર્તિનાં દર્શન માટે બિનીવાલાએ રોક્યો. બિનીવાલા દત્તભક્ત છે. માટે રસ્તામાં મંદિર આવતાં તેમના મનમાં દત્તભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. અને નીચે ઉત્તરવાનું મન થયું. પણ મને શિરડી આવવાની ઉતાવળ હતી માટે મેં જ તેમને તે ટાળી દેવાની કોશિશ કરી. મેં કહું શિરડીથી પાછા ફરતાં દર્શન કરતા જઈશું. આમ શિરડી પહોંચવા માટે ખૂબ વાર થરો તે ઉતાવળને કારણે મેં શ્રીદત્તના દર્શન તરફ હુર્લક્ષ કર્યું. પછી આગળ ગોદાવરીમાં નહાવા માટે જતાં મોટો કાંટો પગમાં ઘૂસી ગયો એવું લાગ્યું. મને ખૂબ જ ત્રાસ થયો, અને મહામુસીબતે તેને ખેંચી કાઢ્યો.’ ત્યારે બાબાએ સુચક ઉપદેશક્રી ઈશારો કર્યો, ‘આટલી ઉતાવળ સારી નહિ. તારું નસીબ સારું કે દર્શનનો અનાદર કરીને પણ ફક્ત કાંટો વાગવામાંથી તું છૂટી ગયો. દત્તાત્રેય જેવા ભગવાન રસ્તામાં ઉભા હોય અને તારા જેવો દુર્દેવ અભાગી જેણો દર્શનનો લહાવો પડતો મૂક્યો તેવાને વળી હું કયાંથી મળવાનો? આ પ્રસંગ અંગની નાનાસાહેબને મૈનાતાઠ કુવલેકર નામની પુત્રી સ્વ. પ. પૂ. નરસિંહ સ્વામી આગળ ૧૯૭૯ની સાતમાં કરેતા નિવેદનમાં બીજી એક માહિતી આપી તે આ પ્રમાણે હતી. ‘મારી માસીના યજમાન બાળસાહેબ બિનીવાલા પરમ દત્તભક્ત હતા. ઈ.સ. ૧૮૮૮ કે ૧૯૦૦ની સાતમાં જ્યારે તેઓ સાઈબાબાના દર્શન માટે ગયા ત્યારે તેમનો શ્રી બાબા ઉપર પૂર્ણ વિશ્વાસ ન હતો. મારા પિતાશ્રીના આગ્રહને કારણે તેઓ શિરડી ગયા હતા. પરંતુ જ્યારે તેમણે પોતાની સગી આંખે સાઈમહારાજને જેયા ત્યારે તેમને સાક્ષાત્ બાબાની જગ્યા ઉપર ત્રિમૂર્તિ શ્રીદત્ત ભગવાનની પ્રતીતિ થઈ. ત્યાર પછી જીવનભર તેઓ સાઈના અનન્ય ભક્ત થઈને રહ્યા.’ આ પ્રસંગ ઉપરથી શ્રીસાઈ દત્તાત્રેયના અવતાર જ હતા. જે વાતને સાઈબાબાની આરતીની ચોથી કદીમાં પુષ્ટિ મળે છે. ‘કલિયુગી અવતારા | સગુણ બ્રહ્મ

શ્રી સાઈનું સત્ય ચાટિત્ર

સાચાર | અવતીર્ણ થયા | સ્વામી દત્ત હિંગંબર | દત્ત હિંગંબર | આરતી સાઈબાબા ॥' (ઓ. ૧૨૬-૧૪૬)

હવે હંડીની વાત થોડી આગળ ચલાવીએ. શું મસ્ઝિફમાં સાઈબાબા સાથે બપોર પછીના જમણાની પવિત્રતા અને સાઈની ભક્તો તરફની અમીદાણી ! બપોરની પૂજન થયા બાદ દરરોજ બાબાની આરતી પૂર્ણ થતાં ભક્તો જ્યારે પાછા જતા ત્યારે બાબા તે સર્વને ઉદ્દી આપીને વિદ્યાય કરતા. તેઓ મસ્ઝિફના ઓટલાની કિનારો ઉપર આવીને ઊભા રહેતા અને આંગણામાં રાહ જેતા ભક્તો એક એક કરીને આવીને તેમનાં ચરણોમાં વંદન કરતા અને જે કોઈ ત્યાં ઊભો રહેતો તે દરેકના કપાળે બાબા ઉદ્દી લગાડતા. પછી, 'હવે દરેક પોત પોતાના ઘરે જમવા જ્ઞાવ' આવું બાબા કહેતા કે તરત જ તેમની આજા શિરોમાન્ય રાખી ભક્તજનો પોતપોતાને ઘેર જતા. પછી બાબાની પૂંઠ ફરતાં રોજના રિવાજ પ્રમાણે પડ્દો પાડવામાં આવતો. થાળી વાડકાઓનો ખખડાટ શરૂ થતો અને પ્રસાદનો ઢાઠ જમતો. સાઈબાબાના હસ્તસ્પર્શ થયેલું એ પવિત્ર નૈવેદ્ય પાછું પોતાને મળે તે આશાએ અમુક લોકો તો આંગણામાં તેની પ્રતીક્ષા કરીને બેસી રહેતા. અહીંથા બાબા જ્યારે ભીતિ તરફના ખૂણા પાસે પીઠ ફેરવીને બેસતા ત્યારે તેમની બંને બાજુઓ જમવાની પંગત પડતી અને બધાને આનંદ થતો. સાઈસમર્થની સામે જે તે બધાય નૈવેદ્ય લઈને આવતા, અને સાઈસમર્થ પણ પોતાની થાળીમાં દરેકનું થોડું થોડું નૈવેદ્ય લઈ બધું લેળવીને ભેગું કરતા. બાબાના હાથનો સ્પર્શ પામેલો અન્નનો કણ પણ મળવો એ મોટી બાયની વાત હતી. અને તે ખાનારા સંપૂર્ણપણે પુનીત થઈને તેમનું જીવન સાર્થક થઈ જતું હતું. વડાં, અનારસા, સાંજા, પુરી, સાહી પુરી, રાઇતું ચોખા કે ઘઉના રૂવામાંથી બનાવેલી ધારણે, ચોખા વાનગીના લોટની પાપડી, અનેક પ્રકારની શાકભાજુઓ અને ઝીર તથા કચુંબર બધું ભેગું કરી નાખતા. તે અન્ન બાબા ઈશ્વરને અર્પણ કરતા. અને માધવરાવ દેશપાંડે અને નાનાસાહેબ નિમણોકર પાસે થાળીઓ ભરી ભરીને પીરસાવતા. દરેકને વારાફરતી બેસાડી ખૂબ પ્રેમથી જમાડતા. સ્વાદિષ્ટ ધીમાં પુરણપોળી અને મોળીદાળ ભેગી કરીને તૈયાર કરેલો કોળિયો બાબા બધાને પીરસતા. પ્રેમથી તૈયાર કરેલો એ કોળિયો ખાદ્યાબાદ થતા આત્માનંદની તો શી વાત કરવી ? ખાનારો તો આંગળા ચાટતો રહી જતો, અને ખૂબ જ સંતુષ્ટ થતો. કયારેક ઘઉના લોટમાંથી બનેલા પકવાનો, પુરણપોળી, ગળીપુરી, બાસુદી, શિરો જેવી સ્વાદિષ્ટ વસ્તુઓ પણ પીરસતા. કયારેક આંબામોર નાખેલો બાસમતીનો ભાત, તેની ઉપર સુંદર દાળ અને ધી, જુદી જુદી શાકભાજુ, અથાણું, પાપડ, રાઇતું, અનેક પ્રકારના ભજિયાં અનેક પ્રકારનાં અને રીગણનું ભરત અને કયારેક સાધારણ ખાટું દહીં, છાશ અને પંચામૃત પણ રહેતાં. જે લોકોના નસીબમાં આ હિંદ્ય આવાનો મોકી મજ્જો તે ધન્ય થઈ ગયા. જ્યાં સાઈમહારાજ જેવા ગુણજ્ઞ પિરસવાવાળા હોય તેવા જમણાના હું શું વખાણ કરું ? ત્યાં ભક્તો ગળા સુધી-પેટ ભરીને જમતા અને સંતોષના ઓડકાર ખાતા. દરેક કોળિયે કોળિયે સાઈનામ સહ ભક્તો પોતાના ઉદ્દરમાં આહુતી આપતા. થાળીઓ ખાલી પડતી જ નહીં. ઉપરા ઉપરી જેને જે પકવાની ઈચ્છા થતી, તે તેમને પ્રેમથી પીરસવામાં આવતું. કેટલાકને કેરીના રસ ઉપર પ્રેમ હતો. તો તેમને આગ્રહથી તે પીરસવામાં આવતો. આમ દરરોજ અન્ન પીરસવા માટે બાબા નાનાસાહેબ નિમોણકરને અથવા તો માધવરાવે દેશપાંડેને આજા કરતા. આ બંનેનું આ નિયમિત કાર્ય હતું. પ્રસાદ વહેંચવો તે જ તેમનું કામ રહેતું અને તેને માટે તેઓ ખૂબ પ્રેમથી જહેમત ઉઠાવતા. (ઓ. ૧૪૭-૧૭૦)

સ્વાદિષ્ટ જીરસરનો ભાત જાણે કે મોગરાનાં ફૂલની કળીઓ. તેની ઉપર તુવેરની પીળી ધમક દાળ અને ત્યારબાદ બધાને એની ઉપર એક પળી ધી પીરસતાની સાથે તેમાંથી મધ્યમધતી સુવાસ છૂટતી. જમણ ચટણીના ચટાકે મસાલેહાર અને ધમધમાટ રહેતું. જરાપણ કાચું કે સ્વાદ વગરનું ત્યાં પીરસાતું નહીં. ઘઉં ચોખાના લોટમાંથી બનાવેલી સેવની ઝીર આવા પ્રેમાળ પ્રસાદની તો શું વાત કરવી ? સુખનો અને શાંતિનો સ્વાનુભવ થયા વીના અહીંથા કોણ જમવા આવી શકે ? જ્યાં હરિ પોતે જ અન્ન છે, ઈશ્વર પોતે જ ખાનારો છે અને ચાખનારો છે, તેવી જગ્યાએ અન્ન પીરસનારો અને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સેવન કરનારો બંને ધન્ય છે. આ મીઠાસનું મૂળ એટલે ગુરુમાં રહેલી પ્રભળ નિષ્ઠા અને જગ્યારજસ્ત શ્રદ્ધા જ હોઈ શકે. ખાંડ કે ગોળ મીઠો નથી હોતો પણ શ્રીનાં ચરણોની સમૂળણી દફ શ્રદ્ધા જ મધુર હોય છે. ખીર અને શિરાની રેલમછેલ રહેતી અને થાળી પર બેઢા પછી કોઈની પણ ચૂંકે ચા ચાલતી નહિ. આવી અનેક પ્રકારની વાનગીથી પેટ ભર્યા બાદ હરી ભાત ખાધા વીના સંતોષ મળતો નથી. માટે એ જ્યારે ન મળતાં ત્યારે જમનારાઓ છાશ તો માંગી જ લેતા. એક દિવસ સ્વસ્થ છાશનો ખ્યાલો જે ગુરુમહારાજે જાતે પોતાના હાથે ભરીને મને પીવા માટે આપ્યો હતો, અને તેને મોઢે લગાડતાં જ, જે સુખ સમાધાન અને આત્માનંદનો અનુભવ મેં કરેલો તે અવિસરળીય છે. એક તો પહેલેથી જ પકવાનોથી પેટ ભરેલું હતું ત્યાં આ ખેંચી તાણીને છાશ કેવી રીતે પીવાશે એવી શંકા હું મનમાં કરું ત્યાં તો તે ઘૂંઠડો મને ખૂબ જ સ્વાહિષ્ટ લાગ્યો. મને આવા સંકોચમાં દૂબેલો જોઈને બાબા કાલાવાતા કરીને બોલ્યા, ‘પી.... જ પી....જ બધુંય પી....જ !’ અને મને પણ લાગ્યું કે, આવો મોકો ફરી મળવાનો નથી માટે હું બધી જ છાશ પી ગયો. મારો અનુભવ સાચો થયો. ત્યારબાદ બે જ મહિનામાં બાબાશ્રીએ પોતાની અવતારી લીલા સંકેલી લીધી. તેમજ તેમનું નિર્વાણ થયું. હવે તે છાશની તરસ છીપાવવા માટે સાઈકથાડ્યી અમૃત પીધા વીના બીજે કોઈ રસ્તો નથી. તે જ આપણો આધાર છે, અને એ જ તારણહાર છે. હેમાડપંત સાઈબાબાના શરણે આવ્યા છે. તેઓ જ જ્યારે આગળ જવાની આજા આપશે ત્યારે જ હવે પછીની કથાનું વર્ણન કરી શકશે. શ્રોતાઓએ પોતાનું લક્ષ કાયમ રાખ્યાં. (ઓ. ૧૭૫-૧૮૪)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા, ભક્ત હેમાડપંત રચિત.

શ્રી સાઈસમર્થના સત્ય ચરિત્રના ‘હંડી-વર્ણનમ્’ નામનો આડત્રીસમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



અધ્યાય ઉન્નતાનાથને અર્પણ.

આ અધ્યાયની મુખ્ય શિખામણ ગરીબોને અન્નદાન કરવાની છે. ‘પુણ્યમાં પુણ્ય એટલે અન્નદાન | આચાર ધર્મમાં તેને પ્રાધાન્ય | અગ્રગણ્ય છે અન્નદાન ||’ માટે જ બાબાએ આ વસ્તુને જાતે જ આચરણમાં મુકીને લોકોને એનો પાઠ શિખવ્યો છે.

પરંતુ આજના ચુગમાં પહેલાંના જમાનાની માફક અન્નદાન કેવી રીતે કરવું તે પ્રક્રિ થઈ પડે છે. ખુલ્લી જગ્યા મળવી રસોઈ તૈયાર કરાવવી અને યોગ્ય માણસો જમવા માટે ભેગા કરવા, વગેરે ખાસ કરીને મોટા શહેરોમાં આ મહામુરીબતનું કામ છે. મંદિરોમાં અથવા તો તીર્થક્ષેત્રોમાં જમવાનું પીરસવા માટે કે ફરાળ પીરસવા માટે પ્રયત્ન કરવા જતાં પહેલાં તો

શ્રી સાઈનું સત્ય ચિહ્ન

બિખારીઓની ખૂબાખૂમ ખેંચાખેંચ અને મારામારી એટલી હૃદ સુધી વધી જય છે કે આપણા મનમાં ગુસ્સો આવે છે અને ઉલ્ટાનો તે કાર્ય માટે તિરસ્કાર ઉત્પન્ન થાય છે. તેથી પુણ્યને બદલે પાપ જ ભાગે આવે છે. તેનાથી એ સાંચું કોઈ સંસ્થાને અન્નદાન માટે ફાળો આપવો. છતાં ધાર્યા પ્રમાણેની વ્યવસ્થા કયાં સુધી સફળ થશે તે બાબતની મનમાં શંકા થાય છે. તે સિવાય બાબાની અન્નદાન માટેની શિખામણ તેઓ જાતે રંધીને જમનારાઓને ખૂબ પ્રેમ અને આદરથી સામે બેસીને જમાડતા તેવી છે. બાબાના હાથ નીચે આટલા સારા ઉત્સુક ભક્તો હોવા છતાં અન્ન રંઘવાનું કષ બાબા જાતે કરતા હતા. ત્યારે આજની પરિસ્થિતિમાં મારા મતે અત્યંત સહેલું અને ફાયદાકારક અન્નદાન એટલે કે કોઈ અંધશાળામાં અપંગગૃહમાં અથવા અનાથાશ્રમમાં અન્ન અથવા મીઠાઈઓ જાતે જ વહેંચવી અને તે આરોગીને સંતુષ્ટ થયેતા વ્યક્તિઓના આનંદિત ચહેરા જેવા તે છે.

આ અધ્યાયમાં અન્નદાન માટેની બીજી શિખામણ અતિથિ વિષેની છે. ‘સમયસર વગર સમયે આવે અતિથી । અન્નદાન કરી એવા ગૃહસ્થિઓને સુખ આપો ।’ એ માત્ર આજના સમયમાં પાળવું શક્ય છે. ‘કોઈ ક્યારે પણ દરવાજે આવે । કર્વો ન અનાદર એનો ।’ આ વાત બરોબર ધ્યાનમાં રાખજો. કપડાં, વાસણો કે રોકડા પૈસા દાન કરતી વખતે પાત્રતાનો વિચાર કરવો પડે છે. પણ જમાડવા માટે કે ફરાળ કરાવવા માટે આપો વિચાર કરવાની જરૂર નથી. ‘અન્ન જળ વગર જે મને રાખે છે । અચુક એ દુર્ગતિને આમંત્રે છે ।’ અને આપો જ ઈશારો અધ્યાય જદુમા જેવા મળે છે -

હોયા વિના કંઈ લાગતું માગતું । કોઈ પણ ક્યાંય નથી જતું ।

મનુષ્યજ નહિ પણ પક્ષીકે પશુ । હેહે કોઈને તેથી ના કરશો ॥૧૪૧॥

કોને ખબર બાબા જાતે જ તે ઝેપે ત્યાં આવ્યા હોય તો પછી પાછળથી પ્રશ્નાતાપ કરવાનો વખત ન આવે ! ત્યારે -

આવ્યા ગયાનો આદર કરે । તરસ્યાને જળ, ભાખરી ભૂખ્યાને ।

બેસવા ઓસરી વચ્ચે વચ્ચેલીને । દેતાં શ્રીહરિ થશે ખુશ ॥૧૪૨॥

અન્નની સાથે સાથે એક વધારાની શિખામણ પ્રસાદ માટેની પણ છે. ગુરુ પોતે જ શિષ્યને કોઈ પ્રસાદિક્ષપ ચીજ ખાવા માટે આપે તો તે ખાવાલાયક છે કે નહીં, તેનો વિચાર ન કરતાં આદરપૂર્વક તેનો સ્વીકાર કરી તરત જ તેને મો મૂકવો જોઈએ -

ગુરુ જાતે પ્રસાદ આપે । અને જતજતના વિકલ્પ આવે ।

શિષ્યપામે નિજ આત્મવાત । અધઃપતને જાયે ॥

સંત કહે શિષ્યને વહેંચ । કલ્પના પણ આ અપાર ।

સંતકૃપાથી ભરપૂર ભરેલા । તેમની રીત તેમને જ અખર ॥

આજ નિયમ મને લાગે છે, દેવના પ્રસાદને માટે પણ હોવો જોઈએ. મંહિરમાં અથવા શ્રીસત્યનારાયણની પૂજનમાં સાકરિયાદાણા અથવા શિરાનો પ્રસાદ મળે તો પણ ગુરુવાર કે એકાદશી વગેરેના ઉપવાસના દિવસે અમુક લોકો તેને ખાતા નથી. તે દિવસે રાતે અથવા તો બીજે દિવસે ઉપવાસ ધૂટતા ખાઈશું એમ વિચારીને મૂકી રાખે છે. મારા મતે આ વિકલ્પ યોગ્ય લાગતો નથી. આમ વર્તતાં આપણે દેવતાનો અનાદર કરીએ છીએ. સદ્ભાગ્યે મળેલો આપો દૈવીપ્રસાદ ઉપવાસ ભાંગશે માટે આપણે તે ખાવાનો ટાળીએ છીએ. પણ જુભના ચટકા માટે બજરમાંથી જહેરાતનાં માન્ય બતાવેલો ગમે તેવો ખાદ્ય પદાર્થ સંકોચ વગર લાવીને એ દિવસે ખાઈએ છીએ, આ કંઈ યોગ્ય અને પ્રસંશનીય છે ? એ સિવાય પણ વ્યવહારની દશિએ પ્રસાદ મુકી રાખવો અને ન ખાવો તે સાંચું નથી. તેને હાથમાં પકડી રાખવો અથવા ધરે લઈ જવો કે તેને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સુરક્ષિત રાખવો તે પણ અહુચણવાનું કામ છે. પરંતુ કયારેક કયારેક ઉપવાસ ધૂટચા બાદ બે પ્રસાદ ખાવાનું ભૂલાઈ જય છે. હું પોતે તો શિરડીથી બીજી સ્થાનોએથી આવેલો પ્રસાદ શું છે તે જેવાં કરતાં લે સ્થિરમાં હોઉં એ જ સ્થિતિમાં તરત જ બાબાને વંદન કરીને કે ઇષ્ટ દેવને યાદ કરીને તે જગ્યા ઉપર જ ગ્રહણ કરું છું અને પ્રસાદનો ફૃપાનો આનંદ લૂંટ છું.

આ પહેલાં પણ અમુક અધ્યાયોમાં અન્ન વિષેની બાબાએ સારી એવી શિખામણો આપી છે, તે ટૂંકાણમાં આ પ્રમાણે છે.

(૧) અન્નનો અનાહર કરવો નહિ. ‘અન્નથી કયારેય મોહું ફેરવવું નહિ। અને પીરસેલી થાળી કયારેય ધકેલવી નહિ અ. ૩૨/૫૫ ॥’ કોઈ પણ પ્રકારના કામ માટે નીકળ્યા હો, અને જમવાનો સમય થયો હોય તો ભૂખે પેટે નીકળવું નહીં. તેમજ કોઈએ પ્રેમથી ટુકડો ભાખરી ઘરી હોય તો તેને નકારવી નહિ. ઉલ્ટાનું તેને ‘માનવું શુલ્શુકન. કાર્ય નિર્વિધન કારક ॥’ અધ્યાય ઉરમાં આ માટે બાબાને વનમાં મળેલ વણજારા વિષેનો અનુભવ તેમણે કહ્યો છે અને હેમાડપંતે અધ્યાય ઉરમાં અપાસાહેબ કુલકણી ફીકરની શોધમાં નીકળ્યા તેનું વર્ણન કર્યું છે અને તેમાં આ જ સમજબ્યું છે.

(૨) અન્ન ‘એકલું ખાવું સારું નહિ (અ. ૨૪-૨૪)’ આપણી સામે કોઈ વ્યક્તિ કે પશુ પક્ષી હોય, તો તેમને તેમાંથી થોડું અન્ન જરૂર આપવું. જે કોઈ પણ ન હોય તો બાબાનું સ્મરણ કરીને એમને અર્પણ કર્યા પછી ખાવું. આ વિષયની શિખામણ બાબાએ અધ્યાય ૨૪માં ખુદ હેમાડપંતને લીલા ચણા માટે મશકરી કરીને અને હેમાડપંતને શ્રીકૃષ્ણના સખા સુદામાનું આપ્યાન કહીને આ વાત સૌના મનમાં સારી રીતે ઠસાવી છે.

(૩) બાબા જાતે કદી ઉપવાસ કરતા નહિ અને અન્યને કરવા પણ દેતા નહિ. તેમનું કહેવું એવું હતું કે, હાથ પગ વગેરે હિન્દ્રિયો જ્યાં સુધી સશક્ત ન હોય ત્યાં સુધી ઈશ્વરની ભક્તિ થઈ શકતી નથી. ‘ના હોય જ્યાં સુધી અન્નનો ભાગ। ઈશ્વરને કઈ આંખોથી જેશો। કઈ વાચાઓ એનો મહિમા ગાશો। કચે કાને એને સાંલળશો ॥૧૨૭ અ. ૩૨॥’ ઉપવાસ કરતી વખતે ધારું કરીને આપણે આપણા શરીરને ત્રાસ આપીએ છીએ, અને અયોગ્ય અને ન પચે તેવો વધારે પડતો આહાર કે પદાર્થ ખાઈને સ્વાસ્થ્ય બગાડતા હોઈએ છીએ. ‘ઉપવાસ એટલે ઈશ્વરની સમક્ષ બેસવું.’ તેમની સામે સતત ચિંતનમાં હિવસ પસાર કરવો એવો થાય. એતો આપણે કદીએ કરતા જ નથી. માટે જ ઉપવાસના બદલામાં બાબા, ‘પુષ્ટ આહાર એ પણ ન હિતકર । મિતાહાર એ જ ખરો સુખદાઈ ॥૧૨૮॥’ આવા વ્યવહારિક ઉપદેશ કરતા. અધ્યાય ૧૮માં સંગમનેરના રાધાબાઈને અને અધ્યાય ૩૨માં ગોખલબાઈને બાબાએ આ માટે જ ઉપવાસથી દૂર રહેવા પ્રેરીત કર્યા હતાં.

(૪) માંસાહાર વિષે બાબાએ તે કદી ખાવો કે ન ખાવો એવી કોઈ ચોખ્ખી શિખામણ આપી નથી. જે લોકો પરંપરાગત ખાતા આવ્યા છે તેમણે માંસાહાર ન કરવો એવું પણ એમણે કહ્યું નથી. ઉલ્ટાનું તેમણે ગમતું જમણ તેઓ જાતે રાંધીને, તેને યોગ્ય હોય તેવાને પ્રસાદ્યે વહેંચતા હતા. કદીચિત આમાં બે કારણો હોઈ શકે. એક તો હિંદુ અને મુસલમાનોની એકતા સાધવા માટે તેમણે મુસલમાન ૩૫ ધારણ કર્યું હતું. તે વેશ માટે માંસાહાર ઉચિત જ હતો. તેમજ બીજું કારણ એટલે કે ધર્મના તત્ત્વનો ઊંડાણથી વિચાર કરીએ તો હેખાઈ આવશે કે પરમાર્થ સાધવા માટે માંસાહાર ન કરવો, એ એક સાધના છે. પણ તે અંતિમ દ્યેય નથી. વેદોમાં પણ સારા બોધદ્ધી સુચનાનો વિશ્વામિત્ર જેવા ઋષીએ જ કર્યા છે. જનક રાજ જેવા સંસારી અને મહાન બ્રહ્મજ્ઞાની તરીકે પ્રસિદ્ધ પામેલા એક ક્ષત્રિય રાજ હતા. તેમને માંસાહાર વજર્ય ન હતો. પોતાના સુખ ખાતર અન્ય પ્રાણીની હત્યા ન કરવી. આ અહિંસાના તત્ત્વ ખાતર અને માંસાહારને લીધે રજેગુણ અને તમોગુણ વધી જતાં એકાગ્રતા સાધવામાં અહુચણો ઊભી થાય છે. માટે પરમાર્થના માર્ગને શાકાહાર કરવો એ જ ઉચિત ગણવામાં આવ્યું છે. પણ તેના વીના મોક્ષ પ્રાપ્ત થતો નથી. એવું કહેવું અથવા તો માંસાહાર કરનારને અપવિત્ર કે નકારો માનવો તે પણ બરાબર નથી. નહિ તો મહંમદ પૈગંબર જેવા અને ઈશુ જેવા મહાન સંતો બીજન ધર્મોમાં

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કે જ્યાં માંસાહાર પ્રચલિત છે, ત્યાં પેદા જ ન થયા હોત. તે સિવાય પણ આપણા ભારતમાં જે જલતિઓ અને જનસમુહમાં માસાહારને નિષેધ માનવામાં આવે છે તે પણ અહિસાનું તત્ત્વ પાળવા ખાતર રજેગુણ કે તમોગુણ વધે નહિ તે માટે થોડું હોય છે ? આ એક સમુહ શાકાહારી છે, તે એક પરંપરા અને ઝદ્દિને કારણે શાકાહારી છે. તેમને માંસાહાર કદી ચોખ્યો નથી, એટલે એવા પ્રત્યે તેમને ઘૃણા હોય છે બસ એટલું જ આજકાલ તેમાંના ઘણાં ખરાં તરુણ તરુણીઓને માંસાહારનો ચટકો લાગ્યો હોઈ હોટલમાં જઈને ખાવા લાગ્યાં છે. તેવી જ રીતે સમાજ પોતાને શાકાહારી કહેવડાવે છે તેમના ખાવામાં આબત્તાં ભરચ્યાં, મસાલા, તળેલા પદાર્થો, માલવાની મીઠાઈઓ, લાટુ, શ્રીઅંડ વગેરે જેવા પકવાનો પણ રજેગુણ અને તમોગુણ વધારનારા અને પરમાર્થ સાધનામાં અંતરાયો ઊભા કરનારા તો ખરાં જ.

ખરું જેતા તો આધ્યાત્મમાં જેમ જેમ પ્રગતિ થતી જય છે, તેમ તેમ માંસાહાર કે પકવાનોની લાલસા આપોઆપ ઓછી થઈ જય છે. અને થોડા સમય પછી તે કાયમ માટે બંધ થઈ જય છે. ગળામાં તુલસીની માળા માત્ર પહેરવાથી અને માંસ ઈંડા વગેરે છોડી દેવાથી અથવા પરંપરા પ્રમાણે આપણાથી ન ખવાય તેવું ન ખાવાથી પરમાર્થમાં શ્રેષ્ઠતા આવે છે એવું પણ નથી. માંસાહાર છોડીને પણ એ પદાર્થો રંઘેલા નજરે પડતા મોઢામાં પાણી છૂટે, અથવા તો પશુ પક્ષીઓને હુદુક કરીને લાકડી મારીએ તો શાકાહાર સ્વીકાર્યો વ્યર્થ નથી કે ?

બાબાના વિચારો મોટા ભાગે આવા જ હોવા જેઈએ, માટે જ તેમણે કોઈને પણ માંસાહાર છોડવા કયારેય ઉપદેશ કર્યો નથી. ત્યારે ગમ્મત ખાતર આ જ અધ્યાયમાં ઉપર વર્ણવ્યા પ્રમાણે દાદા કેળકર જેવા આચાર વિચાર સંપત્ત બ્રાહ્મણને એકાદશીના દિવસે બજ્જરમાંથી માંસ લાવવા માટે બાબાનું કહેવું અને પરીક્ષા લેવા માટે અધ્યાય રઉમાં વર્ણન કર્યા પ્રમાણે કાકાસાહેબ દીક્ષિત જેવા શુદ્ધ બ્રાહ્મણ શિષ્યને બકરાની હત્યા કરવાની આજા આપી પરંતુ તે કાર્ય શરૂ થતાં પહેલાં જ બાબાએ તમે તે રોકી લીધા હતા. તેમજ જેમની જલતિમાં ધર્મમાં શાકાહાર જ ઝદ્દ થઈ ગયો હતો એવાઓને બાબાએ કદાપિ માંસાહાર ખાવા ઉત્સેહિત પણ કર્યા નથી. પોતાના ભક્તોને માંસાહારથી દૂર કરવાની બાબાની રીત કંઈ અલગ જ હતી. માટે જ તેમનો વારંવાર એક જ ઉપદેશ રહેતો કે, પ્રત્યેક પ્રાણીમાં તેઓ જલતે જ વસેલા છે.

કદી હું શાન કદી હું દુક્કર । કદી હું ગાય કદી બિલાડી ।

કયારેક કીડી, માણી કે જળચર । એવે ઝેપે વિચું હું ॥૧૨૬॥

ભૂતમાત્રમાં મને જે જુએ । મારો પ્રીતપાત્ર તે જ જણાજે ।

માટે તજ લેદુભુદ્ધિને । ભજ મને તું આ રીતે ॥૧૩૦॥

આવી દષ્ટિ અને ભાવના દઢ થતાં કોણ પ્રાણીની હત્યા કરીને તેનું માંસ ખાવાની ઈરછા રાખશે ? માંસાહાર આપોઆપ છૂટશે કે નહીં ?

(૫) જે વાત માંસાહારની તે જ વાત કાંદાની. બાબા જલતે કાંદો અને ભાખરી જ ખાતા હતા. પણ બીજાઓને તે તિરસ્કાર બતાવવો કે દુર્ગધને લીધે ખાવા માટે વજ્ઞ ગણવો તે તેમને પસંદ ન હતું. દાદા કેળકર, દાસગણું અને કુશાભાઉ-કૃષ્ણાજી કારીનાથ જેખી વગેરે ભક્તોની કાંદા ઉપરથી મશકરી કરી હતી. તેવી જ રીતે એક યોગ અભ્યાસીને પોતે કાંદો અને ભાખરી ખાય છે, જણાવીને પોતાના અગાધ યોગ સામર્થ્યથી ચક્કિત કર્યો હતો. જાણો કે બાબા લોકોને કહેવા માગતા હતા. કે, પરંપરાને કારણે અને ખોટી કલ્પનાઓને કારણે તમે કાંદા અને લસણ જેવા આયુર્વેદ જેની પ્રશંસા કરી છે એવા શક્તિ અને આરોગ્ય આપનાર સ્વસ્થ અને સહજ મળનારા આજ્ઞ તરફ પૂછ ફેરવી રહ્યા છો. તે કેટલું સાચું છે ? ગરીબ અને મહેનતું એફૂતો કાંદો અને ભાખરી ખાઈને જ આટલાં બધાં મહેનતનાં કામ કરતા હોય છે. કોઈ વ્યક્તિ વાઈના રોગથી બેશુદ્ધ થઈને પડી જય તો આપણે તેને કાંદો સૂંઘાડીએ છીએ. પશ્ચિમના દેશમાં લસણ એ હદ્યરોગ પર અને લોહીના

શ્રી સાઈનું સત્ય ચટિત્ર

દુબાળ ઉપર એક ગુણકારી ઔષધ છે એવી શોધ થતાં જે તે દરેક જજણ લસણનાં ચુક્તની મૌંધી ગોળીઓ (Lasona) વેચાતી લઈને ખાવા લાગ્યા નથી કે ?

આ અધ્યાયની બીજી ભલ્લાંખની શિખામણ, સર્વ દેવ સમાન છે તે અંગે છે. શિરડીમાં સાઈબાબાના દર્શન માટે જવાની ઉતાવળ હતી, માટે પોતાના સાઢુ બિનીવાલાને રસ્તામાં આવતા દત્તમંહિરમાં ભગવાન દત્તાત્રયનાં દર્શન માટે ઉત્તરવા ન દીધો તે વિષે નાનાસાહેબ ચાંદોરકર ઉપર બાબા રોષે ભરાયા હતા. તે આ જ શિખામણ આપવા માટે જ ગુસ્સે થયા હતા. બાબાનું કહેવું એવું હતું કે સર્વ દેવતાઓ એક જ છે પણ લોકો તેમને જુદાં જુદાં નામથી બોલાવે છે. ‘એકં સદ વિદ્રા બહુધા વદન્તિ’ અગ્રવેદ ૧/૧૬૪/૪૬ માટે બીજી દેવોનું અપમાન ક્યારેય ન કરવું. અધ્યાય ૨૮માં મેધો બાબાની પૂજન કરવા માટે દ્વારકામાટીમાં આવ્યો ત્યારે ખંડોબાના મંહિરના દરવાજાન બંધ હતા, માટે તે પૂજન છોડીને આવ્યો હતો. તે વખતે બાબાએ તેને હવે દરવાજે ખુલ્લો છે એવું કહીને પૂજન કરવા માટે પાછો મોકલી આપ્યો હતો અને તે બાદ જ પોતાની પૂજન કરવા દીધી હતી. એ ઉપદેશ બાબાનો હંમેશાને માટેનો રહેતો -

રામ અને રહીમ એક । ના કંઈ બેમાં ફરૂક ।
તો ભક્તિમાં જ શા માટે હઠ । અને કુસંપ શા માટે ॥૫૦॥
તમો બાળકો કેવાં મૂઢ । હિંદુ-યવન બાંધો સંપ-ગંઠ ।
થાવ દઠ વિચારે રૂઢ । તો જ પામશો પેલે પાર ॥૫૧॥

રતનજી જેવા પારસી ભક્તને પણ તેમણે પોતાના કરી લીધા અને પ્રિસ્તી ધર્મ માટે તેમની શિખામણો આદરણીય હતી. તેમની હૃથીતીમાં ચક્ષનારાયણ નામના એક પ્રિસ્તી ફોજદારની રાહતના મુકામે નિમણૂક થઈ હતી. એ સાંભળીને એમના નિકટવતી હિન્દુ ભક્તે કહ્યું હતું કે, બાબા રાહતામાં એક પ્રિસ્તી ફોજદાર આવ્યો છે. ‘તો શું થયું એ તો મારો ભાઈ છે.’ આવું કહીને તેને બોલતો બંધ કરી દીધો હતો.

આ પ્રકારે આ અધ્યાયમાં અન્નદાન અને સર્વ દેવોની સમાનતા અને સર્વ ધર્મની સમાનતા એ વિષય ઉપર બાબાએ અત્યંત મૂલ્યવાન શિખામણો આપણાને આપી છે.



॥ અદ્યાય ૩૮ ॥

ગીતા વિશિષ્ટ શ્લોક અર્�નિવેદનં તથા સમાધિમંહિર નિર્માણમ्

(શ્રીમદ્ ભગવદ ગીતાના ચોથા અધ્યાયના ચોતીસમા શ્લોકનો અર્થ કહેવો અને સમાધિ મંહિર બાંધવાની શરૂઆત)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

ધન્ય ધન્ય એ શિરડી સ્થાન, ધન્ય એ દ્વારકામાઈ જેખું પવિત્ર ભુવન જ્યાં તે પુણ્યવાન અને પવિત્ર શ્રીસાઈનાથ મહારાજ દેહત્યાગ સુધી ફર્યા. ધન્ય તે શિરડીના લોકો કે જેમને માટે બાબાએ આટલે દૂરથી કોઈ પણ કારણસર આવીને તેમને ઋણી બનાવ્યા. શિરડી તો મૂળમાં એક નાનું ગામદું હતું. પણ સાઈબાબાના સહ્યવાસમાં આવ્યા બાદ તેની મહત્ત્વા વધી ગઈ. શ્રીસાઈબાબાનાં ચરણોને કારણે તે પાવન બની ગયું. બાબાના વસવાઠથી શિરડીને એક તીર્થસ્થળનું સ્વરૂપ પ્રાપ્ત થયું. તે શિરડીની સ્ત્રીઓ પણ ધન્ય અને તેમની અનન્ય શ્રદ્ધાને પણ ધન્ય. સ્નાન કરતી વખતે, દળતી વખતે, ધાન્ય ખાંડતાં તેઓ અસામાન્ય એવા સાઈનાં જ ગીતો ગાતી હતી. ધન્ય ધન્ય તેમનો નિર્ઝપાપ પવિત્ર પ્રેમ. તેમનાં ગીતો અતિ ઉત્તમ હતાં. તેમાંના કંઈ ઉત્કૃષ્ટ ગીતો સાંભળવાથી મનને અપાર શાંતિ ભણતી. મનને આવી શાંતિ આપનારાં તે ગીતો શ્રોતાઓને પોતાની લુજાસા તૃપ્ત કરવા માટે યોગ્ય સમયે આ કથાના અનુસંધાનમાં હું કહીશા. (ઓ. ૧-૬)

શ્રી સાઈબાબા પહેલાંના નિર્જામ રાજ્યના ઔરંગાબાદ તરફ જવાના રસ્તાને અડીને આવેલા એક આંખાના વૃક્ષ નીચે પ્રગટ થયા અને ધૂપખેડાની લઘ્નની જન સાથે શિરડીમાં અચાનક આવ્યા હતા. આ ફૃષ્ટીપ્રધાન ગામડાના પુણ્યવાન ચાંદપાટીલ નામના ગૃહસ્થના હાથે આ ખજનો શિરડી ગામને મળ્યો. તેમના હિસાબે જ બીજી બધાઓને શ્રીસાઈના અતિ પવિત્ર એવા દર્શનનો લહાવો મળ્યો. તે પાટીલની ઘોડી કેવી રીતે ખોવાઈ હતી અને સાઈબાબાએ તેની ભાજ કેવી રીતે કાઢી તથા ચાંદપાટીલને તેની ખુશીમાં ચલમ કેવી રીતે પીવડાવી અને ઘોડી કેવી રીતે પાછી મળી તેમજ ચાંદબાઈનાં પત્નીનો ભત્રિને લઘ્નની ઉભરનો હતો, અને તેને શિરડીની કન્યાનો યોગ થયો અને લઘ્નની જન છોકરીના ગામે શિરડી કેવી રીતે આવી વગેરે સંપૂર્ણ કથા શ્રોતાઓ માટે પહેલાં કહેવામાં આવી છે. હમણાં તે વાત પ્રસંગ અનુસાર યાદ આવી છતાં તેને ફરીથી દહોરાવવાનો મારો કોઈ ઈરાદો નથી. ચાંદીપાટીલ તો માત્ર એક નિભિત હતા. બાબાએ તો પોતાના ભક્તોના ઉદ્ધારની ફિકરના કારણે અવતાર લીધો હતો અને શિરડીમાં પદ્ધાર્યા હતા. આ સાઈબાબા સિવાય મંદબુદ્ધિના, મૂર્ખ તથા હલકા શૂદ્ધના, દીનબંધુઓના વ્રત, તપ અને ભોગી એવી જે પ્રજનો ઉદ્ધાર કરો શકે ? અદાર વર્ષ જેવી નાની ઉભરે છતાં બાબાને એકાંતમાં રહેવાની આદત હતી. આવા ભેંકાર અને નિર્જન સ્થળે તે રાત્રીના સૂતા હતા. તેમને કોઈ ભય જ ન હતો. કારણ કે તેમના મતે દ્વેરક સ્થળે અને દ્વેરક વસ્તુમાં પરમેશ્વર જ વ્યાપેલો દેખાતો હતો. જ્યાં પહેલાં એક જમાનામાં મોટો ખાડો હતો અને તેનો ઉપયોગ ગામવાસીઓ ઉકરડા તરીકે કરતા હતા તે જ જગ્યા એ દિવસ દરમ્યાન ચારે બાજુએ ફરીને તે રાત્રે સૂવા માટે આવતા હતા. આવી રીતે અનેકો વર્ષ વિત્યાં અને તે જ ખાડાનો ઉદ્ય થયો. એ જ ખાડાવાળી જગ્યામાં આ દીનદયાળુ દીનોના નાથ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

શ્રી સાઈનાથનો ભવ્ય વાડો થયો અને એ ખાડાના જ મધ્ય ભાગના ગર્ભમાં તેમના દેહના વિસામાની કાયમી જગ્યા થઈ. ત્યાં તેમનું સદાને માટે રહેવાનું ડેકાણું બન્યું જયાં આજે વિરાટ સમાધિ મંહિર સ્થાપયું અને આજના અનેકો શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્થાન બની ગયું. (ઓ. ૭-૧૭)

શરણે આવેલાઓ ઉપર પ્રેમ કરવા માટે, શ્રી સાઈસમર્થે અતિશાય અધરા અને સંસાર સાગરના કઠીન માર્ગ પાર કરાવવા માટે પોતાની ચરિત્રપી નૌકા ભક્તજગ્નોના કલ્યાણઅર્થે નિર્માણ કરી. આ સંસાર સાગર પાર ઉતારવો ધણો જ કઠીન છે અને આ આપણો ભક્ત પરિવાર તો અંધ અને પાંગળો છે. તે કેવી રીતે પાર કરી શકવાનો છે? તે જ મોટી મૂંજવણ બાબાના મનમાં સદાય રહેતી. સંસારપી સાગર પાર કરી જાણવો એ તો દરેકને માટે આવશ્યક છે. અને તેને માટે પહેલાં અંત:કરણ શુદ્ધ થવું જેઠાં. ચિત્તશુદ્ધ જ ભવસાગરને પાર કરવાનું મુખ્ય સાધન છે. તેને માટે ઇશ્વરની ભક્તિ સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. ગુરુક્થા સાંભળવા જેવી બીજી કોઈ ભક્તિ નથી. તેનાથી ગુરુનાં ચરણોની સહાય મળે છે. બુદ્ધિ શુદ્ધ અને નિર્મણ થાય છે. તેમજ એ રસ્તે જ, પછી આગળ ઉપર પરમાર્થ સાધી શકાય છે. (ઓ. ૧૮-૨૧)

શ્રી સાઈબાબાની કથાઓ તો અસંખ્ય છે. દરેક જે કહેવા બેસું તો તેનો પાર જ આવવાનો નથી. જે હું થોડામાં જ પતાવવા માંગું તો પણ હું ફાવી શકવાનો નથી. શ્રોતાઓનો જેમ જેમ સાંભળવાની ઉત્સુકતા વધતી જય છે. તેમ તેમ વક્તાની વર્ણનશક્તિ પણ વધતી જય છે. આવી રીતે આપણે એક બીજાની હોંશ પૂર્ણ કરી લઈએ અને પોતાનું કલ્યાણ સાધી લઈએ. અહીં સાઈમહારાજ એક નાવિક છે અને અત્યંત ધ્યાનપૂર્વક સાંભળવું તે તરાપો છે. કથાશ્રવણ તરફ જે શ્રદ્ધા અને આદર હશે તેમજ નાવડી અને નાવિક ઉપર જે આટલ વિશ્વાસ હશે તો આ ભવસાગરને સામે કિનારે પહોંચવામાં જરા પણ વાર લાગશે નહિ. (ઓ. ૨૨-૨૪)

પાછળના અધ્યાયમાં હંડીનું સંસ્કૃતપણે વર્ણન થયું, અને એક ભક્તની હત્થભક્તિ પાકી થઈ, તેમજ ભક્તોને નૈવેદ્ય ખવડાવીને સંતુષ્ટ કરવાનું વર્ણન પણ થયું. દરેક અધ્યાયના અંતમાં આગલા અધ્યાયના વિષયની સૂચના લખવાની પદ્ધતિ અહીંથાં સુધી હતી, તે બધાને ખરબ છે. પણ પાછલો અધ્યાય પૂરો થવાના સમયે આગળની કથાની યાદ રહી નહીં. શ્રી બાબા જે કાંઈ વિષય યાદ કરાવે છે તેનું જ વર્ણન કરી શકાય છે. એવી મેં સ્પષ્ટ ઘોષણા કરી હતી. અને તે જ પ્રમાણે સાઈબાબાની કૃપાથી હવે જે યાદ આવ્યું છે તે જ શ્રોતાઓ માટે હું રંજૂ કરી રહ્યો છું. શ્રોતાઓને મારી નમ્ર વિનંતી છે કે વિદ્ધનોને દૂર ખ્યેલી શાંત ચિસે અહીં ધ્યાન આપવું. મનને આનંદ થશે. (ઓ. ૨૫-૨૮)

એક વખત નાનાસાહેબ ચાંદોસ્કર મસ્નિદ્વારાં બેસીને બાબાના ચરણકમળની સેવા કરી રહ્યા હતા. તેમજ મુખેથી ગીતાનો કોઈ શ્લોક ધીમેથી ગળગણતા હતા. ભગવદ્ગીતાના ચોથા અધ્યાયનું રટણ જુબ દ્વારા થતું હતું. જ્યારે તેઓ બાબાના ચરણની સેવા કરતા હતા, ત્યારે શું બન્યું તે સાંભળો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણો કાળનું જ્ઞાન ધરાવનારા શ્રીસાઈમહારાજના મનમાં આવ્યું કે, આ નાનાને ગીતાનો અધ્યાય બરાબર સમજની દેવો જેઠાં. જ્ઞાન, કર્મસંન્યાસ અને બ્રહ્મપાર્થણી બાબતમાં બોધ આપનારા આ ચોથા અધ્યાયને મો વડે બોતલવાનો જેથી નાનાએ કરેલાં અસ્પષ્ટ ઉચ્ચારણો દૂર કરી શકાય માટે બાબાએ પોતાનો પ્રશ્ન ઉંલલવા ખાતર તેને કારણભૂત કર્યો. ‘કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાયતે’ અર્જુન! બધાં જ કર્મોનો અંત જ્ઞાનમાં જ થતો હોય છે. આ તેત્રીસમ્ભો શ્લોક પૂરો થતાં ‘તદ્વિદ્ધ પ્રણિપાતેન’ આ ચોત્રીસમ્ભો શ્લોક શરૂ થયો. જેવો ચોત્રીસમ્ભો શ્લોક નાનાએ બોતલવાનો શરૂ કર્યો ત્યાં જ એ કરેલા પઠને વિશ્રાંતિ મળી ગઈ. તે સમયે બાબાના મનમાં પ્રશ્ન પૂછવાની અને ઉપદેશ કરવાની જરૂર જણાઈ. બાબા બોત્યા, ‘નાના! શું ગળગણતી રહ્યો છે? જે ધીમે ધીમેથી ગાઈ રહ્યો છે, તે સ્પષ્ટ રીતે ખુલ્લા દિલથી બોલ. જે તારા

શ્રી સાઈનું સત્ય ચાટિત્ર

મોમાં બોલી રહ્યો છે તે મને સારી રીતે સાંભળવા હેને !' બાબાએ બોલવાનું કહેતાની સાથે જ તેમણે આજાનું પ્રમાણ સમજુને તે શ્લોકનાં ચારે ચરણો ફરી પાછાં બોલી સંભળાવ્યા. બાબાશ્રીએ એનો અર્થ કરીને સમજલવવા માટે કહ્યું. તે સાંભળતા નાનાએ અતિશય નમૃતાપૂર્વક હાથ જેડીને આનંદિત મનથી મધુરવાણીમાં જવાબ આપ્યો અને ભગવાન શ્રીકૃષ્ણના મનની વાત સ્પષ્ટ કરી. (ઓ. ૩૦-૩૮)

હવે આ બાબાશ્રી અને સ્વ. નાનાસાહેબ ચાંદોરકના સંવાદો બધાને વ્યવસ્થિત રીતે સમજલય માટે ભગવદ ગીતાના મૂળ શ્લોકનો શબ્દે શબ્દને છૂટો પાડીને અર્થ કરીએ. પ્રશ્નોનો મર્મ જાણવા માટે, તેમજ સંતોનાં મનની ગહેરાઈ સમજવા માટે એવું લાગે છે કે આવી જ શરૂઆત કરવી જેઠાં જેને કારણે શ્લોકનો અર્થ એકદમ સારી રીતે સમજલય. આમ પણ સંસ્કૃત ભાષા સમજવા માટે અધરી છે. તે સાઇબાબાને સુગમ કેવી રીતે થઈ ? અને તે સિવાય પણ પેલો પ્રશ્ન પણ એકદમ એ વિષયને અનુસરીને જ હતો. આજુભાજમાં બેઠેલા લોકો આશ્વર્ય પામી કહેવા લાગ્યા કે, 'સાચે સાચ સંતોના જ્ઞાનની મર્યાદા ન સમજ શકાય તેવી હોય છે. સાઇબાબાએ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરારે કર્યો અને ગીતા કરારે વાંચી કે જેને હિસાબે તેઓ ગીતાના અર્થનો મર્મ જાણનારા વિદ્ધાનની માફક પ્રશ્ન પૂછી રહ્યા છે ?' શ્રોતાઓના સમાધાન માટે અને તેમને તે મૂળ શ્લોકની કલ્પના આવે માટે તથા ચચ્ચામાં મહદૃદ્યપ થાય એમ ધારીને ભગવાન શ્રીકૃષ્ણનાં વચ્ચનો હું નીચે આપું છું -

તદ્વિલ્લ પ્રણિપાતેન, પરિપ્રક્ષેન સેવયા ।

ઉપેદેશંતિતેજાનં, જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ ॥અ.૪ શ્લોક ૩૪॥

આ ગીતાનો મૂળ શ્લોક છે. ટીકા કરનાર પુષ્કળ થઈ ગયા અને તેમના મત પ્રમાણે આ શ્લોકનો અર્થ જેવા જઈએ તો બધાનો લગભગ એક જ અર્થ નીકળે છે. નાના પણ ખૂબ જ મોટા ભાણોલા ગણોલા વિદ્ધાન હતા અને સારું એવું વાયન ઘરાવતા હતા. ગીતા ઉપર દીર્ઘ અભ્યાસ કરીને પારંગત બન્યા હતા. તેઓ વિવિધ લખાણોમાં આપેલા આ શ્લોકના દરેક દ્વારા શબ્દનો અર્થ છૂટો પાડીને કહેવા લાગ્યા. અતિશય વિનયપૂર્વક અને નમૃતાથી અને મધુરવાણીમાં શ્લોકના પદના શબ્દો ગધમાં ગોઠવી અર્થ ધ્યાનમાં લઈને તેઓ સમજલવવા માટે તૈયાર થયા. તેઓ બોલ્યા, 'ગુરુ ચરણમાં જે દંડવત્ થઈને નમસ્કાર કરે છે, ગુરુની સેવા કરતાં જે પોતાનો પ્રાણ પણ ત્યાગવા માટે તૈયાર હોય છે અને ગુરુને જ આદરપૂર્વક પ્રશ્ન પૂછે છે તેને જ જ્ઞાનીજનો અથવા તત્ત્વવેત્તાઓ જ્ઞાનના અર્થ સાથે ઉપેદેશ કરે છે. સારાંશ કે ભગવાન શ્રીકૃષ્ણે પ્રેમથી અર્જુનને જે કહ્યું તે આ જ.' હે અર્જુન ! ગુરુસેવા અને ગુરુવંદન એ જ જ્ઞાન પ્રાપ્તી કરવાનું છે. તું આ માર્ગે જ્યારે જઈશ ત્યારે તત્ત્વ જાણનાર અને આત્મદર્શન પામેલા જ્ઞાનીજનો તને જ્ઞાનનો માર્ગ બતાવશે.' બાબા ! એ જ અર્થ હું જાણું છું. શંકરાચાર્ય, આનંદગિરી, શંકરાનંદ, શ્રીધર, મધુસુદન અને નીલકંઠ જેવા બધાએ પોતાના વિવરણમાં શ્રીકૃષ્ણના ઉપેદેશનો આવો જ અર્થ કહી સંભળાવ્યો છે. (ઓ. ૩૮-૪૦)

પહેલાં બે ચરણનો અર્થ સાઇસમર્થે માન્ય રાખો. પણ બીજ અડધા શ્લોકની ચર્ચા કરતાં બાબાએ શો અભિગ્રાય આપ્યો તે હવે જેઠાં. તે સમયે ચકોરઝીપી બીજ ભક્તગણો પણ સાઇમુખ ચંદ્ર તરફ ધ્યાન આપીને, આ અમૃત વચ્ચનોનું સેવન કરવા માટે પોતાની જગ્યાએ બેસી રહ્યો હતા. બાબા બોલ્યા, 'નાના ! શ્લોકનું ત્રીજું ચરણ પૂર્ણપણે ધ્યાનમાં લે. જ્ઞાન શબ્દની પાછળ અવ્રગહ-'અ' નો લોપ બતાવનારું 'ડ' ચિહ્ન લગાડ અને પછી એ ચરણનો અર્થ કર. હું કાંઈ વિપરિત થોડું કહી રહ્યો છું, કે અર્થનો અનર્થ કરી રહ્યો છું, પહેલાના આલોચના કરનારાઓનો મત ખોટો છે એવું પણ હું કહેતો નથી. જ્ઞાની અને તત્ત્વ સમજનારાઓ, 'જ્ઞાનનો જ ઉપેદેશ કરશે.' એવું જ્યાં તું કહે છે ત્યાં, 'અજ્ઞાનનો ઉપેદેશ કરશે,' એવો શબ્દ જોડ એટલે તેનો ખરો અર્થ સમજશે. જ્ઞાન એ બોલવાનો વિષય નથી. તેને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ફક્ત અનુભવવાનું જ હોય છે. તો પછી એનો ઉપદેશ કેવી રીતે કરી શકાય? માટે જ્ઞાન શબ્દનો વિરોધી શબ્દ લે અને પછી જ તેનો અનુભવ કર. તારા આ, ‘જ્ઞાન’ શબ્દની જગ્યાએ ‘અજ્ઞાન’ શબ્દનો જે અર્થ લેવામાં આવે તો શું બગડવાનું છે? ‘અજ્ઞાન’ તે વાણીનો વિષય હોઈ શકે છે. પણ ‘જ્ઞાન’ તો શબ્દની પેલે પારનો છે. જે પ્રમાણે નાળ ગર્ભને વીટળાયેલી હોય છે અને જે મેલ અરિસાને અથવા તો રાખ અનિને ઢાંકી દે છે એ જ પ્રમાણે અજ્ઞાન જ્ઞાનને ઢાંકી દે છે. જ્ઞાન હુંમેશા અજ્ઞાનથી ઘેરાયેલું રહે છે. એવું શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે અજ્ઞાનેનાવૃત્તં જ્ઞાનં તેન મુદ્યતિ જન્તવઃ ॥અ. પ શ્લો. ૧૫॥ અજ્ઞાન ચાલ્યુ જય એટલે જ્ઞાન તેની મેળે જ પ્રકાશિત થાય છે. જ્ઞાન એ સ્વયંભ પ્રકાશિત છે. પણ સેવાણથી ઢાયેલા શુદ્ધ પાણી જેવું છે. આ સેવાણને જે સમજુ માણસ બાજુએ સરકાવી શકે છે તેને જ શુદ્ધ પાણીનો લાભ મળે છે. જેવી રીતે સૂર્ય અને ચંદ્રના ગ્રહણ વખતે સૂર્ય અને ચંદ્ર બંને પ્રકાશમાન જ હોય છે. પણ રાહુ અને કેતુ જેવી છાયા વર્ચ્યે આવીને તેની દર્શિનો અવરોધ કરે છે. સૂર્યને કે ચંદ્રને આને કારણે કાંઈ ફરક પડતો નથી, પણ અમારી દશ્ટિમાં જ વાંધો ઊભો થાય છે. બસ તેવી રીતે જ્ઞાન પણ પોતાની જગ્યા પર સ્વયંસિદ્ધ, સુરક્ષિત અને કોઈપણ પ્રકારની અહચણ વગરનું છે. આંખો જે જુએ છે તે જેવાની શક્તિ એ જ્ઞાન, અને એની ઉપરનું પદ એટલે અજ્ઞાન છે જેને અવશ્ય દૂર કરવું જેઠાએ. એ આચાદનને પોતાના હાથના કૌશલ્યથી દૂર કરો અને અજ્ઞાનદ્વી અંધકારને ખસેડીને તેને જેવાની શક્તિ પ્રગટ કરો.’ (ઓ. પર-૬૬)

‘નજરે પડે છે તે બધુંજ કે જેનું વર્ણન કરવું અધ્યનું છે તે બધો માયાનો જ ખેલ છે. તે જ અનાદિ અજ્ઞાનનું એટલે કે માયાનું પ્રકાશિત થવું તે આ જ છે. જ્ઞાન તે વસ્તુ જ્ઞાનવા યોગ્ય છે. એ ઉપદેશનો વિષય થઈ શકે નહીં. ‘પ્રણિપાત’ એટલે સાણંગ નમસ્કાર કરવા, પરિપ્રક્ષ એટલે ફરી ફરીને પ્રક્ષ પૂછવા અને સેવા તે ગુરુની કૃપા મેળવવાનાં સાધનો છે. અનું માનો તો આ જ મોટી જગતની ગેરસમજ છે અને તે જ જ્ઞાન ઉપરના અંધકારદ્વીપી આચાદનો છે જે સૌથી પહેલા દૂર થવાં જેઠાએ, જેથી શ્રેષ્ઠ જ્ઞાનદ્વીપી અદ્ભૂત વસ્તુ-ભ્રમ પ્રગટ થશે. અજ્ઞાન જ સંસારનાં દુઃખનું મૂળ કારણ છે. ગુરુકૃપાનું કાજળ આંખમાં લાગતા વેત માયાનાં આવરણો દૂર ભાગી જય છે. અને સ્વાભાવિક જ્ઞાન શેષ વધે છે. જ્ઞાન તે સંપાદન કરવાનું નથી હોતું. એ તો મેળવવા યોગ્ય છે જે આપણે માટે પોતે જ રાહ જેતું ઊભું રહેલું છે. જ્ઞાનને અજ્ઞાનનો અવરોધ હોય છે. તેનું નિરાકરણ થતાં જ પૂર્ણ જ્ઞાન બાકી રહે છે. દોરડાની જગ્યાએ સાપનો ભાસ થથો તે જ દોરડાના શુદ્ધ સ્વરૂપનું અજ્ઞાન છે. સાચા સ્વરૂપના જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય છે અને દોરડાનું જ્ઞાન થાય છે. અંદર સોનું હોય અને ઉપર કાટ દ્વીપી કચરો હોય છે. કચરાથી ઢાયેલા સોનાનો પોતાનો ઝગમગાટ હોય છે. પણ તેને અન્નિ પરીક્ષાની આવશ્યકતા છે. તેવી જ રીતે જ્ઞાન પ્રગટ થવા માટે આંખમાં અંજન લગાડનાર ગુરુની જ આવશ્યકતા હોય છે.’ (ઓ. ૬૬-૭૩)

‘દેહ જગ્નમનું કારણ જ માયા છે અને દેહની હીલચાલ અને વર્તન નસીબ ઉપર અવલંબિત છે. બધાં જ દુંદ્રો જે મેલ સુખ દુઃખ, વિનય પરાજ્ય, લાભ હાનિ વરોરે પણ નસીબ ઉપર અવલંબિત છે. પોતાના શરીર પ્રત્યેની આસક્તિ હોવી એટલે જ અજ્ઞાન એમ થાય છે. માટે જેને દેહનું અભિમાન જ નથી હોતું તેમને સુખ કે દુઃખનું ભાન થતું નથી. હું એક શરીર છું એવું મનમાંથી નીકળી જતાં અહંકાર ઓગળી જઈને અજ્ઞાનનો નાશ થાય છે. પોતાના ખરાં સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે માયાનો અથવા તો શરીર ઉપરના મોહનો જગ્નમ થાય છે. ગુરુકૃપાને લીધે માયાનું નિરાકરણ થતાં આપણા ખરા સ્વરૂપનું જ્ઞાન સ્વાભાવિકપણે થઈ જતું હોય છે. એક ભગવદ ભક્તિ સિવાય બીજુ સાધનાનો કંટાળો શા માટે આવે છે? ભ્રમા ખુદ માયાને આધીન છે અને તેમને પણ ભક્તિના જ પ્રતાપે માયાથી છૂટકારો મળે છે. ભ્રમલોકની પ્રાપ્તિ થાય છતાં ભક્તિ સિવાય મુક્તિ નથી. અને ત્યાં પણ ઈશ્વર ભક્તિમાં જે બાધા પડે તો મનુષ્ય

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પુનર્જન્મના ચક્કરમાં પડી જય છે. માટે માયાનું નિવારણ કરવા માટે ઈશ્વરનું ભજન એક માત્ર ઉપાય છે. ઈશ્વરના ભક્તનું પતન થતું નથી, અને સંસારનાં બંધનો પણ નથી હોતાં. લોક કહે છે કે માયા ઠગારી છે. તે સાચી નથી, અંતે જદુ ટોણા પણ કરનારી છે, અને જ્ઞાનીઓને પણ ક્ષાણે ક્ષાણે ફસાવે છે. પરંતુ એક ખરો ભક્ત તેને ચપટીના તાલે સહેલાથી નચાવે છે. જ્યાં મોટા મોટા જ્ઞાની વિદ્ધાનો ફસાઈ જય છે. ત્યાં અશિક્ષિત અને અભાજી ભાવિકો ટકી જય છે. તેનું કારણ એ કે તેઓ સદાને માટે હરિચરણે શરણે ગયેલા હોય છે. જ્યારે વિદ્ધાન જ્ઞાનીઓ પોતાના જ્ઞાનનું મિથ્યા અભિમાન હોય છે. માટે જ માયાને પાર કરી જવા માટે શ્રદ્ધાથી અને વિનમ્રપણે સહૃદ્ગુરુનાં ચરણ સેવવાં જોઈએ. તેમને અનન્ય ભાવે તેમના શરણે જવાથી સંસારનો લેશમાત્ર ડર રહેતો નથી. આવનારું મરણ જરૂર આવે પરંતુ હરિનું વિસ્મરણ ન થાય. પોતાની ઇન્દ્રિયોથી પોતાના આશ્રમ પ્રમાણે અને પોતાનાં વણો પ્રમાણે પોતાનું આચરણ કરતા રહેવું અને મનથી ઈશ્વરનાં ચરણોનું ધ્યાન કરતા રહેવું જોઈએ.' (ઓ. ૭૪-૮૩)

રથમાં જેમ ઘોડાઓ જેડાયેલા હોય છે, તેવી જ રીતે શરીર ઇન્દ્રિયો સાથે જેડાયેલું છે. તે ઇન્દ્રિયોને મનની લગામથી બુદ્ધિ કાબૂમાં રાખે છે. સંકલ્પ અને વિકલ્પથી ભરેલું અને સ્વેચ્છા પ્રમાણે ભરકનારું મન ફાવે તેમ દોડવા માગે છે. પણ બુદ્ધિ તેને પોતાના નિશ્ચયથી થોભાવી રાખે છે અને તેને લગામઢળી મનને રોકીને સરખું કરીને પોતાની સત્તા પ્રસ્થાપિત કરે છે. બુદ્ધિ જેવો કુશળ નેતા રથનો સારથી હોય પછી રથના સ્વામીને શેની ચિંતા ? તેનો તો બસ સ્વસ્થ ચિંતે વ્યવહાર કરવાનો. દેહનાં સર્વ કાર્ય કરવા તે બુદ્ધિનું પોતાનું કામ હોય છે. આવી મનને ટેવ પાડવાથી બધો જ વ્યવહાર હિતકારક સાબિત થાય છે. (ઓ. ૮૪-૮૭)

શબ્દ, સ્પર્શ, ઝ્યપ, રસ અને ગંધ આ વિષયો પાછળ ઇન્દ્રિયો પડે એટલે શક્તિ વ્યર્થ વપરાઈ જય છે, અને ડગલેને પગલે અધોગતિનો ભય રહે છે. શબ્દ, સ્પર્શ, ઝ્યપ વગેરે પાંચ વિષયોનું જે સુખ હોય છે, તે અંતે તો દુઃખમાં જ પરિણામે છે. સાચે જ અજ્ઞાન જેવું બીજું દુઃખ જ નથી. શબ્દનો વિષય હરણનું ભાન ભૂલાવે છે અને તે પોતાના પ્રાણ ગુમાવે છે. સ્પર્શનો વિષય હાથી ઉપભોગ કરે છે તે છે પાછળથી તેને અંકુશનાં દુઃખ સહન કરવાં પડે છે. ઝ્યપને વિષયને કારણે પતંગિયાં ભાન ભૂલે છે અને બળતી જ્યોતમાં આકષ્માઈ ને બળી મરે છે. ભમરો ક્રમના ફૂલમાં ગંધ માટે ગોધાઈ જય છે. દરેક માછલાં રસવિષયોના સુખમાં ઉપભોગીને તાત્કાલિક પોતાના પ્રાણ ગુમાવે છે. વિષયોને કારણે આવા પ્રસંગ આવે છે. તો જે પાંચેચ વિષયો બેગા થઈ જય તો કેટલા ભયંકર પ્રસંગ આવતા હશે ? આ તો બધાં પશુ, પક્ષી અને જળચર પ્રાણીઓ રહ્યાં. પરંતુ જાણનારા જ્ઞાની મનુષ્યો પણ વિષયોની પાછળ દોડીને તેમની ખરાબ દરશાનું અનુકરણ કરે છે. તેના કરતાં મોટું અજ્ઞાન કર્યું હોઈ શકે ? આ અજ્ઞાનનો નાશ થઈ વિષયોથી દૂર થયા કે અસ્વસ્થ મનને હરખ થાય છે. જીવ સ્વ સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ તરફ વળે છે. અને શાશ્વત એવું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત કરે છે. અંતઃકરણથી હરિનું કે ગુરુનું ચિંતન કરો. કાનથી તેમનું ચરિત્ર સાંભળો. મનથી તેનું સતત ધ્યાન ધરો અને મુખ વડે તેમનું નામસમરણ કરો. પગ વડે હરિના અથવા ગુરુના સ્થાનમાં જવ. નાક વડે તેમના ઉપરથી ઉત્તરેલાં ફૂલોની સુવાસ લો. હાથ વડે તેમનાં ચરણોમાં નમસ્કાર કરો. અને આંખોથી તેમનાં દર્શન કરો. આવી રીતે એ બધી ઇન્દ્રિયોની વૃત્તિ હરિના અને ગુરુના કામે લગાડી દેતાં ભક્તની સ્થિતિ ધન્ય થઈ જય છે. આ સિવાયની બીજી ઈશ્વર ભક્તિ કઈ ? દુંકાણમાં, અજ્ઞાનને જડમૂળથી ઉઝેડી નાખવું જોઈએ અને જે બચે તે સ્વયંસિદ્ધ જ્ઞાન જ છે, તેવું સમજે, એવો આ જીલોકનો ગર્ભિત અર્થ ભગવાન શ્રીકૃષ્ણને સુચય્યો છે. (ઓ. ૮૮-૯૮)

એક તો નાનાસાહેબ પહેલેથી જ ખૂબ વિનયશીલ અને એમાં પાછો બાબાએ કરેલો આ સુંદર ઉપદેશ. એ સાંભળતાં

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

જ તેમણે બાબાને સાથાંગ નમસ્કાર કર્યા. બંને હાથથી બાબાનાં ચરણો પકડી લીધાં અને ગળગળા થઈને પ્રાર્થના કરી અને બાબાએ કહ્યું, ‘હે બાબા ! મારું અજ્ઞાન દૂર કરો. મને યોગ્ય શિક્ષણ આપીને મારી આ જીવ અને અભિમાન નષ્ટ કરો. ઉપર ઉપરથી સાત્ત્વિકતાની હોંશ પણ મનમાં હંમેશા સંશય અને ક્ષણભરનું અપમાન ન સહન કરનારું અજ્ઞાન બીજું કર્યું ? પેટમાં માન સન્માનની અને કીર્તિની તીવ્ર ઈચ્છા અને ઉપરથી ધ્યાનનો ઢોંગ અને અંદરથી કામ, કોઇ ઘસમસ્તા હોય, પછી બીજું કર્યું અજ્ઞાન ? આચાર વિચારના ડેકાણા નહીં અને વિવેક વિચારોનું દેવાળું. પણ બહારથી બ્રહ્મનિષ્ઠ થઈ ફરવું. આ સિવાય અજ્ઞાન તે વળી કર્યું ? માટે બાબા ! આપ તો કૃપાના મેધ છો, કૃપાઙ્ગી વર્ષાનું સિંચન કરીને મારામાં રહેલ અજ્ઞાનઙ્ગી અશ્રિને શાંત કરો. બસ આટલાથી જ હું ધન્ય થઈ જઈશ. મારે ફક્ત જ્ઞાનની વાતો નથી જોઈતી. મારી અજ્ઞાનની પરાકાશ દૂર કરો. મારી ઉપર કૃપાદિષ્ટ રાખો તે જ મારે માટે સુખ અને સમાધાન છે.’ (ઓ. ૮૮-૧૦૫)

શ્રી સાઈબાબા તો પ્રેમ અને કરુણાના સાગર હતા. તેમને અનેક રીતે નિમિત્ત આગળ ધરીને તમે અમે સૌને માટે તેમણે ગીતાનું અર્થ સભર પ્રવચન કર્યું. ગીતા એ તો ઈશ્વરનાં વચ્ચેનો છે. માટે એ તો પોતે જ પ્રત્યક્ષ એક શાસ્ત્ર છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણોય કાળમાં તે અપનાવેલું એક પ્રમાણ સ્વરૂપ છે. તેનું અપમાન કે અવગણાના કયારેય થઈ શકે નહીં. અત્યંત વિષયાસકત અથવા જીવમુક્ત તે બંનેને શાસ્ત્રોના અર્થની જરૂર નથી. શાસ્ત્રની ઉત્પત્તિ તો ફક્ત મુમુક્ષોને બચાવવા માટે જ હોય છે. પોતાના મુમુક્ષ ભક્તોને જોઈને જ્યારે સંતોને અત્યંત ચિંતા ઉત્પત્ત થાય છે, ત્યારે જ તેઓ કંઈ પણ નિમિત્ત બનાવીને સહજ રીતે ઉપદેશ કરે છે. હવે શ્રી સાઈમહારાજની વર્તવાની બીજી એક પદ્ધતિનું વર્ણન કરું છું. કોઈ એકાદ કાર્યને ઉભું કરીને આપમેળે ન સમજય તેવી રીતે તે બતાવતા હતા. નાનું હોય કે મોટું હોય, અનું કારણ કર્યારેય સમજતું નહીં. પરંતુ કાર્ય માત્ર ધમાકા સાથે ઉભું થતાં ધીમે ધીમે શરૂ થાય. એકાદ જે કામ સહજપણે પાર પડે અને તેની જ શરૂઆત કરે. પરંતુ તેના મૂળ હેતુનું નામ નિશાન રહે નહિ, ઉલ્લાની ઉપર ઉપરથી ખોટી સમજૂતી કરી લેવાની. ‘બોલે તે કરે નહીં, અને ગંભેરે તે વર્ષે નહીં.’ આ ડિનિનો જ્ઞાનો કે સાઈબાબા પ્રત્યક્ષ અનુભવ કરાવતા હતા. બાબા જેવા અવતારી પુરુષો પરોપકાર માટે આ જગતમાં અવતાર ધારણ કરે છે અને નિશ્ચિત કાર્યની સમાપ્તિ થતાં છેલ્લે પાછા અભ્યક્તમાં તીન થઈ જય છે. પરંતુ આપણી બાબતમાં આપણને જ મૂળ કારણની ખબર હોતી નથી. આપણે કયાંથી આવ્યા ? કયાં જવાનું છે ? શા માટે ઉત્પત્ત થયા ? આ જન્મનો હેતુ કયો ? તે બધી બાબતની આપણને કોઈપણ જતની ખબર હોતી નથી. મનને ફાયે તેમ વત્તની જીવન વિતાવતા હોઈએ છીએ. પછી આગળ ઉપર મૃત્યુનો સમય આવતાં બધી ઈન્દ્રિયો નિષ્ઠિય થઈ જય છે. ત્યાં સુધી કલ્યાણ માટેનો કે પરમાર્થ માટેનો સુવિચાર સૂજતો નથી. પત્ની, પુત્ર, ભાઈ, માતા, મિત્રો અને સગાવહાલાઓમાંથી પણ બધાંને આંખો સામે ભરતાં જોઈએ છીએ. મનમાં પોતાના સાચા પરમાર્થ માટેની કે ઉદ્ઘાર માટેની જોગવાઈ કરતાં ઠેઠ સુધી ફાવતી નથી. અને ઝરી આંખો ખુલતી જ નથી. પણ સંતો માત્ર આવા નથી હોતા. તેઓ ખૂબ જ સાવધ હોય છે. તેમને પોતાના અંતઃકાળનું પૂર્ણજ્ઞાન પહેલેથી જ હોય છે, અને મૃત્યુનું સ્થળ પણ જણાતા હોય છે. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી આ શરીરને પોતાના પરમ ભક્તો માટે અતિશય પ્રેમથી ખર્ચી નાખે છે. તેમજ દેહ પડી ગયા બાદ પોતાના શરીર ત્યજવાની ‘જગ્યાને’ પણ પોતાના શરીરને જે જગ્યા ઉપર ચીર વિશ્રાંતિ મળવાની હોય છે, ત્યાં પોતાની સમાધિના પથ્થરો ચણાવી જ દેતા હોય છે. બાબાએ પણ એવું જ કર્યું. શિરડીમાં સમાધિ મંદિર બંધાવ્યું પરંતુ તેની ગંધ પણ નજીકમાંના ભક્તોને આવવા દીધી ન હતી. ખરેખર, આ બાબાની કરણી અકલ્ય અધ્યાતીત હતી. (ઓ. ૧૦૬-૧૨૩)

પોતાનું આ સ્મારક બાબાશ્રીએ બાપુસાહેબ બુઝી નામના નાગપુરના એક મોટા શ્રીમંત ગૃહસ્થ દ્વારા બંધાવડાવ્યું.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

બાપુસાહેબ બાબાના ખૂબ જ મોટા ભક્ત હતા. અને બાબાનાં જ ચરણોમાં સદાય આસક્ત રહેતા હતા. તેઓ પોતાના કુંભીજનો સાથે બાબાની સેવામાં શિરડીમાં આવીને વસ્યા હતા. બાબાશ્રીનાં ચરણોનો લાભ લેવા માટે તેઓ ઉપર ઉપરી શિરડીમાં આવીને રહેતા અને પછી આગળ ઉપર સમય જતાં તેઓએ ત્યાં જ કાયમનો વસવાટ કરી લીધો. તેમના મનમાં આવ્યું કે એકાદી જગ્યા વેચાતી લઈને તેની ઉપર એક નાની સરખી ઈમારત બંધાવવી અને તેમાં સ્વતંત્રપણે મુકામ કરવો. અહીંથાં જ આ વિચારના બીજ રોપાયાં. અને ત્યાં જ આજે આ ભક્તોના પ્રેમ ખાતર બાબાનું સમાધિ મંદિર સ્મારક છે. આ સમાધિ મંદિર કેમ કરતાં ઉભું થયું, કેવી રીતે એની શક્ફાત થઈ, અને કેવી રીતે આકાર પામ્યું, તે આખો વૃત્તાન્ત હવે સાંભળો. (ઓ. ૧૨૪-૧૨૯)

આવા વિચારો જ્યારે તેમના મનમાં ચાલતા હતા તે સમયે બાપુસાહેબ બુઝી પોતે દીક્ષિતના વાડાની મેડી ઉપર સૂતા હતા. તે વખતે એક સરસ મલેદાર દિવ્ય સ્વભન આવ્યું. ત્યાં જ એક બીજી બીજાના ઉપર શામા સૂતા હતા. જેવાની ખૂબી એ છે કે તેમને પણ તે સમયે એવું જ સ્વભન આવ્યું. બંને જગ્યા ત્યારે સામ સામે વાતો થતાં ખૂબ જ આશ્રય થયું. બાપુસાહેબ સ્વભનમાં જોયું કે બાબા તેમને આજ્ઞા આપતા હતા, ‘તમે તમારો દેવધર સાથેનો વાડો બાંધો.’ આમ સ્વભન પુરું થતાં જ બાપુસાહેબ સફાળા જગ્યાનું થઈ ગયા. પોતાની પથારીમાં બેસીને આવેલા સ્વભનનો પહેલેથી છેલ્લે સુધીનો વિચાર કરવા લાગ્યા. આવું જ્યારે ચાલી રહ્યું હતું એટલામાં માધવરાવને ઊંઘમાં રહતા સાંભબ્યા. બુઝીએ તેમને કહ્યું જગ્યાનું થાવ એમ કહી બૂમ પાડીને ઉઠાડ્યા. તે સાંભળતાં જ માધવરાવની ઊંઘ ઉડી ગઈ. બુઝીએ તેમના ડ્રનનું કારણ પૂર્ણથિયું. આ સાંભળતા તેઓ બોત્યા, ‘બાબાના પ્રેમભર્યા શબ્દો સાંભળીને પ્રેમનો ઊભરો આવ્યો અને ગળું ભરાઈ આવ્યું. આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં અને આ ઉત્કર પ્રેમના ઊભરાને રોકી ન શક્યો તથા તે ડ્રનમાં પરિણામ્યું.’ તે કહેવા લાગ્યા કે, મારી પાસે આવીને બાબાએ સ્પષ્ટ આજ્ઞા કરી કે, ‘દેવધર સાથેનો વાડો તૈયાર થવા હો. હું બધાની ઠચ્છા પૂર્ણ કરીશા.’ આ સાંભળીને બાપુસાહેબ બુઝીને ખૂબ જ નવાઈ લાગી કે બંનેને એક સાથે જ એક સરખા વિચાર કેવી રીતે આવ્યા? પણ તેને કારણે મનમાં કોઈ પણ પ્રકારનો સંશય રહ્યો નહિ અને કાર્યની શક્ફાત કરવાનો નિશ્ચિય કરી નાખ્યો. બુઝીસાહેબ તો જન્મનાત ગર્ભશ્રીમંત હતા. તેથી વાડો અને દેવધર બાંધવા માટે તેઓ સમર્થ હતા. જ્યારે માધવરાવ ખાદ્ય પીધે સુખી હતા. તેમ છતાં બંનેને એક સરખો જ વિચાર આવતાં અને તેમાં પણ સ્વભનનું આવું સરખાપણું જોઈને બંને ખૂબ જ આનંદિત થયા. તેમણે તરત જ વાડો અને દેવધર બાંધવાનો નકશો તૈયાર કરાયો અને દીક્ષિત સહેભની તે માટે અનુમતિ લીધી. બીજે દિવસે સવારે આ ત્રણે જણા બાબા પાસે હતા. તે સમયે બાબા હંમેશાની માફક પોતાના શામા તરફ મોરાખીને પ્રેમથી જોઈ રહ્યા હતા. એ તકનો લાભ લઈને માધવરાવ બોત્યા કે, ઓ દેવા! આ તારો કેવો વિચિત્ર ખેલ છે! અમને શાંતિથી સૂવા પણ નથી દેતો! ત્યાં પણ અમને બબડાટ કરાવે છે! એ સાંભળીને બાબાએ પોતાના કાન ઉપર હાથ મૂક્યા અને બોત્યા, ‘જેને જે કહેવું હોય તે કહે, અમે તો અમારી જગ્યા ઉપર જ હોઈએ છીએ.’ પછી એ ઉપર કહેલી યોજના બાબાની સામે મૂકી સંભળાવી અને દેવસ્થાન સાથેનો વાડો બાંધવાની એમની પરવાનગી પણ તરત મળી ગઈ. (ઓ. ૧૩૦-૧૪૪)

માધવરાવે કર્મચર કસી અને ભોયતળિયું તથા પહેલો મજલો તૈયાર થઈ ગયાં. તેમના હાથે કુવો પણ ખોદાઈને તૈયાર થયો. આ રીતે કામ અહીંથાં સુધી આવી પહોંચ્યું. બાબા પણ લેંડીબાગથી આવતા જતા સમયે જ્યાં બારી બારણાં બેસાડવામાં આવતાં હતાં તેને ઉત્સુકતાથી જોતા હતા. અને પોતાના જમણા હાથના અંગૂઠાની જોઉની આગળ ઉપર કરી બતાવીને કહેતા કે અહીંથાં દરવાજે મૂકજે, અહીં બારી મૂકજે, અને આ બાજુ છજીવાળી ગેલેરી કાઢજે. જેથી સુંદર શોભા આવરો. કોઈને કોઈ કારણે અને નિભિતે આગળ ઉપરનું કામ બાપુસાહેબ જોગ દ્વારા થવાનું

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હતું માટે તેમને સોંપવામાં આવ્યું. આ પ્રકારે કામ ચાલતું હતું ત્યારે બુદ્ધીના અંત: કરણમાં એક પ્રેરણા જગી, કે આમાં જ એક અંદરના મધ્ય ગર્ભભાગમાં ઓરડો બાંધીને તેમાં મુરલીધરની શ્રીકૃષ્ણની મૂર્તિની સ્થાપના કરી શકશો. કલ્પનાનો ઉદ્ઘય થયો પણ બાબાની ઈચ્છા જાણ્યા વીના અને તેમની આજ્ઞા મેળવ્યા વીના બુદ્ધી કોઈપણ કાર્યનો આરંભ કરતા જ નહિ. આ તેમનો એક રોલિંગ્ઝો નિયમ હતો. બાબાની આજ્ઞા તે જ તેમને માટે મહત્વની વાત હતી. અને તેના સિવાય એક કોઈ કામની શરૂઆત કરતા નહિ. વાડાની વરચ્ચે દીવાનખાનું શાને માટે જોઈએ ? દીવાનખાનાની શી જરૂર છે ? બંને બાજુની ભીતો ચણીને મુરલીધરની સ્થાપના ત્યાં કેમ ના કરીએ ? આ પ્રકારે દીવાનખાનામાંથી દેવાલય બનાવવાનો બુદ્ધીના મનમાં વિચાર આવ્યો. પણ બાબાનો અભિગ્રાય આ બાબતમાં લેવો. અને જે તેમની ઈચ્છા હોય તો નિશ્ચિંતપણે કાર્ય શરૂ કરવું. તે માટે એમણે માધવરાવને કહ્યું, ‘આ બાબતમાં આપણે બાબાનો મત લઈએ અને ‘દેવાને’ ગમે તે પ્રમાણે આગળનો કાર્યક્રમ ચાલુ રાખીએ.’ બાબા ફેરી ઉપર હતા. અને તેમની સવારી વાડાના દરવાજ પાસે આવતાં જ શામા ઉંફું માધવરાવે તેમને પૂછ્યું, ‘હેવા ! બાપુસાહેબ કહે છે કે, દીવાનખાનાની બંને બાજુની ભીતો ચણીને ત્યાં પ્રેમપૂર્વક મુરલીધર શ્રીકૃષ્ણની સ્થાપના કરીએ ? વરચ્ચેના ચોકની ખાતી જરૂરા નક્કી કરીને ત્યાં સિંહાસન બનાવીએ. એટલે તેની ઉપર બિરાજમાન થયેલા મુરલીધરની શોભામાં અભિવૃદ્ધિ થશે. બાપુસાહેબની આવી યોજના છે પણ આપની અનુમતિ જોઈએ. આમ આ મંદિર અને વાડો બંને સાથે સાથે જ તૈયાર થઈ જશે.’ શામાનું આવું કહેવું સાંભળીને બાબા આનંદથી ‘સારું’ બોત્યા, અને વાડા તરફ પોતાની નજર ઠેરવીને કાનને સુખ મળે એવા મધુર શબ્દો બોલવા લાગ્યા, ‘વાડો પૂરો થતાં આપણે જ ત્યાં રહેવા જઈશું. ત્યાં જ આપણે વાતો કરીશું, હરીશું, ફરીશું અને ત્યાં આપણે બેગા મળીને રમીશું તથા એકબીજાને વીટળાઈને આનંદથી સમૃદ્ધિ ભોગવીશું.’ માધવરાવે બાબાને તે માટે ફરી પૂછ્યું, ‘જે તમારી આજ્ઞા હોય તો પાચાનું મુહૂર્ત કરીએ ? શું આ સમય સારો છે દેવા ? નાળિયેર વધરેવા માટે લાવીએ ?’ એ સાંભળીને બાબા બોત્યા, ‘વધેર વધેર’ એવું કહેતાં જ તેમણે તાત્કાલિક શ્રીકૃષ્ણ વધેર્ય અને પછી મુરલીધર મઠની જરૂરા તૈયાર થઈ અને મૂર્તિ બનાવવા માટે પણ એક કારીગરને કાર્ય સોંપવામાં આવ્યું. (ઓ. ૧૪૫-૧૬૪)

છેવટે એવો સમય આવ્યો કે, બાબાની તબિયત લથડી અને તેમનો અંતકાળ પાસે આવ્યો. ભક્તોના હૃદયમાં એક બેચેની ઉત્પન્ન થઈ અને બાપુસાહેબના અસ્વસ્થ મનને હવે આગળ ઉપર વાડાની શી દશા થશે તેની ચિંતા થવા લાગી અને ખૂબ દુઃખ થયું. ‘હવે પછી બાબાનાં ચરણો આ મંદિરમાં પડશે ખરાં ? આટલો બધો ખર્ચ કર્યા પછી આવું વિધન કેમ ઉભું થયું હશે ? બાબા દેહ છોડી દે તો આ મુરલીધરના મંદિરની અને વાડાની મારે શી જરૂર છે ? આવા અશુભ વિચારો બુદ્ધીસાહેબના મનમાં આવવા લાગ્યા. દેવયોગે શ્રી સાઈનાથ મહારાજની અંત:સમયની ઈચ્છાને લીધે અને વાડાના મહાન ભાગ્યથી બધાના જ મનનું ધારેલું થયું. ‘મને બુદ્ધીના વાડામાં લઈ જાવ.’ આ બાબાના અંત સમયનાં વચ્ચેનો તેમના મુખેથી નીકળતાં સર્વના મનને શાંતિ મળી. ત્યારબાદ તે પવિત્ર ‘સાઈદેહ’ ભૌંયરાના ગર્ભમાં સ્થિર થયો, અને એ ધન્યભાગી બુદ્ધીનો વાડો સમાધિ મંદિરમાં ફેરવાઈ ગયો. ખરેખર શ્રીબાબાનું ચરિત્ર અગાધ છે. ધન્યભાગ પેલા બુદ્ધીનાં કે, જેમની પોતાની માલિકીના ધરમાં જ. જેમનું નામ પણ જીબ પર લાવવું અતિશય પવિત્ર છે તેવો આ શ્રી સાઈમહારાજનો દેહ ત્યાં જ અંતે વિસામા માટે મૂકવામાં આવ્યો.’ (ઓ. ૧૬૫-૧૭૨)

આવી આ પવિત્ર કથા સાંભળીને શ્રોતાઓ સુખ સંપન્ન થાઓ. હવે હેમાદ્રીપંત સાઈનાથનાં શરણોમાં જઈ રહ્યા છે. તેમજ ક્ષણભર માટે પણ તેમનાં ચરણોને છોડવા માટે તૈયાર નથી. સારી કે નરસી અવસ્થામાં પણ શ્રીસાઈબાબા ભક્તોને સંતુષ્ટ રખવા માટે સમર્થ છે. તેમના ઉપરેશ પ્રમાણે જ વર્તવામાં કલ્પયા છે. આ કથા અને તેને કહેનાર વક્તા તથા

શ્રી સાઈનું સત્ય ચિત્ર

બોલનાર મુખ, આ સર્વે ઠેકાણે સાઈસમર્થ જાતે જ હોવાને કારણે હેમાડપંત વળી ક્યાંના ? વગર કામનાં આ ઉપનામ માટે જે પ્રમાણે આગળ પ્રેરણા ભળશે તેવી જ કથા શ્રોતાઓને સાંભળવા ભળશે. તે સમયે જે પણ ર્યાશો થશે તે પ્રમાણે જેવાઈ જશે, એની ચિંતા હમણાં શા માટે કરવી ? (ઓ. ૧૭૩-૧૭૬)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા હેમાડપંત રચિત શ્રી સાઈસમર્થના સત્ય ચિત્રનો ‘ગીતા વિશિષ્ટ શ્લોક અર્થનિવેદન તથા સમાધિ મંહિર નિર્માણમ्’ નામનો ઓગણચાલીમો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



અધ્યાય ત૩૮નું અર્થ વિવરણ.

આ અધ્યાયના પ્રસંગનું ‘બાબાનું બાળક’ સ્વ. બાળકૃષ્ણ વિશ્વનાથ દેવ નિવૃત્ત મામલતદાર હતા. જેમણે અધ્યાય પદમાંની અવતરણિકા રચેત છે અને જેમની કથા અધ્યાય ૪૦ અને ૪૧માં આગળ આવશે. તેમણે વધારાનું વર્ણન કરેલું છે, જે શ્રી સાઈલીલા માસિક નં. ૪ પૃ. ૫૬૩ પર પ્રકાશિત થયેલું છે. તે ઉપરાંત સ્વ. પ. પૂ. નરસિંહ સ્વામીના સાઈબાબા ઉપરના અનેક ગ્રંથોમાં આવેલું છે. જે વાંચીને વાચકોને આ અધ્યાય સમજવામાં થોડી સહેતાઈ થશે માટે આ જગ્યાએ હું થોડા વિસ્તારથી કહું છું.

નાનાસાહેબ ચાંદોસ્કર સંસ્કૃત વિષય સાથે મુંબઈની એલિફ્ન્સ્ટન કોલેજમાંથી સ્નાતક થયા હતા. અને સંસ્કૃતમાં ગીતાના શાકરભાસ્ય જેવા અભ્યાસમાં પારંગત હતા. સ્વાભાવિક રીતે તેમને પોતાની વિદ્વત્તા ઉપર અહેંકાર હતો. મોક્ષ પ્રાપ્તિના માર્ગમાં અહેંકાર મોટામાં મોટી અભ્યાસ ઊભી કરનારી વસ્તુ છે. માટે તેને તોડવા માટે અને તેની સાથે સાથે શિષ્યને જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુને શરણે કેવી રીતે જવું તે નાનાને શિખવવાનું બાબાએ નક્કી કર્યું.

એક દિવસ મસ્જિદમાં નાનાસાહેબ બાબાનાં ચરણોની સેવા કરી રહ્યા હતા તે સમયે મનમાં કંઈક ગણગણતા હતા. બાબાએ તેમને રોકીને તું શું ગણગણે છે એમ પૂછ્યું. તે સાંભળીને નાનાએ કહ્યું કે હું સંસ્કૃતનો શ્લોક બોલી રહ્યો છું.

બાબા : ક્યો શ્લોક ?

નાના : ગીતાનો શ્લોક.

બાબા : તો પછી મોટેથી બોલને ? અમને પણ તે સાંભળવા દે, તે સાંભળીને નાનાએ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો ગુરુ શિષ્ય સંબંધને સંબોધિત કરતો ઉઘમો શ્લોક કહી સંભળાવ્યો.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તદ્વિજ્ઞ પ્રણિપાતેન, પરિપ્રેમેન સેવયા ।
ઉપદેક્ષયંતિ તે જ્ઞાનં, જ્ઞાનિનસ્તત્વહર્ષિનઃ ।

અંતર્જ્ઞાની બાબા ચાંદોરકર કયો શ્લોક ગાળગણતા હતા તે બરોખર જાણતા હતા. બસ એ જ સમયે યોગ્ય તક સાધીને બાબાએ નાનાને રોકીને પ્રશ્ન પૂછેલો અને પોતાનું કાર્ય સિદ્ધ કર્યું. બાબાએ નાનાને પૂછેલું કે, ‘તને એનો અર્થ ખબર છે ? કહે જેઓ મને.’ તે સાંભળીને નાનાએ પોતાની રીતે સમજલવેલું કે ‘ગુરુને સાણાંગ નમસ્કાર કરીને, પ્રશ્ન પૂછીને, એમની સેવા કરીને, આ જ્ઞાન જાણી લે. જેથી કરીને બ્રહ્મવેતા, જ્ઞાનીજનો તને જ્ઞાનનો ઉપદેશ કરશે.’ આવો, શ્લોકનો સર્વ સાધારણ અર્થ કહ્યો હતો. પણ બાબાએ કહ્યું હતું કે ‘મારે આનો એકંદરે ભાવાર્થ નથી સાંભળવો, પણ તેના દરેક શબ્દનું વિશ્લેષણ કરીને મને કહે.’ નાના આશ્વર્યમાં પડી ગયા. જેમનું કોઈ પણ જતનું શિક્ષણ થયું નથી અને જેમને સંસ્કૃતભાષાની ગંધ પણ નથી, તેમને વળી આ શબ્દ શબ્દનો અર્થ કરીને કહેવાથી તે સમજશે ખરા ? કંઈપણ હોય, તેમણે એ રીતે અર્થ સમજવવાની શક્યાત્ત કરી, અને બાબાએ તો તેમની ઉલટ તપાસ જ જાણે શક્ય કરી દીધી.

બાબા : ‘તદ’ શબ્દ શેને ઉદ્દેશીને છે ?

નાના : જ્ઞાનને

બાબા : કયા જ્ઞાનને ?

નાના : પાછળના શ્લોકમાં કહ્યા પ્રમાણે જેમાં કહ્યું છે સર્વ કર્માભિલં પાર્થ જ્ઞાને પરિસ્માય્યતે ॥૩૩॥ અજૂન ! બધાં કર્મોના અંતે જ્ઞાન જ હોય છે.

બાબા : ગુરુને ફક્ત સાણાંગ નમસ્કાર કરવાથી ચાલશે ખરું ?

નાના ‘પ્રણિપાત’ એટલે સાણાંગ નમસ્કાર એટલું જ મને ખબર છે.

બાબા : ‘પરિપ્રક્ષ’ એટલે શું ?

નાના : ‘પ્રશ્ન’ પૂછવો.

બાબા : પ્રશ્ન એટલે શું ?

નાના : એ જ.

બાબા : ‘પરિપ્રક્ષ’ અને ‘પ્રશ્ન’ આ બંનેનો જે એક જ અર્થ થતો હોય તો મુનિ વ્યાસે ‘પરિ’ આ વધારાનો પ્રત્યય શા માટે લગાડ્યો છે ? તેમનું માથું ફરી ગયેલું કે શું ?

નાના : ‘પરિપ્રક્ષ’નો બીજો કયો અર્થ હોઈ શકે તો હું જાણતો નથી.

બાબા : ‘સેવા’ એમાં કઈ સેવા વિશે કહેવામાં આવ્યું છે ?

નાના : અમે જે દરરોજ કરીએ છીએ તે જેમ કે ચરણ સેવા.

બાબા : એટલી જ સેવા પૂરતી છે કે ?

નાના : ‘સેવા’ શબ્દનો બીજો પણ કોઈ અર્થ હોઈ શકે, તે બાબતમાં હું કાંઈ જાણતો નથી.

બાબા : ‘ઉપદેક્ષયંતિ તે જ્ઞાનં’ આ ત્રીજી ચરણમાં અનુષ્ઠાપ વૃત્તાનો ૮ અક્ષરમાં ફેરન કરતાં, એકાદો વધારાનો અક્ષર પણ કયાં મુકવો તે આવશે કે ?

નાના : હા આપણે ‘ઉપદેક્ષયંતિ તે જ્ઞાનં’ - અજ્ઞાન એમ કહી શકીએ. પરંતુ ગુરુએ શિષ્યને અજ્ઞાનનો ઉપદેશ કર્યો હોય તે વિષેનો શાંકરભાષ્યમાં કયાંથે પણ ઉલ્લેખ નથી.

બાબા : કંઈ વાંદ્યો નહીં. શાંકરાચાર્યે ‘અજ્ઞાન’ શબ્દ જે ના લીધો હોય પરંતુ તેને કારણે જો શ્લોકના અર્થ વધારે સ્પષ્ટ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

થતો હોય તો તને કંઈ વાંધો છે કે ?

નાના : વાંધો નથી, પરંતુ ‘અજ્ઞાન’ શબ્દ લઈને ડ્લોકનો સચોટ અર્થ કેવી રીતે કાઢવો તે મને સમજનું નથી.

બાબા : શ્રી કૃષ્ણે અર્જુનને જ્ઞાની અને તત્ત્વદર્શી લોકો પાસેથી જ્ઞાન મેળવવા માટે તેમને નમસ્કાર કરવા માટે, પ્રશ્ન પૂછવા માટે અને તેમની સેવા કરવા માટે શાથી કહ્યું છે ? શ્રી કૃષ્ણ જાતે જ તત્ત્વદર્શી ન હતા કે ? જાતે જ મૂર્તિમંત જ્ઞાન જ હતા ને ?

નાના : હા, ખરું છે. પરંતુ તેમણે અર્જુનને જ્ઞાની લોકો પાસે જવા માટે શા કારણે કહ્યું તે મને સમજનું નથી.

બાબાના આવા બેદભરેલા પ્રશ્નો સાંભળીને નાનાસાહેબ બિલકુલ ગુંઘવાઈ ગયા. તેમનું અભિમાન પીગળવા માંડ્યું અને તેમણે બાબાને જ તેમના દરેક પ્રશ્નોનો જવાબ આપવા માટે વિનંતી કરી.

બાબા સમજવવા લાગ્યા, ‘પ્રણિપાત’ એટલે ફક્ત સાણાંગ નમસ્કાર નહિ. જમીન ઉપર જેમ લાકડી પડે તેવી રીતે પોતાનું આખું શરીર ગુરુ ચરણમાં અર્પણ કરી દેવું જોઈએ. આપણે જાતે શૂન્યવત્ત અને ગુરુ એટલે બધું જ આવી સંપૂર્ણ નભ્રતાથી અને કાચા વાચા અને મનથી ચરણાગતિની ભાવના હોવી જોઈએ. ‘પરિપ્રક્ષ’ એટલે ખરી લુણાસાથી અને પોતાની શંકાનું નિવારણ કરીને સારી રીતે સહજ ગમ્ભેત સમજને પ્રશ્નો પૂછવા તેથો તેનો અર્થ નથી થતો. સેવા એટલે ફક્ત ગુરુની ચરણ સેવા કરવી એટલું જ બસ નથી. પણ તે સેવામાં ગુરુને પોતાનું સર્વસ્વ એટલે કે તન, મન, ધન અર્પણ કરવું જોઈએ. આ સેવા હું કરી રહ્યો છું અથવા તો થોભાવી દેવા માટે હું સ્વતંત્ર છું આવી ભાવના પણ ન હોવી જોઈએ. મૈં જે મારું બધું જ ગુરુને અર્પણ કરેલું છે, તેની ઉપર ફક્ત તેમની જ માલિકી છે એવો ભાવ હોય ત્યારે જ તેમનું છે તે એમની જ સેવામાં લગાડેલું હોવું જોઈએ. તે વિષે મારી પાસે કોઈપણ પ્રકારની મોટાઈ કે નિર્ણય કરવાનો અધિકાર જ નથી તેવી ભાવના હોવી જોઈએ.

‘હવે ગુરુએ શિષ્યને અજ્ઞાનનો ઉપદેશ કરવા અંગે કહું ને, નાના ! બ્રહ્મ એટલે શુદ્ધ સદ્ગુરૂનું કે જ્ઞાન જ ને ?’

નાના : હા બરાબર

બાબા : અને તે બધું અસત્ત અને અજ્ઞાન નથી કે ?

નાના : હા

બાબા : બ્રહ્મ મન અને વાણી જેવી ઠિન્ડિઓથી જાણવું શક્ય નથી. તેવું શાસ્ત્રે નથી કહ્યું કે ? થતો વાચો નિર્વત્તને | અપ્રાપ્ય મનસા સહ || તૈત્તિરીય ઉપનિષદ વ. ૨ અ. ૪

નાના : હા

બાબા : તો વાણી એટલે બ્રહ્મ કે જ્ઞાન નહીં ને ?

નાના : ના

બાબા : તો પછી ગુરુ જે કહે છે તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, નહીં ?

નાના : એવું લાગે છે ખરું.

બાબા : ગુરુનો ઉપદેશ તે ખરેખર અજ્ઞાન જ હોય છે. એક કંટાથી જેવી રીતે બીજે કંટો કાઢીએ છીએ, તેવી જ રીતે ગુરુના અજ્ઞાનદ્વારી શાબ્દિક ઉપદેશ શરૂ થાય કે શિષ્યનું અજ્ઞાન જે એના જ્ઞાન ઉપર ઢંકાયેલું હોય છે, તે બાજુએ ખસી જલ્ય છે અને ખરું જ્ઞાન પ્રગટ થાય છે. અજ્ઞાનેનાવૃત્ત જ્ઞાનના તેન મુદ્યાન્તિ જંતવઃ || ગીતા અ. ૫ ડ્લોક ૧૫ || માટે ગુરુ જે ઉપદેશ કરે છે તે અજ્ઞાન જ હોય છે. જેનું પરિણામ જ્ઞાનમાં ઝપાંતર થવું એમ થાય છે. જ્ઞાન ઉત્પન્ત કરી શકાતું નથી, પણ મૂળમાં ત્યાં હોય છે જ. તેને ઉચ્ચારવું પડતું નથી. ઉપદેશેલા શબ્દથી શસ્ત્રકિયા વિશારદના કાર્ય પ્રમાણે શિષ્યની

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આંખોના મોતિયા કાઢી નાંખવામાં આવે છે. તે પછી શિષ્યને સરસ અને ચોપખું દેખાવા માંડે છે. તેથી તેને પોતાના શુદ્ધ ચૈતન્ય શાન સ્વરૂપનું ભાન થાય છે. સંત શાનેશ્વરે ૧૮ મા અધ્યાયમાં ૧૩૬૬મી ઓલીમાં એમ કહ્યું છે કે, ‘પછી અજ્ઞાન નિર્મૂળ થાય છે। હું એક જ છું એવો અધિકાર ગ્રાન્ત થાય છે। સનિદ્રા સ્વર્ણમાંથી આપણે જગૃત થઈએ છીએ ॥’

પછી શ્રીકૃષ્ણ જાતે જ શાની હોવા છતાં તેમણે અર્જુનને બીજી શાની પાસે કેમ મોકલ્યો એનો ખુલાસો કરતા બાબા કહે છે કે, ‘શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે, શાની એ મારો જ આત્મા છે. શાની ત્વાત્મૈય મે મતમ્ ॥ અ. ૭ લોક ૧૮. ત્યારે તેમણે અર્જુનને પોતે જ શાનનો ઉપદેશ આપ્યો કે બીજી શાનીજનો પાસે મોકલ્યો. તે બધું સરખું જ ગણાય છે. ફક્ત ઈશ્વર પોતાના ભક્તોને મોટાઈ આપીને તેમનું સન્માન કરવા માગે છે. માટે તેઓ આમ કરે છે. અધ્યાય ૩૦માં સપ્તશૃંગી માતાએ પોતાના પૂજારી કાકાળ વૈદ્યને મનની શાંતિ આપવાની શક્તિ પોતાની પાસે હોવા છતાં શિરડીમાં સાઈબાબા પાસે મોકલવાનું દાંત આપણે પહેલા જેઠ ગયા છીએ. દેવ દેવીઓ નિજ ભક્તને. કેવા સંત હાથમાં સોંપે। આ પણ એક ચમત્કારિક ઝૂટિ । સાદર ચિત્રે તે સાંભળો ॥૧૬॥’

ઉપરનું સુંદર વિવેચન સાંભળ્યા બાદ નાનાસાહેબે સાઈબાબાને આખી ગીતા જ સમજલવીને કહેવા માટેની વિનંતી કરી હતી અને બાબાએ પણ ત્યાર પછી તેમને દરરોજ બેસાડીને ધીરે ધીરે ગીતા સમજલવીને કહી હતી. આ કેટલું મોટું ભાગ્ય કહેવાય ? આમ ઈ.સ. ૧૬૦૨ સુધી ચાલુ રહ્યું. પછી ધીરે ધીરે મણિદમાં ભક્તોની ગિરદી વધતી ગઈ અને બાબાએ આ બધી વાતો સાંકેતિક ભાષામાં અને અપ્રત્યક્ષ રીતે સામુહિક ઉપદેશ રૂપે કરવાની શરૂઆત કરી.



॥ અદ્યાય ૪૦ ॥

ઉદ્ઘાપન કથા કથનમું

(વ્રતોની પૂર્ણાહૃતિ સમયે કરાતી વિવિધોના પ્રસંગે બનેતી વાતોનું વર્ણન)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

ધન્ય ધન્ય શ્રી સાઈસર્વ્ય કે જેમણે આ ગ્રંથદ્વારે સ્વાર્થનો અને પરમાર્થનો ઉપહેશ કરીને ભક્તોને ફૂતાર્થ કર્યા. તથા પોતે હાથ ધરેલાં કાર્યોનો ઉદ્દેશ પૂર્ણ કર્યો. તેમનો હાથ મસ્તકને અડતાની સાથે તરત જ શક્તિપાત થતો. અને ગુરુ શિષ્યનો ભેદ મીટાવીને શિષ્યને કયારેય ન ભળી શકે તેવી વસ્તુ પણ મેળવી આપતા. હું, તું એવી જુદાઈની ભાવનાને દૂર કરીને તથા સાધારણ નમસ્કાર કરીને તેમને અનન્ય ભાવે શરણે જતાં તેઓ આપણને આલિંગન આપીને છાતી સરસા ચાંપી દેતા. સમુદ્ર અને નદી તે આમ તો નામથી જુદા જુદાં હોય છે. પરંતુ યોમાસામાં એક બીજાની સાથે ભળી જતાં તેમનું ઝ્રય એક જ થઈ જાય છે અને તેમનામાં જરા સરખુ જુદાપણું બાકી રહેતું નથી. એવી જ મનોવૃત્તિ સાથે સદ્ગુરુ સાઈનાથ મહારાજને જે અનન્ય ભક્તિથી શરણે જતા તેમની ઉત્તમ ભક્તિ જેઠાને તેમની પોતાની ગુરુતા બદલતા હતા. (ઓ. ૧-૫)

હીનબંધુઓ પર દ્વારા કરનાર શ્રી સાઈનાથ મહારાજ ! તમારો જય જયકાર હો. અત્યંત પ્રેમ કરનારા સાઈબાબા ! તમારો જય જયકાર થાઓ. ભક્તોનો ઉદ્ધાર કરવા માટે અભિલ બ્રહ્માંડમાં તું વ્યાપેલો હોવા છતાં શિરડીમાં નિરાળો થઈને બેસે છે. પરંતુ જમીન પર દળણા દળવાના પથ્થર મૂકીને પગ ફેલાવીને દળણું દળતા અને ઘંટીનો હાથો ઢોકીને ધાન્ય દળીને બહાર કાઢતા બાબાને જેઠાને મારા મનમાં આશ્રમ થયું હતું અને આ ગ્રંથના લેખનમાં તે જ બાબત કારણભૂત થઈ. મનમાં તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થતાં અને સાઈબાબાની આવી લીલાઓનું અને કર્મોનું સકળ વર્ણન જે કરવામાં આવે તો પાપોનો સંદર્ભ નાશ થશે અને ભગવાન પોતે પ્રસન્ન થશે. કારણ કે ભગવાનને પોતાના કરતાં પણ વધારે પોતાનાં ભક્તો દ્વારા કરેલી સ્તુતિ કે ગુણવર્ણન વધારે પસંદ હોય છે. સજજન શ્રોતાઓને શંકા ઉત્પન્ન થાય અથવા તો આ મારું વિધાન પુરાવા વિનાનું લાગે તો તેમને ‘ભવિષ્યોત્તરપુરાણ’ જેવું. જેમાં ત્રિપુરારીએ શંકર ભગવાને આ પ્રમાણે જ કહ્યું છે. વસ્તુસ્થિતિ તે એ છે કે આ બદ્ધી સાઈની જ પ્રેરણા છે. પરંતુ લોક ઝાંદીને બતાવવા માટે ગ્રંથની આ રચનાને ભક્તોના કલ્યાણ માટે તેમણે સંમતિ આપી. ત્યારથી દેરેક મહિને ‘શ્રી સાઈલીલા’ માસિકના અંકોમાં સાઈસર્વ્યનાં વૃત્તાંતને શ્રોતાઓ ખૂબ પ્રેમથી વાંચી રહ્યા છે. સાઈ એ જ આ કથાને સંમતિ આપનાર છે. તેજ બુદ્ધિ આપનાર અને મારી મૂળ પ્રેરણાનું સિંચન કરનારા પણ તેઓ જ છે. તેઓ પોતાની કથા પોતે જ કહી રહ્યા છે. માટે આ હેમાડપંત પોતાને મન ફાવે તેવાં કથાનકો રચી રહ્યા છે. એવો સંશય મનમાં જરા પણ રાખતા નહિ. શ્રોતાઓને હું વિનંતી કરું છું કે, આ ચરિત્રના ગુણા કે દોષ મરે માથે મારતા નહિ. સારા ગુણ હોય તો તે સાઈના અને જે દોષ દેખાય તો તે પણ તેમનો જ સમજ લેવો. હું તો માત્ર દોરીથી બાંધેલી નાચતી કઠપૂતળી છું. સૂત્રધારના હાથમાં પૂતળીઓની દોરીના છેડા હોય છે. તેને ફાયે તે રંગબેરંગી અથવા તો અનેક પ્રકારનાં ચિત્રવિચિત્ર ચરિત્રને અનુક્રમ તે નચાવે છે. (ઓ. ૬-૧૬)

આટલી પ્રસ્તાવના હવે પૂર્તી છે. શ્રોતાઓના મન ઉત્સુકતાથી ભરેલાં છે. કથામાં કંઈ નવીન વિશેષતા હોય તે

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

જણવા માટે તેઓ આતુર છે. અને તે બાબતમાં પૂર્ણી રહ્યા છે. તેમને માટે ગુરુ અને તેમના ભક્તોની મહત્તમાનું વર્ણિન કરીએ. અને તેમની ગૌરવગાથા ગાઈએ. પાછળનો અધ્યાય સમાપ્ત કરતી વખતે આગળના અધ્યાયની શરૂઆત જેમ જેમ યાદ આવતી જશે, તેમ તેમ કહેવાનું જણાવ્યું હતું તે હવે મને યાદ આવી જતાં તે પ્રમાણે કહી રહ્યો છું. હવે આ મધુર આખ્યાન શ્રોતાજનોએ સાવધાનીથી સાંભળવું. ભક્તોને પ્રેમથી જમાડ્યા પછી સાઈને ખૂબજ સમાધાન થતું. નાના બાળકને જેવો તેની માતા માટે પ્રેમનો ઉમળકો હોય છે તેવો જ અનુભવ શ્રી સાઈમહારાજ પોતાના ભક્તોને કરાવતા. ભક્ત ગમે ત્યાં રહેતો હોય છતાં પણ તેને માટે તેઓ દોડીને મદદે આવતા. તેમના આ ઉપકારનો બદલો તો કોઈનાથી પણ વાળી શકાય તેમ નથી. શરીરથી ભલે શિરડીમાં રહેતા હોય પણ તેમનું આ હરવું ફરવું સંસારના ત્રણે લોકોમાં રહેતું હતું. આ જ વિષય ઉપર એક સુંદર વાત શાંત ચિત્તે સાંભળો. (ઓ. ૧૭-૨૧)

ભક્ત શ્રેષ્ઠ બાબાસાહેબ દેવ તેમની સાઈચરણોમાં ગાઢ શ્રદ્ધા હતી. તેમનાં માતુશ્રી પણ બધાનું જ કલ્યાણ થાય તે માટે હુંમેશાં વ્રત ઈત્યાદી કરતાં હતાં અને તેમના હથે પણ અનેક પ્રકારનાં પરોપકારી વ્રતો અને સત્કર્મો થયાં હતાં. પરંતુ તે બધાં યથાશક્તિ સંપૂર્ણ થયા બાદ તેમના ઉદ્ઘાપનો બાકી રહી ગયાં હતાં. વ્રતનું એકવાર આપોજન કરીએ એટલે તેની પૂર્ણાંહૃતિ અવશ્ય કરવી જ પડે, નહીં તો પૂર્ણાંહૃતિ ન થાય તો વ્રત કે પૂજન કરનારે તેનું ફળ પ્રાપ્ત થતું નથી. અને જે વ્રત કર્યું હોય તે પણ અધૂરું જ રહે છે. આ કારણે દેવે પણ પોતાની માતાના પચ્ચીસથી ત્રીસ વ્રતોના ઉદ્ઘાપન માટે સો બસો ખ્રિસ્તીનો જમવા માટે આમંત્રિત કર્યા હતા. તે અધુરા રહી ગયેતા વ્રતોના ઉદ્ઘાપન માટે તિથિ પ્રમાણે દિવસ નક્કી કરીને અને શ્રીસાઈનાથ મહારાજને શિરડી આમંત્રણ આપવા માટે બાપુસાહેબ જેગને એક પત્ર લખી મોકલ્યો, ‘તમારા આવ્યા વીના ઉદ્ઘાપનના સર્વ સંસ્કાર પૂર્ણ થશે નહીં. માટે મારી આ પ્રાર્થના માન્ય રાખીને આ ગરીબને આભારી કરીને ફૂપા કરશો. હું તો સરકારી નોકર છું. પેટ ખાતર નોકરી કરું છું. તેમાંથી કરી શકાય એટલો પરમાર્થ સાધવા પ્રયત્ન કરું છું. એ તમે તો જણો જ છો. આપને દહાણુથી મુંબદી અને મુંબદીથી શિરડી સુધી આવું પડે. આટલે દૂર સુધી તમે આવો તે માટે હું લાચાર છું. છતાં આપ આ આમંત્રણનો સ્વીકાર કરશો એવી મારી ખાસ ઈચ્છા છે.’ આમ દેવસાહેબનો પત્ર બાપુસાહેબ જેગે બાબાશ્રીને સંપૂર્ણપણે વાંચી સંભળાયો અને બોલ્યા કે દેવનો આ કાર્યભાર આપે વ્યવસ્થિતપણે સંભાળી લેવો. બાબાએ આ દેવનું શુદ્ધ ભાવપૂર્વકનું આમંત્રણ સાંભળી લીધું અને બોલ્યા, ‘જેને મનમાં મારી યાદ હોય છે, તેની પણ હું હુંમેશા કાળજી રાખ્ય છું અને યાદ કરતો રહું છું. મને ગાડી, ધોડા, વિમાન કે આગગાડીની જરાયે જરૂર પડતી નથી. જે મને પ્રેમથી બોલાયે છે તેની સામે તાત્કાલિક પ્રગત થઈ જઉં છું. તું, હું અને ત્રીજે એક એમ આપણે ત્રણે જણા ત્યાં જઈશું તે પ્રમાણે દેવને પત્રનો જવાબ મોકલી આપ. પત્ર મળતાં તેને ખૂબ આનંદ થશે.’ જે કાંઈ બાબાશ્રી બોલ્યા તે બધું જેગે દેવસાહેબના ઘરે પત્રથી લખી જણાવ્યું અને બાબાશ્રીનાં કઢી પણ ખોટાં ન ઠરનારાં વચ્ચનોથી દેવ અતિશય સંતોષ પામ્યા. દેવને પૂર્ણ ખાત્રી થઈ કે બાબા તો હવે નક્કી આવવાના જ છે. પરંતુ જ્યારે તેનો પ્રત્યક્ષ અનુભવ જે દિવસે થશે તે તો સાનાનો દિવસ ઉગશે. દેવને તે વાતની પણ અભર હતી કે, બાબા શિરડી છોડીને ફક્ત ત્રણ જ જગ્યાએ જતા હતા. અને ત્યાં પણ કોઈ કોઈ વખત જ જતા. બાબા તો સદાને માટે શિરડીમાં જ વાસ કરતા. કોઈવાર એકાએક મનમાં તુક્કો આવે તો રહતા, રૂએ કે નિમાગાંવ જતા. પણ મોટે ભાગે તેઓ શિરડીમાં જ રહેતા. આ ત્રણ ગામથી દૂર તેઓ કયારેથી જતા નહીં. તો પછી આટલે દૂર મારે ત્યાં દહાણુ કેવી રીતે આપશે? પણ તેઓ તો સાક્ષાત્ ભગવાન વિષણુના પૂર્ણ અવતાર છે. ઈચ્છા થતાં મનમાં ફાવે ત્યાં જતાં તેમને કેટલી વાર લાગે? તે તો જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. તેમનું આવવું જવું લોકો માટે ઔપચારિક જ રહેતું. ખું જેતાં તો તેઓ અંદર બહાર બધે જ સર્વબ્યાપી છે. તેમનું શિરડીથી અહીંથા આવવું કે અહીંથાથી શિરડી પાછા જવું એ બંને ડિયાઓની ખબર આકાશને પણ પડવાની નથી. તેઓ તો બધે જ સમાયેતા છે. બાબાની હલચલ સમજ ન શકાય તેવી વિચિત્ર હતી. જરૂર અને ચેતન બંનેમાં તેમનો નિવાસ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

રહેતો. તેમને વળી શું આવવું અને શું જવું ? મનમાં લહેર આવે તે જગ્યાએ તેઓ પ્રગટ થઈ જતા. (ઓ. ૨૨-૪૧)

આ પહેલાં સુમારે એક મહિના પહેલાં એક સંન્યાસી દહાણુ રેલ્વે સ્ટેશન પર પોતાના કામ માટે સ્ટેશન માસ્તરને મળવા આવ્યા. તે ગૌશાળાના પ્રચારક તરીકી અને તેના સ્વયંસેવક હોવાને કારણે સંસ્થાની આર્થિક સ્થિતિ સુધારવા માટે ફાળો ઉધરાવવા માટે આવ્યા હતા. સ્ટેશન માસ્તરે તેમને એક બુક્ઝિટ સુજાડી, ‘તમે ગામમાં જાઓ, ત્યાં તમારી વ્યવસ્થા થશે. ત્યાં તાલુકાના મુખ્ય અધિકારી રહે છે. તેમની સામે તમારો આ વિચાર મૂકો. જેથી શેઠ શાહુકારો સાથે પરિયય થશે અને તમારા કાર્યમાં મદદ મળશે. મામલતદાર જેવાની સાથે સંબંધ બંધાતાં સૌનો સહકાર આપોઆપ મળશે. તેથી આવા ધાર્મિક કામ માટે ફાળો પણ બેગો કરી શકારો. તમે હવે સ્વસ્થ ચિંતા ત્યાં જ સીધા જાબ.’ આવું સ્ટેશન માસ્તર બોતી રહ્યા હતાં. ત્યાં જ બહારની બાજુએ ઘોડાના ડાબવા સંભળાયા અને મામલતદાર પોતે જ ત્યાં આવ્યા. તેઓ ઘોડાગાડીમાંથી ઉત્તરીને સ્ટેશનની અંદર જેવા સ્ટેશન માસ્તરના ઢભમાં પ્રવેશ્યા કે સ્ટેશન માસ્તરે સંન્યાસીને કહ્યું, ‘લો મામલતદાર તો અહીંથી જ આવ્યા છે. હવે તેમને જે કહેવું હોય તે કહો. તમારા સારા નસિબે તમારી તેમની સાથે આ રીતે ઓચિંતી જ મુલાકાત ગોઠવાઈ ગઈ છે.’ તે સાંભળી સંન્યાસીએ મામલતદારને પોતાની બધી હકીકત કહી સંભળાવી. પછી તેઓ બંને ઓરડીની બહાર જઈને એક મોટી પેટી ઉપર બેઠા. સંન્યાસી વિનંતી કરવા લાગ્યા, ‘આ કાર્ય પાર પાડવાનું છે. ગાયોના રક્ષણનું આ ધર્મકાર્ય તમારા જેવાઓએ માથે લીધા વીના મારા જેવા એક અનલાયા માણસને આ કાર્યમાં તલમાત્રનો પણ થશે મળવાનો નથી. આપ તો તાલુકાના અધિકારી છો અને હું તો એક બિક્ષુક છે. આ મુંગા જનાવરોની મદદ માટે અને સંભળ માટે હું ધેરેધેર ફૂંકું છું અને ફાળો બેગો કરું છું. તમારા જેવા માણસની સિફારસનો ફાયદો મને એ રીતે મળશે કે તમારા શબ્દો દ્વારા માંનું કામ આસાન થઈ શકશે અને આપને ગૌમાતાના આશીર્વાદ મળશે. તમારી કીર્તિમાં પણ વધારો થશો અને તમારી આ કામની પ્રશંસા પણ થશો.’ સંન્યાસીની વિનંતી સાંભળીને દેવે તેમને શું જવાબ આપ્યો તે હવે સાંભળો, ‘હાલમાં ગામના મોટા શાહુકાર નગરશેઠ જેમના હદ્યમાં આવા મુંગા અને દુઃખી પ્રાણીઓ ઉપર આપાર દ્વારા છે અને જેઓ ખૂબ જહેમતથી આ અંગેનો ફાળો ઉધરાવી રહ્યા છે, તો મને સમજનો કે તમારા આ કાર્યને માટે હું તમને કેટલા ઢપિયાની મદદ કરી શકીશ ? આ સમય તમારા માટે અનુકૂળ નથી. તમારા આ શુભ કાર્ય માટે પછી આગળ ઉપર વિચાર કરીશું. બે ચાર મહિના હમણાં રોકાઈ જાબ. હાલમાં પરિસ્થિતિ અનુકૂળ નથી.’ (ઓ. ૪૨-૫૭)

સંન્યાસી તો ત્યાંથી નીકળી ગયા અને આ વાતને માંડ એક મહિનો નહીં થયો હોય ત્યાં તો ટાંગમાં બેસીને તે દહાણુ પાછા આવ્યા. દેવસાહેબના દરવાજન સામે પરાંજપે વક્કિલનું ધર હતું ત્યાં ટાંગો રોકતાં જ સંન્યાસી નીચે ઉત્તરતા નજરે પડ્યા. દેવના મનમાં શંકા આવી અને તેમણે પોતાના છોકરાને કહ્યું, ‘આજ તે પહેલાં મળેલો સંન્યાસી ? ફાળો ઉધરાવવા પાછો આવી ગયો છે ! હજુ તો પૂરો મહિનો પણ થયો નથી છતાં તે આટલો બધો વહેલો કેમ આવ્યો છે ? પહેલાંની કહેલી વાત બધી ભૂલી ગયો કે શું ?’ દેવના સંશયનું આ જ મુખ્ય કારણ બન્યું. સંન્યાસીએ ત્યાં જ ટાંગો છોડી દીધો અને થોડો સમય આમ તેમ પસાર કર્યો અને ત્યાર પછી દેવને ધેર જઈશું કહેવા લાગ્યો તે સાંભળો, ‘સવારના દરશ વાગ્યાનો સમય હશે, દેવસાહેબના ધરમાં ધાંધલ ધમાલ જોઈને તે બોલ્યો, ‘મને પૈસાની કોઈ જ ઉતાવળ નથી.’ મેં લેને કે લિયે નહીં આયા હું. આજ તો સિફ હે ભોજન ચાહિયે.’ તે સાંભળીને દેવસાહેબે જવાબ આપ્યો, ‘પદ્મારીયે આનંદ હુચા યહ ધર આપકા હી સમજ લીજુયે.’ એટલામાં તે સંન્યાસી બોલ્યો, ‘હમારે હો બચ્યે સાથ મેં હૈ.’ તે સાંભળી દેવ બોલ્યા, ‘ફીર તો ઔરભી અચ્છી બાત હૈ.’ હજુ જમવા માટેનો ધણો સમય બાકી હતો દેવસાહેબ સંન્યાસીને પૂછવા લાગ્યા, ‘આપકા ઉતારા કહાં હૈ, જહીં મેં તપાસ કરને કે લીધે લેજું.’ ત્યારે સંન્યાસી બોલ્યા ‘કયા જરૂરત હૈ ? કબ મેં આઉં ? કીસ ધો મેં બહાર રહું, કીસ ધો મેં હાજર રહું. જબ બોલોગે તબ મેં આતા હું’ પછી દેવે કહ્યું, ‘અચ્છા બચ્યે લેકર સાથ, બારા બન્યે

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ક વક્તપર આઓ ઓર ભોજન પાઓ.' (ઓ. ૫૮-૬૮)

પછી તે સંન્યાસી પાછા ગયા અને બરાબર બારના ટકોરે પાછા આવ્યા. ત્રણે જણ જગવા બેઠા અને પેટ ભરીને જમીને તૃપ્ત થઈ ગયા. રસોઈ તૈયાર થઈ જતાં ખ્રાલણોની પંગત બેઠી અને યમજમાન અને તેના બે છોકરાઓ સાથે દેવે સૌને જમાઈને તૃપ્ત કર્યા. બે જણાને લઈને સંન્યાસી પોતે આવ્યા હતા. પરંતુ દેવને તો એમજ હતું કે ગૌશાળા માટે ફાળો ભેગો કરવા માટે આ લોકો પહેલાં આવ્યા હતા તેમ તેમનું પ્રયોજન પણ તે જ હશે, આમ તેમની બુદ્ધિ વિચારી રહી હતી અને તે જ કારણે તેમને એમ લાગ્યું કે એક અતિથિ જમવા માટે આવ્યો છે બસ એટલું જ. તેવું દેવના મનમાં થયું. આ પ્રકારે જમણવાર પૂરો થયો. જમણ પછી શુદ્ધ પાણીનું આચયમન પત્યું અને ઉત્તરાપોષન થયું. સુવાસિત ઠંડુગાર પાણી પીવું અને મુખ શુદ્ધ પણ થઈ. એક રીવાજ પ્રમાણે દેવે સૌને આનંદથી બહુમાન કરીને તથા ચાંલ્લા કરીને કૂલ અર્પણ કર્યા અને પાનનાં બીડાં આપીને અત્તર અને ગુલાબજળનો છંટકાવ કર્યો. આમ આવેલો સમૂહ પોતપોતાને ઘરે ગયો. પદ્ધારેલા સંન્યાસી પણ પોતાના પરિવાર સાથે પાછા ફર્યા. તે સંન્યાસી આમંત્રણ વગરના અચાનક તે વખતે આવીને જમ્યા છતાં દેવને, એ સાઈબાબા લાગ્યા નહિ અને તેમના મનમાં સંશય રહ્યો. આવું બન્યા પછી પણ ન બોલાવતાં આવેલા ત્રણાને જમાડયા છતાં દેવની શંકા મનમાં તેવિને તેવી જ રહી. તેમણે જેગની પાસે બાબાના આવ્યા અંગેનો પુરાવો માય્યો. ઉદ્ઘાપન પાર પડતાં જેગસાહેબને પત્ર લખ્યો, 'બાબા અમને આ રીતે ફસાવે છે? તેમણે દહાણું આવવાનું ખાત્રીપૂર્વક વચ્ચન શા માટે આપ્યું હતું? તમે પણ સાથે આવવાના હતા. મને બાબાએ લખાવેલા શબ્દો ખોટા ઠર્શે તેવું તો કદાપિ લાગતું ન હતું! મને એમ હતું કે કોઈ પણ પ્રકારે પુરાવો તો મળશે જ છતાં આવું કેમ બન્યું? મને જ વચ્ચન પાણીને શા માટે નિરાશ કર્યો? મેં બાબાને ખૂબ પ્રેમથી આમંત્રણ આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે અવશ્ય આવીશ! તો તે આવ્યા કેમ નહિ? મારાથી શિરડી આવી શકાય તેમ ન હતું. મારી પરતંત્રતા હતી તેથી ઢબ્ઢ ન આવતાં પત્રથી આમંત્રણ આપ્યું હતું. તેનો જવાબ મળ્યો હતો કે અમે બધા દહાણું આવીશું તે જ્ઞાણીને મેં ખૂબ ધન્યતા અનુભવી હતી. એ સાંભળતાં એવું લાગેલું કે આપ કોઈ પણ નિમિત્તે કોઈ પણ રૂપે જરૂર આવશો જ, પણ એમાંનું કંઈ પણ બન્યું નહીં, માટે મને વિશેષ આશ્વર્ય થયું.' (ઓ. ૬૮-૮૩)

જેગસાહેબને ફરીથી દેવનો પત્ર મળતાં તેમણે એ બધી હકીકત સાઈમહારાજની સામે ખુલ્ટી કરી ત્યારે બાબા આશ્વર્યચક્કિત થઈને બોત્યા, 'મારી સામે જ પત્ર ખોલ્યો હોવા છતાં વાંચતા પહેલા જ આ આવેલા પત્રમાં લખેલ વિચારો મારી સામે આવીને ડોબા રહે છે. માટે તેને પત્ર લખ કે હું ખાત્રી આપ્યા મુજબ આવ્યો હતો. હું જેને વચ્ચન આપું છું તે પાછ્યા વગર રહેતો નથી અને કોઈને ખોટી રીતે ફસાવતો પણ નથી. તેને કહે, ત્યાં આવેલા સાઈને ઓળખ્યો નહિ. તો તે મને બોલાવ્યો હતો શા માટે? લૌકિક દિશિએ તો અહીં શિરડીમાંથી હાલ્યો પણ નથી. પરંતુ ઉદ્ઘાપનનું જમણ તો જમી આવ્યો. સાથે બંનેને લઈને આવીશ તેમ કહ્યું હતું. તે પ્રમાણે જ તે બંનેને લઈને ત્યાં આવ્યો હતો. જમણની તે સમયે વાર હતી ત્યારે આરામથી હું એકલો જ મળવા ગયો હતો. તને મારો સંન્યાસીનો વેશ ચાદ નથી? ચાદી જ રીતે હું પહેલાં પણ આવ્યો હતો. મને અચાનક આવેલો જેઠીને તારા મનમાં ડર હતો કે કદાચ હું પૈસા માંગવા તો નથી આવ્યો ને? ને તારી એ શંકા મેં દૂર નહતી કરી? જમવાના સમયે બંનેને લઈને પાછો આવીશ. એમ કહીને બરાબર તારા કદ્યા મુજબ બારના ટકોરે બંનેને સાથે લઈ જમવા નહતો આવ્યો? મારા શબ્દો પણ ખોટા પડતા નથી.' સાઈનાથે આમ જેગ સાથે વાતો કરતાં જે કહ્યું તે સાંભળી જેગના મનમાં આનંદ સમાતો ન હતો. બાબાના આપેલાં વચ્ચનો કયારેય ખોટાં પડતાં ન હતાં. તે બધાને જ ખબર હતી અને ઘણાએ અનુભવ્યું પણ હતું. અત્યારે પણ અનેકને આવા અનુભવો થાય છે. પછી જેગે એક સવિસ્તારથી પત્ર લખીને આ બધી હકીકત ખૂબ આનંદથી દેવને જણાવી. દેવના હાથમાં પત્ર આવતાં તેમની

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આંખોમાં પ્રેમનો ઉભરો આવ્યો અને ભીની આંખે બોલ્યા, ‘સાઈબાબા ! મેં તમને ખોટો દોષ દીધો. વિક્કાર છે મારા પોતાના ઉપર.’ એવું બોલી મનમાં હુંખી થયા. બાબાશ્રીનો મહિમા ઘન્ય છે. મને બધી ખબર પડે છે. એવા અભિમાનને વિક્કાર છે. પણ સંન્યાસી એ પોતે જ બાબા હતા તે મને કેમ ન સમજયું ? તેની મને ખબર નથી. કારણ કે બાબાએ શિરડી મુકામે આમંત્રણ મોકલતા પહેલાં જ તે સંન્યાસીનું અહીંયા આગમન થયું હતું. અને તે પણ તેમના પોતાના કામ માટે આવ્યા હતા. તેમનો ધ્યેય તો ફાળો ઉધરાવવાનો જ હતો. તેમને મુદ્દત આપેલી અને ચાર મહિનાબાદ ફરીથી આવવા માટે કહેલું. તે જ સંન્યાસી પાછા આવ્યા તેઓ બાબાશ્રી જ હશે તેવી મને ખાત્રી કેવી રીતે થાય ? બાબાનું જ એમ કહેવું હતું કે જમવા માટે તેમની સાથે બીજા બે જણા પણ આવરો. તેની મને જરાએ યાદ રહી નહીં. તે આમંત્રણ બાબાને મોકલ્યા બાદ સંન્યાસી સાથે પહેલાં મુલાકાત થઈ હોત અને તે પણ ફક્ત જમવા માટે જ તો આવી ગફકત ન થઈ હોત. પરંતુ તે સંન્યાસી આવ્યા ગૌરક્ષાના ફાળા નિભિતે પૈસા એકત્રિત કરવા માટે અને સાઈબાબાને ઉદ્યાપનનું આમંત્રણ ત્યાર બાદ જ શિરડી ગયું. માટે બાબા હું ભ્રમમાં પડ્યો અને તેથી જ આવો ગોટાળો થયો. બાબા તમે બંને શિષ્યોને લઈને જમવા માટે આવ્યા હતા. છતાં મને તેમજ લાગ્યું કે ગૌરક્ષાવાળા સંન્યાસી આ વખતે અન્ય બે જણાને લઈને આવ્યા હશે. તેવું જ મને લાગ્યા કરતું હતું. પહેલાં જેમની ઓળખાણ ન હતી એવા બે જણા જમવા આવવાના સમયે કંઈક ખબર પડી જય તેવું જે બન્યું હોત. તો પણ સાઈબાબા જ આવ્યા છે તેની ખાત્રી થઈ હોત. પરંતુ આ સંતોની રીત અને કાર્ય તેમજ તેમનું વર્તન એવું આશ્ર્વયકારક હોય છે અને ગમે ત્યારે આવી તીલાઓ અચાનક કરી નાખતા હોય છે. ભક્તોના ધરમાં પણ પ્રસંગોપાતા એવી વિચિત્ર યોજનાઓ કરે છે જેને સમજવું અશક્ય બની જય છે. ભક્ત અનન્યપણે તેમનાં ચરણોમાં આસકત થતાં તેમની કાર્ય સિદ્ધિ પછી આમ અચાનક જ થઈ જતી હોય છે. સંતકૃપાની કલ્પના આપણાને નથી હોતી. ચિંતામણિ ઇચ્છીત વસ્તુઓ જ આપતો હોય છે. કલ્પવૃક્ષ મનમાં આવેલી વસ્તુ જ આપે છે. કામદેનું ધરેલી વસ્તુ આપે છે, પણ ગુરુમાવલી જ્યારે પણ કલ્પના ના કરી શકાય એવી વસ્તુઓ પણ આપે છે.’ (ઓ. ૮૪-૧૦૫)

બાબાને આમંત્રણ તો આવ્યું હતું અને તેઓ સંન્યાસી રૂપે પ્રગટ થયા. પરંતુ તેમની લીલાઓ અને ચમત્કારોનો કોઈ પાર જ નથી હોતો. કયારેક તો તેઓ આમંત્રણ વીના પણ આવી જતા હોય છે. પછી તે છાયા ચિત્રના રૂપે હોય કે કયારેક માટીની મૂર્તિરૂપે આપોઆપ પ્રગટ થાય છે. આવી તેમની ફૂપાનો કોઈ અંત જ નથી. આ વિષય પરનો મારો પોતાનો અનુભવ સાંભળીને શ્રોતાઓને આશ્ર્વય થરો અને મહારાજશ્રીની લીલાઓનો મહિમા સમજશે. મારી આ પોતાની વાત ક્યારે પણ ન બની હોય તેવી વિચિત્ર છે. કોઈ તેને કથા કહે છે, તો કોઈ એને કલ્પનિક વાત કહે છે. જે હશે તે ! ખુશીથી જેમને જે સમજવું હોય તે સમજે. શ્રોતાઓએ ફક્ત તેને ધ્યાનથી સાંભળવા તૈયાર રહેવું. આળસ નિદ્રા અને થાક છોડી દઈને સાવધાન થઈ આ કથા સાંભળવાનું દાન મને આપો, જેથી મને સમાધાન થાય. મનના શોક, વ્યગતા એક કાણ માટે ઝાટકી કાઢીને સ્વસ્થ ચિંતા આ કથા સાંભળવાથી કામમાં આવરો. આગળ ઉપર સતત મનન અને ચિંતન થરો. અને ત્યાંથી જ આગળ જઈને સાક્ષાત્કારનો પણ અનુભવ થરો. પરંતુ આ બધાનો આધ્યાત્મિક કથા સાંભળવા ઉપર છે. તે જ આ બધાનો સાર છે અને આવા જ યોગોથી સુખ હુંખું અને ચિંતાથી ભરેલો આ સંસાર કોઈ પણ જાતની મુસીબત વગર પાર પડશે. (ઓ. ૧૦૬-૧૧૨)

ઇ.સ. ૧૯૧૭ના ફાગણ મહિનાની પૂનમના દિવસે હું બિછાનામાં સૂતો હતો તે સમયે મળસ્કે મને એક સ્વપ્ન આવ્યું. સાઈનું કૃત્ય કેવું અજલયબ છે, તે જુઓ ! સુંદર સંન્યાસીનો પોષાક ધારણ કરેલો હતો. મને દર્શન આપીને જગાડ્યોને બોલ્યો, ‘આજે હું તારે ત્યાં જમવા આવીશ.’ સ્વઘનમાં પણ જગૃત થવું તેને પણ પૂર્ણપણે સ્વપ્ન જ કહેવાય. ઉધમાંથી ઉઠતાં હું યાદ કરવા લાગ્યો અને આંખો ખોલીને આમ તેમ જેવા લાગ્યો. પરંતુ તે જગ્યાએ સાઈ ન હતા, કે બીજું કોઈ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પણ ન હતું. ક્ષણમાત્ર પહેલાનું જ એ સ્વખન હતું. જગૃતિ જરા પણ ન હતી. મનની આ રીતે ખાતરી થતાં સ્વખનની આવી અવસ્થાને ચાદ કરવા લાગ્યો. કોઈ પણ જાતના વિસ્મરણ વગર મને અક્ષરે અક્ષરે તેમના બોલ ચાદ આવ્યા. ‘આજે હું તારે ત્યાં જમવા આવીશા.’ સાઈભાબાના સ્પષ્ટપણે મને જણાવેલ તે શબ્દો ચાદ આવ્યા અને મારા જીવમાં જીવ આવ્યો. તે આનંદની વાત મેં મારી પત્નીને કહી સંભળાવી. મનમાં સાઈનું ચિંતન એ તો જે કે મારી દરરોજની જ ટેવ હતી. મારો સાઈમહારાજ સાથેનો સાત વર્ષનો સંબંધ હતો છતાં તેઓ કહી જમવા માટે આવશે તેવી કલ્પના પણ ન હતી. મારા ધર્મપત્નીને મેં કહી રાખેલું કે આજે હોળીનો તહેવાર છે, માટે સો ગ્રામ ચોખા જરા વધારે રંઘવા, એ બાબતની અવશ્ય ચાદ રાખવી. એમને આમ કહેતાં મને કારણ પૂછ્યા લાગ્યા, મેં કહ્યું, ‘આજે તહેવારના દિવસે એક મહેમાન જમવા આવનાર છે.’ ત્યારે તે બોલી, ‘કોણ આવવાનું છે એ તો કહો ?’ મારી પત્નીને એ જાણવાની ખૂબ ઉત્સુકતા થઈ. પરંતુ આનું જે હું સાચુ કારણ કહું તો હું પોતે એક મશકરીનું સાધન બનીશ. એની મને ખાત્રી હતી. છતાં સત્યની સાથે છેતરામણી થાય નહિ માટે તેને મેં શ્રદ્ધાપૂર્વક ખરી વાત કહી સંભળાવી અને બોલ્યો, ‘આ શ્રદ્ધાનો વિષય છે. જેવી જેમના મનમાં શ્રદ્ધા તેવી જ એકાદ વાત તેને ખોટી કે ખરી લાગે છે. બધી જ રીતે તમારા મન પર તેનો જ આધાર હોય છે.’ આ પ્રકારે એનો વિશ્વાસ સંપાદન કરવા માટે મેં અનેક પ્રયત્નો કર્યા. છતાં તેના મનનું સમાધાન થયું નહિ. તે બોલી, ‘શિરડીથી આટલે દૂર બાબા આપણે ત્યાં શા માટે આવે ? આપણે ત્યાં જમવું અને હોળીનો તહેવાર, એની સાથે શું સંબંધ ? શિરડીમાંનું સાત્વીક અન્ન છોડીને અહીંયા સાંદું શા માટે જમે ?’ આવું એનું ભાષણ સાંભળીને હું બોલ્યો, ‘એક પાશેર ચોખા વધારે રંઘવા માટે તને શું તકલીફ થવાની છે ? પાશેર ચોખાની આપણે ઘેર કોઈ ખોટ છે ? પ્રત્યક્ષ સાઈમહારાજ જ આવશે એવું હું તને નથી કહેતો. પરંતુ કોઈને કોઈ તો જરૂર આવશે તેવું મને લાગે છે. એની મને ખાત્રી છે. પછી તારે મનમાં જે સમજનું હોય તે સમજ. હું તો તેમને સાઈ જેવા જ સમજશ. વધારે તો નહિ પણ હું તેમને બીજી કોઈ ન માનતાં પ્રત્યક્ષ સાઈમહારાજ જ સમજશ. મારું સ્વખન તો ખરું જ પડવાનું છે.’ (ઓ. ૧૧૩-૧૨૮)

આમ અમારી વાતચીત પૂરી થઈ. પછી બપોરનો સમય થયો. વિધિસર હોળીની પૂજન પૂરી થયા બાદ જમવાની થાળીઓ ગોઠવાઈ. મારી પુત્રી જમાઈ, પૌત્ર અને પૌત્રીઓ તેમજ અંગત મિત્રો એ પાટલા અને થાળીઓને હારબંધ ગોઠવીને સુંદર રંગબેરંગી રંગોળીઓ પૂરી. તેમાં મુખ્ય પંગતની વચ્ચમાં એક ખાસ પાટલો મૂક્યો અને બીજાઓની માફક જ શ્રીભાબાને માટે પણ એક થાળી પીરસી. થાળીની આજુબાજુ ખાસ પ્રકારની રંગોળી દોરી. દેરેક જમનાર માટે પાણીનો લોટો અને મોટો ઘડો ડેયા સાથે મૂક્યો. સર્વની થાળી એક સરખી ભરેલી હતી. પાપડ તથા કોળાં અને કાકડીને કાચલીકે જેમાં મીઠું મરચું બેળવીને તેને સૂક્ખાવીને રાખેલાં તે તેલમાં તળીને મૂક્યાં. કચૂંબર અને અથાળાં તથા રાયતાં અને અનેક પ્રકારના શાકભાજુ તેમજ પીર વગેરે પીરસીને લગભગ બધી જ તૈયારીઓ થઈ ગઈ. બપોરના બારના ટકોરા થયા તે સાંભળીને બધા જમનારા અભોટિયું પહેરીને એક એક પાટલે ગોઠવાઈ ગયા. તે સિવાય બીજું કોઈ આવ્યું નહીં. બધા જ જમવા બેસવાના પાટલા ભરાઈ ગયા અને થાળીમાં દાળ, ભાત, રેટલી પીરસાયાં. વચ્ચમાં મૂકેલી ખાલી થાળી થાળી સિવાય કચાંય કોઈ પણ જાતની કમી રહી ન હતી. કોઈ મહેમાન કે અતિથિ આવશે તે વિચારે રસ્તા તરફ બધાનું ધ્યાન હતું. છેવટે મારા મનમાં શંકા આવી કે કેટલી રાહ જેવાની ? માટે મેં દરવાજે સાંકળ લગાવી. જલ્દીથી અન્નશુદ્ધ કરી અને પ્રસાદ ધરાવીને વૈશ્વેદેવને દેરેક પ્રકારનાં અન્ન અર્પણ કરવાનો સમય આવ્યો, હવે ‘ॐ પ્રાણાય સ્વાહ ઉં અપાનાય સ્વાહ’ આમ બોલીને પાંચ પ્રાણોની આહૃતિ આપવાની શરૂઆત કરી. એટલામાં દાદર ઉપર કોઈનો પગરખ સંભળાયો. ‘રાલસાહેબ કચાંય છે’ આવનાર એવું બોલ્યા. પાટલા ઉપર બેઢેલ સ્વજનનો સ્તરબંધ થઈ ગયા ને હું કોણ આવ્યું છે તે જેવા માટે દરવાજી પાસે ગયો અને ધીમેથી બારણાની કડી ખસેડી. તો દાદર ઉપર બે માણસો ઊભેલા દેખાયા. એમાંનો તો એક અલ્લી મહેમદ હતો. અને બીજે સંત મૌલાનાનો શિષ્ય ઈસ્મુ મુજબવર હતો. બંને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ખૂબ જ આનંદમાં હતા. થાળીઓ પીરસેતી જેઠિને અને જમવાની તૈયારી થયેતી જેઠિને અલ્લીએ વિનંતી કરી, ‘તસ્દી આપી તે બહલ ક્ષમા કરજે. અમારે કારણે આપને જમતાં જમતાં ઉઠવું પડયું. પંગતમાં બીજા જમનારાઓ પણ તમારી રાહ જેઠ રહ્યા છે. તમે તમારી આ વસ્તુ લો. ફુરસદે પાછો આવીને મળીશ અને આ બાબતમાં અતિશય નવાઈ પમાડે તેવી જે વાત છે તે બધી હકીકત જે રીતે બની શકે છે તે કહી સંભળાવીશ.’ તેમ જણાવી બગલમાં દ્વાવેલું એક મોટું પૂંઠાનું ખોખું કાઢી સામે ટેબલ ઉપર મૂકી અલ્લી એની ગાંધો છોડવા મંડયો. વર્તમાનપત્રનાં પાનાઓમાં લપેટેલું જે હતું તે બહાર નીકળતાં શ્રીસાઈબાબાની મૂર્તિ હેખાઈ. તે બોલ્યો, ‘આ વસ્તુ તમે સ્વીકારો. મારી આ આટલી વિનંતી માન્ય રાખો.’ સાઈ મહારાજની પ્રતિમા જેતાની સાથે જ મારો રોમે રોમ ખીલી ઉઠ્યાં. મેં બાબાનાં ચરણોમાં માથું ટેકવી દીયું અને પ્રેમ અને આનંદના અતિરેકમાં મારો અવાજ ઝંઘાઈ ગયો. જાણે મોટો ચયત્કાર થયો હોય એમ મેં અનુભવ્યું કે સાઈની આ લીલા કેવી અદ્ભુત છે? આ રીતે પોતાનો પરચો બતાવીને તેમણે મને પાવન કરી દીધો. મારા મનમાં મોટી જ્ઞાનસા ઉત્પન્ન થઈ કે, અલ્લી વળી આ લાય્યો ક્યાંથી? અલ્લીએ કહ્યું કે એક દુકાનમાંથી મેં મૂર્તિ વેચાતી લીધેલી છે તે હું લાય્યો છું. પછી તે બંને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વીના બોલ્યા, ‘અમે હવે જઈએ છીએ. આપ પણ હવે જમવા બેસો. આ વાતનું કારણ હમણાં ને હમણાં જ જણાવતાં જમવાનું ખોરંબે પડશો. માટે આ પછી હું તમને આરામથી આવીને કહી સંભળાવીશ.’ તેનું કહેવું પણ મને યોગ્ય લાગ્યું. શ્રી સાઈનાથ ધરમાં પદ્ધાર્યા તે હર્ષમાં જ હું ગરકાવ થઈ ગયો. તે બંનેનો આભાર માનીને હું બોલ્યો, ‘સારું ત્યારે આવન્ને. અમે આ અહીંથા જ રહેવા દઈએ છીએ અને આવવાનું કારણ પછી અવશ્ય જડાવન્ને.’ (અં. ૧૩૦-૧૫૩)

તેઓ બંને જતા રહ્યા. તે પછી પહેલેથી જ નક્કી કરેલા વર્ચ્યે મૂકેલા આસન ઉપર તે મૂર્તિની સ્થાપના કરી. સૌને આનંદ થયો. સાઈબાબાનું કૌશલ્ય ખરેખર અતિકૃષ્ણ છે. તેમણે આ નિમિત્તે જાતે પદ્ધારીને પોતાને સ્વખનમાં કરેલા શબ્દો સાચા ઠેરથા. કોઈ અતિથિ આવીને પંગતમાં જમવા બેસરો એવી જેની અપેક્ષા હોય તેને આ તસ્વીર આવેલી જેઠિને કેટલું આશ્રમ થયું હોશે? આ મૂર્તિની સુંદરતા જેઠિને બધાના મનમાં આનંદનો પાર ન રહ્યો. અનપેક્ષિત રીતે તે બધું થઈ ગયું તેથી સર્વે દંગ થઈ ગયા. આ તસ્વીર એટલે બાબાનું કાગળ ઉપર દોરેલું, કે છાપેલું ચિત્ર નહિ, પણ સાધારણ રીતે ત્પથી ૪૦ સે. મિ. ઊંચાઈ ધરાવતી લંબગોળ આકારની મૂર્તિ જેની ઉપર કાચ બેસાડવામાં આવ્યો છે તેવી મોટીની ફેમ, જેમાં સાઈબાબાની માટીની પ્રતિમા ચોંટાદેલી છે જે ઉપસી આવેલી હેખાય છે. તે આજે પણ સ્વ. હેમાદ્પંતના પ્રપોત્ર શ્રી ગોવિંદ ગજનનરાવ દાબોલકરને ત્યાં ‘સાઈનિવાસ’ સેન્ટ માર્ટીન સ્ટ્રીટ, ટર્નર્સેડની બાજુમાં, વાન્ડ્રા મુંબઈ-૪૦૦૦૫૦. મુકામે દેવધરમાં જેવા મળે છે. આટલાં બધાં વર્ષોં વીતિ ગયા છિતાં એ જે સ્થિતિમાં હતી તેવીને તેવી જ છે. એનું મહત્ત્વ એ છે કે આ જગ્યા પર ઈ.સ. ૧૯૨૨ થી ૧૯૨૯ના સમય દરમ્યાન શ્રી હેમાદ્પંતે શ્રીસાઈ સચ્ચરિત્રના લખાણની શરૂઆત કરી હતી. આ પ્રકારે આ મૂર્તિદ્વારી તસ્વીરની સ્થાપના કર્યા બાદ વિધિપૂર્વક અદર્ય અને પૂજન કરીને તે દિવસથી આજદીન સુધી દોક હોળીના તહેવારે આ મૂર્તિદ્વારે પદ્ધારેલ સાઈમહારાજનું વિધિપૂર્વક અષ્ટોપચાર પૂજન થાય છે. તેમજ ધરના દેવધરમાં મૂકેલા બીજાં બધાં દેવદેવીઓની સાથે દરરોજ તેની પૂજન થાય છે. આવી આ અપૂર્વ લીલા સાઈબાબા પોતાના ભક્તોને ડાલે ને પગલે બતાવતા હતા. (અં. ૧૫૪-૧૬૦)

ત્યાર પછી આજકાલ કરતાં લગભગ કેટલાંથે વર્ષોનાં વહાણાં વીતિ ગયા, છિતાં તે બંનેનો (અલ્લી અને ઇસ્મુની) કોઈ ભાગ મળી નહિ. એક સમયે સારા નસિબે હું રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અલ્લી મહિમદ સાથે અચાનક જ મુલાકાત થઈ ગઈ. તેમને મળતાંની સાથે આટલાં વર્ષોની પેલી વાત પૂછવાની ઉત્સુકતાને લીધે તે બાબતમાં મેં તેમને પૂછ્યું, કેમ ભાઈ? આટલાં વર્ષોની સુધી તમે દેખાયા જ નહીં? તમે મૂર્તિ વાળી વાતનો પણ ફોડ પાડ્યો નહીં? આમ મૂંગા કેમ બની ગયા? તે દિવસ જેવી જ આપણી આ પણ અચાનક જ મુલાકાત થઈ છે. ભગવાન ભરોસે આજે પાછો આ યોગ મેળ્યો છે,

શ્રી સાઈનું સત્ય ચટિત્ર

મને પેલી મૂર્તિંગ્ધી તસ્વીરની બધી વાત કહી સંભળાવો. આપ પણ શ્રીસાઈના જ ભક્તો છો, એ તો હું જાણું છું. પરંતુ તે જ દ્વિષે આમ એકએક આપલોકેનું પધારવું કયા કારણે થયું હતું? તે મને હવે ખુલાસો કરીને સમજાવો.' એ સાંભળતા અત્સી મહમદ બોલ્યા, 'હવે હું તમને જે વાત બની હતી તે પહેલેથી છેલ્લે સુધી વાત કહી સંભળાવું છું.' બાબાશ્રીની લીલા જુઓ કેટલી અપૂર્વ અને અલૌકિક છે. તેનો તમને અંદાજ આવશે. આ લીલાનો અર્થ શો? આમ કરવા પાછળ શ્રી સાઈમહારાજનો હેતુ કર્યો? અને ભક્તિનું રહસ્ય શું? એ તો મહારાજ જ જણો. આપણે માટે તો આ લીલાઓ અત્યંત કલ્યાણકારી છે. માટે સાંભળીએ છીએ, અને મુખેથી તેમના ગુણો ગાઈએ છીએ.' (ઓ. ૧૬૧-૧૬૮)

હવે આગળનો ભાગ આવતા અધ્યાયમાં સવિસ્તારપૂર્વક વર્ણન કરીને કહીશું. શ્રોતાજનોને તેનો આનંદ થશે. શ્રીસાઈનું ચરિત્ર હંમેશા ફળદાય હોય છે. કોઈ ઉપર દ્રેષ્ણ ન કરનાર શ્રી સાઈ સદાને માટે આનંદિત અને પરીપૂર્ણતામાં જ રહેતા. તેમનું અખંડ ભજન કરવાથી જીવને આરામ મળે છે અને મન વાસનારહિત થઈ જય છે. ચાતક પદ્ધી તો પોતાને માટે મેઘને વિનવતું હોય છે. પણ મેઘ તો આખી સુષ્ઠિની તૃષ્ણા છીપાવે છે. બાળાસાહેબ દેવ બાબાને આમંત્રણ આપે છે તો બાબા ભક્તને પણ બૂમ મારીને બોલાવે છે. ભક્તોની કતારમાં શ્રોતાઓ પણ બેસે છે. અને ઉદ્ઘાપનની કથા સાંભળીને સાઈના સહલાસનો આનંદ માણે છે. તેઓ તૃપ્ત થઈને તૃપ્તિનો ઓડકાર પણ ખાય છે. શ્રી સાઈબાબાને ન બોલાવતાં પણ કેવા આવે છે? માટીની મૂર્તિના ઢપે તે કેવા પ્રગટ થાય છે? પોતાના સેવકોને કેવા આભારી કરે છે! અને હગલે ને પગલે જગૃતિ લાવીને કેવા સતેજ કરી નાખે છે તે બધા ભક્તો સાંભળી રહ્યા છે. હેમાદપંતે સાઈનું શરણ લીધું છે. હવેની કથાની શરૂઆતના મંડાણ આનાથી જ થશે. શ્રીસાઈ પોતે જ પોતાનું યથેચ્છ વર્ણન કરીને તેનું મંડાણ કરશે. તે શરણે આવેલાને પોતાનું છત્ર અને રક્ષણ આપે છે. તે જ એમના વ્રત ખાતર હેમાદપંત સાઈનાં ચરણોમાં બેઠા છે અને મહારાજ પણ તેમને દૂર થવા દેતા નથી. (ઓ. ૧૬૬-૧૭૫)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજ્જનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાદપંત રચિત,

'ઉદ્ઘાપન - કથા - કથનમ' નામનો ચાલીસમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણા.

